



૩૦૦૮૮૫

૧૯૬૦-૬-૨૨૩૧૦૪

સર્વાશ્રદ્ધા લિએટ.

તાજી હૃપ કુંભ વિચારણ



શ્રી જેન હીન્ડીસ્વામી અરદ્ધતી ચારા.

શ્રી હીન્ડીસ્વામી

૨૮૩૪

दान

■ सम्यग्गुर्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः। ■

शील

■ सं ज मे म हा सु लवं

■ म न प व म नु व्या  
णां का र ण वं ध मो  
क्षयोः

■ नमोत्थुणं समणस्स भगवओ महावीरस्स ■



# श्रीपार्थ्यचंद्रगच्छ

दुक्त ३५ रेखा.



—: संपादक तथा प्रकाशक :—

श्री जैन हठीसींगि सरस्वती सभा।  
शामणानी पोण-अमदावाद.

सं. १६६७ वीर सं. २४६७ पार्थ सं. ३८५

क्रि. १-०-०

भाव

■ ज्ञान-क्रियाभ्यां मोक्षः ■


तप

યુગપ્રધાનશ્રીપાદ્મચંદ્રસૂરીશ્વરદાદાનો છંદ.

સૂરિપાદ્મચંદ્ર હુવા અવતારી, જેના નામ તણી મહિમા ભારી;  
કષ્ટ ટળે મરે તાપ તપો, પૂજય દાદાજુનો જાપ જપો. ૧  
પૂજય નામે સખ કષ્ટ ટળે, વળી ભૂત પ્રેત તો નાંહિ છળે;  
મળે ન ચોર હોય ગરૂપચ્ચપો, પૂજય દાદાજુનો જાપ જપો. ૨  
લક્ષ્મી દિનદિન વધી જવે, ઓર હુઃઅનેડો તો નહિ આવે;  
વેપારમેં હોવે બહુત નહોં, પૂજય દાદાજુનો જાપ જપો. ૩  
અડયો કામ તો હોઠ જવે, વળી બગડ્યો કામ તો બનજવે;  
ભૂલચૂક નહિ હોય ઉપો, પૂજય દાદાજુનો જાપ જપો. ૪  
રાજ કાજમેં તેજ રહે, વળી ખમાખમા સખ લોક કહે;  
આછિ જાયગા જથ રૂપો, પૂજય દાદાજુનો જાપ જપો. ૫  
પૂજયનામ તણો જેણે લીયો ઓટો, તેને કદિ નહિ આવે તોટો;  
ઘર ઘર બારણે કાંઈ તપો, પૂજય દાદાજુનો જાપ જપો. ૬  
એક માળાકો નિત્ય નેમ રખો, કોઈ વાત તણો નહિ હોય ધરો;  
ખાલી બિમાસ ઓર ટળે જુસપો, પૂજય દાદાજુનો જાપ જપો; ૭  
સ્વગચ્છતણી પ્રતિપાણ કરે, મુનિરામ સહા તુમ ધ્યાન ધરે;  
કોઈ પ્રત્યક્ષ વાત નહિ ઉથપો, પૂજય દાદાજુનો જાપ જપો. ૮



આ ચોપડી ધી મહેન્દ્ર ગ્રિ. પ્રેસમાં છોટાલાલ ખાલચંદ હોશીએ  
રતનપોળ ગોલવાડ નાકા—અમદાવાદમાં છાપી.



અમહાવાહ-શામળાની પોળના શ્રીમત્રાગપુરીય  
તપાગચ્છ (પાર્કિંગાંડ્રગચ્છ) ના ઉપાયથના  
આગળના ભાગનો ભવ્ય હેખાવ.



# ઉપોદ્ધાત

—

સંચોગ અને વિચોગ એ તો સંસારનો કુમ છે. જન્મ અને મૃત્યુથી એ વાત નિશ્ચિત હોવા છતાં અનંત જ્ઞાનીઓએ ઉચ્ચારેલા અને સમયે સમયે દ્રષ્ટિગોચર થતા મોહની અટવિમાં અટવાઈ પડેલા આપણે ધૃષ્ટ સમયે આનંદ અને વિચોગના સમયે હુઃખ અનુભવીએ છીએ. પરંતુ આપણું મહાન ઉપકારી શ્રીતીર્થંકર લગવંતોએ આપણુંને આ ભવસમુદ્ર તરવા માટે શાસનરૂપી જહાજ આપ્યું છે. આવું શાસન પામ્યા પછી પણ આત્માએ ઉત્ત્રત સ્થિતિએ ન પહોંચે તો પછી તે હોષ કર્મનો અને સ્વપુરુષાર્થની આમીનોજ વેખી શકાય. પુણ્યપુરુષોના જીવન પર જેણો પ્રકાશ ફેંકવામાં આવે નેણો તે ભવી અને સુસુશ્રુ આત્માએ માટે લાલદારીજ છે.

વર્ણમાન શાસનમાં પૂર્ણ આવાર્યો શાસનની પારે બિરાજતા નાયકો છે. એ મહિર્બિંદો જે સ્વપર કર્યાએ અથે જીવી ગયા અને ઓધપાઠ રણુ કરી ગયા તે જીવન અનેક આત્માઓને તારનારું અને ઓધક છે. આપણું શ્રીમત્ત્રાગપુરીયતપાગરદ્ધિ ઉંડેં શ્રીપાર્શ્વચંદ્રસૂરિગરદ્ધિના ભૂતકાળમાં થઈ ગયેલા મહાન ઉપકારી પુરુષોના જીવનપ્રસંગોને એક સાંકળમાં ગુંધવાથી આપણું શ્રીમંધના આઆલવુદ્ધ ભાઈ ગ્રહોને ઓધરૂપ થાય એ હેતુજ્ઞા ‘શ્રીપાર્શ્વચંદ્રગરદ્ધિ

કુંક ઇપરેખા'ને આ નાની પુસ્તિકા દ્વારા રજુ કરવામાં આવે છે. એમાંથે જેઓના નામે આપણો શ્રીસંધ વધુ પ્રકાશ માં આવ્યો છે. તે ૫૦ પૂર્ણ પુષ્ટિશલોક પ્રાતઃસ્મરણીય ચુગપ્રધાન શ્રી ૧૦૦૮ શ્રીપાંચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં જીવનપ્રસંગોમાંથી ત્યાગ ને તપશ્ચયો, સાહિત્યસેવા અને સહિષ્ણુતા, ચંમતકારો અને બુદ્ધિપ્રકાશથી ભરપૂર છે. ચારે ક્ષત્રોમાં એ પૂજ્યપુરુષની સેવાએ વિશિષ્ટ છે. એ સિવાય પૂર્ણ શ્રીકુશલચંદ્રજી ગણિવરે મહારાજ, પૂર્ણ આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી ભાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂર્ણ શાંતત્પોમૂર્તિં શ્રીપુનમચંદ્રજી ગણિવરે મહારાજ, પૂર્ણ આચાર્ય શ્રી જીગતચંદ્રજી ગણીમહારાજ આદિના ત્યાગ અને સાહિત્ય-સેવાની સુરલથી મધ્યમધતા જીવનપ્રસંગો પ્રાપ્ત થયેલ વિગતો પરથી આ પુસ્તિકામાં ઉતારવામાં આવ્યા છે. સંભલ છે કે એમાં ઘણી તુટીએ રહી જવા પામી હોય પરંતુ વાંચકવર્ગને આ જીવનચરિત્રો એ પૂજ્યપુરુષોના પગલે જવાની પૈરણું કરે એ ધ્યેયને સાન્નિધ્યમાં રાખીનેજ આ પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલું વાંચકવર્ગ બરાબર વિચારશે એવી આશા રાખવાનું અસ્થાને નથીજ.

આ પુસ્તિકાને સચિત્ર બનાવવા માટે સ્વર્ગ પૂર્ણ ૫૧૦ આચાર્યનેવો અને સ્વર્ગસ્થ તથા વિઘ્નમાન પૂર્ણ મુનિરાજે પૈકી જેટલાના ઝોટાએ પ્રાપ્ત થયા છે તે તેમજ ખીજ મંગાવીને ફંકોક બનાવરાવી સાચો ખ્યાલ વાંચકવર્ગને આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આમાં ૨૮ ઝોટા મૂકવામાં આવ્યા છે.

સંસ્થાનું એ સદ્ગુરીભ્રમાણ છે કે આવી ઉપરોગી પુસ્તિકા બહાર પાડવાનું તેના ઝાળે આપ્યું છે. આ પુસ્તિકા આ સંસ્થાની સ્થાપનામાં જે મહાપુરુષના ઉપરોગ અને ધર્મ-વાણીએ મહાન લાગ ભજ્યો છે તે સ્વી પૂર્ણ પાઠ આચાર્ય શ્રીબ્રાહ્મચંદ્રસૂરીદ્વારા (ભાઇચંદ્ર) મહારાજને અપણું કરી એ પૂર્ણ શુદ્ધેવ પ્રત્યેનું ઋણ યંત્રિચિત્ર અહા કરવાનો મનસુએ પાર પડ્યાનો આત્મસંતોષ લઈ શકીએ છીએ. આ સંસ્થાના પ્રેરણામૂર્તિ સ્વી શ્રેષ્ઠિશ્રી હઠીક્ષીંગભાઈ ને પણ આ તકે અમે તેઓશ્રીનો ખેડોક રજુ કરી જાનની પરબ અપણું કરી લાવી પ્રજાના આત્મકલ્યાણનું સાધન કરી આપવા માટે તેઓશ્રી પ્રત્યે આલારદ્ધર્ણન કર-કરવાનું ચૂકી શકતા નથી. વળી શ્રીસંધના અચ્યગણ્ય ગૃહદસ્થો કે જેમણું આ પુસ્તિકા લખાવરાવવા અને છપાવવા માટેના અમારા મનોરથને પ્રોત્સાહન આપ્યું છે તેઓનો પણ આ તકે અમે આભાર પ્રદર્શિત કરીએ છીએ.

વળી અતે ચાતુર્માસ ખીરાજતા પૂર્ણ મું શ્રી કૃપા-ચંદ્ર મહારાજ સાહેબ તથા પૂર્ણ મું શ્રી બાલચંદ્ર મહારાજ સાહેબે અમારી વિનંતિને માન આપી આ પુસ્તિકાના દૈખનમાં ઘટતા સુધારા-વધારા કરી તેને સુંદર બનાવવા અને ગેલીએ સુધારી આપવા પાછળ સમય અને શક્તિનો ને લોગ આપ્યો છે તે માટે અમે તેઓશ્રીના ઋણી છીએ. પૂર્ણ મું શ્રી બાલચંદ્ર મહારાજે પણ બાબ્ય વયે દીક્ષા અદ્ધય કરી શાખોનો હીક ડીક અલ્યાસ કરવા ઉપરાંત જર્યોતિષ્પ અને કવિત્વ સંબંધે જાન ઉપાજ્ઞન કર્યો છે. તેઓશ્રીએ

પોતાના પૂર્ણ ગુરુહેવના સમરથુંથે આજ સુધીમાં છ અંથ-  
મણુકા ખડાર પાડ્યા છે એ પરથી તેઓશ્રીની એ શક્તિ  
વિષે આપણુને સહેને જ્યાલ આવે છે. તેઓશ્રીનો હાથ આ  
પુસ્તિકાના લખાણ પર ફરવાથી તે સુંદર અને આદર્શદ્વિપ  
અની છે.

હવે છેદલે છેદલે પુરુષ પાડવામાં આવેલ સાહિત્ય અને  
વિગતો ઉપરથી આ પુસ્તિકાનું સાંચે મેટર તપાસી ચોણ્ય  
ભાષામાં ગોડવી આપનાર, જૈનપ્રક્ષોના અભ્યાસી અને  
જાણીતા લેખક શ્રી લગ્નવાનજીભાઈ જગળુવનદાસ  
કુપાસી જેઓ આપણા ગંધીના સ્વામીભાઈ છ તેઓનો  
પણ આલાર માન્યા સિવાય કેમ રહી શકાય.

અંતમાં પ્રલ્યક્ષ કે પરોક્ષ રીતે આ પુસ્તિકામાં સહાય  
કરનારા સરેનો આ તકે આલાર માનીએ છીએ.

આ પુસ્તિકામાં ગુટીએ રહી જવા પામી હશે તે  
ખાને વાંચકવગ્ન ક્ષમ્ય કરશે અને ધ્યેયને સાન્નિધ્યમાં  
રાખી એનો બને તેટલો વધુ પ્રયાર કરશે એવી આશા સાથે  
વિરમીએ છીએ.

<b>શામળાની પોણ</b> <b>અમદાવાદ.</b> <b>વિજયાદશમી ૧૯૬૭</b>	<b>૬૧૦</b>
--	------------

**શ્રી જૈન હળિસીંગ સરસ્વતી સભા.**

श्री भगवान्पुरीयतपागच्छगगननभोमणि शासन-  
प्रभावक बालअख्यारी ५० पू० श्री १००८  
श्रीभगवार्थ्यद्रसुरीर्थरजनी हेरी।



श्री भगवान्पुरीयतपागच्छगगननभोमणि शासन-  
प्रभावक बालअख्यारी ५० पू० श्री १००८  
श्रीभगवार्थ्यद्रसुरीर्थरजनी हेरी।



# અનુક્તમણીકા.

વિષય	પાઠનું
શાસનપ્રભાવક શ્રીવાહિદેવસ્તુરિની દુંક જીવન રેખા....	૨-૬
પાટપરંપરા .... .... .... .... ....	૬-૭
શાસનપ્રભાવક ચુગપ્રધાન શ્રીપાર્વત્યંદ્રસૂરિ-ચરિત્ર	૮-૭૫
પર્વતિથિઓનું આરાધન (પથુંખણુપર્વ પંચમીના દિવસે કરવું તેને નિષ્ણ્ય, ચૌમાસી-નિષ્ણ્ય અને પાક્ષિક-નિષ્ણ્ય) .... .... ....	૭૫-૮૮
પર્વતિથિ-મંત્રય અને પર્વતિથિઓનો નિષ્ણ્ય	૮૮-૯૧
પાટ પરંપરા ... .... .... ....	૯૨
પૂર્વ શ્રીકૃશાલયંદ્રલુ ગણિવરનું દુંક જીવન-વૃત્તાંત	૯૩-૯૭
પૂર્વ શ્રીભાતૃચંદ્રસૂરીખરળના જીવનનો દુંક પરિચય	૯૮-૧૨૧
પૂર્વ શ્રીપુનમચંદ્રલુ ગણિવરનું દુંક જીવન ચરિત્ર	૧૨૨-૧૩૪
પૂર્વ શ્રીજગતચંદ્રલુ ગણિવરનું દુંક જીવન-ચરિત્ર	૧૩૫-૧૩૮
પૂર્વ શ્રીસાગરચંદ્રસૂરીખરળનું દુંક જીવન-ચરિત્ર	૧૩૯-૧૫૫
શ્રી જૈન હઠીસિંગ સરસ્વતી સભાનો અહેવાલ	૧૫૯

## શુદ્ધિપત્રક.

પાઠનું	લિટી	અશુદ્ધ	શુદ્ધ
૪	૪, ૬, ૧૨,	સુરિ	સૂરિ
૭	૧	"	"
૭	૬	ચૂડામણિ	ચૂડામણિ
૭	૨૩	સૂરીગઢ	સૂરિગઢ

૬	૨૦	પારસચંદ	પાસચંદ
૧૨	૧૧	દોષીત	દોષિત
૨૨	૩	જ્યોતિંધર	જ્યોતિધર
૨૪	૩	જીવહિસા	જીવહિસા
૨૭	૨૩	સુરીશ્વરજી	સૂરીશ્વરજી
૪૨	૮	આદિ	આદિ
૪૪	૧૪	હણડ નામના કસાઈને હણર કસાઈઓને	
૪૪	૧૫	તેને	તેમને
૪૭	૧૬	રાજવશી	રાજવશી
૪૮	૨૧	અક્ષરસ	અક્ષરશઃ
૪૯	૮	યુગપ્રવત્તાને	યુગપ્રવૃત્તિને
૮૦	૧૭	કાચાર્ય પણુ	કાચાર્ય પણુ
૮૭	૧	( -પણુ )	( -પળ )
૮૭	૧૪	ચૌમાની	ચૌમાસી
૧૦૩	૧૮	મલજી	મલસિહજી
૧૦૩	૨૧	પધાર્યાં	પધાર્યાં
૧૧૫	૬	સૂરીશ્વરજી	સૂરીશ્વરજી
૧૨૩	૨૨	:ખોને	હુઃખોને
૧૨૬	૧૬	૨૭ વ્યં	૨૬ વ્યં



ॐ अहैं नमः ।

युगप्रधान-श्रीपार्वचंद्रसूरीभरगुरुभ्यो नमः ।

श्री पार्वचंद्रगच्छीय-आदर्श ३५८०८।

વर्तमान शासनना नायક चरम तीर्थ्यति लगवान  
श्री महावीरस्वामी पछી તેઓશ્રीના શાસનને અવિચ्छીન્જપણે  
ગતિમાન રાખનાર ગણુધર લગવાનો અને ત્યારબાદ આચાર્ય  
લગવંતો વિગેરે નિર્માણ થયેલા છે. પ્રભુના નિર્વાણ બાદ  
આચાર્યલગવંતોના સમયમાં જૈનોના એકત્રિત સમુદાયોને  
જુદા જુદા નામાલિધાન કર્યોનું શાસ્કોક્તા તપાસ પરથી  
જણાય છે. જે સુજાય સૌશી પ્રથમ નિર્થથગચ્છ આવે છે  
અને ત્યારબાદ શ્રી સુધર્મસ્વામી, બારમા પદૃધર શ્રી  
સુસ્થિતસૂરિ, સત્તરમા પદૃધર શ્રી ચંદ્રસૂરિ અને અદારમા  
પદૃધર શ્રી સામંતભદ્રસૂરિથી અનુક્રમે કૌટિક, ચંદ્ર,  
વનવાસી અને વડગચ્છ નામોથી ગચ્છે ઓળખાતા હતા.

## શાસનપ્રભાવક શ્રીવાદિવેવસૂરિ.

પરંતુ જેને આપણે શ્રીમન્નાગપુરીયતપાગચ્છિના નામથી ઓળખીએ છીએ તેનામ આપણા મહાન પૂર્વવત્જયે। તિર્થર આચાર્ય ભગવાન શ્રી વાદિવેવસૂરિના સમયમાં એટલે વિક્રમ સં. ૧૧૭૭ માં સ્થપાયું. આચાર્ય વાદિવેવસૂરીના જયેતિર્ભૂષણ અને વિક્રાન શિષ્યરત્ન શ્રી પદ્મપ્રભસૂરિજી મહારાજ વિ. સં. ૧૧૭૭ માં અન્ય સ્થળોએ વીચરતા—અનેક જીવોને એધિષ્ઠીજ પમાડતા એક સમયે નાગોર નગરે પદ્ધાર્યો. નાગોરના રાણુને સચોટ અને સતત ધર્મોપહેશથી જૈનધર્મમાં અઞ્ચામય કરી જૈનધર્મી બનાવ્યો. રાજાએ આચાર્યશ્રીની વિક્રતા અને ગ્રભાવ જોઈને “નાગપુરીય તપા શ્રી પદ્મપ્રભસૂરિ” એ પ્રમાણે નામ સ્થાપન કર્યું ત્યારથી જગતમાં નાગપુરીય તપા એ નામથી સુપ્રસિદ્ધ થયા.

આપણા વર્તમાન ગચ્છિના મૂળસ્થાપક પ્રભાવિકપુરુષ આચાર્ય ભગવાન શ્રીમહૃ વાદિવેવસૂરિ શાંકોક્તા જાનથી એટલા વિલૂધિત થયેલા હતા કે એમની સામે ચર્ચા કરવામાં ભલભલાને તેઓશ્રી પરાજ્ય પમાડતા. આવી રીતે આણુણીલપુર પાટણુના રાજ સિદ્ધરાજે રચેલી વિવાદ સભામાં સં. ૧૧૮૧ની સાલમાં અલિમાની હિગમભર આચાર્ય કુસુદ્યંક સાથે વાદવિવાદ કરી શ્રીમન્નાગપુરીય તપા ગચ્છિનો વિજ્ય વાવટો કર્યાંન્યો. આચાર્યશ્રીની વિક્રતા અને વિવાદમાં થહણુ કરેલી તર્કશક્તિ તેમજ દલીલખાળથી પ્રસન્ન થઈને રાજાએ આ મહાપુરુષને “સકળવાદિ સુગટ” એટલે વિવાદમાં શિરોમણિ તરિકેનું બિર્દદ આપ્યું. અને પાટણ

શહેરમાં કોઈ દિગભર ન આવે એવું ફરમાન કાઢયું, આચાર્ય ભગવાન શ્રીમહ્બ વાદિદેવસુરિના આ વિજયના ડંકા દિગંતમાં ચોમેર ગાળુ ઉઠયા અને ટેરડેરથી તેઓ શ્રીની વિદ્ધિતા પર પ્રસંશાના પુણ્યો વેરાવા લાગ્યા. આચાર્ય ભગવાને પોતાના જીવનકાળ દરમ્યાન સં. ૧૨૦૪માં શ્રી ફલવધિં ( ફ્રોધી ) પાશ્વનાથની પ્રતિક્ષા કરી જે હાલ વિદમાન છે અને આરાસણુમાં શ્રી નેમિનાથ પ્રલુના બિધને સ્વહસ્તે પદરાવી. પ્રલુપૂજનની જીવનમાં શા માટે જરૂરીયાત છે. અને એ એક આવશ્યક વસ્તુ છે. એ વાત સિદ્ધ કરી બતાવી અનેકને એ માર્ગ અહૃણુ કરવા પ્રેરણું કરી.

વિદ્ધાનોમાં ભૂખણુ સમાન આ સમર્થ આચાર્યભગવાને ચોરાસી હજાર પ્રમાણુ ન્યાયનો “સ્થાદાદર્તનાકર” નામનો અંથ કર્યો અને “પ્રલાતસમરણકુલક” “આવક ધર્મકુલક” તેમજ પોતાના ગુરુદેવ પ્રત્યેની ભાવના વ્યક્ત કરવા તેમજ સ્વજીવનને આટલી ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટેના મહ્બ ઉપકાર-ડણુ યત્કચિત અદા કરવા “મુનિચંદ્રગુરુ સ્તુતિ” વિગેરે અનેક પ્રમાણભૂત, મનનીય અને વિદ્ધિતાથી ભરપુર અંથો રચ્યા છે.

### શ્રી વાદિદેવસુરિલ સિદ્ધરાજની સલામાં

પૂજયશ્રીની વાદ શક્તિ માટે નીચેની હકીકત સંપૂર્ણ સમર્થ કરનારી છે. પૂજયશ્રી સિદ્ધરાજની સલામાં વાદી : કુમુદચંદ્રની સાથે વાદ કરવા માટે વિ. સં. ૧૧૮૧ ના વૈશાખ સુદ ૧૫ ના રોજ પધાર્યા.

વાદી કુમુદચંદ્રનો પક્ષઃ સ્ત્રી મોક્ષમાં ન જય. (૨) કેવળી આહાર ન કરે. (૩) શૈતાંખર મોક્ષમાં ન જય પણ. દિગંખર જય. આ ત્રણુ મુદ્દાઓ પર વિવાદ ચલાવવાનો હતો.

પ્રતિવાદી શ્રી વાદિવેષુરિનો પક્ષઃ સ્ત્રી મોક્ષમાં જય. (૨) કેવળી આહાર કરે અને (૩) શૈતાંખર (વસ્ત્રધારી) મોક્ષમાં જય.

વાદી કુમુદચંદ્ર તરફના સલ્યોઃ કેશવ નામના ત્રણુ પંડિતો હતાં. અને સભાપતિ પક્ષ તરફના સાગર, મહર્ષિ અને ઉત્ક્ષાહ એ નામના ત્રણુ વિદ્ધાનો હતા.

પ્રતિવાદી શ્રી વાદિવેષુરિ તરફના સલ્યોઃ કવિ ચક્રવતી શ્રીપાલ અને બાનુ હતા.

ઉપરના પ્રશ્નો પરનો સામસામો વિવાદ ૧૬ દિવસ પર્યાત ચાલ્યો હતો. અને છેવટે શ્રી વાદિવેષુરિનું વિજય થયો હતો.

આચાર્ય લગ્નવાન શ્રી વાદિવેષુરિએ ચોવીશ પુરુષોને આચાર્યપદે સ્થાપ્યા હતા. કે જેએ વિક્રિતા, ચારિત્રમાં એક ધીજાની હરિક્ષાધ કરે તેવા હતા જેમના નામો આ નીચે આપવામાં આવે છે.

- |   |                   |    |                  |    |                  |
|---|-------------------|----|------------------|----|------------------|
| ૧ | શ્રી પદ્મપ્રલસૂરિ | ૮  | શ્રી વદ્ધમાનસૂરિ | ૧૭ | શ્રી વજસેનસૂરિ   |
| ૨ | ભહેન્દ્રસૂરિ      | ૧૦ | ચંદ્રપ્રલસૂરિ    | ૧૮ | પ્રસત્તયંદ્રસૂરિ |
| ૩ | ભહેશ્વરસૂરિ       | ૧૧ | જ્યથપ્રલસૂરિ     | ૧૯ | કુમુદસૂરિ        |
| ૪ | રતનપ્રલસૂરિ       | ૧૨ | પૂર્ણાલદ્રસૂરિ   | ૨૦ | પદ્મહેવસૂરિ      |
| ૫ | મનોરમસૂરિ         | ૧૩ | પરમાનંદસૂરિ      | ૨૧ | માનહેવસૂરિ       |
| ૬ | લદ્રેશ્વરસૂરિ     | ૧૪ | દૈવેન્દ્રસૂરિ    | ૨૨ | ષેણુસૂરિ         |
| ૭ | માનતુંગસૂરિ       | ૧૫ | પૂર્ણહેવસૂરિ     | ૨૩ | હરિષેણુસૂરિ      |
| ૮ | શાન્તિસૂરિ        | ૧૬ | યશોલદ્રસૂરિ      | ૨૪ | સામસૂરિ          |

ચરમતીર્થપતિ ભગવાન શ્રી મહાવીરહેવથી ૪૪ મી પાટે  
થનાર આ પ્રલાવિક આચાર્યભગવાન શ્રીમહૃવાહિહેવસૂરિના  
જીવનકાળને જાણુવા માટે આપણે તેઓશ્રીના જીવનચરિત્રમાં  
કુંકમાં ઉત્તરવું પડશે. આચાર્ય ભગવાનનો જન્મ વીશાપોર-  
વાડ જાતિમાં વિડુમ સંવત ૧૧૪૩ માં ગુજરાતમાં આવેલા  
મહાદાહૃત નામના ગામમાં થયો હતો. પિતાતું નામ વીરનાગ  
અને માતાતું નામ જીનહેવી હતા. આચાર્ય ભગવાને માત્ર  
૬ વર્ષના બાળ્યકાળે એટલે સંવત ૧૧૫૨ માં શ્રી મુનિચંદ્ર-  
સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અર્હણુ કરી હતી.  
માતપિતાના ધાર્મિક સંકારો અને પુણ્યાનુભંગી પુણ્યનું જ  
એ કૃપા હતું. જૈનશાસનમાં અનેક મહાપુરુષોએ બાળ્યકાળે  
શ્રીભાગવતીપ્રમન્યા અર્હણુ કરીને શાસનને દિપાંયું છે અને  
સ્વપર જીવનને ઉજમાલ કર્યું છે તેમ આ મહાપુરુષની  
જીવનકંડિકાઓમાંથી આપણુને જાણુવા મળે છે. દીક્ષાર્થી  
થયા પણી તેઓશ્રીનું નામ શ્રી રામચંદ્ર રાખવામાં આવ્યું  
હતું દીક્ષા અર્હણુ કર્યો બાદ શ્રી રામચંદ્રજી પોતાનો સમય  
શાસ્ત્રોના અભ્યાસમાં ગાગવા લાગ્યા અને તેમાંથી ઉત્તરોત્તર  
આગામાં વધી વિદ્વાનોની ડક્ષાએ પહોંચ્યા ત્યારે ગુરુએ પ્રસન્ન  
થઈને સં. ૧૧૭૪ માં એટલે કે દીક્ષા બાદ ૨૨ વર્ષે સૂર્યપદથી  
વિલૂષિત કરી તેઓશ્રીનું નામ હેવસૂરિ રાખ્યું. આ નામના  
પદ્ધતામાં પણ ગુઢાર્થી સમાયેલો છે અને તે એકે શ્રી હેવસૂરિજી  
ખરેખર વિઘામાં હેવ સમાન હતા. સં. ૧૧૮૧ ની સાલમાં  
પારણુની રાજમંજુસામાં દિગંગરાચાર્ય શ્રી કુમુદચંદ્રની સાથે  
વાડમાં જીવનાશી નેમનું નામ શ્રીવાહિહેવસૂરી જાડેર થયું.

પોતાના વિહાર દરમ્યાન સચોટ અને અસરકારક ઉપદેશ વડે તેઓશ્રીએ ઉપ૦૦૦જ ધરોને જૈની કંઈ અને જુદા જુદા સ્થળોએ એમની સામે વાદમાં ઉત્તરેલાએને આ મહાપુરુષે મહાત કંઈ. જૈની સંખ્યા ૮૪ ની હતી.

આ આચાર્ય ભગવાનના સમયમાં શ્રીહેમયંત્રાચાર્ય હતા એમ ધતિહાસના પ્રમાણુથી મળી આવે છે.

આચાર્ય ભગવાન “સકળવાહિ મુગટ” શ્રી વાહિ-હેવસ્તુરિ અનેક જીવો પર ઉપકાર અને શાસનની પ્રલાવના કરતાં થકા સંચત ૧૨૨૬ ના શ્રાવણ વઢી ૭ ને શુરૂવારે કાળધર્મ પામી સ્વર્ગો સિધાવ્યા. ૮૩ વર્ષના આચુષ્યમાંથી ૭૪ વર્ષનો કાળ એમણે મુનિવેશમાં ગાજ્યો. જે દરમ્યાન ડેરફેર જૈનશાસનની પ્રલાવના કરીને એના વિરોધીઓને વાદમાં શીકસ્ત આપી. આ પ્રલાવિક પુરુષને આપણે કેમ વિસરી શકીએ?

આચાર્યભગવાન શ્રીમહૃવાહિહેવસ્તુરિના કાળધર્મ બાદ તેઓશ્રીની પાટે ઉત્તરેાત્તર નીચેના સમર્થ અને વિદ્ધાન આચાર્યો થઈ ગયા છે કે જેઓએ તપ, જપ, સંયમ દ્વારા જગતને ત્યાગધર્મનો મહિમા અને પ્રભુ મહાવીરહેવે પ્રદેશ અહિસાના સિદ્ધાંતની જ્યોત જળહળતી રાખી છે.

૪૫ શ્રી પદ્મપ્રલસ્તુરિ      ૫૦ શ્રી હેમતિલકસ્તુરિ

૪૬ „ પ્રસત્તયંત્રસ્તુરિ      ૫૧ „ રત્નશેખરસ્તુરિ

૪૭ „ ગુણુસમુદ્રસ્તુરિ      ૫૨ „ હેમયંત્રસ્તુરિ

૪૮ „ જ્યશેખરસ્તુરિ      ૫૩ „ પૂણુંચંત્રસ્તુરિ

૪૯ „ વજસેનસ્તુરિ      ૫૪ „ હેમહંસસ્તુરિ

૫૫ „ લક્ષ્મીનિવાસસુરિ ૫૬ „ પુષ્ટ્યરત્નસૂરિ  
૫૭ શ્રી સાધુરત્નસૂરિ

આમ તેઓશ્રીની પાટે એક પઢી એક પ્રલાવશાળી,  
કિયોદ્વારક અને ચારિત્રયુડામણિ આચાર્યો થઈ ગયા.  
એમના સમય દરમયાન શાસન હિતના અનેક કાર્યો થયા છે  
પણ એની બહુ જાણ સમાજને નથી

પરંતુ શ્રી સાધુરત્નસૂરિની પાટે વિભૂષિત થનાર અનંત  
શક્તિના ધર્મા-શાંત, દાંત, મહંત અનેકગુણગણાલંકૃત,  
ચારિત્રયુડામણિ આચાર્યભગવાન શ્રી ૧૦૦૮ શ્રી પાર્શ્વ-  
ચંદ્રસૂરીશ્વરજી મહારાજનું નામ લેતાં જેમ સૂર્યને દેખી  
કર્મ વિકાસને પામે, મેધને જોઇ કૃષિકાર હર્ષને પામે અને  
ધન દોલત પ્રાસ થતાં નિર્ધનને આનંદ થાય તેમ આપણા  
હૈયા પ્રકૃતિલિત અને ગર્વથી લર્પુર બને એ સ્વાભાવિક છે.  
આ જગતમાં અનેક જીવો આવે છે અને ચાદ્યા જય છે.  
કાગનું ચક નિરંતર વધ્યાજ કરે છે. એના સુખમાં માનવહેલ  
જીવનકાળ પુરે થતાં ચાહેલ જુકાવે છે, એમાંથી બહુજ  
શ્રોતાનાં નામો આપણે યાદ કરીએ શીએ. એમને સાક્ષાત્કાર  
માની પૂજાએ છીએ.

શ્રીપાર્શ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમયથી શ્રી-  
મજાગપુરીયતપાગચ્છ ઉર્દે તેઓશ્રીના નામ સાથે  
અંકળાયેલ શ્રી ‘પાયચંદ ગચ્છ’ને ઓળખ્ખીએ છીએ.  
આ મહાન પુરુષના સમયમાં આ ગચ્છ ખૂખ્ખૂઅ પ્રકાશમાં  
આવ્યો છે અને ત્યારથીજ તે શ્રીપાર્શ્વચંદ્રસૂરીગચ્છ યાને  
પાયચંદ અરદ્ધશ્રી અપ્રચિદ્ધ છે.

શ્રીપાર્થ્યચંદ્રમૂર્તીક્ષરળ મહારાજ એવું કેવું જીવન જીવ્યા કે આપણે આજે એમના કાળધર્મ પામવાને ચાર ચાર સદ્ગીઓ પસાર થવા છતાં યાદ કરીએ છીએ, પૂજુએ છીએ? એ વિચારવું અને હૃદયમાં ઉતારવું જોઈએ. જીવન પણ એક સમશ્યા છે. સાચી રીતે જીવન વ્યતિત કરવું એ કષ્ટસાધ્ય વરતુ છે. જીવન એક અણુમાલ સાધના છે. અનન્ત સાધકો એની સિદ્ધિ માટે આવે છે. તેમાંથી કેટલાક એની સાચી આરાધના, કેટલાક વિરાધના તો ખીજ ઉપેક્ષા કરીને આ દેહથી ચાંચા જાય છે. સાચું જીવન તો વિરતિમાં રહેલું છે. કે જે માટે અનંત જ્ઞાનના ધર્ણી-ત્રિલોકનાથ શ્રી તીર્થ્યકર ભગવંતોએ ઉપરેશ આપ્યો છે. જે જે પુરુષોએ એ ઉપરેશા-મૃતનાં પાન કર્યાં છે-એનો રસ જીવનમાં ઉતાર્યો છે તે આ ભવસિધુને તરી ગયા છે અને અનેકને તારી ગયા છે. એમાંના એક આપણા ગરછના મુગટમણિ સમા શ્રીપાર્થ્યચંદ્રમૂર્તીક્ષર ભગવાનતું જીવનચરિત્ર આપણુને હરહંમેશા પ્રેરણા આપનારું નીવડે એ અથે ઉતારવામાં આવે છે. જેને ચિત્ત દઈ વાંચી જવાથી પણ અનેક આત્માએનાં હૃદય ઉજ્જમાલ થશે.

### યુગપ્રધાન શ્રીપાર્થ્યચંદ્રમૂર્તિ ચરિત્ર.

ચૌહાણ રાજ હમીરસિંહે સ્વપરાકુમથી વસાવેલ હમીર-પુરમાં વીશા પોરવાડ જ્ઞાતિમાં કુળદીપક નરોતમ શાહ ના સુપુત્ર વેદગશાહ નામના શ્રાવકના ગુણોથી સુસજજ ડ્રિયાપાત્ર અને જીવનમે ધર્મભાગે લઈ જનાર સુશ્રાવક

શ્રીમનાગપુરીયતપાગંધાવિરાજ શાસ્ક્રિનિશારહ બાલ-  
અભયારી યુગપ્રધાન શ્રી ૧૦૦૮ શ્રીમત્  
પાદ્યોચંદ્રસૂરીશ્વરજી મહારાજ.



જી-મ સં. ૧૫૩૭

દીક્ષા સં. ૧૫૪૬

ઉપાધ્યાય પદ સં. ૧૫૫૪

કિયોદ્ધાર ૧૫૬૪

ને મહાનવિમુત્તિના પ્રેરક જીવનકાર્યો માટે તેઓશ્રીનું જીવનચરિત  
મહનપૂર્વક વાંચી જવા જૈન જનતાને વિનંતિ છે.

જી-મ સ્થાન હમીરપુર

આચાર્યપદ સં. ૧૫૬૫

યુગપ્રધાનપદ સં. ૧૫૮૮

સ્વર્ગવાસ સં. ૧૬૧૨



હતા. તેમના પતનીનું નામ હતું વિમળાહેવી. આ દંપતી ઉલય ટંક આવશ્યક પ્રતિકમણ, પૂજા-પ્રલુના ગુણુતુરાગ અને રિદ્ધિસિદ્ધિના પ્રમાણમાં દાનાદિ આત્મકલ્યાણકારી પ્રવૃત્તિમાં હરહુંમેશા રસ્યાપદ્યા રહેતા. વિમળાહેવી હુંમેશાં પતિના ઉત્તમ વિચારોમાં સાનુકુળ થનારી આદર્શધર્મ-ચારિણી હતા. કેટલોક કાળ વ્યતિત થયા ખાદ વિમળાહેવીને ગર્ભ રહ્યો કે જે પ્રલાવિક ગર્ભના પ્રલાવથી વિમળાહેવીનું મન હુંમેશાં દેવદર્શાન, પૂજન, પ્રલાવના, તીર્થવંદન, ગુરુ-લક્ષ્મિ આદિ ધર્મકાર્યો તરફ સવિશેષ દોરાવા લાગ્યું. જ્યારે ગર્ભનો જીવ મહાપુરુષ થવાની આગાહી આપે છે ત્યારે તેની માતાને એવાજ ઉત્તમ વિચારો સ્વયં પ્રગટે છે. વિમળાહેવીને આ ગર્ભ રહેતાં પહેલા થોડાજ સમયે એક એવું સ્વર્પન આવ્યું કે જણે પૂર્ણિમાનો ચંદ્ર વિકસતો તેણીના વદનકમળાને દેદીઘ્યમાન કરે છે. વિમળાહેવીએ સ્વર્પનની વાત પોતાના પતિ વેલગશાહ પાસે રણુ કરી અને વેલગશાહે પોતાની બુદ્ધિ અને મેળવેલ જાન વડે કહ્યું કે “આજથી ર૮૦ દિવસે આપણુને એક પુત્રરત્ન સાંપડશો. તે કોઈ સામાન્ય નહિ પણ જગતના જીવોનું કલ્યાણ કરનાર મહાપુરુષ થશે, જૈન ધર્મની જ્યપતાકા ચોમેર ફરકાવશે અને જગતમાં પોતાના કુળને અજવાળશે.” એથી વેલગશાહે પુત્રનું નામ પારસ્યં દરાખવાનો મનસુષો જણેર કર્યો.

વીર પરમાત્માના ત્રિકાલાભાધિતશાસનની ગર્ભકાગ દરમ્યાન આ ધર્મદંપતી ઉત્તમ પ્રકારની આરાધના કરે છે અને જીવનની સાર્થકતા માને છે. જેમની ઉત્સાહભરી વિશ્રદ્ધ

પ્રવૃત્તિ ધાર્મિક જનતાના અંતરમાં આરીવીદના અમીજરણાં ભરે છે—જેમનો ધર્મરાગ જેઈ જનતા લક્ષ્મિભર્યો હૈડે અનુ-મોદના કરે છે અને ભવોભવ આ શાસન મળો એવી મનોભાવના ભાવતાં રહે છે. શાસનસેવા સિવાય આત્મોન્તતિ સાધક દિંયપંથ જગતમાં ખીને કોઈ નથી એવી માન્યતા જેમના રોમેરોમમાં પરિણમેક્ષી છે તેવા આ ધર્મદંપતિના સ્વર્ણની અને સ્વર્ણ અંગે ભાખેલા ભવિષ્યની સત્યતા સાખિત થવાની ઘડી આવી પહોંચી.

અને જે દિવસ કેટલાક જૈન જ્યોતિર્ધારો અને અવતારી મઙ્ગાપુરુષોના જન-મહિન તરિકે સુવિષયાત છે તેજ સંવત ૧૫૩૭ના ચૈત્ર સુદ ૬ શુક્રવારની ર્ણીયામણી રાત્રે શુભ મુહૂર્તો વિમળાહેવાંચે પુત્રરત્નને જન્મ આપ્યો.

પુત્રના જન-મથી ઉદ્ઘાસ પામીને વેલગશાહે અનેક પ્રકારના દાનો કરવા વડે સાધુ મુનિરાજેને આવશ્યક વસ્તુઓ વહેઠારાવવા સાથે સાધભીડી અને અતિથિયોની ઉત્તમ પ્રકારે ભક્તિ કરી. વાળુંત્રો મીડા શ્રોદો ગજવતા હતા—સુમંગળ દિવસ હોઈ સાકરની પ્રભાવનાદિ હર્ષવૃદ્ધિ કરનારા તેમજ ધર્મને પ્રાધાન્યપણું આપનારા અનેકવિધ કાર્યો વધુ પ્રગતા ગતિથી થવા લાગ્યા. શ્રી જિનમંહિરમાં અફૂઈ મહોત્ત્સવ ઉજવાયો. આમ પુત્રજન્મની વધાઈમાં પુણ્ય ઉપાર્જન કર્યું. આખરે મતુષ્યના જીવનના લેખો લખવાનો વિધાતાનો નિર્માણ કરેલ ‘છઠીના લેખો’નો દિન—છફો દિવસ થયો. ને પોતે કરેલા મનસુખા મુજબ પુત્રનું નામ પાસચંદ (પાર્શ્વચંદ) કુમાર રાખવામાં આવ્યું. જેમ બીજનો ચંદ્ર


પ્રતિદિન વૃદ્ધિને પામે, જેમ મેઘની મહેર થતાં જમીનમાંથી તરુએ વિકાસ પામે, જેમ ભરતી આવતાં દરિયે પ્રકુલ્પિત ખની હેલે ચઢે તેમ પાસચંદ કુમાર દિન પ્રતિદિન વધવા લાગ્યા. મુખની અને હેઠળી કાંતિ પણ એવીજ હતી કે જણે પુનમનો ચંદ્ર. કહેવત છે કે પુત્રના લક્ષ્ણ પારણામાંથી તેમ આ પાસચંદ કુમારનું આદ્યજીવન પણ એટલુંજ નિર્દેખ અને મહાપુરુષના ભાવીનું સુચક હતું. મહાપુરુષોના માતપિતાદિ પણ એવાજ કુણ અંસ્કારી અને વિશિષ્ટ પ્રકારે જીવનનો સમય સ્વપ્રકલ્યાણ માર્ગમાં પસાર કરનારા હોય છે. હુન્યવી મહાપુરુષો ગણ્યાય છે તેમના તરફ દ્રષ્ટિપાત કરતાં આપણુંને એજ વસ્તુનો અનુભવ થયા વિના કંઈ રહેતો નથી.

આજે આપણે જેઠાં છીએ કે જૈન સમાજમાં વર્ત્માન વાતાવરણની હવાએ કેવી અસર નીપળવી છે કે ઉત્તમ કુણ, જૈનધર્મ અને ઉમદા વાતાવરણમાં જન્મવા છતાં પણ સંસ્કારોના અલાવે કેશ્વાક જૈનો ઉન્માની-ઉત્સૂત્રભાષી અને ધર્મ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ દાખવનારા જેવામાં આવે છે. અઃ ખધાનું કારણ માતપિતાદિના સંસ્કારસિંચનના અલાવનું છે. કુમળા આડને જેમ વાળીએ તેમ વળે છે તેવીજ રીતે બાળકને જેવા અંસ્કારો ગૃહેથી મળે છે તે મોટે ભાગે તેના જીવનમાં સ્થગીત રહે છે. કોઈ વૃક્ષને ભીલવિનું હોય તો ઉત્તમ પ્રકારના ખીજ નાખવા જેધાએ. થોર વાવીને બોરડીના ભાશા કર્ય રીતે કરી શકીએ? તેવીજ રીતે બાળકોમાં સંસ્કારો કેવા રેડવા તેની ચિત્તા જૈનસમાજે રાખવીજ રહી. તેમ નહિં થાય તો આ ચુગમાં જેમ પુત્ર પિતાની, પુત્રી માતાની અને

સ્વરૂપનો વડિલોાની અને વડિલો ગુરુની આજાને ઘોળીને પી જનારા નીકળે છે તેમ ભવિષ્યમાં વધુ ઉન્માદી નીવડે તેમાં શું નવાઈ? જૈનશાસનમાં થઈ ગયેલા જ્યોતિર્ધર્મો અને મહાપુરુષોના માતપિતાઓના જીવનમાંથી આપણે ધારીએ તો ધારું મેળવી શકીએ તેમ છીએ. એમ થાય તો “આજના છોકરાજ એવા છે-જમાનાનો પવન છે” વિગેરે કહેવાનો સમય ન આવે. જૈન માતપિતાઓને આવી બાળતમાં ઉપદેશ દેવાનો હોય કે? નહિં. પરંતુ આજે કેટલાક વડિલોાની રહેણી-કરણી એવી જોવામાં આવે છે કે પુત્રને હોષ હેવા કરતાં પુત્રના ભાવીના જવાખદારી અદા નહીં કરનારા માતપિતાનેજ હોષીત કેળીએ. માતા આજે પુત્રને હાલરડું ગાતાં ‘પાઠકે એસી નાયો’ વિગેરે ગાતાં સાંલળીએ છીએ-‘ બાવો આન્યો’ એવી ધમકી રડતાં શાંત રાખવા કે પોતાના કોઈ કાર્યમાં બાળક મસ્તી કરતો અટકે એટલા ખાતર આપીએ છીએ. આ બધાનું પરિણામ આજની પ્રભાની નિર્ભળતામાં આન્યું છે. જૈન માતાઓએ તો સતી-ઓના જીવનગ્રસ્ત્રો-શ્રીતીથારુદેવોએ પોતાના પુત્ર મારે ચિંતવેલા સંસ્કારોને ઝડપ્યમાં ઓતપ્રોત કરી તેના હાલરડા ગાવા. જેઇએ કે જેથી બાળક તેજસ્વી અને સંસ્કારી થાય પછી કોઈ પૂર્વના પાપોદ્યે ધર્મવિરોધી બને તો તે જુદી વાત છે.

આશીજ વેલગશાહ અને વિમળાહેવીરૂપી સોનું ને સુગંધની જોડલીએ પોતાના બાળકમાં ઉચ્ચ પ્રકારના સંસ્કારો રેડવાની અહુનિંખ ચિત્તા સેવી હતી અને ગર્ભકાળ અને જરૂમ પછી

श्रीभगवान्पुरीयतपागच्छगगनहिनमणि युगप्रवान  
 श्रीपार्वत्यंद्रसूरीयरल्लना भद्रिमानो अने धर्मनेः  
 विजय इंडो वगाइनार



आवन वीरमांना वीर उपासकना तात्कालिक  
 वांछित पूरनार भक्ता लैरवहेव.  
 अमदावाद-शामगानी पोणना उपाश्रयमां दादानी हेरीमां



પણ એવાજ ઉદ્ઘાસ આપનારા કાર્યો કરવા ચાહું રાખ્યા હતા.

ખીજના ચંદ્રમાની પેઠે વૃદ્ધિ પામતા પાસચંદ કુમારને બાદ્યકાળ પણ એવો સુરમ્ય હતો કે તેને જેનારને એમ લાગ્યા વિના ન રહે કે આ બાળક આગામ જતાં મહાન થશે. જેમ માટીમાંથી સુવર્ણને કાઢીને એપ આપતાં ચળકાટ આવે છે, જેમ વાદવિવાદમાં પંડિતોની પડિતાઈની પીછાન થાય છે, જેમ શીશીમાં પુરેલ કસુરી બુચ ઓલતાંજ તેની મનોહર સુગંધીનો અનુભવ થાય છે તેમ વડિલોના સંસ્કારોથી ઘડાયેલા બાળકો મોટી ઉમ્મરે હીપી નીકળે છે. અસાધારણ બૃદ્ધિવાળા આત્માઓ પૂર્વના પુષ્યોદયે વિદ્યાભળ અને આત્મભળનો સંચાર થયેલ હોઈ નાની ઉમ્મરે મોટા અનુભવી જેવી વાતો કરે છે.

પાંચ વર્ષની વય થતાં માતાપિતા પાસચંદ કુમારને સુગુરના હાથમાં સુપ્રત કરે છે. અને જેમ બાહોશ માળીના હાથમાં રહેલ અગીચો ફાલે કુલે છે તેમ કુમાર પાસચંદ નાની ઉમરમાંજ પોતામાં રહેલ અગ્રભ્ય ક્ષયોપસમને ફોરવે છે અને યોગ્ય શુરૂના સહયોગથી શિક્ષણમાં આગળ વધે છે. મહાપુરુષો બાદ્યકાળથીજ વિદ્યામાં ચકોર હોય છે. શ્રી વાદ્યિવસ્તુરી, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી ઉમાસ્ત્વાતી મહારાજ વગેરે મહાજ્ઞાની પુરુષોના જીવનચરિત્રો અને તેમાંથી બાદ્યકાળ તપાસવાથી એ વાતની ખાત્રી થશે.

બાલક કુમાર પાસચંદના ભાવી સંસારની ચિંતા કરતાં માતપિતા તેને માટે ઉત્તમ કુળની-શીળવતી, ગુણ-કૃપ સંપત્ત કન્યાની શોધ કરવાનો નિશ્ચય કરે છે. પરંતુ જીજુ ગાંગુ

પુત્રની જન્મકુંડલી તરફે નજર કરે છે તો તેમાં સર્વણતા મળશે કે કેમ એનો પણ વિચાર કરે છે, કારણ બાળકના જન્મમાસ્કરે જાતાવતી જન્મકુંડળીમાં તો બાહ્યકાળેજ દીક્ષા કળાનિધિયોગ અને અંશાવતારના યોગો પડેલા હતા. આમ છતાં પુત્ર પ્રત્યેના ઠાલ અને ભમતાને કારણે વેલગશાહ અને વિમળાદેવી ઉત્તમ કુળવધુની તપાસતાં વિચાર કરે છે. પરંતુ લવિતવ્યતાના યોગે મહદૂલિપકારી ગુરુરાજ શ્રી સાધુરત્નસૂરિજીનું હમીરપુરમાં આગમન થાય છે. શ્રી સંધધામવું મપૂર્વક સામૈયું કરી પૂર્ણ સાધુરત્નસૂરિજીને શહેરના ઉપાશ્રયમાં લાવે છે. ગુરુજીના ઉપહેશામૃતનો હમીરપુરની જનતા લાલ લે છે. ત્યારે જે બાળકના જન્મ અને પૂર્વલવના સંસ્કાર ઉત્તમ હોય. જેનું ચિત્ત ધર્મમાં પરોવાયેલું હોય તે આવા સુગુરુથી અદગ કેમ રહી શકે? કુમાર પાસ્યંદ પણ ગુરુની પાસે આવવા લાગ્યા. ગુરુના પરિચયથી તેમની સ્થિર રહેલી શક્તિઓ ખીલી ઉઠી અને તેઓ ગુરુને પણ કેટલીકવાર પ્રશ્નો પૂછવા લાગ્યા. ગુરુને લાગ્યું કે આવો વિચક્ષણ ખુદ્ધિવાળો શિષ્ય મળી જાય તો કેવું સાઝે? તેવોજ પડ્યો કુમાર પાસ્યંદના હૃદયમાં પડ્યો. હતો કે જે આવા ગુરુદેવની હંમેશા માટે સેવા મળી જાય તો લવસાગર કેમ ન તરી જાઉ? જેમ સુગુરુઓ ઉત્તમ શિષ્યોને શોધતા હોય છે તેમ યોગ્ય શિષ્યો પણ ઉત્તમ ગુરુના યોગની રાહ જેતા હોય છે. જ્યારે બન્નેનો સુમેળ લાગ્યયોગે થાય છે ત્યારે મનના મનોરથો ફૂલે છે. અને જે માતાપિતા વર્ષોથી જૈનશાસનની સેવા કરી આત્મકલ્યાણ અર્થે ઉત્તમ કોટીની આરાધના કરવા

મારેની એક એક તક જડપી લેવા હંમેશા તૈયાર હોય છે તે આ અસાર અંસારને જેઠને જન્માર્ગ જતાં પુત્રને શા માટે રોકે? કુમાર પાસચંદના માતપિતાને તો તેમના જન્મની સાથેજ ખાત્રી હતી કે આ પુત્ર જગતવંદ્ય થશે અને તેમ થવાનો રાહ કોઈ હુન્યવી લક્ષ્મી કે માયા ભમતવનો નહોતો પણ એ રાહ હતો અનેક સુસુલુ આત્માઓને મુક્તિ મેળવી આપનારો—ત્યાગનો.

કુમાર પાસચંદની ઈચ્છા જેઠ માતપિતા પણ વહીલથી પુત્રની માગણીને મંજુર રાખે છે અને જૈનશાસ્કારોના કથનમાં કહીએ તો સાચા હિતસ્વી માતપિતા તરિકેની કુરજ ખજાવે છે. પરંતુ વર્તમાન જગતમાં આપણે કેટલાયે ક્રીસ્ટાઓમાં આથી ઉદ્દોજ વર્તાવ જેઠાએ છીએ. આજે દીક્ષા લેવા તત્પર થનાર ઘણું પુત્રોને માતપિતાને જાણ થતાં રોકવામાં આવે છે. દીક્ષા એ કેમ જાણે કોઈ અનિચ્છનીય કે લયંકર વસ્તુ ન હોય એમ હુન્યાની દ્રષ્ટિએ દેખાડવામાં આવે છે, ઉંમર લાયક પુત્ર-પુત્રીઓ શાસ્કોક્તારીતે દીક્ષા બ્રહ્મણ કરે ત્યારે માતા-પિતાને એવા કુળને દીપાવનાર રતનો માટે હંમેશાં હર્ષજ થવો જેઠાએ. આ સ્થળે અચોંય દીક્ષાનો બચાવ કરવાનો જરાપણ હેતુ નથી. એ વાત ખરાખર છે કે કેટલીયે વાર પાત્ર-સ્થિતિ-સંજોગોનો વિચાર કર્યા વિના કે ચોંય પરીક્ષા વિના દીક્ષા આપવાથી ખોદું ઘર્ષણું ઉલ્લં થાય છે પરંતુ ખીજુ બાળુ ચોંય દીક્ષાઓ અંગે પણ સગાસ્નેહીએ ને કુદુંખી-જનોની ધમાલ જેવામાં આવે છે. ધર્મને તેના સાચા સ્વરૂપમાં

એળાયો. નથી એનુંજ પરીણુામ છે. જે દિવસે જૈન માતપિતા શ્રી જિનેશ્વરદેવો કથિત માર્ગને સમજશે ને સમજને હૃદયમાં ઉતારશે તે દિવસે આજના જેલું વિષમ ને ડોળાયેલું વાતાવરણ નહિ હોય. દરેક માતપિતાએ વેલગશાહ ને વિમળાહેવીની ભાવનામાંથી પ્રેરણું લેવી જોઈએ.

**કુમાર પાસચંદની દીક્ષાનો** સમય નક્કી થયો તે પૂર્વે અફ્ટાઈ મહોત્સવાહિ ધાર્મિક કિયાની ધામધુમ વેલગશાહને આંગણે શરૂ થઈ. ગરિયાને દાન, સાધર્મિક બંધુઓની અક્રિતિ, ગુરુપૂજન, મંગળ ગીતો ઉપરાંત સારાયે હમીરપુરમાં માંગલિક પ્રસંગને અનુરૂપ શોભા ને નગર રચના થઈ. ઘેર ઘેર આનંદની છોળો ઉછળવા લાગી. જ્યાં જૈન શાસનની પ્રલાવના થતી હોય ત્યાં આવી જતનું વાતાવરણ હોય એમાં આશ્રીયે પામવા જેલું કંઈ નથી.

આખરે ત્યાગ માર્ગના પંથી કુમાર પાસચંદની દીક્ષાનો દિવસ તે સંવત ૧૯૪૬ ના વૈશાખ સુદ ઉ ને શુભ દિન આવી પહોંચ્યો. અને વાજતે ગાજતે મુલ્યવાન પાલખીમાં એસી પાસચંદ કુમાર સંસારની માયાનો અંચળો ઝગાવી ત્યાગ માર્ગના મુસાફર બન્યા અને શ્રી ચતુર્વિધ સંધ શહેર બહાર આવેલ બગીચામાં રહેલા અશોકવૃક્ષની શીતળ છાંયાનીચે આવી પહોંચ્યો.

ગુરુદેવ શ્રી સાધુરત્નસુરીજીએ વિશાળ સમુદ્દરાયની હાજરીમાં જૈન શાસ્કોક્તા વિધિ અનુસાર દીક્ષા આપી કુમાર પાસચંદનું મુળનામ કાયમ કરી મુનિ પાર્શ્વચંદળ રાખ્યું

આ પ્રસંગે જનતામાં જે આનંદમંગળ પ્રવતી રહ્યો હતો અને ધર્મની જે પ્રલાવના થઈ તેનું વર્ણન શફ્ફોભાં શું આપી શકાય? આ દીક્ષાને દિવસ અક્ષય તૃતીયાના મહિમાથી નિઅ૰થિત થયેલો છે. ભગવાન શ્રી ડ્રષ્ટલહેવસ્તવામીને તપશ્ચર્યા પુરી થતાં શ્રી શ્રેયાંસકુમાર છક્ષુનો રસ આ દિવસે વહેઠારાવે છે. આજે પણ પાદીતાણુમાં એ તપશ્ચર્યા કરનારા મહાનુભાવો વૈશાખ સુદ ઉના રોજ પોતાનું વ્રત શેલડીનો રસ પીને પુરું કરે છે.

દીક્ષાને અંતે મુનિશ્રીપાશ્રીચંદ્રજીના સંસારી માતપિતા આજણો, લોજકો તેમજ યાચકેને સારા પ્રમાણુમાં દક્ષિણા આપે છે. દીક્ષાના દિવસે ગુરુ અને શિષ્ય ખંડાર રહે છે અને બીજે દિવસે સામૈયાપૂર્વક શહેરના ઉપાશ્રેયે લાવવામાં આવે છે.

**મુનિરાજશ્રીપાશ્રીચંદ્રજીએ તો ગુરુલુ પાસે શાંતોનો અલ્યાસ શરૂ કર્યો.** ખરુણાસ્ત સંબંધીની ચર્ચાવાદનાં શાંતો, વૈદ્યાકરણ, કાવ્ય સાહિત્ય, નાટક, ચંપુ, સંગીત, રસાલાંડાર, તડ, યોગ, સ્વમતમંડન, પરમતખંડન, આગમો, શ્રુતિ-સ્મૃતિઓ, ગણ્યિત, પ્રકરણ, વિગેરે અનેક ગંભીર રહુસ્યવાળા શંથોનો અલ્યાસ શરૂ કર્યો. આ ઉપરાંત કાવ્ય, ચિત્ર-પ્રબંધ, રાગ-રાગણીઓનું જાન, કવિતામાં પદવાલિત્યતા, અર્થગંભીરતા અને અદોષતા લાવવાનું જાન, વૈધક, સંસ્કૃત, માગધી, પ્રાકૃત વિ. ભાષાઓનો ઉચ્ચ અલ્યાસ દુંક સમયમાં કરી એક ધુરંધર વિદ્ધાન આચાર્યના પદને શોભાવે એવા સ્થાને ચઢ્યા. **મુનિશ્રીપાશ્રીચંદ્રજીની નિગ્રણણુદ્ધિથી ગુરુ પ્રસન્ન થયા અને ડેર ડેર એમના જાનની પ્રસંશા થવા લાગી,**

સરસ્વતીપ્રસાહનું બિડુહ પ્રાત કરવામાં, મતવાદીઓના વાટનું ખંડન કરવામાં, હૈવીચમતકારો હેખાડવામાં અને જિતાજા સુજખ આત્મકંથાણુના રાહની શોધ કરી તેને જીવનમાં ઉતારવામાં તેમનું ચિત્ત સદાય પરોવાયેલું રહેતું.

અક્ષેસોસની વાત છે કે આવા મહાપુરુષોની જગતી કારકિર્દિનું પાનું જૈન સમાજથી મોટેલાગે ખીડાયેલુંજ રહ્યું છે. આ મહાપુરુષ જયારે દ્વાલિસર-વાહ કરનાર પ્રત્યે પણ માનપૂર્વક ચર્ચાઓ ચલાવતા અને વિજ્ય મેળવતા ત્યારે આજે આપણું સમાજને તિથિચર્ચાએ કેટલો છીન્નભીજ કરી નાંખ્યો છે? તિથિચર્ચાએ આજ એ સ્વરૂપ ધારણ કર્યું છે કે જે એને ઉપશમ નહિ થાય તો એ કેટલી હુદે પરસ્પર તિરસ્કાર વરસાવવા તરફ વળશે. કે વધુ અંગત સ્વરૂપ ધારણ કર્યું છે તે જેતાં આપણને ખરેખર ખેદ ઉપજે એમ છે. છતાં જયાં એ રણ્ણાંધપણું પ્રત્યક્ષ બેહું હોય ત્યાં સત્ય સમજવે કોણું? સુનિરાજ શ્રીપાર્થીચંદ્રજીએ વિવાહો કરી પ્રતિપક્ષીઓને વિજ્ય કણુલ કરાવ્યો તે કયાં અને આજનો સ્વમતે કલ્પી લીધેલો પ્રતિપક્ષનો પરાજ્ય અને જાતીય વિજ્યની વાત કયાં?

આમ શાસ્ત્રોનું ઉચ્ચયજાન મેળવી, ઉત્તમશક્તિ ડેળવીને સુનિરાજ શ્રી પાર્થીચંદ્રજીએ શુરુની પ્રસન્નતા અને ડેરડેરથી તેઓશ્રીની વિદ્વતાથી આકર્ષાયેલા શ્રીસંઘોની વિનિતિઓ થઈ. સં. ૧૫૪૬ થી ૧૫૫૪ લગીના આઠ વર્ષના દુંકા સમય દરમયાન શ્રી પાર્થીચંદ્રગણ્ણોએ વિદ્યાકળામાં મેળવેલી

અનહુદ નિપૂણતા, જનસમાજના હૃદયમાં પ્રાપ્ત કરેલું સ્થાન અને વિશ્વભરમાં અગાધ જ્ઞાનના યોગે મેળવેલ ખ્યાતિના પરિણામે અને લોકલાગણી-શુરૂની પ્રસન્નતા અને શિષ્યની યોગ્યતાએ ઉપાધ્યાયપદ અપણું કરવાના લાભવાનો કળાંશ નાગોરના શ્રીસંઘ પર ઢાગાયો. આથી સકળ સંઘમાં આનંદ પ્રવતીં રહ્યો. આજની આપણી સ્થિતિ જોઈએ છીએ ત્યારે યોગ્યાયોગ્યતા તપાસ્યા વિના પહીવીએ ધારણું કરનારના મોહના કારણે અપાય છે. તે માટે આપણુંને બહુજ ઐદ થાય છે. યોગ્યનું યોગ્ય સંમાન થવું જોઈએ. પણ એ યોગ્યતા માપવાનું કામ તો સંઘનું છે.

પૂરો શ્રી પાર્શ્વચંદ્રજીને ઉપાધ્યાયપદ આપવાનું હોઈ શેડ ભજવાણી ગોત્રના સહસ્મલજ વિગેરે ભાવિક ભક્તોએ અફુંદ મહેતસ્વ શરૂ કર્યો. દેશદેશાવરના શ્રીસંઘાને આ શુભ અવસર પર નાગોર પધારવાની વિનંતિ કરતી નિમંત્રણ-પત્રિકાએ હલકારાએ દ્વારા મોકલામાં આવી. સારાયે શહેરમાં અમારીધોષ વગડાવ્યો, જિનમંહિરામાં રોજ પૂજાએ ભષ્યાવા લાગી, સ્વામીવાત્સલ્યાદિ કાયો અનેરા હું વર્ચે શરૂ થયા. આમંત્રણપત્રિકાએ પહેંચતાં સ્થળે સ્થળેથી શ્રી સંઘના અશેસરો આવી પહેંચ્યા. દેવગુરુની લક્ષ્ણિનો રંગ ખૂબ ઝીલી ઉઠ્યો. ચોમેર આનંદનું જ વાતાવરણ જમેલું હતું. શુલ મુહૂર્તે, કિયા-વિધિપૂર્વક પૂરો શ્રી પાર્શ્વચંદ્રજીને સંવત ૧૫૫૪માં ઉપાધ્યાયપદથી વિભૂષિત કરવામાં આવ્યા અને એ વર્ખતે પધારેલા હલારો ભાઇ પહેનો તેમજ નાગોર-

વાસીઓમાં ઉત્સાહ ને આનંદના જે ઉલ્લરાઓ આંધ્રા તેનું  
વર્ણન શાખાઓમાં કરી શકાય તેમ નથી.

**પૂઠ ૫૦ મુનિરાજશ્રીપાર્થીચંદ્રજી ઉપાધ્યાય**  
 પદવીથી વિભૂષિત થયા બાદ જ્ઞાનતત્ત્વના સંશોધનમાંજ હૃદયને  
 આત્મોત્ત્સાહની રીતને એટાત્મોત્ત્સાહની રીતને કરે છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજે ચોથા પરમેષ્ઠીપદે  
 પ્રતિષ્ઠાત્મક હોય છે. એ પરમખિંઓ શ્રી આચારાંગ આદિ બારેય  
 અંગસૂત્રોના સ્વાધ્યાયના પારગામી અને તેના અથોના ધારક  
 હોવા સાથે તે સૂત્ર અને અર્થું ઉલ્લયનો વિસ્તાર કરનારા  
 હોય છે. ઉપાધ્યાય ભગવાન શ્રી પાર્થીચંદ્રજી ગણિષુવરમાં  
 એ ત્રિવેણીસંગમનો યોગ હતો. સમ્યકૃત્વની આ જાતની  
 સુંદર પ્રકારની નિર્મણતાથી આ મહાપુરુષ જગતલરમાં પંકાયા  
 છે. આવા મહાપુરુષો અજ્ઞાનરૂપ વ્યાધિથી પીડાતા આત્માઓ  
 માટે ધન્વન્તરી વૈધની ગરજ સારે છે. કારણું જગતમાંથી  
 અજ્ઞાનરૂપ રોગને દેશવટો આપવામાં તેઓ સમ્યગ્જ્ઞાનરૂપી  
 ઔષધીનોજ ઉપયાર કરનારા હોય છે. આ મહાપુરુષે શ્રુત-  
 જ્ઞાનનો ઉપયોગ એટલી સુંદર રીતિયે કર્યો કે જે કળાના યોગે  
 શ્રુતમાં આવતા ભાવન અક્ષરોને ભાવનાચંદ્રન બનાવી-તેના  
 વડે જનતાના પાપરૂપી તાપોને વિદ્યાર્થી છે. આવા ઉચ્ચ  
 કોટિના વર્તન દ્વારા સ્વપ્રરના જીવનનું શ્રેયસાધનારા આત્મા-  
 ઓની ઉપાસના કરવાનું સદ્ગુલાઙ્ગ જેમને સુયોગે સાંપડયું છે. તેઓ  
 અરેજ આસનસિદ્ધિક છે એમ કહેવામાં જરાપણ ખોદું નથી!

**આમ અનેક સુમુક્ષુઓને સન્માર્ગે હોરી રહેલા ઉપા-  
 ધ્યાયમેવર શ્રીપાર્થીચંદ્રજી બારકોટ-મેવાડ વિગેરે પ્રહેશોના।**

અવ્યજીવોને પ્રતિષ્ઠોધતાં વિહારને આગળ લંખાવે છે. ડેર્ટેર એ મહાપુરુષના મુખેથી જરૂરી સિદ્ધાંતિક વચ્ચેનોની સરિતામાં અનેક જીવો પાવન થતા રહ્યા. અને થાય એ સ્વાભાવિક છે કારણ ગમે તેવો પાપાત્મા પણ પુણ્યોદયે સહૃદયનો યોગ પામીને પાપલીકૃ બને, તો ધર્મનો અધિકારી બનવા લાગ્યાણી થાય છે. અનેક જીવોએ પાપનો ત્યાગ કરી પ્રલુપ્તિની ધર્મનો સ્વીકાર કરવા મારે આ મહાપુરુષ પાસે તત્પરતા બતાવી હતી. આ શાશ્વતમાં એવા અનેક દ્રષ્ટાંતો છે કે વોર પાપાત્માઓ પણ સહૃદયના યોગે પરમધર્માત્મા બનીને જામાન્ય મનુષ્યોને આશ્ર્યચંદ્રકિત કરી નાંએ એવી રીતે ખણ્ણ અદ્યપકાળમાં પરમપરના લોકોના બની શક્યા છે.

આ પ્રતાણી ઉપાધ્યાયના ઉચ્ચવિહારમાં આવેલા સ્થળોએ ઉપરેણાના પરિણામે ડિઝકો હિસા તરજ્વા લાગ્યા, અશ્રદ્ધાવાનું શ્રદ્ધાનું બનતા ગયા, કૃપણુમાં પણ ઉહારતાની ભાવના જણાવા લાગી, ધર્મથી વિમુણ રહેણારાઓ તેની નજુક આવવા લડચાયા. આમ અનતું એ સ્વપરાત્મકલયાણુની ભાવના ભાવનારા મહાપુરુષો મારે ખણ્ણ છે. ઉપાધ્યાયપ્રવર શ્રીપાર્શ્વચંદ્રજી યતિઓમાં ઉત્તમ હતા. સુખ કે હુઃખ, શોક કે હર્ષ નિદા કે પ્રસંશા એ દરેક પ્રસંગોએ આવા આત્માઓ મનની જમતુલા જળવનારાજ હોય છે. જેઓ જ્ઞાન, દર્શાન અને ચારિત્રકૃપી પણ રત્નોથી અલંકૃત હોય, પાંચ સમિતિઓના ધારક હોય, પણ શુભી વડે સુશોલિત હોય, પંચ મહાવતોને વહન કરવામાં કુર્દખર હોય, પરિણામ અને ઉપસગોડી શાનુંઓને હંમેશાં

પરાજિત અવસ્થામાં રાખનારા હોય તે મહર્ષિઓ સાચી સમતાના ઉપાસક હોય છે. ઉપાધ્યાયશ્રીપાર્શ્વચદજને એ કંકામાં મૂકી શકાય. એવા આ જ્યોતિંધર શિષ્ય-સંપત્તિ વધારતા, શ્રીજૈનાગમો, સિદ્ધાંતો, સૂત્રો, પંચાંગી આદિ સંખ્યાભંધ અથેનો અલ્યાસ કરી તેમાંથી નીચોડ કાઢતા અવ્યલારતલ્લમિને પાવન કરવા લાગ્યા. તેઓશ્રીએ પોતાના વિહાર દરમ્યાન યતિમંડળના એક વિલાગમાં કિયાકંડ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ અને તેમાં વ્યાપેલો શિથીલાચાર જોઈને આ મહાપુરુષ અતિભીજી થયા. વર્ત્માન યુગમાં પણ આપણે શિથીલાચાર સામે થતા પડકારે તેના આધાતો અને પ્રત્યાઘાતો વિષે ધ્યાનું સાંલળીએ છીએ. પરંતુ આજે જૈનસમાજ બાગલામાં વહેંચાઈ જવાથી અને આચાર્યો એટલા વાડા ઉલા થવાથી જ્યાં શિથીલાચાર છે ત્યાં તે નભી રહ્યો છે. આજે એકલ વિહારીઓનો સમાજમાં તોટો નથી. અનેક દર્દ્દરી વાતો અવારનવાર આપણું કાને પડે છે પરંતુ કોઈ કહે છે ત્યારે અમે નિરૂપાય છીએ એમ કહી લાચારાથી એ હાથ લેડી એસી રહીએ છીએ, કારણું કે લગવાન સુધમ્બસ્વામીની પાટે વર્ત્માનમાં બીરાજનાર આચાર્ય અને ઉપાધ્યાય વિગેરે મહારાજે પણ આજે પક્ષાપક્ષીમાં અટવાયેલા હોઈ શિથીલાચાર માટે કોઈ મજબૂત ધોરણું કરી શકતા નથી. શિથીલાચારને સાઝે કરવા માટે કડક ઉપાયો કામે લગાડવા જોઈએ. પણ આજે કોઈ કોઈને ઐદું લગાડવા કે સામે પક્ષ પોતાની પ્રત્યે દ્વેષલાવથી જુઓ એવા ભયને લીધે તૈયાર નથી. પરંતુ ઉપાધ્યાય શ્રીપાર્શ્વચદજ લેણનિંદા કે લેણાક વાહવાહની

પરવાહ કર્યો વિના યતિઓને વાહવિવાદથી-સન્માગ್ં દર્શાનથી તેમનામાં રહેલી શિથીલતા હુર કરાવી શ્રીજિને અશરહેવો એ ખાંધેલી મર્યાદામાં આણુવા માટે સતત પ્રયાસો ચાહુ કર્યો. આવક-આવિકાઓને શ્રીતીથોડું કર ભગવંતોએ પ્રદેપેત કિયા-કંડનો શુદ્ધ અને સત્ત્વથી ભરપુર રાહ ખતાવ્યો. એક સમયે પૂ. ઉપાધ્યાયજીએ પોતાના ગુરુહેવને બહુજ નામતાથી પ્રશ્ન કર્યો કે “ગુરુહેવ! હાલમાં શુદ્ધકિયાકંડ કેમ અમલમાં નથી આવતો?”

ગુરુહેવ આ પ્રશ્નના જવાબમાં પોતાના શિષ્યરત્નને જણાવે છે કે ‘કેટલાક સમયથી ભાદશાહો આચાર્યભગવંતાદિ મુનિરાજેના બહુમાન કરે છે કે જેમાં લપટાઈને શિથીલાચારે ઘર ધાદ્યું છે.’

આ પછી ગુરુહેવ રાજવીમાં કેવા ગુણો હોવા જોઈએ તેનું જવિસ્તર વણ્ણન કરતાં ન્યાય, નીતિ; ધર્મપરાયણતા એ ગુણો પ્રજાપાલક રાજવીમાં હોવા જોઈએ એમ જાહેર કરે છે ત્યારે પૂરો ઉપાધ્યાયજી શ્રીપાર્શ્વચંદ્રજી ગુરુહેવ પાસે શિથીલાચાર હુર કરી કિયોછાર કરવા માટે આશીષ અને આજા માગે છે. ગુરુહેવ પણ શિષ્યના વિદ્યાબળ, પ્રભાવબળ, મનોબળ અને પુષ્યપ્રભળતા આદિ જોઈને રજા આપે છે. આમ ૧૦ વષ્ટ ઉપાધ્યાયપદને શોભાવી યથાર્થ કર્યો બાદ જંવત ૧૫૦૪ની સાલમાં ૭૦ શ્રીપાર્શ્વચંદ્રજી કિયોછાર માટે દ્રદ્રસંકદ્રસ અંત નિશ્ચયાત્મક મનોબળ વડે કિયોછાર માટે તત્પર થાય છે.

આમ કિયોદ્વારના કાર્ય માટે નાગોર પધાર્યો જયાં  
શ્રીસંઘે પૂર્ણ ઉપાદ્યાયજી મહારાજ શ્રીપાદ્યચંદ્રજીની  
ઇચ્છાતુસાર અફુાઈ મહેતસવ શરૂ કરી તે હિવસોએ જીવદિના  
ખંધ કરાવી, ચાચકોને દાન દઈ-સાધમિંડોની ઉત્તમ પ્રકારે  
અક્રિતા કરી. નવકદ્રોપી વિહાર કરતા, તેમજ પાંચ સુભિતિ  
અને ગ્રણ ગુમિયુક્ત મુનિમાર્ગ મુજબ પરિષહોને સહન કરતા  
અપ્રતિબદ્ધપણે વિચરતા શીથીલાચારના મૂળીયા ઉપેડવા  
લાગ્યા અને થોડાજ સમયમાં તે નિર્મૂળ થતાં ભગવંતે  
અતાંબ્યા મુજબ કિયાકંડ કરવા સૌ તત્પર થયા.

આમ નાગોરમાં કિયોદ્વારક તરિકે અનેકવિધ નામના  
મેળવી ધર્મનો ધ્વજ ઝરકાવતા પૂર્ણ ઉપાદ્યાયજી મહારાજ  
વિહાર કરતા જોધપુર નળુક આવી પહોંચ્યા. આ પ્રલાવિક  
પુરુષના આગમનના સમાચાર સાંલળીને શ્રીસંઘે લંઘ  
સામૈયું કરી તેઓશ્રીને શહેરના ઉપાશ્રયમાં લાંબ્યા. તેઓશ્રીની  
વ્યાખ્યાનરૌદ્રી અને મધુરવાણીની પ્રસંશા સાંલળીને જોધ-  
પુરના પાટવી કુમાર માલહેવ પણ ગુરુહેવના મુખેથી  
નીકળતી શાસ્ત્રીયવાણી સાંલળવા આવવા લાંબ્યા. ઉત્તમ  
જીવો કદી પોતાને આત્મહિત માટે મળેલી કોઈપણ  
તકને જતી કરતા નથી. કારણું તકને આગળ વાળ  
અને પાછળ ટાલ હોય છે. જે વાળ ન પકડાય તો પણ  
ટાલ હાથમાં આવેજ કર્યાંથી એટલે ઉચ્ચ આત્માઓ, ગુરુ-  
ગમ, જ્ઞાન-ધ્યાન અને શ્રી જિનેશ્વરહેવ જગતના કલ્યાણ માટે  
દર્શાવેલ મુક્તિમાર્ગની કોઈ તક જતી કરતા નથી. એટલુંજ

નહિં પણ એવી તક મળવા માટે પોતાની જતને ભાગ્યશાળી માની તેનો પુરેપુરે ઉપલોગ કરે છે.

૫૦ ઉપાધ્યાયજી મહારાજ કુમાર માલહેવને ઉદ્દેશીને બાજુધર્મનો સાચો ભર્મ જરમજરી ધર્મોનું રક્ષણ કેવી રીતે થધ શકે તે વિષે સચોએ ઉપહેશ વ્યાખ્યાનમાં આપે છે. અને થથા રાજ તથા મજનું રહસ્ય સમજાવે છે. આથી કુમાર પ્રતિષ્ઠાધ પાડે છે. અને સલાજનો દાન, તપ, શીલ અને ભાવનાનો તથાપ્રકાર જાણુતાં તે વિશુદ્ધ કિયાઓનો ગાદર કરે છે. એજ સમયે શ્રી સંધની ભાગ્યહ વિનંતી અને લાભાલાભનું કારણું જેઈ પૂરો ઉપાધ્યાયજી મહારાજ એ સાલ જેધ-પુરમાં ચાતુર્માસ રહ્યા. આ ચાતુર્માસમાં પર્વાધિરાજ શ્રી પર્યુષણુપર્વ આવ્યા અને આ મહાપુરુષે શાસ્ત્રાનુસારી પરંપરાગત હંમેશ સુજગ ભાદરવા સુદી પંચમીની સંવત્સરી કરી. જેથી અપવાહને કાયમ બનાવી લાદરવા સુદૂર ૪ ની સંવત્સરી કરનારાઓ છેડાઈ પહ્યા. આ છેડાઈ પડવાનું કારણું મમતવનુંજ કહી શકાય. કારણું શાસ્ત્રોક્ત ભાદરવા સુદી પંચમી છે. શ્રી કાલિકાચાર્ય લગવાને સંવત્સરી ભાદરવા સુદૂર ૪ ની કરી. એક વાત દીવા જેટલી સ્પષ્ટ છે કે રાજની પ્રતિકૂળતાના કારણેજ શ્રી કાલિકાચાર્ય લગવાને શાસ્ત્રાનુસાર પંચમીને સ્થાને ચોથની સંવત્સરી કરી હતી. આ અપવાહને પૂરો ઉપાધ્યાયજી જેવા કિયોદ્વારક શાસ્ત્રોક્ત તરીકે કઈ રીતે અપનાવી હે? અને ન અપનાવે તો પછી પંચમીનીજ સંવત્સરી કરેને? એ વર્ષના ચાતુર્માસની પૂર્ણાઙ્કૃતિને

અંતે થોડો કાળ વ્યતીત થયા ભાઈ શ્રી કાલિકાચાર્યું ભગવાન  
કાળધર્મ પામ્યા અને તે પછીથી તે સમયના વિદ્યમાન  
આચાર્યોએ ચોથની અપવાદરૂપ કરવામાં આવેલ સંવત્સરી  
દિનની ૭૮ પદ્ધતિ રાખી છતાં પંચમી કરનારા તો તેજ  
કરતા હતા. જે મતલેહો આજે પણ મોટી દિવાલ જેમ ઉલા  
છે. આને અંગે શ્રીમત્ત્રાગ્યુરીયતપાગચ્છ એટલે શ્રી  
પાર્શ્વચંદ્રસૂરિગચ્છના ધુરંધર આચાર્યહેવ શ્રીમહ્મ  
ભાત્રચંદ્રસૂરીધરજી મહારાજ અને તેઓશ્રીના સ્વ.  
શિષ્યરતન આચાર્યશ્રી સાગરચંદ્રસૂરીધરજી મહારાજે લાદરવા  
સુધી પંચમીની સંવત્સરીજ શાસ્કોક્તા છે. એ પ્રમાણે ટાંકીને  
બતાવતી પુસ્તિકાએ અફાર પાડી હો. પરંતુ જ્યાં સામાન્ય  
પ્રક્રમાં પણ મેરુ જેવા મતલેહો ઉલા કરવામાં આવતા હોય  
ત્યાં ચાલી આવતી રૂઢીના નામે શાસ્કોક્તા માન્યતાને ઉથલા-  
વાય નહિં તો બીજું શું થાય? કોઈ દર્દીને માંદગી દરમ્યાન  
ડોકુર હવા આપે છે અને અમુકજ વસ્તુએ ખાવા કરમાવે  
તો તેથી શરીરનું ઝાપૂણું સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યો પછી પણ શું  
અણે પેલા માંદગીમાં અપવાદરૂપે અપાતી હવા પીધાજ કરવી  
ને ચરી પાળવી? એમ તો કેમ બની શકે? અપવાદ એ  
અપવાદ અને મૂળ તે મૂળજ. આવી સાહી સમજમાં આવે  
એવી વાત છે અને શાસ્કોક્તા જે વાત છે તેને કદાચિત્તા  
કહો કે ગમે તે કારણે પણ સત્ય તરિકે સ્વીકારતાં આજના  
શ્રી તપાગચ્છના આચાર્યો અચકાય છે.

આમ પૂરો ઉપાધ્યાયજ મહારાજે શાસ્કોક્તા રીતે પર-  
પરાગત સંવત્સરી પર્વની આરાધના કરી-કરાવી તેથી અપવાદને

વળગी ઉત્સુક કિયા કરી રહેલાએએ ગચ્છલેદની તકરારના કારણે આ મહાપુરુષની ધર્મા કરવા લાગ્યા. પરંતુ જેમને શાસ્ત્રોક્ત રીતે વત્તંબું છે તેમને એની અસર શું થાય? અનેક સ્થળોએ આ મતલેદોના પડધા પડયા અને સત્યના અર્થી આત્માએ સન્માર્ગ તરફ વણ્યા.

એથી માત્રદેવ રાજ અને શ્રીસંઘની પ્રસરતા પૂજ્ય ઉપાધ્યાયણ મહારાજ પર ઉત્તરી અને સત્યમાર્ગના દ્રષ્ટા આ વિદ્યાભૂષણ ઉપાધ્યાયને સૂર્યિપદ આપવાની વિનંતિ તેઓ શ્રીના શુરુદેવ અમશ્શ રણુ કરવામાં આવી. લાયક માણુસો કરી માનની વાંચછિના રાખતાજ નથી પણ માન એમને સામે આવીને લેટે છે. ઉપાધ્યાય શ્રી પાર્શ્વચંદ્રલ ગણિવરના શુરુદેવ શ્રી સાધુરત્નસૂર્યિલાએ શ્રીસંઘ અને જેધપુર નરેશના આથડને માન આપી સૂર્યિપદ અંગે અઙ્ગુધ મહોત્સવ શરૂ કરવા માટે આજા ફરમાવી અને પૂર્ણ ઉપાધ્યાયણને સૂર્યિમંત્રના તપ અને ધ્યાન વિધિપૂર્વક શુરુદેવે શરૂ કરાવ્યા. આ પ્રભ્રગને હીપાવવા માટે નિમંત્રણપત્રિકાએ દેશલરમાં પહોંચાડવામાં આવી અને પાંડિતપ્રવરો, વિદ્ધાન આચાર્યાદિ મુનિરાજે, ધર્મપ્રેમી ગૃહન્થો મોટા પ્રમાણમાં જેધપુર નગરે પદ્ધાયો. શ્રીયતુર્વિધસંઘની હાજરીમાં અત્યંત આનંદમય વાતાવરણ અને લોકોના અનેના ઉત્સાહ વર્ચ્યે સં. ૧૫૬૫ માં પૂર્ણ ઉપાધ્યાય શ્રી પાર્શ્વચંદ્રલ ગણિવરને સૂર્યિપદથી શુરુદેવે વિભૂષિત કર્યા અને આચાર્ય શ્રીપાર્શ્વચંદ્રલ શ્રીમદ્વરલ થયા.


નોંધપુરમાં ઉપરના મહોત્સવની પૂર્ણાહૃતિને અંતે પૂર્ણાચાર્યદેવ શ્રીમદ્ભ્રગ પાર્થચંદ્રસૂરીધરણ મહારાજા હૃદય જયોતને પ્રગટાવતા, ઉથ વિહારના નિયમોને અમલમાં મુકવા લાગ્યા. આજે તો પરિસ્થિતિ એવી છે કે વિહારના જરૂરીયાત વાળા સ્થાનો વર્ષોના વર્ષો ખાલી પડી રહે છે. જ્યારે એકજ સ્થળે ઉપરાઉપરી ચાતુર્માસો થાય છે. શાસ્વેક્તાદ્રષ્ટિએ કારણ સિખાય એકજ સ્થાનમાં બીજું ચાતુર્માસ નહિ કરવાના ફરમાનનો. આજે ડેરટેર છાડે ચોક લંગ થઈ રહ્યો છે. આ સ્થિતિ ભીયાવના અને વિદારથી અણુગોડાચેવી ભૂમિને પાવન કરવા માટે યોગ્ય પ્રણંધ થવાની ઘડી આવી ગણાંચી છે.

વિહાર કરવા સાથે આચાર્ય ભગવાન તપશ્ચયાને કાંઈ થોડાજ વિસારે પાડે એમ હતું. એએશ્રીએ ઉથ તપશ્ચયાં પણ જારી રાખી. સંયમ શુદ્ધ માટે તપની હંમેશા આચાર્યક્તા રહેલી છે. સંયમ એ કાંચન છે જ્યારે સમ્યકૃત્વ કાંચનને વિશુદ્ધ બનાવનાર અણિન છે. આ અણિન હેઠને તપાવતો નથી પણ આત્મામાં જે કાંઈ હોષ્ટાદ્રષ્ટ ખુલ્લે હોય છે તેને તે જલાવી હેનાર છે. જેમ ચારિત્ર વિના આત્માની શુદ્ધ નથી તેમ તપ વિના શુદ્ધ ચારિત્રની પણ સિદ્ધ નથી. જાની મહાત્માઓએ તપના મહાત્મ્યનું ધાણું ધાણું વળુંન કરી ચારિત્રધર્મને સ્થિર કરનાર મહાનું સાધન તરિકે તપને જણાવેલ છે. સંયમની શુદ્ધ અઙ્ગિસાર્દ્ય ધર્મના યથાર્થ પાલન માટે અતિ આવશ્યક છે. તેમ સંયમ ધર્મના શુદ્ધ પાલન માટે તપની શુદ્ધ પણ

શ્રીમત્તાગંડુરીયતપાગંડાધિરાજ શાસનપ્રભાવક

પ્રાતઃસ્તમરણીય ૫૦ પૂર્ણ શ્રી ૧૦૦૮

શ્રીમત્તાગંડાધિરાજની હેરી



વીરમગામ પાંચાંદ્રગંધિના ઉપાશ્રમાં

સ્થાપિત દાદાની હેરી.

તાત્કાલિક વાંછિતદાન દાતા.



જરૂરી છે. શ્રી ઇપલહેવસ્વામી વિ. તીર્થંકર ભગવંતો પોતાની આજ ભવમાં સિદ્ધિ છે એમ જાણવા છતી તે તારકો પણ તપનું અનેડ અને અનુપમ સેવન કરે છે. જે તપને ક્ષમા સહિત આચરવામાં આવે તો એમાં એવી શક્તિ રહેલી છે કે નિકાચિતકર્મની ઘડીમાં નિર્જરા કરી શકાય છે. જેમ સુવર્ણમાં રહેલી મારીને અખ્યિ અત્યગ કરે છે તેમ તપ એ જીવનમાં રહેલ કર્મદૃપ કાટને હૂર કરે છે. તપના પ્રભાવે નાની લભિદ્યોની પણ પ્રાપ્તિ થાય છે. તપ એ સાક્ષાતું કલ્પતર્ફ છે. એવા કલ્પતર્ફની આરાધના કરતા આચાર્ય-ભગવાન શ્રીપાત્રીચંદ્રસૂરોધરજી મહારાજ શ્રીકૃષ્ણાધિપાશ્વનાથજીની યાત્રાથે પધાર્યા ને ત્યાંથી લયહરનાર લેરવ પ્રતાપથી ગાજતા દૃષ્ટુગામે [ રતનપુરી ] આવી પહોંચ્યા. શાંક્રોક્ત સર્વવિરતિ ધારણુ કરનાર પૂર્ણ આચાર્યાંહિ મુનિરાજેને દેવો પણ વંદન કરતા હોય ત્યાં આ લયહર લેરવનાથ સુગોતાથે જન્મોત્પાત્રને ઘર આંગણે આવેલા જેઈ કેમ નમન ન કરે ? નમન કરીને લેરવનાથ ગુરુહેવની સાન્નિધ્યમાં રહ્યા. એવી પ્રતીતિ હવે પઢીના બનાવો પદ્થી થાય છે. આ સ્થળે લાલા લાલના કારણે આચાર્યભગવાને માસકલ્પ કર્યો. તે સમયે ત્યાંના વતની ઓશવાળ વાહદહેવ અને ચાંપલહેવીનો સુપુત્ર વરદરાજ કે જે ગલોવસ્થાથીજ ઉત્તમ સ્વર્પન અને ભાવીનું દર્શાન કરાવનારો હતો તેને ગુરુવાણીનો ઉપદેશ સચોટપણે લાગતાં અસાર સંસ્કારથી હૂર થઈ સર્વવિરતિ અંગીકાર કરવાની ભાવના થઈ. શ્રીસંદે અને વરદરાજના માતપિતાએ સંદર્ભ રજ આપી પોતાના આંગણે શ્રીઅધ્રાન્દિકામહેત્ય

શરૂ કર્યો. અને વરદરાજને શ્રીભગવતીપ્રવર્જયા આપી તેનું નામ સુનીશ્રી વિજયહેવ સ્થાપવામાં આવ્યું.

વિહાર કરતા આચાર્ય ભગવાન શ્રીપાશ્વચંદ્ર-સૂર્યિલ નાગોર પદ્માર્થી. આ સમયે શ્રીવતુર્વિંધસંઘને ઉપદ્રવ કરતા વીરમંડાળને પ્રતિષેધી-તામે કરી એક વિતંડા-વાઢી યોગિનીને પણ વાદમાં જીતી. આચાર્યશ્રીના જ્ઞાનબળને જોઈને ત્યાંના ધણ્ણા ક્ષત્રી વીરાએ ખડુમાનપૂર્વક શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને કર્મમળને તોડવા માટે કિયામાં દઢતાથી જોડાયા. એ સાત શ્રીસંઘની વિનંતીથી નાગોરમાં ચાતુર્માસ રહ્યા અને ત્યાં જેમ જણે ચોથા આરાની ભાવના પ્રવર્ત્તિ ન હોય એવું આદહાદજનક વાતાવરણ ખડું થયું. તેમાંથે પૂ. આચાર્યભગવાને કુતકાવળી તપ્ય કરી દોકાને તપનું સાચું મહાત્મ્ય સમજાવ્યું.

આ ચાતુર્માસ સમયે લોંકાશાહ નામના મૂર્તિઉત્થાપક એક સ્થાનકવાસી ગૃહસ્થ પ્રલુપૂજન ધર્ત્યાદિ કર્માનુષ્ઠાનો વિષે ભારે અંધાધુંધી ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા હતા. તેની સાથે આચાર્ય ભગવાન શ્રી પાશ્વચંદ્રસૂરીધરલાએ વાદવિવાદ શરૂ કરી સ્વમત સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ જ્યાં કદાચહ હોય ત્યાં સ્પષ્ટ સમજાય કર્યાંથી? આજે એજ લોંકાશાહને પ્રકાશમાં લાવવાના પ્રયત્નો સ્થાનકવાસી સમાજ તરફથી થઈ રહ્યા છે. પરંતુ જેમ જેમ સ્થાનકવાસીએ સરળાવે વિચાર કરે છે તેમ તેમ તેમના મગજમાં મૂર્તિપૂજા પ્રાચીન છે એ માન્યતા ઠસાતી જય છે.

એજ લોંકાશાહ સાથે વિવાદ કરતાં આચાર્ય ભગવાન શ્રીપાર્વતીંદ્રસૂરીશ્વરજીના મિષ્ટાંત્રિક સચ્ચોટ પુરાવા સામે ટકી શકવાનું અશક્ય જણાતાં નિવાદમાંથી તેઓ વિતંડાવાદમાં તણાવા લાગ્યા. જે જોઈ પૂજયશ્રીએ બર્યા છોડી હીધી પરંતુ લોંકાશાહના સાત વિદ્ધાન અને ગુણપૂજક શિષ્યોના મન પર પૂજયશ્રીની વિદ્ધતાની તેમજ કિયાકંડની ભારે છાપ પડી અને તેઓશ્રીની છંચાથી શુદ્ધ કિયાનુષ્ઠાન કરી તેમને પૂજયશ્રીએ પોતાના શિષ્યો અનાવ્યા તેમજ ચાતુર્માસના અંતે નાગોર વતની વીશાઓશવાળ હેમરાજજીને મહેતસવપૂર્વક હીક્ષા આપવામાં આવી. ત્યાંથી શિષ્ય સમુદ્દર સાથે નવકલ્પી વિદાર કરતા આચાર્ય ભગવાન બિકાનેર પદ્ધાર્યા. અને ત્યાં મોટી સંખ્યામાં લોકોને સાચી કિયાના માગ્ય તરફ વાળી અદ્યપ-સંસારી બનાવ્યા અને પૂ. સૂરીશ્વરજીએ અણકુમંસ્થૂદન તપ આદર્યો. ત્યાંથી તેઓશ્રી જેસલમેર પદ્ધાર્યા જ્યાં ગ્રાચીન ભંડારના પુસ્તકોનું અધ્યયન અને મનન કરી પોકણું ફોલોધી તરફ થઈ જેધપુર શહેર નજીક પદ્ધાર્યા. જેધાણુનાથ (જેધપુર નરેશ) અને શ્રી સંધ સૂરીશ્વરજીને સામૈયાપૂર્વક ભારે આડ-ભરથી ઉપાશ્રયમાં લાવવામાં આવ્યા. અહીં પૂ. સૂરીશ્વરજીએ વધ્યાંમાન તપ શરૂ કર્યો. ત્યાં અનેક ભણ્ય જીવો પર ઉપકાર કરી પૂ. સૂરીશ્વરજી જીવોનથી આહોર થઈ ગોલવાડની પંચ-તિથીંની યાત્રાએ પદ્ધાર્યા. ત્યાંથી શ્રીઆખુજ પરના પવિત્ર જગન્નાથજીના જીવાનાં જુહારી પુનઃ હમીરપુરની સ્પર્શના કરી. નહાનો પંચ તિથીંની યાત્રા કરી સાચોરથી વાવ થરાદમાં પુષ્કળ પ્રમાણમાં શ્રાવકોને પ્રતિબોધી આચાર્ય ભગવાન

## શ્રી પાશ્ચયંડ્રસૂરીશ્વરેજુ મહારાજ અણુહીલપુર પાટણ પદ્ધાર્યો.

આ સમયે જતિઓનું જેર વધી પડ્યું હતું અને તેઓ શુદ્ધ કિયાકંડને છોડીને પોતાની આજુવિકા પ્રાપ્ત કરવા માટે અચોણ્ય સાધનોનો ઉપયોગ કરી અંધાધુંધી ઈલાવી રહ્યા હતા. પૂર્ણ આચાર્યભગવાનના આગમનથી તેમને ભય લાગ્યો કે આપણી પોકળતા ખુલ્હી પડશે. એથી તેનેદ્રેષ્ણના તણુખા જરવા લાગ્યા અને પૂર્ણ આચાર્યભગવાન પર ઉપરદ્રવ શરૂ કરવાના હેતુથી વીરોની સાધના કરી પરંતુ ભયહર લૈરવનાથ જેના દાસ હોય એવા આ મહાત્માને વીરો શું કરી શકે ? ઉદ્દું એ મહાપુરુષે ઉન્માર્ગો ગન્ધેલાઓને પ્રતિઓધી સાચા માર્ગ તરફ વાળ્યા. જ્ઞાની પુરુષો શરૂઆતું પણ કુદી ખુરુ કુદ્દપતા નથી પણ તેને સન્માર્ગો હોરવા હંમેશાં મ્રથાસો કરે છે. જતિઓએ ઈલાવેલ અંધાધુંધીને હૂર કરી ગર્વાંધીનો મહ ઉતારી પૂર્ણ આચાર્યભગવાને ધર્મમાર્ગ સરળ થતાં ઉદ્વાસવાન અનેલા આત્માઓના ઝૂફ્યના ઉંડાણુમાં માનવંત રથાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રીની વિક્રિતાની ચોમેર પ્રસંશા થવા લાગી. ત્યાંથી પૂર્ણ આચાર્યભગવાન રાધનપુર પદ્ધાર્યો. આ સમયે રાધનપુરમાં હિંદુ-મુદ્દ્દીમ વચ્ચે વૈમનસ્ય ઉચ્ચ હંદે ચાલતું હતું જે બન્ને કામોને પ્રતિઓધી હંમેશા માટે ખંધ કરાવ્યું. મહાપુરુષો જે જે સ્થળે વૈમનસ્ય જુઓ છે તે તે સ્થળે ઉપહેશની સચોટ ધારા નહેતી મૂકીને હૂર કરાવવા માટેના તેમજ શાંતિની સ્થાપના અથે બનતા અધળાએ પ્રયત્નો. કરવા ચુક્તા નથી. આજે ખૂબ જૈનોના અંતરિક

વિખવાહો આટઆટલા વિધમાન આચાર્યો હોવા છતાં મરવાને બદ્ધે વધી રહ્યા છે એ કેટલું શોયનીય છે ?


રાધનપુરમાં એ કોમો વચ્ચે સુલેહશાંતિ થતાં ત્યાંના શ્રીસંદે આદરપૂર્વક વિનાતિ કરતાં સં. ૧૫૬૭ નું ચાતુર્માસ રાધનપુરમાં કરવામાં આવ્યું અને ત્યારબાદ ઉત્ત્ર વિહાર કરતાં પૂજયશ્રી કચ્છ દેશ તરફ પદ્ધાર્યો, ભયાઉમાં અનેક મિથ્યાત્ત્વી અન્યદર્શાંનીએને પ્રતિષ્ઠાધી શ્રાવક કર્યો. અને શુદ્ધ રાહ ખતાવી શ્રીવીતરાગપ્રણીતધર્મ પ્રવર્તીવી અંનાર, લદ્રેક્ષર, સુદ્રા, માંડવી, બુજ વિગેરે સ્થળોએ થઈ શિથીલાચારને નિર્મૂળ કરતાં કરતાં કાઠિયાવાડમાં મોરણી, વાંકાનેર, બામનગર, રાજકોટ થઈ શ્રીગીરનારણુની યાત્રાએ જુનાગઢમાં પ્રવેશ કર્યો. આ સ્થળે તેઓ શ્રીએ ૨૧ ઉપવાસની તપક્ષયો આદરી અને કેટલો સમય સ્થિરતા કરી. ગીરનારણુની યાત્રા કરી પૂજયશ્રી લાવો-દધિતારક એવા શ્રી મિદ્ધગિરિને લેટવા ત્યાં પદ્ધાર્યો. ગિરિરાજના ગંભીર મહાત્મ્યને આચાર્ય લગવાને સ્વરચિત સ્તવનોમાં ઉતાયું અને તેનો રાસ પણ બનાવ્યો. શ્રી ગિરિરાજની છાયામાં સર્વતોભદ્ર તપુ પૂણું કરીને પાંચ ભવ્ય જીવોનો ઉદ્ઘાર કરી વલ્લભીપુરમાં પદ્ધાર્યો જ્યાં જાનલાંડારોનું અવલોકન કરતાં પૂજયશ્રી લીંબડી પદ્ધાર્યો. ત્યાં નદી કિન્દરે એક મતવાહી ચોણી સિદ્ધિની સાધના કરી રહેલ હતો પરંતુ તેમાં તેને નિર્ઝળતા સાંપડી પણ પૂરો આચાર્ય લગવાને સિદ્ધ પ્રાપ્તિનો રાહ ખતાવતાં તે પૂજયશ્રીનો ઉપકાર માનવા લાગ્યો.

લીંબડીથી વિહાર કરી વદ્વાણું થઈ પ્રાંગણા પદ્ધાર્યો. અહીં

આદ્ધારુની એ કન્યાઓને પ્રતિબોધી અને આવક શાન્તિકાઓને શુદ્ધ કિયાવંત બનાવ્યા, ત્યાંથી શ્રી શાંખેશ્વરલુની યાત્રાએ પધાર્યો જ્યાં હૃદયને લક્ષ્ણિતના રંગથી રંગી પોતે તેની સ્તુતિઓ રવી. માંડળ પધાર્યો જ્યાં શ્રીસંઘે ભવ્ય સામૈયું કરી પૂજ્યશ્રી અને તેઓશ્રીના શિષ્ય સમુદ્દરયને ઉપાશ્રયમાં બહુમાનપૂર્વક પદ્ધરાયા. જ્યાં વ્યાખ્યાન આપતાં શ્રાવકના ધર્મ વિષે સુંદર બોધ આપ્યો. અને શ્રાવકમાં કેટલા ગુણો હોવા જેઠાં તે વિષેનું સવિસ્તર વર્ણન કરતાં કોકો શુદ્ધ કિયા માર્ગ તરફ આકર્ષાયા.

આ પ્રમાણે ડેરફેર કિયોદ્ધાર કરતાં કરતાં પૂર્ણ આચાર્ય ભગવાન શ્રીપાર્શ્વચંદ્રસૂરીધીધરલુ મહારાજા વીરમગામ સુકામે આવી પહેંચ્યા. ત્યાં પણ વિદ્યાસાગર નામના એક હઠવાદીનો તેઓશ્રીને લેટો થયો. પૂર્ણ આચાર્ય લગવાને તેને આગમાનુસાર અહોવિષિત કિયાનુષ્ઠાનની પદ્ધતિ બતાવી હઠવાદી યોગીના ગર્વનું ખંડન કર્યું. આમ કેટલોંક સમય સ્થિરતા કર્યો ખાદ પૂજ્યશ્રીએ વીરમગામના શ્રીસંઘ પ્રત્યે પોતાના વિહારની દૃઢા પ્રદર્શિત કરી. આવા પરમતારક શુરૂહેવના વિયોગથી કયા સરળ અને સુઝ હૃદયને આધાત ન લાગે? પરંતુ આ ઉચ્ચ વિહારી શુરૂહેવના નિશ્ચય આગળ સૌ લાચાર બન્યા. ગુરુરાજ ગામ ગામનો વિહાર કરી પુનઃ ગુજરાતના એ વખતના પાટનગર શ્રી અણુહીલપુર પાટણ પધાર્યો. શ્રી સંઘે પરમ શુરૂહેવનું ભારે ધામધુમપૂર્વક સામૈયું કરી તેઓશ્રીને શહેરના ઉપાશ્રયમાં બિરાજમાન કર્યા. શ્રીસંઘના ભારે આગ્રહને લીધે

શ્રીમત્નાગપુરીયતપાગંધાધિરાજ શાસન પ્રભાવક  
 પ્રાતઃસ્મરણીય ૫૦ પૂર્ણ શ્રી ૧૦૦૮  
 શ્રીમત્યાર્થ્યંદ્રસૂરીધરજની દેરી



અમહાવાહ શામળાની પોળના પાર્થ્યંદ ગંધના  
 ઉપાશ્રયમાં સ્થાપિત દાદાની દેરી.  
 તાત્કાલિક વાંછિતકલ દાતા.



પૂજય સૂરીશ્વરજી મહારાજાએ સં. ૧૫૭૫ તું ચાતુર્માસ  
ત્યાંજ કર્યો.

શ્રાવક-શ્રાવિકાએ પોતાના અહોભાગ્ય માની આ  
મહાન જ્યોતિર્ધરના સાંપડેલા સુયોગથી તથ, જ્ય, વતાદિ  
પચચખાણુંની કિયાએ વિશિષ્ટ પ્રકારે શરૂ કરી અને ચઠતા  
લાવ વડે ગુરુ ઉપદેશના પરિણામે દાન, તથ, શીલ અને  
લાવનો મહિમા ચોમેર પ્રવર્તીંયો. પ્રલાવના, પૂજા-સાધમિંક  
વાતસદ્વયાદિ પુષ્યને પોષતાં અનેકવિધ કાર્યો એ ચાતુર્માસ  
દરમ્યાન થયાં. બાગ હોય પણ જળસીચન કરનાર માળી ન  
હોય તો પુલો કયાંથી ઉગે? ડષ્યા હોય પણ એન્જિન ન  
હોય તો તેને ગતિમાં કોણ લાવી શકે? એવીજ રીતે સરળ  
શ્રાવક શ્રાવિકાએ અણુહીલ્પપુરમાં હતા પણ તેમને કિયા-  
નુધાનદર્શક પૂજયપુરુષનો સુયોગ ન સાંપડે તો આત્માની  
અનંતશક્તિ પૈકિ ઉપરોક્ત શક્તિએ કયાંથી ખીદે?

આ ચાતુર્માસ દરમ્યાન પૂર્ણ સૂરીશ્વરજી મહારાજાની  
વૈરાગ્યમયવાણીથી પ્રેરાઈ અંતરંગ વૈરાગ્ય લાવનાથી રંગાયો  
છે એવા શોઠ ભીમાશાહ અને વહાલાહેવીના સુપુત્ર શ્રી  
અમરસિહ કે જેનો જન્મ સંવત ૧૫૬૦ ના માગશર સુદી  
૧૧ ના રોજ શુભ સમયે થયેલો હતો. તે પૂજય ગુરુદેવ પાસે  
૧૫ વર્ષની ખાદ્યવયે શ્રીભાગવતીપ્રત્યા લેવા તત્પર થાય  
છે. પૂજય ગુરુદેવ તેના વૈરાગ્યભાવની પરીક્ષા-કસોટી કરી  
અને બાદ માતાપિતાદિની રણ મેળવવા આજા કરી.

અને એ સરળસ્વભાવી તેમજ શ્રી જિનેશ્વરહેનોના॥

માગે પર જેમને અચળ શ્રદ્ધા છે એવા શેઠ લીમાશાહ અને વહાતાહેવીએ પુત્ર અમરસિંહની કુલોદ્ધારની માગણીને અતી ઉદ્ઘાસ વડે માન્ય કરી અને સારાએ અણુહીદ્વાપુર પાટખુમાં અહૃદ્ધ મહેત્સવની શરૂઆત કરી અને કવિધ ધર્મકાર્યો કરવા થકી કુમાર અમરસિંહે પૂરો સૂરીશ્વરજીના વરદ હુસ્તે સંવત્ ૧૫૭૫ ના માગશર શુદ્ધી પ ના રોજ વિજય મુહૂર્તે શ્રી ભાગવતીપ્રવન્ધ્યા અંગીકાર કરી. સારાએ નગરમાં ગુરુહેવની દેશનાશક્તિ, અગાધજ્ઞાન અને કિયાકંડની પ્રસંશા થવા લાગી. નવદીક્ષિતનું નામ મુનિ સ્વમરચંદ્ર રાખવામાં આયુ.

પૂરો સૂરીશ્વરજી મહારાજાના અન્યશિષ્યો હોવા છતાં આ તીવ્યખુદ્વિવાળા મુનિરોજ શ્રી સ્વમરચંદ્રજી વિદ્યાલ્યાસમાં આગળ વધવા લાગ્યા જે જેઈ પૂજયશ્રીને ખાત્રી થવા લાગી કે લવિષ્યમાં મારી પાટને આ પુરુષ જરૂર સાચવશે.

આમ અણુહીદ્વાપુર પાટખુમાં ધર્મન્યોત જગાવીને લાંથી વિહાર કરતાં પૂજયશ્રી શિષ્યમંડળ સાથે અમદાવાદના આંગણે સામૈયાપૂર્વક પદ્ધાયો. આ સમયે અમદાવાદમાં મરકીનો લય કર ઉપદ્રવ ચાલી રહ્યો હતો. જેથી શહેરીએ ત્રાસ પામીને અહીં તહીં નાશભાગ કરી રહ્યા હતા. પ્રભજનોએ પૂરો સૂરીશ્વરજીના વિચક્ષણ જ્ઞાનના મહિમાથી પ્રેરાઈને તેઓશ્રી સમક્ષ આ વાત રજી કરી અને રજી કરવાની સાથેજ કુંક સમયમાંજ સૌના આક્ર્યુ અને હર્ષ વર્ચ્યે મરકીનો ઉપદ્રવ બંધ પડી ગયો. અને સર્વત્ર આનંદ-આનંદ થઈ રહ્યો.

હુનીયામાં ચમતકારનેજ નમસ્કાર હોય છે. કખીર કહી ગયા છે કે ‘પરચા વિના ડોઈ નહિ પૂજે.’ પરંતુ પૂજયશ્રીના વાયદા વિનાના ફાયદાને જોઈ તેમજ ભારે ઉપદ્રવમાંથી મુક્તા કરવાની મહાશક્તિ નીહાળી વિધમીઓમાં પણ જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને શ્રાવકધર્મ સ્વીકારી તેઓ પોતાનું જીવન સાકૃત્ય કરવા લાગ્યા. એથી પ્રેરાઇને ક્રિનાલયોમાં શાંતિસ્નાત્ર, પૂજા, અક્ષિતનો ભારે રંગ જાર્યો. અને રાજનગર-નિવાસીઓ પોતાની જતને આવા ગુરુ કેટવા માટે ધન્ય ગણુવા લાગ્યા.

આમ રાજનગરના ચાતુર્માસ દરમયાન અનેક જીવોને પ્રતિષેધી જૈનધર્મનો મર્મ સમજલવી તે માર્ગમાં જેડી ધર્મની પ્રલાવના કરતાં ચાતુર્માસ પૂર્વ થયે પૂજયશ્રી ખંભાત બંહર પદ્ધાર્યો. અભાતના શ્રીમંદે ગુરુહેવના આગમનની વાત સાંભળી લાદથી તેઓશ્રીના પ્રલાવની હકીકતોથી સહ્ભાવનાની શ્રેષ્ઠી વૃદ્ધિંગત થતી ચાલી હતી અને ગુરુરાજના આગમન સમયે ભારે ઉત્સવપૂર્વીક ઉપાશ્રયમાં લાવવામાં આવ્યા. ખંભાતમાં આ સમયે મઝદુખની ચાલી આવતી ઢાળી મુજબ લાંના નવાખ સાહેબે એક ગાયને પકડી કુરખાની માટે મરણુદ્ધ તરફ લઈ જવા કર્માન્યું. એથી રાજ્યના નોકરો ગોવધ માટે ઉત્સુક અની ગાયને લેવા ચાહ્યા. આ અનિષ્ટકૃત્ય આર્યાવર્તની ભૂમિમાં અને ધર્મનગરી સમા ખંભાતમાં પૂજય સૂરીખરળ મહારાજની હાજરીમાંજ બને એ શ્રીમંદને બહુજ અટકવા લાગ્યું. આવું કૃત્ય જે દિવસે સૂરિરાજની પધરામણી થવાની

છે તે દિવસે તો ન બને તોજ આનંદ થાય એવો વિચાર કરવા લાગ્યા. એમ વિચારીને શ્રીસંધના અત્રેસરોએ નાં નવાખ સાહેબ સમક્ષ જઈ એ ધાર્મિકલાગણીને દુલ્ભવનાં કૃત્ય એક મહાન જ્યોતિર્ધરના કુમકુમ પગલા નગરેમાં થાય તે દિવસે તો ન થાય એ માટે વિનંતી કરી પરંતુ નાં નવાખ સાહેબે પણ એ કુરખાનીને પોતાનું ધર્મકૃત્ય છે એમ જણાવી પ્રનજનોની વિનંતીને નકારી. આથી શ્રીસંધે ગૌવધની આ બાબત ભિન્ન હુદાયે પૂજય ગુરુદેવ સમક્ષ રંજુ કરી અને પોતાની લાગણી પ્રદર્શિત કરી.

જે મહાપુરુષોમાં દૈવિકશક્તિનો યોગ હોવ તે સમગ્ર જનતાની દુલ્ભાતી ધાર્મિકલાગણીને લેઇનેતેનો ઉપયોગ કર્યા ક્ષિવાય કેમજ રહી શકે? હંમેશાં આવી શક્તિઓનો ઉપયોગ અસાધારણ એવા જનકલ્યાણના પ્રક્રમાંજ કરવામાં આવે છે. તેવી રીતે પૂજયશ્રીએ પોતાની દૈવિકશક્તિનો ઘડીભર પરચો બતાવ્યો. પરિણ્ણામ એ આવ્યું કે કુરખાની કરવા માટે જે ગાય લઈ જવામાં આવતી હતી તે ગાયને અદ્રશ્ય કરી હીધી અને ગાયને લઈ જનારો રાજ્યના સેવકો હતા તેજ જાયા પર સ્થિર થઈ ગયા.

ધીજા રાજ્યસેવકોએ તુરેતજ નવાખ સાહેબ પાસે જઈ જૈનસૂરીશ્વરમહાત્માનો દૈવિકશક્તિના યોગે બનેલા બનાવનું વણુંન કર્યું. નાં નવાખ સાહેબ આ અદ્ભુત પ્રસંગને

જાતે નિહાળવા તત્પર થયા અને જે સ્થળે આ અનાવ  
અન્યો હતો ત્યાં આવી પહોંચ્યા. પોતાના સેવકોએ  
કરેકી વાત સાચી જણુંતાં તેઓ પણ અહુ વિરમય  
પામી પોતાની બેઅદથી મારે પૂજય સૂરીધરજી મહા-  
રાજ પાસે ક્ષમા યાચવા પદ્ધાર્યા.

પૂર્વવત્ત રાજવીએના અનેક દ્રષ્ટાંતો આપણને મળી  
આવે છે કે કે જેએ આવા પ્રસંગને લેઇ રાજ્યદંડની વાત નહિ.  
કરતાં શુરૂદેવોની અદ્ભુતશક્તિએને નમન કરતા હતા અને  
એવા શુરૂદેવોની આજાને શિરસાવંધ માની ન્યાય અને  
નીતિથી રાજ્યશાસન ચ્યાપતા હતા. એવા આ નવાખ સાહેણે  
ઉપાશ્રયમાં પદ્ધારી પૂજયશ્રીને વંદના કરી પોતાની ભૂલ મારે  
સરળાહૃદયે પદ્ધાતાપ જહેર કરી ક્ષમા આપવા વિનંતી કરી.  
પૂજયશ્રીએ નવાખને જગતના સર્વ જીવો ક્ષમાન છે-  
ક્ષમાન દ્રષ્ટીને પાત્ર છે એમ સચોટ ઉપહેશ આપી  
કરીને આવું ડિસ્કાઉન્ટ નહિં કરવા આજા આપી.  
આજે તો ચોમેર જ્યાં જુઓ ત્યાં આર્યાવર્તની લૂભિ  
નિર્દોષ જીવાના કોહીથી ખરડાયેલી જણ્ણાય છે. આ આપણી  
સંધ સત્તાની નાભણાઈનું કારણ છે. જે સમયે સંધસત્તા-  
મહાજનમન્ત્રા વ્યવસ્થિત અને સંગૃહીત હતી તે સમયે  
દિનપ્રત્યે જીવદિસાના સમાચારો આજે મળે છે તેવી સ્થિતિ  
નહોંતી. આજે તો આપણા રાજવીએ વિદેશીએના પગલે  
ચાલીને જીવદિસાને પોતાની દૈનિકચર્ચા હોય એમ માની  
અતુક્ષ્માગુણ્યને ફૂદ્યમાંથી દેશવડો દઈ રહ્યા છે. આજના

મહાજનો લાચાર છે. શાફિદ્કવિરોધ સિવાય બીજુ કોઈ શક્તિ નથી કે તે પોતાના રાજવીને નિર્દોષ પશુ-પક્ષીઓની થતી હિસા અટકાવી શકે. આજે જીવદ્યાનો જરે સુકાતો જાય છે અને તેથીજ જીવો જગતમાં અનેક રિદ્ધિ-સિદ્ધિ પામવા છતાં પણ હુંખી હેખાય છે. આપણુને બીજા નિર્દોષ જીવને હણવાનો શું અધિકાર છે? આપણે આજે દ્વારાશુદ્ધ બનતા જઈએ શ્રીઓ. જે ક્રીડી-મંકેડી હણવાથી આપણુને અરેરાઠી ઉપજતી તે ‘અરેરાઠી’ શાખ આપણા મગજમાંથી શુભ થઈ ગયો છે. આજે ટેરઠેર વ્યવસ્થિત કલ્યાણાચોમાં હળવો ઢારોની કલ્યાણ થાય છે. આજે ટેરઠેર નિર્દોષ પશુ પક્ષીઓના સંહાર થાય છે. ભગવાન નેમિનાથ જેવા શ્રી તીર્થેંકરદેવની સંસારી અવસ્થામાં લગ્નની જાન જોડાઈ. આ લગ્ન ઉત્સવ અંગે સામા પક્ષે નિર્દોષ પશુ-પંખીઓને અન્ય જીવોની હિસા મુઢેંમાનોની મીજલસ માટે કરતાં પશુઓનો પોકાર ભગવાનના હૃદયને સ્પર્શથો. અને ભગવાનનું હૃદય કુકળી ઉંઘયું કે મારા એકના લગ્ન માટે આટલા ઐસુમાર પશુઓની હિસા? તેમણે ત્યાં જીવદ્યા ચિંતવી અને લમ્બનો વિચાર પડતો મૂકી પાછા કરી સર્વવિરતિનો સ્કવીર કર્યો. એ પણ એક રાજકુમાર હતા. પરંતુ આજના રાજવીઓ એંશઆરામ અને મોજશોખમાં મર્સ્ત હોય ત્યાં એમને સાચી ધર્મ કોણું સમજાવે? આજનું વાતાવરણ સર્વત્ર એકસરખુંજ હોય ત્યાં કોણું કોનો હાખલો વ્યે?

આગળના જરૂરમાં અંભાતના નવાખ સાહેબ જેવા

મુસ્લીમ રાજીવીને પણ પોતાના હૈયામાં પોતાની જીવિસાની ભૂલ ઉતરે છે અને તેઓ શ્રી સૂરીકરણ મહારાજ પાસે પોતાના કૃત્યની ક્ષમા યાચે છે, ત્યારે કહેવું જેઈએ કે એ હૃદય કેટલું ભરણ અને સત્યનું અથી હેઠું જેનું એ ? પૂજય શ્રી નવાબ સાહેબને રાજીવીધર્મ સમજાવતાં કુરાને શારીર શુદ્ધરમાચે છે તે જગ્યાવતાં કહે છે કે કુરાને શારીર કહે છે કે પુણ્ય કરો, કોઈનું ભલું કરો, બદી છોડો, નેકી કરો, ખુદાનો ઐએ રાખો, કોઈ જીવને ન ક્ષતાવો, જેવું કરશો તેવુંજ પામશો, જેવા કામ કરશો તેવી શિક્ષા કે અક્ષીસ મળશો. ગાય જેવા ઉપકારી માણીની કુરાનાની એતો મહાઅનર્થકારી અને જીવને અધોગતિમાં લઇ જનારે કૃત્ય છે. એમ નવાબને ઉપરેશ આપી જગ્યાનું કે કોઈનું પણ અકુદ્ધરતી મરણ નીપળવવાની ભાવના કરવી એ પોતાના આત્માનું ઘોરઅધઃપતન છે. હ્યાથીજ જગત (સ્વર્ગ)ના દરવાજ ખુલ્લા થશે. વિં પ્રતિએધ આપતાં નવાબના હૃદયને અસર થઈ અને જીહિંસા ત્યાગ કરવાનો નિશ્ચય કરી લીધે.

આમ આ ચમતકારથી જેમ શ્રીસંધના હૈયા લખ્યેલા અન્યા તેમ જૈનશાસનની ઉત્તનતિ થયેદી જેઈ શ્રાવકો કિયાનો આદર કરવા લાંયા. સ્વામીચાત્સલ્ય, પૂજા, મેલાવના, ગુરુભક્તિ અને અભયદાન આદિ ચઢતા પરિણામે સાચવી જીવનનો દાદાર લેવા લાંયા.

આમ અંસાતમાં ધર્મની અપૂર્વ પ્રભાવના કરતાં કરતાં

પૂજયશ્રી કાવી, ગાંધાર-જાંબુઅર થઈ ભરૂચ મુકામે પધાર્યા તેમજ સહૃદિપહેશથી કિયોછાર કરતાં, અનેક જીવોને ધર્મ-માર્ગમાં જોડતાં સ્થિર કરતાં સુરત, વડોદરા થઈ માલવહેશ તરફ વિચાર્યો. માલવહેશમાં આ સમયે દ્રવિડ હેશના બારસો જેટલા પાખંડીઓએ ધર્મના નામે ધતીંગ ચલાવવા માંડયું હતું. જગતમાં જેમ પાપ અને પુણ્ય, સત્ય અને અસત્ય તહેડો અને છાંયડો વિગેરે આદિ અનાદિ છે તેમજ સત્ય સામે પાખંડ પણું અદિ અનાદિ છે. જ્યાં સુધી સત્યની જ્યોતિ જગતનારાં જ્યોતિર્ધરાનો લેટો. જગતને થતો નથી ત્યાં સુધી ધર્મ-માર્ગથી વંચિત રહેલા જીવો નિર્દોષભાવે પાખંડીઓને ધર્મગુરુ માનીને પૂજે છે. પરંતુ સૂર્યના આગમન સાથે જેમ રજની પોતાની સોડ સંકેલી લેછે, પોતીસ આવતાંની સાથે જેમ ચોર-ડાઢુઓ નાશી જય છે તેમજ શાસન ચોકીની રક્ષા કરનાર પૂજયશ્રીના પધારવા સાથે અસત્ય ફૈલાવી રહેલા દ્રવિડો પકડાઈ જય છે. પૂજયશ્રી તેમને સંમાર્ગદર્શાંન અથેં ધર્મના દશ લક્ષણો સમજાવે છે અને કુરમાવે છે કે જ્યાં આ દસ લક્ષણો વિદ્યમાન હોય ત્યાંજ ધર્મ વિદ્યમાન હોય છે. જેના આચરવાથી પોતાના આત્માનો ઉદ્ય અને આત્મકલયાણ થાય તેજ ધર્મ અને જે કાચાંની શરૂઆત ન્યાયથા થાય અને અંત પણ એજ રીતે આવે તેજ ધર્મ.

આ મકારનો સતત ઉપહેશ સાંભળીને એ ૧૨૦૦ દ્રવિડો મિથ્યાત્વથી વિરમી સંયકૃતવસાધક થવા અને શ્રી ગુરુરાજના પરમહિપાસક ખની અત્યંત

આલાર માનતા શુદ્ધ કિયાએ કરવા થકી જરૂરને  
સરળ થયેલો જાણી અતિ આનંદિત થયા.

હવે ગુરૂજીને માલવ પ્રદેશના મધ્યમાં વિહાર કરવાનો  
વિચાર હોય ક્ષિપ્રા નહીને પેલે પાર જવું હતું પરંતુ નહીમાં જળ  
હોયને હોષ લાગે એ હેતુથી વિહારનો વિલંબ કરી જળ  
સુકાય ત્યારેજ નહી પાર ઉત્તરવા નિર્ણય કર્યો. પરંતુ કુદર-  
તના હૈવીસંભેગો. અને આ મહાત્માના ધર્મની ઉત્કૃષ્ટ  
આરાધનાના ગ્રભાવખળ વડે તે નહીના અધિપટાયક  
હેવે જળમવાહને જડ બનાવી રથણરૂપ કરી દીધો  
જેથી ગુરૂહેવને ધારેલી સરળતા પ્રાપ્ત થઈ અને ક્ષિપ્રા નહી  
આમાનીથી ઉત્તરી ગયા. નિશ્ચલમનોખળ-ઉત્કૃષ્ટ આધ્યાત્મિક  
ખળ અને ઈષ્ટહેવાની આરાધના કરનારને માટે જે મુજિત  
અશક્ય નથી તો આવી હુન્યવી મુદ્દેલીએ તો કેમજ અંત-  
રાયરૂપ બને? આમ પોતાનો મનસુષો પાર પડતાં પૂજયશ્રી  
આગળ વિહાર લંબાવે છે ત્યાં ઈસ્તલામ ધર્મના ચોર્નીસ  
પીરોના સ્થાનક પાસેથી પસાર થાય છે. આ પીરો  
જગતી જીવતી જ્યોતિરૂપ હતા તેમણે ગુરૂહેવના આત્મ-  
ખળની કસોશી અર્થે કેટલાક મશ્શો પુછ્યા. ગુરૂહેવના  
ઉત્તરોથી પોતાની જાતને મહાત થયેલા જોઈ એ  
પીરોના મનમાં ગુરૂરાજનો ઉપહેશ ઠસી જતાં તેમનું  
બહુમાન કરવા લાગ્યા.


આમ વિહાર કરતાં કરતાં રાજ વીરવિંદમ અને લોજના  
પરાકમોથી પ્રખ્યાત થયેલ ઉજાર્ણેન નગરીમાં પૂજયશ્રી પધાર્યા.

જ્યાં કિયાનુષ્ઠાનો વિષે પ્રવત્તાંતી અંધાધુંધીને સાક્ષી કરી, અનેક ખાળ જીવોને પ્રતિબોધી-સન્માર્ગમાં જોડી તેમને ભવલીડું ઘનાંયા. તેમજ ઉજાનૈન નગરીના રાજવીને પ્રતિબોધી જીવદ્યાનું ચથાથીતાત્પર્ય ગંભીરપણે સમજનવી જીવહિસા બંધુ કરાવીને રાજને આવકુદ્ધમ્બ અંગીકાર કરાયો. આજે વર્તમાનમાં અમુક રાજવીએ વિવેકની ખાતર કોઈ આચાર્યોના વ્યાપ્યાનોમાં જય છે અને કામચલાઉ અમુક હિવસો માટે જીવહિસા બંધુ કરવા ફરમાવે છે અને શુરૂહેવના ગયા પછી પાણી એજ સ્થિતિ ચાલુ રહે છે.

પૂજય આચાર્ય ભગવાન શ્રી પાશ્ચાંદ્રસૂરીશ્વરજી મહારાજાએ જે જે રાજવીએને મતિબોધ્યા છે તે હમેશા માટે એ માર્ગમાં સિથર ક્ષયા છે. માલવહેશમાં જીવહિસાને અદ્કાવવા માટે ઉપર કહ્યા તેવા અનેકવિધ પ્રયત્નો ઉપરાંત પૂજયશ્રીએ હજારું નામના કુસાઈને જીવહિસાના કૃત્યથી ઉપરેરાવડે સુક્તા કરી તેને દ્યામય ધર્મ ઉચ્ચયરેંદ્રિયો.

આમ માલવલૂભિમાં કિયાનુષ્ઠાનો અંગેના અપકૃત્યોને સાક્ષી કરી, અનેક જીવોનો ઉદ્ઘાર કરી, તેમજ જીવહિસા બંધુ કરાવી પૂજય આચાર્ય ભગવાન મેવાડ ભૂમિના પાઠનગર ઉદ્યપુરમાં પદ્ધાર્યો. ત્યાં પણ માલવ પ્રહેણની જેમ લોકોને ધર્મનો સાચો રાડ અતાવી પુનઃ પૂજયશ્રી જોધુપુરે નજીક આવી પહેંચ્યા. જંગલખાતાના અદ્ભુતરને પૂજયશ્રીના આગમનના સમાચાર સૌથી પહેલાં પોતાના હંમેશા રિવાજ

श्रीनामपुरीयतपागच्छाधिराज शासनप्रभावक  
 प्रातःस्मरणीय, ५० पू० श्री १००८  
 श्रीमत्यार्थ्यंद्रसूरीश्वरज्ञनी हेवी



मांडणमां श्री पार्थ्यंद्र गच्छना उपाश्रयमां  
 स्थापित दादानी हेवी.  
 तात्कालिक वांछितक्षल दाता।



મુજાના પર્યાટનથી થઈ અને તેણે શહેર તેમજ રાજ્યમાં શુરૂ આગમનની વધાઈ આપી. જોધ્ખાણુનાથ અને શ્રીસંઘે પૂર દમામથી પૂજયશ્રીનું સ્વાગત કર્યો અને ઉપાશ્રયે લાવવામાં આવ્યા.

જોધ્પુરમાં શુરૂદેવના આગમન સમયે લારે હુષ્કાળ પ્રવતીં રહ્યો હતો. અનેક મુંગા પ્રાણીઓ કાળના જડખામાં હોમાઈ રહ્યા હતા. લોકો લારે વાસને પામી રહ્યા હતા. તેમણે રાજ જોધ્ખાણુનાથને કુણું કે આપ પૂજયશ્રીને વિનંતી કરો તો તેઓશ્રીના પ્રલાવખાંથી અનેક લુચો ઉગરી જાય એવો રસ્તો જરૂર નીકળી આવશે. રાજએ પોતાની પ્રણની લાગણીને તુરતજ માન આપ્યું. શુરૂરાજને વિનંતી કરી પણ શુરૂદેવ તો મૌનજ રહ્યા. પરંતુ ભકૃત લૈરવ શુરૂમહિમા અને ધર્મનો વિજયડ કો તથા અભયદાનનું ઉત્તમ કારણું જાણી શુરૂ ધ્યાનખળવડે મેધવૃષ્ટ થવાની સિદ્ધિ શરૂ કરી. લોકો પોતાના ઘર તરફ ઇયો અને સ્વર્ચ આકાશ વાદળોથી ઘેરાવા લાગ્યું. અને જોતજોતામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ આવવા લાગ્યો, ખૂબ વૃદ્ધિ થવાને કારણે કેટલાક મકાનો પડવા લાગ્યા આથી દાન જોધ્ખાણુનાથે શુરૂદેવ પાસે આવી બહુ વિનયપૂર્વક જણાયું કે આપના પ્રતાપે આ હેશના અનેક લુચોને અભયદાન પ્રાપ્ત થયું છે. સુકી ભૂમિ જળજળાકાર બની છે. અને જેમ વજસ્ત્રામી, વિષણુકુમાર અને આર્યસુહસ્તસૂરિલુના તપોણે શ્રીસંઘાના કાર્યો કરી આપહાનો અંત આપ્યો હતો તેમ આપે અમારા

ચિંતામન હૈયાને શાંત કર્યો છે. પરંતુ કૃપા કરી હવે સંપૂર્ણ  
વૃષ્ટિ થઈ છે તો તેને બંધ કરો!

પ્રતાપી શુદ્ધરાજે ભક્ત લૈરવની કરણીને સંકેતવાનો  
સંકલન કર્યો કે તુરતજ તે બંધ પડી. આમ આ મહદુ  
ઉપકારથી મોતના જડખામાં ટપોટપ પડતાં લુવો બચી ગયા  
અને સારાથે દેશમાં આનંદમંગળ પ્રવતીં રહ્યો.

લોકોમાં એ દ્રદ્રતાએ વાસ કર્યો કે પૂજયશ્રીપાર્વતીદ્ર-  
સૂરીશ્વરજી મહારાજનો પ્રભગપ્રભાવ ચેવો છે કે જેમનાં  
દર્શાન કરતાંજ દારિદ્ર હૂર ભાગે છે, હર્ષનો સાગર  
ઉભરાય છે, પીડાતા લુવો પરમ આનંદને પામે છે  
અને સકળ લુવોનું હિત થાય છે અને આ શાસન  
પ્રભાવક પુરુષના પગલાં જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં તે  
ભૂમિ પાવન થતા સાથે હંમેશા આનંદમંગળ વર્તે છે.  
આ મહાપુરુષના યશોગાન અને પ્રભાવિકપણુંની સુતિઓ  
કેરદેર થવા લાગી.

એક વાત નિર્વિષાદ છે કે જ્યાં શ્રી જિનરાજ હેવ  
છે, શાંતિનિધિ ગુરુ છે, કૃપાસમુદ્ર ધર્મ છે, શુદ્ધ  
અજ્ઞપાન અને વસ્ત્ર વડે પ્રવર્તન છે, ચિદાનંદ માટે  
વિદ્ધા છે અને જ્યાં ઉપકાર એજ નિત્યકર્મ થઈ  
પડેલ છે એવા શ્રમણપણુંને નિહાળીને કલ્પવૃક્ષના  
લાલની માઇક કર્યો માણુસ સુખી ન થાય ?

અચિત્ય મહિમાવંત સૂરીધરજીના સદ્ગ્રોધથી  
મુણેાતગોત્રીય ક્ષત્રી રજપુતનાં ૨૨૦૦ ધરવાળાઓને  
પ્રતિબોધ આપવાથી તેઓ મુણેાતગોત્રી પરમ જૈન  
ધર્માનુરાગી શ્રાવક થયા અને ચુદ્ધ કિયાનુધ્યાન અપ-  
નાવીને એશવાળ વંશી ગણ્યાયા.

પૂજ્ય સૂરીધરજી મહારાજાને મર્દધર (મારવાડ) માં  
સદૃદ્દિપદેશના પ્રતાપે બાવીશ ગોત્રીઓને પ્રતિબોધ આપી  
જૈનધર્મી કર્યા. તે હાત સુધી પણ વિધમાન છે જેમના  
ગોત્રોના નામો નીચે મુજબ છે.

૧ બાંઠીયા	૬ બરડીયા	૧૬ લણુથાલી
૨ દૃદ્ધિતરી	૧૦ રાખેચા	૧૭ શ્રીમાલ
૩ ઘેગવાણી	૧૧ રામપુરીયા	૧૮ લંડારી
૪ તાતીડ	૧૨ હુગડ	૧૯ ટેટીયા
૫ લોઢા	૧૩ સુણેાત	૨૦ ચોધરી
૬ છેદિયા	૧૪ અંબલીયા	૨૧ સોની
૭ નવદ્વારા	૧૫ ગોગડ	૨૨ વોડાવત
૮ ખટોલ		

આમ હજરોને જૈનધર્મી અનાવતાં, રાજ્વીઓને પ્રતિ-  
બોધતાં પૂજ્યશ્રી પાસે જોધપુરનો એક રાજ્યશી કુમાર  
વૈરાધ્યવંત થતાં ચાતુર્માસ પૂછું થયે માતાપિતાની અનુમતિ  
મેળવી ૫૦ સૂરીધરજીના હાથે દીક્ષા અંગીકાર કરી. આ  
નવદીક્ષિતનું નામ સુનિ દિદ્યયંદ્રજી રામવામાં આવ્યું.

પૂજય આચાર્યભગવાનશ્રીપાર્થીચંદ્રસૂરીશ્વરજી  
મહારાજ જેધપુરનું ચાતુર્માસ પૂર્ણિ કરી પુનઃ નાગોર નગરે  
પોતાના ગુરુદેવ શ્રી સાધુરતનસ્તુરિજીનાં ચરણને નમસ્કાર  
કરી, સુગંધાતા પુષ્ટિ વિશેષ વિનય વૈયાવચ્ચ સાચચી આલો-  
યણા તપ્ય અંગીકાર કરી આનંદ પામ્યા. ગુરુદેવે શિષ્યના  
ઉત્સાહની વૃદ્ધિ થાય એવા આશીર્વંચનો ઉચ્ચાચ્ચા. પૂજયશ્રી  
ગુરુદેવ સાથે કેટલોક સમય રહ્યા હાદ થીકાનેર, રતનગઢ,  
જયપુર, દિલ્હી, આચા, અનારસ, સુરાંદાખાદ,  
રાજગૃહી અને શ્રી સમુત્સુધીશ્વરજી આદ્ધિ તીર્થની યાત્રા  
કરી. રસ્તામાં દરેક સ્થળે શ્રી જિનશાસનની પ્રલાવના કરતાં,  
શાન્દુરી અમૃતનો આસવાદ લવિકજનોને ચખાડતા હતા.  
એક સ્થળે બે પદ્ધો વચ્ચે કેટલીક ધાર્મિક વિચારણાઓ  
સંખ્યાંધમાં મતલેદો ઉભા થતાં તેનું સમાધાન મેળવવા આ  
શાસ્ત્રવિશારદ સૂરિપુરંગવ પાસે તેઓ આવી પહોંચ્યા. સૂરી-  
શ્વરજીએ તેમને શંકાશીલ પ્રશ્નો પૂછ્યા અને તેના યોગ્ય  
ઉત્તરો આપવા માટે સહર્ષ જણાયું. પૂછાયેલા તમામ પ્રશ્નોના  
ઉત્તરો સંતોષ મળતાં બંને પક્ષો વચ્ચેનો માન્યતા લેદ હુર  
થયો. આમ પૂર્ણ આચાર્યભગવાનના શાન્દુરા, તર્દુકિતિ  
અને શાસ્ત્રોક્તશાન જોઈ તેઓ એક ણીજ પ્રત્યે કહેવા લાગ્યા  
કે જીનાચાર્યોને સર્વજ્ઞ પુત્રોના બિજુદ્ધનો દાવો કરે  
છે તે અરેખર અક્ષરેસ સત્ય છે. વિશેષમાં સૂરીશ્વરજીએ  
કેટલોક અવધ્યાનો કરી બતાવ્યા જેથી વિવાદથ્રસ્ત ઉસથ  
પક્ષો આનંદિત થયા.

શ્રી તીર્થુકર ભગવંતોએ પોતાની પછી ત્રીજી પદે શ્રી

આચાર્ય લગ્વાનોને શાસનના નાયક તરિકે નિર્માણ કરેલા છે. શાસનને સુસમર્પિત થયેલા આચાર્યો શાસનનેજ જીવનમાં ભાવતા હોવાથી ભાવાચાર્ય તરીકે પૂજાવાને લાયક છે. જાનાચારાહિ જેવા પાંચ આચારોને જીવનમાં અખંડપણે પાળતા ભાવાચાર્યોને લોકહેરી કદ્દી સ્પર્શી શકતી નથી. એથીજ એ તાર્કો ભવ્યતમાઓને ધર્મના સાચા રસીયા બનાવી શકે છે. ભાવાચાર્યો લોકહેરીથી પર રહી પંચાચારનું પાલન કરવા અને કરાવવામાં ઉદ્યુક્ત હોવાને લીધે વિશ્વમાં પોતાની યુગપ્રવતીને અભાધિત રાખી શકે છે. આમ સાચા ભાવાચાર્યની કોટિમાં શ્રીપાર્થ્યંદ્રસ્ફુરીશ્વરજી મહારાજ પોતાના આધારે રહેનારાઓ ઉન્માર્ગો ન જય અને સદ્ગ્યા સન્માર્ગમાંજ રહે એની પુરતી કાળજી ધરાવી રહ્યા છે. ભાવાચાર્યો શાસન પ્રત્યેની પોતાની કુરજ અદા કરવામાં પાછી પાની કરતા નથી આમ પૂજ્યશ્રી અનેકનો ઉદ્ઘાર કરતાં, તરત્વવાદ વડે દિગ્ભિજય કરતાં અનેક અદ્વય સંસારો જીવોને દીક્ષામાર્ગમાં જોડ્યા બાદ કલકત્તા થઈ પટણું વિગેરે સ્થળોએ વિચરતાં પૂજ્યશ્રીએ દક્ષિણ ભણી વિહાર લંબાવ્યો.

આગાઉની આગાહી મુજબ દક્ષિણમાં વીચરી રહેલા પૂજ્યશ્રીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી વિજયહેવજીએ ત્રણ વર્ષમાં સવાલાખ ચિંતામણી થંથનું અધ્યયન કરી પ્રવર પંડિત થયા હતા. એ સમયે બીજપુર ગામમાં પાંચસો પંડિતો ધર્મચર્ચા માટે એકત્ર થયા હતા, જ્યાં પંડિતપ્રવર શ્રી વિજયહેવ મુનિરાજ પણ આમંત્રણથી પદ્ધાર્યો અને વિવા-

દમાં વિજય મેળવી પોતાનું બિડુદ સાર્થક કરી સર્વને આનંદ આપ્યો. ત્યાંના રાજએ શ્રી વિજયહેવળની અદ્ભુત વિદ્રત્તા અને શાખપારંગતપણું જેઠને તેમને આચાર્યપદનો અધિકાર સુપ્રત કર્યો. આચાર્ય શ્રી વિજયહેવસૂરીશ્વરજી મહારાજ સૂરિમંત્રના જપક બની ધર્મધોષ હેલાવી નાગપુરે તરફ પદ્ધાર્યો. એ અરસામાં આચાર્ય મહારાજ શ્રી પાંચંદ્રસૂરીશ્વરજી ત્યાં પદ્ધારતાં શ્રીવિજયહેવસૂરિજી શ્રીસંધ સાથે ગુરુહેવનો સતકાર કરવા પદ્ધાર્ય અને સામૈયાપૂર્વક તેઓશ્રીને નાગપુર નગરમાં પ્રવેશ કરાવ્યો. અને શ્રીસંધની વિનંતીથી એ સાલનું ચાતુર્માસ ત્યાંજ થયું. ત્યાં શ્રાવક-શ્રાવિકાઓને પ્રતિ-ઓધી ધર્મમાર્ગમાં લીન કર્યો.

વિ. સં. ૧૫૮૪ની સાલથી પૂજયજીએ આગમાદિનું સંશોધન કરી કેટલાક નવીન થયોએની રચના કરી મહાન લાભ પ્રાપ્ત કર્યો. ત્યારબાદ પૂજયશ્રી પોતાના શિષ્યરત્ન શ્રી વિજયહેવસૂરિજી સહિત ચાતુર્માસ પછી વિહાર કરી ગામે-ગામ પાવન કરતા અનેક જીવોને ઉનમાર્ગથી બચાવી સનમાર્ગમાં વાગતાં ધર્મની વૃદ્ધિ કરવા લાગ્યા.

આ વખતે ચિતોડગઢપતિ મહારાણા શ્રી સંથામ સિંહજીની કચેરીમાં ખરતર ગચ્છ, તપગચ્છ, કડવામતિ આદિ એકત્ર થયા હતા. આ કચેરીમાં જંગમયુગપ્રધાન જાણી નાગપુરીયતપાગચછાધિરાજને પણ પદ્ધારવા માટે રાજનું આમંત્રણ મદ્યથી હતું જેથી પૂજયશ્રી ચિતોડ પદ્ધાર્યો. ધર્મચર્ચામાં પૂજયશ્રીએ લાગ લઈ વિજય પ્રાપ્ત કરી

એકન્દ્ર થયેલા પંડિતો તેમજ અન્યત્ર મેદનીને આનંદિત કર્યા. તેમજ શ્રી આણું દવિમલસૂરીશ્વરજીએ પૂછેલા પ્રશ્નોના સચોટ ઉત્તરો આપી શ્રોતાજીનોને મુખ્ય કર્રો હીથા હતા.

મહારાણાજીને વાસ્તુશાખ સંબંધી કેટલાક ખુલાસાએ જેઠતા હતા જે આ મહાપુરુષ પાસેથી સંતોષકારક મળતાં તે અત્યંત સંતુષ્ટ થયા. વિ. સં. ૧૫૬૮ની સાલમાં પૂજયશ્રીએ શાંખલપુરમાં પગડા પાવન કર્યો. તે સમયે શ્રીમન્નાગ-પુરીય તપાગચ્છાધિરાજ શ્રીસોમવિમલસૂરીશ્વરજી ભીરાજમાન હતા. તેઓશ્રીએ શ્રીપાર્શ્વચંદ્રસૂરિજીને સર્વ પ્રકારે યોગ્યતાવંત અને ઉત્તમોત્તમ જૈનતત્ત્વપ્રકાશક નાણી સર્વ આચાર્યોની સર્વમતિ સહ યુગપ્રધાનપદ આપવાની વિચારણા કરી નિર્ણય કર્યો. શ્રી સંધને પણ આ પહોંસવ ઉજવવા ઉમીંએ થઈ તે માનવા લાગ્યા કે પૂજયશ્રી વચ્ચનાતિશયવંત વિદ્યમાન છે માટે તે યુગપ્રધાનપદ માટે અરાખર લાયક છે. તે સાથે પૂજયશ્રીના સુયોગ્ય શિષ્યરત્ન શ્રી સમરચંદ્રજીને ઉપાધ્યાયપદ આપવાનો હહાવો કેવાનો પણ નિરધાર કર્યો. શ્રી સંધે પોતાના આંગણે પહોંસવ શરૂ કર્યો.

આ માંગલિક કાર્યમાં પુણ્યપ્રભાવક અને માર્ગાનુસારી શ્રાવક મોદજ્ઞાતીય શેઠ વિકુમશાહ તથા શેઠ સધરશાહ તેમજ શ્રીમાળીજ્ઞાતીય શેઠ હેમાજીના સુપુત્ર ડોસાશાહ અને શેઠ ડાશાશાહ, લાધ્યાશાહ, પાશરાજ એ છ ભાગ્યશાળીએ અગ્રભાગ લઈ જીવનને સાકૃત્ય કર્યું.

આ મહેતસવમાં લાગ લેવા માટે ઠેરઠેરથી આમંત્રણું પત્રિકાઓને માન આપી ભાવિકજનોા, આચાર્ય મહારાજે, ગીતાર્થ પંડિતો વિગેરે મોટો સમુદ્ધાય એકત્ર થયો હતો. એ પ્રસંગમાં પૂજયળુના પ્રતિષેધથી જૈનધમીં બનેલા રાજ, મહારાજ, રાણુશ્રી વિગેરે પણ ત્યાં પધાર્યો હતા અને શોલામાં અભિવૃદ્ધિ કરી હતી. પૂજાઓ, પ્રલાવના, સ્વામીવાત્સલ્યાદિ ધર્મ અને શુણાનુરાગી કાર્યોની જ્યોત જળહળતી હતી. સર્વત્ર અમારીપદહ વજડાવ્યો હતો. સુગીતાર્થ આચાર્ય શ્રી સોમવિમળસૂરિલુના વરદ હસ્તે શ્રીચતુર્વિધસંધની અતુમતી અને હાજરી વચ્ચે જૈન વિધિ પ્રમાણે પૂજયળુને ચુગમેધાનની અને સ્વમરચંદ્રલુને ઉપાધ્યાય પદવીઓ એનાયત કરવામાં આવી. આ પ્રસંગે યાચકોનેદાન, અતિથિઓને લોજનાદિ વિગેરે અનેકવિધ કાર્યો થયા. આ પ્રસંગની યાદરૂપે અનેક શ્રાવક-શ્રાવિકાઓએ સંખ્યાબંધ વત-નિયમાદિ પચ્ચાણ્ણો થહણુ કર્યો. વિવેકી સજજનો હંમેશાં સંસારની અસારેતા સ્વમજ આવા પુણ્ય પ્રસંગો ઉજવવા તન, મન, ધૂનથી ઓતમેત થાય છે.

લારખાદ જંગમચુગપ્રધાન આચાર્યભગવાન શ્રી પાંચ્-ચંદ્રસૂરીશ્વરલુ મહારાજ શિષ્યમંડળ સાથે સામૈયાપૂર્વક ખંભાત બંદરના ઉપાશ્રયમાં પધાર્યો હતા. આ વખતે આચાર્યશ્રીવિજયદેવસૂરીશ્વરલુના કાળને નળુક આવતો પૂજયશ્રીએ જોયો અને આચાર્યશ્રીને અણુસણુ અદરાંયું. થોડાજ સમય બાદ શ્રીવિજયદેવસૂરીશ્વરલુ સમાધિપૂર્વક

સ્વર્ગે મિધાંયા. આમ રાજ મહારાજને પૂજવા ચોણ્ય, ન્યાય-  
શાસ્ત્રપારંગત, પંડિતપ્રવરશ્રીના દેહોત્સર્ગથી પૂજયશ્રીને  
લારે ખેદ થયો. શાસનના આવા અણકતા કોહીનુર જવાથી  
કેને ખેદ ન થાય? આ બનાવ બન્યા બાદ વિ. સં. ૧૬૦૦ની  
સાતમાં પૂજયશ્રી ઘંભાતથી વિહાર કરી રાજનગરમાં લારે  
ધામધૂમપૂર્વકના શ્રીસંઘના સતકારથી પદ્ધાર્યો. યુગપ્રધાન  
આગ્રાય લગવાને પોતાના ધર્મ વ્યાપારની પ્રખ્યાત ચેઢીનો  
વહીવર ચોઅવટપણે ચલાવી અને હળવાકમી જીવોને લાભ  
આપી શુદ્ધ કિયાનુષ્ઠાનવંત કર્યા.

ત્યારખાં શ્રીશત્રુંજ્યતીક્ષે ફરસવાના ભાવથી  
પૂજયશ્રી કાઠિયાવાડ તરફ વિચયો અને ત્યાં જઈ શ્રી ગિરિ-  
રાજને વંદી અંતરંગમાં ઉચ્ચ લાવની શ્રેણીમાં તહીન થયા  
અને ત્યાં લઘુસિંહનિઃકીડિતતપુ આરંભ્યો. કેટલોક અમય  
ગિરિરાજની શીતળ છાયામાં આરમધ્યાનયુક્ત વ્યતીત કર્યા  
આદ વિહાર કરી ચુરુજુ વાંકાનેર પદ્ધાર્યો અને ત્યાં શુદ્ધોપહેશ  
આપી ભવિ જીવોનો ઉદ્ધાર કરી પાટણુ નગરે પદ્ધાર્યો.  
ત્યાંથી મર્દધર (મારવાડ) ભૂમિમાં પગલાં પાવન કરી ધર્મની  
વિજય પતાડા ફરકાવી. પૂજયશ્રીએ બાળસાહિત્યની પણ  
રચના કરી છે કે જે કાવ્યો નહાનકડાં બાળકો ઉદ્વાસપૂર્વક  
ગાવા ભાથે ભાવવાહી પ્રેરણાનું પાન કરી શકે.


વિ. સં. ૧૬૦૩ ની સાતમાં પૂજયશ્રી ધામધુમથી નાગોર  
પદ્ધાર્યો. મારવાડ મહેશમાં ઉપ૪૦૦ લોડાગોત્રીય મહેશ્શરી  
ધર્મ પાળનારાં ઘરો હતા. તેઓ તેમજ બાંડીયા ગોત્રીને

પણ મહેશરી ધર્મ પરિત્યાગનો ઉપદેશ આપી શુદ્ધ જિન-  
ભાષિતધર્મ અંગીકાર કરાવ્યો. તેમજ વીરમગામમાં  
વિશાશ્રીમાળી મહેશરી ધર્મપાલક કુદુંઘોની શુદ્ધ કરી  
આવક ધર્મમાં આણ્યા. જેનો પરિવાર અધાપિ પર્યંત મોળુદ  
છે. હેશાઈ ટોકર ચતુર સાત ન્યાતના શેઠ હમણું સુધી  
વિધમાન હતા. તેઓ સરેને ખુનમની ચૌમાસી અને  
પાંચમનું સંવત્સરી મતિકમણું ગચ્છની પરંપરા મુજબ  
કિયાતુવાદ કરાવ્યો.

એજ સાલ એટલે વિ. સં. ૧૬૦૩ માં પૂજયશ્રીને એક  
ખીલે આધાત શિષ્યરતન શ્રીવિજયહેવસૂરિજીના કાળધર્મ  
પછી પોતાના ગુરુહેવ શ્રી સાધુરતનસૂરિજીના દેહાતસર્ગથી  
લાગ્યેા. નિરંતર ધર્મધ્યાન કરતા અને સહુપદેશવડે લવિજનોનું  
કલ્યાણુ કરતા, આચુષ્ય મર્યાદા ખૂટતાં તેઓશ્રી આ અસાર  
સંસારને છાડી સ્વર્ગ સિધાવ્યા. આ કાળધર્મ નિમિત્તે શ્રી  
સંધે ભારે ઉત્સાહથી પૂજાઓ લણાવવા સાથે ખીજ ધાર્મિક  
અનુમોદનીય અનેક કાર્યો કર્યા.

પૂજયશ્રી જંગમચુગપ્રધાન આચાર્ય લગવાન શ્રી  
પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી લગવાનના યથાર્થ જાનખળનો ખહુજ  
થોડાને હયાલ છે એમ તેઓશ્રીએ રચેલા નૈનધર્મી ત્રંથો,  
સ્તવનો, સજાચો, ચૈત્યવંદનો, સ્તુતિયો, સ્તોત્રો, સૂત્રોના  
ભાગાવષેધ વિગેરે અનેકવિધ મનનીય, વિક્રતાશક્તિથી લરપુર  
પુસ્તકોની નીચેની નામાવલી પરથી કહી શકાય એમ છે.

શ્રીમત્નાગપુરીયતપાગચ્છગાગનનભોમણિ શાસન-  
પ્રભાવક પ્રાતઃસ્મરણીય ૫૦ પૂર્ણ ૧૦૦૮  
શ્રીમત્પાર્વત્યંદ્રસૂરીશ્વરજીની હેરી.



અભાત બોરપીપળાની ધર્મશાળા પાસે  
સ્થાપિત દાદાની હેરી.  
તાત્કાલિક વાંછિતફલ દાતાર.



- |                            |                             |
|----------------------------|-----------------------------|
| ૧ સાધુવંદના                | ૨૩ સિદ્ધાંત આરાધન           |
| ૨ ગોત્રસ્વામીનો લધુરાસ     | ૨૪ કિયાતુષાન વિચાર          |
| ૩ ચારિત્ર મનોરથમાળા        | ૨૫ નિયતાનિયત વિચાર          |
| ૪ વીતરાગ સ્તવન             | ૨૬ સંખ્યાસંખ્યાનંત વિચાર    |
| ૫ આગમ છત્રીસી              | ૨૭ સિદ્ધાંતોક્તા પંચ પ્રતિ- |
| ૬ ગુરુછત્રીસી              | ક્રમણ વિચાર                 |
| ૭ પાંચી છત્રીસી            | ૨૮ અદ્ધાલિભિત વિચાર         |
| ૮ સુહૃપત્તી છત્રીસી        | ૨૯ આવશ્યક હેતુગલ્ય શુદ્ધ    |
| ૯ ઉત્તરાધ્યયન છત્રીસી      | પ્રદ્યપણ વિચાર              |
| ૧૦ જિનપ્રતિમા સ્થાપના રાસ  | ૩૦ વિધિવિચાર                |
| ૧૧ શત્રુંજ્ય રાસ           | ૩૧ નિયતાનિયત પ્રક્ષોત્તર    |
| ૧૨ એષણા શતક                | પ્રતીપિકા                   |
| ૧૩ ખંધક રાસ                | ૩૨ કાઉસંગના ૧૬ હોષ          |
| ૧૪ રહેટી આરાધના            | ૩૩ અમરદ્વાસમતિકા            |
| ૧૫ નાની આરાધના             | ૩૪ ગંધીચાર પંચાસિકા         |
| ૧૬ સંક્ષેપ આરાધના          | ૩૫ નિશ્ચયન્યવહાર પદ્ધ       |
| ૧૭ પત્રવણુસૂત્રના ૧૧મા     | પંચાસિકા                    |
| પદ્ધની લાખા                |                             |
| ૧૮ ચઉસરણુપયજ્ઞા ઉપર        | ૩૬ સિદ્ધાંત આરાધન એકો-      |
| વાર્તિક                    | ન ચત્વારિંશતિકા             |
| ૧૯ જિનપ્રતિમા અધિકાર       | ૩૭ દૂર્ધા શતક               |
| ૨૦ આચારસંગસૂત્ર પર વાર્તિક | ૩૮ પૂજા શતક                 |
| ૨૧ સિદ્ધાંત વિચાર          | ૩૯ વિધિશતક                  |
| ૨૨ ધૂદ્રોય સ્વભાવ નયવિચાર  | ૪૦ વિવેક શતક                |
|                            | ૪૧ સત્તરલેઢી પૂજા વિચાર     |

૪૨ સત્તરલેદી પૂજા વિધિ-	૬૩ શ્રાવક સાધુ રહસ્ય
ગર્ભિત	૬૪ સૂયગડાંગસૂત્ર ઉપર વાતિંક
૪૩ કેશી પરહેશી પ્રખાંધ	૬૫ અગવતીસૂત્ર ઉપર વાતિંક
૪૪ સંધરંગ પ્રખાંધ	૬૬ પ્રક્ષેપ્યાકરણ ઉપર વાતિંક
૪૫ પચ્ચાખાણુ ભાષ્ય	૬૭ દશ વૈકાલિક ઉપર વાતિંક
૪૬ સંદૂષ્ટાણ સ્વરૂપ	૬૮ ઉત્તરાધ્યયન ઉપર વાતિંક
૪૭ સમ્યક્તવસ્વરૂપ	૬૯ સંધયણીનો ભાતાવભોધ
૪૮ સિદ્ધાંતસાર	૭૦ ગુણુસ્થાનકવિચાર ભત્રીસી
૪૯ આગમપ્રમાણુપ્રકાશક સમાચારી	૭૧ સંવેગ ભત્રીસી
૫૦ ગચ્છસમાચારી	૭૨ વિહૃરમાન ભત્રીસી
૫૧ પૂજા વિધિ	૭૩ અગ્નાર ઐલ ભત્રીસી
૫૨ હીક્ષા વિધિ	૭૪ આત્મશિક્ષા
૫૩ યોગ વિધિ	૭૫ શ્રાવકપાદ્ધિકાદિ અતિચાર
૫૪ ઉપધાન વિધિ	૭૬ પાદ્ધિકાદિ ચૈત્યવંદન
૫૫ પોસહ વિધિ	૭૭ વીસવિહૃરમાન જિનસ્તુતિ
૫૬ પંચપ્રતિકમણુ વિધિ	૭૮ ચતુર્વિંશતિ જિનસ્તુતિ
૫૭ કાળઘરુણુ વિધિ	૭૯ પાર્બત્નાથ જિનસ્તુતિ
૫૮ શ્રાવક મ્રત શતક	૮૦ જિન યોગ્રીશ અતિશય ગર્ભિતસ્તવન
૫૯ ઉપહેશ રહસ્ય ગીત	૮૧ મહિનાથ જિનસ્તવન
૬૦ ગીતાર્થાવભોધકુલક	૮૨ ઓસીયામંડન શ્રી મહા- વીર જિન સ્તવન
૬૧ અધ્યયય દશ સમાધિ સ્થાન કુલક	૮૩ શાગુંજય મહાંત્રય સ્તવન
૬૨ વંદન હોષ ભત્રીસ કુલક	

८४ श्री सुमतिनाथजिन	१०२ श्री इष्टलहेव जिन स्तुति
स्तवन	१०३ नागोरमंडन श्री महावीर जिन स्तवन
८५ शत्रुंजय स्तवन	१०४ श्री महावीरजिन स्तवन
८६ श्रीचंद्रप्रबलजिनस्तवन	१०५ भेडामंडन श्री धर्मशांति पार्श्वजिन स्तवन
८७ श्रीमहावीर जिनस्तोत्र	१०६ काउसगगना १६ होषनी सज्जाय
८८ श्री इष्टलहेव जिन स्तवन	१०७ चित्रकूटचैत्यपरिपाठी स्तवन
८९ श्री पद्मप्रबल जिन स्तवन	१०८ प्रतिकमणि विधि सज्जाय
९० श्री नेमिनाथ जिन स्तवन	१०९ श्रीशांतिनाथजिन पंचवर्ग परिहार स्तोत्र
९१ ज्ञवदयानी सज्जाय	११० श्री वीरजिन विज्ञमि
९२ श्री वीरजिन कल्याणुक	१११ चोवीस जिन कल्याणुक भावनी
सज्जाय	११२ असज्जाय सितारी
९३ श्री जिन प्रतिमा वंदन	११३ श्रीलक्ष्मीपिका
सज्जाय	११४ असज्जाय विचार
९४ चेतना राणीनी सज्जाय	११५ गुणस्थानक चिन्ह
९५ श्री महावीर जिन स्तवन	११६ अष्टकर्म विचार
९६ शुद्ध आण्यागर्भित श्री	११७ आठमहपरिहार सज्जाय
महावीर जिन स्तवन	११८ सामायिकना ३२ होषनी सज्जाय
९७ श्रीआहिनाथजिन विनांति	
९८ श्री जिन प्रतिमास्थापना	
द्विपंचशिका	
९९ इपुकमाणा	
१०० ज्ञरावता श्रीपार्श्वनाथ	
जिन स्तोत्र	
१०१ शंखेश्वर श्री पार्श्वनाथ	
जिन स्तवन	

- ११६ લગ્નવતીસ્કુત્રમાં સંતા-  
વેલું ગણિત પ્રમાણ
- १२० શુરૂપરીક્ષા સજાય
- १२१ રાજવિર્કૃત પ્રક્ષોત્તર
- १२२ ષટ્ટર્ભ્રંથ વિચાર ૩૫  
પ્રક્ષોત્તર
- १२३ જિનાજાપાલન સજાય
- १२४ શ્રી મહાવીર જિનસ્તુતિ
- १२५ શ્રીપાંચનાથ જિનસ્તુતિ
- १२૬ પુરુષ પરાવત્ત સ્તવન
- १२૭ નાગોરમંડન શ્રી શાંતિ-  
નાથ જિનસ્તવન
- १२૮ ચતુર્વિંશતિ જિન કલ્યા-  
ણુક સ્તવન
- १૨૯ શ્રીશાંતિનાથ જિનસ્તુતિ
- ૧૩૦ તારંગામંડન શ્રીઅજિ-  
તનાથ જિન સ્તવન
- ૧૩૧ શ્રી સુમતિનાથ જિન  
સ્તવન
- ૧૩૨ „
- ૧૩૩ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
- ૧૩૪ મિથ્યાત્વ સ્વરૂપ
- ૧૩૫ શ્રીઆદ્ધિનાથજિનસ્તુતિ

- ૧૩૬ શ્રી અજિતનાથ જિન  
સ્તુતિ
- ૧૩૭ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તુતિ
- ૧૩૮ શ્રી વાસુપૂજ્યજિનસ્તુતિ
- ૧૩૯ શ્રીશાંતિનાથજિનસ્તુતિ
- ૧૪૦ શ્રીમલ્લીનાથજિનસ્તુતિ
- ૧૪૧ શ્રીનેમિનાથ જિન સ્તુતિ
- ૧૪૨ શ્રી પાર્વતિનાથજિનસ્તુતિ
- ૧૪૩ શ્રી મહાવીર જિન સ્તુતિ
- ૧૪૪ શ્રીચતુર્વિંશતિજિનસ્તુતિ
- ૧૪૫ શ્રી સીમંધરજિન સ્તુતિ
- ૧૪૬ શ્રી વીજાવીહરમાન  
જિન સ્તુતિ
- ૧૪૭ ઓગણ્યત્રોસી લાવના
- ૧૪૮ શ્રી શાંતિ જિન વિનાંતિ
- ૧૪૯ શુરૂગુણુંની સજાય
- ૧૫૦ નદીઉતારવિધિ પર  
સજાય
- ૧૫૧ શુરૂ આશાતના તેત્રીસ  
વળ્ણન સજાય
- ૧૫૨ પરદેશી રાજની સજાય
- ૧૫૩ સંવરની સજાય
- ૧૫૪ અદ્યપાહુત્ત્વવિચાર કુલ૯

૧૫૫ શ્રીશાંતિનાથજિન	૧૬૪ શ્રી વિમદ-વાસુપૂજય
સ્તવન	જિન સ્તવન
૧૫૬ શ્રીનેમિનાથજિન સ્તવન	૧૬૫ શ્રીપાંકુનાથજિન
૧૫૭ સમ્યકૃતવહીપક હોધકા	ચૈત્યવંદન
(સોરઠા) ૪૯	
૧૫૮ શાત્રુંજ્યમંડનશ્રી	૧૬૬ શ્રી જિનેન્દ્ર સ્તુતિ
આદિનાથજિન સ્તવન	૧૬૭ શ્રી વાસુપૂજય જિનસ્તુતિ
૧૫૯ ઉપદેશ રહસ્ય સંજાય	૧૬૮ શ્રી પરમાત્મ સ્તવન
૧૬૦ એકાદશ ગળુધર સ્તુતિ	૧૬૯ શ્રીપાંકુનાથજિનસ્તુતિ
૧૬૧ આત્મશિક્ષાની સંજાય	૧૭૦ શ્રી મહાવીર ગુણસ્થાન
૧૬૨ શ્રી મહાવીરજિન સ્તવન	સૂચિકા વિજાપુ
૧૬૩ શ્રીપાંકુનાથજિનસ્તવન	૧૭૧ શ્રી સિદ્ધાચલ ચૈત્યવંદન
	ઇલાદિ

આમ સંજાય, સ્તુતિઓ, સ્તવનાહિ ગુજરાતી, સંસ્કૃત  
પ્રાકૃત વીગેરે ભાષામાં પૂજયશ્રીએ મનનયોગ્ય પુસ્તકો લખી  
નૈનસાહિત્યબંડારમાં અનેકવિધ પુષ્પોનો ઉમેરો કર્યો છે.  
આ બધા પર દ્રષ્ટિપાત કરતાં એવો કોઈ વિષય ભાગ્યેજ  
હોશે કે જેના વિષે પૂજયશ્રીએ કંઈ ને કંઈ ન લખ્યું હોય.  
નૈનધર્મની ઈમારત ત્યાગના પાયા પર ઉલેક્ષી હોવાથી  
આત્મિક ઉત્ત્રત તરફ હોઢી જતાં કર્મ-સત્તાનું પ્રાયદ્વય દાખવી  
એમાંથી કેવી રીતે છુટાય એ વાતનું પ્રકાશન કરતાં ઉપરોક્તા  
અંથે અવસ્થય અતિ ઉપયોગી છે છતાં માનવસમાજની સેવા  
લાવનાથી પણ અન્ય વિષય પર ગંધ-પંધમાં સુંદર સાહિત્યનું  
સર્જન કર્યું છે. આ મહાન પ્રલાવિકપુરુષે નૈનસાહિત્યનું

સંશોધન કરી તેને પ્રકાશમાં આપ્યું છે. છતાં એ મહાપુરુષને આજે બહુજ થોડા ઓળખે છે. પૂજયશ્રીમાં સાધુતાનો પ્રભાવ હતો, ચારિત્રની શીળી છાયા હતી. વીરતાના પૂજન હતા. ધર્મ અને સંસ્કૃતિનો સમન્વય સાધતા એ સાંબાન્ધિક મહાપુરુષે અહિંસા પરમો ધર્મની આણ ચોમેર વર્તાવીને દેશભરમાં જૈનધર્મને એક અનેડ ધર્મ તરીકે સાબિત કર્યો હતો. જેમણે વિવાદમાં અનેક ધુરાધર વિદ્વાનોને સુગંધ કર્યા, હઠાત્રહીંદોના મિથ્યાત્વનું ઘંઠન કર્યું. વાણિજ્ય સંસ્કૃતિના એ વારસે સરસ્વતીહેવીની અખંડ ઉપાસના કરીને અન્ય સંસ્કૃતિ પર આધિપત્ય જમાવ્યું હતું.

આમ સાહિત્ય શિરોમણિ આચાર્ય લગ્વાન શ્રી પાશ્ચયંદ્રસૂરીશ્વરજીએ સાહિત્યની અનેડ સેવા કરી સંવત ૧૬૦૪ માં વિહાર કરતાં ૫૦ આચાર્ય લગ્વાન ૫૦ ઉપા. શ્રી સમરચંદ્રજી વિગેરે શિષ્યસમુદ્દાયસહ જુદા જુદા પ્રદેશોમાં વિહાર કરતાં ખાચરોદ સુકામે પધાર્યો. જ્યાં શ્રીસંઘના અતિઆશ્રદ્ધી પૂજયશ્રીએ પોતાના શિષ્યરત્ન શ્રી સમરચંદ્રજી ઉપાધ્યાયજીને શુદ્ધ કિયાનુષ્ઠાન ધારક જાણી પોતાની વિદ્યમાનતામાંજ આચાર્યપુરુષી વિલૂષિત કર્યો. આથી શ્રી સંઘના ધેરધેર આનંદોત્સવ હોય એમ ઉદ્વાસ પ્રગટી નીકળ્યો.

સંવત ૧૫૪૬ થી માંડીને સંવત ૧૬૧૨ લગીના લગલગ ૬૭ વર્ષના અરસામાં પૂજયશ્રીએ જુદાજુદા સ્થળોએ ચાતુર્માસ કરી અનેક ભવ્ય જીવોનો ઉદ્ઘાર કર્યો છે. તેમજ

શાસનપ્રભાવના કરી છે પરંતુ એ બધી હકીકતોથી ગુંથાયેલા પુસ્તકોનો જે ભંડાર થીકાનેરમાં હતો તે પર વરસાદનું પુષ્ટળ યાણી પડવાથી ભંડારમાંની પ્રતો કાગળના માવાડ્યું બની ગઈ. આમ સાહિત્યથી ભરપુર ભંડારની આ શોચનીય દર્શા જોઇને પૂજયશ્રીને એહ થયો. પરંતુ કુદરતની ઈચ્છા આગળ ભલભલા લાગ્યાર છે. એથી આજે કેટલીક ખાખતોમાં દલીલો ટાંકવામાં કે દાખલા આપવામાં સુધ્કેલી અનુભવવામાં આવે છે. આને કારણે પૂજયશ્રીના કંમવાર ચાતુર્માસો, વિહાર તેમજ માસ-તિથિ આદિમાં જોઇતો પ્રકાશ પાડી શકવા ભાગ્યશાળી થઈ શક્યા નથી. એમ છતાં મળેલા સાહિત્ય ઉપરથી પૂજયશ્રીના જીવન પર બને તેટલો પ્રકાશ ફેંકવાનો પ્રયાસ આ દુંક જીવનચરિત્રમાં કરવામાં આવ્યો છે.

**શ્રીસમરચદ્રસૂરિજીનો પટોત્સવ થયા બાદ પૂજ્યજી લગભગ ૬૮ વર્ષની વયે પહેંચ્યવાથી એકાંતમાં રહી ધર્મ-ધ્યાનમાં વિશેષ તલ્લીન રહેવાનું વધારે પસંદ કરતા હતા. એ સખ્યે નાગોરના ઉપાશ્રયને લગતી સાત કોટ્ઠીએ કે જે આજે પણ વિદ્યમાન છે. તેની અંદર એસી પૂજયશ્રી પોતાની ધારણા પ્રમાણે કલાકેના કલાકે અને દિવસોના દિવસો શુભરતા હતા અને ચિદાનંદ સુખની રહેરો અનુભવી યુક્ત સમયને સર્જણતા બદ્ધી આત્મધ્યાનમાં મળ્યા રહેતા હતા.**

પરંતુ ફરશનાનો યોગ પ્રબળ હોવાથી કેટલોક સમય નાગોરમાં આત્મધ્યાનમાં ગાળીને પૂજયશ્રી જોધપુર શહેરે પધારતાં રાજ જોધાલુનાથ અને શ્રીસંઘે આડંખરથી સામૈયું

કરી તેઓ શ્રીને શહેરના ઉપાશ્રયમાં બિરાજમાન કરવામાં આવ્યા. ભાવિક ગુરુભક્તોએ આ વયોવૃદ્ધ ગુરુરાજની ભક્તિ કરી જાનદાન મેળવી તથા શુદ્ધ કિયાતુષાન આરાધી અનંત પુણ્ય ઉપાર્જન કર્યું. તેમજ સંવત ૧૬૧૨ ની સાતનું ચાતુર્માસ સવેંની વિનંતીના પરિણામે ત્યાંજ કર્યું.

આ ચાતુર્માસની પૂર્ણાહૃતિ થતાંજ પૂજયશ્રીની પ્રકૃતિમાં ફેરફાર થતો જણ્ણાવા લાગ્યો. અને દિનપ્રતિદિન તેમાં ઉમેરો થતો રહ્યો. ગુરુરાજને તો જાણ થઈ ગય હતી કે હવે આ પૂર્ણી પર પોતાનો દેહ લાંબો સમય રહેવાનો નથી અને તેઓ શ્રી એટલું સચોટ રીતે જાણુતા હતા કે પોતાને અમુક માસના અમુક દિવસે આ મૃત્યુલોકને ત્યજી પરદૈકગમન કરવાનું છે.

ઉત્તમ ગતિમાંથી આવનાર અને તે તરફ જનાર એ બેઠની રીતભાત પ્રસંશનીય છે. આવી સ્થિતિ પામવી એ ઉચ્ચ ગતિનુંજ ચિનહુ છે અને જો આવા મહાપુરુષો સદ્ગતિના લોક્તા ન થાય તો પણ કોણ થઈ શકે? એજ પ્રશ્ન છે. આવા જાની આત્માએ કિયાનો સુમેળ સાધી જગત પર જે પરમ ઉપકારની વર્ષી વરસાવે છે તેને જગત આપું જીલે છે. જળચર, સ્થળચર, વનચર, સવેંકોઠના હૈયા કુમેશા હૃદ્ધીજ ઉલ્લાય છે.

પરંતુ કાળની ગતિજ ન્યારી છે. તે કોઇને છોડતો નથી. પરંતુ જે મનુષ્યો સમતાભાવે હેઠના કણ્ઠો વેદીને આચુષ્ય પુરું કરે છે તે સદ્ગતિનેજ પામે છે. આપણા

પૂજયશ્રીના જીવનની અંતિમ ઘડીએ ગણુંતી હતી. ભાગશરે સુદ ઉ સંવત ૧૯૧૨ ની કાળરાત્રીની ગણુનામાં નિર્માણ થઈ ચુકી હતી અને વિધાતાએ પણ એમનાં દેહાંતસ્થાન તરિકે જોધપુરને લખી રાખ્યું હતું. દેહના અનેક ફર્હો છતાં ગુરૂરાજ તેને તાબે થતા નથી પણ અંતિમ આરાધના ધર્મદ્યાનમાં જ તદ્વીન રહીને કરી રહેલા હતા. એ પૂજયશ્રીએ એકવાર મેદની સમક્ષ ઉચ્ચાર્યું કે “મારા સ્થળ દેહનો વિરહ થયે થી ઉદાસ ન થતાં. ધર્મદ્યાનમાં મશગુલ રહી મને વિરોષ ધર્મના હિસ્સાનો લાગી કરશો.” અંતિમ વચ્ચે કર્માવી સમાધિપૂર્વક પૂજયશ્રી કાળહેવની પથારીને વશ થયા અને દેવલોકના વાસી થયા.

ગુરૂહેવનો વિરહ ગુણાનુરાગી જનોને પોતાના સગા-સનેહીએના વિરહ કરતાં પણ હુમેશા વધુ સાલે છે. કારણ સગાસનેહીએને તો તે માયાવી સંસાર બંધન માને છે જ્યારે એ માયાવી ભૂતાવગમાંથી સુક્તા કરનાર ગુરૂરાજને તો પોતાના આત્મોદ્ધારક માનીને પૂજે છે, આમ સમસ્ત જોધપુર વાસી-એમાં પૂજયશ્રીના કાળધર્મના સમાચારથી ગુરૂવિરહના કારણે લારે હીલગીરીની લાગણી ઝેલાય છે અને જોધપુરવાસીએનાં ચક્ષુઓ અશ્રુભીનાં બને છે.

પૂજયશ્રીના દેહાંતસગાંથી હિંદલરના શ્રી સંઘામાં ગમ-ગીનીની લાગણી પ્રગટી નીકળી હતી. પરંતુ નામ તેનો નાશ છે એ વસ્તુને સમજેલ શ્રીસંઘા કાંઈ રોક કરીને થોડાજ

એકી રહે તેમ હતા ? તેઓએ તો પૂજયશ્રીના કાળધમને મહોત્સવરૂપ ઉજવી ડેરડેર અહૃદાધ મહોત્સવો કર્યા અને સુમારકે તરીકે નીચેના સ્થળોએ સ્થૂલો ( પાદુકા સ્થાપન ) ઉલા કર્યા જે આજે પણ કેટલાક સ્થળો મોણુદ છે.

૧ ખીડાનેર, ૨ નાગોર, ૩ મેડતા, ૪ પાલી, ૫ સોજત, ૬ રણ, ૭ હેસણુંક, ૮ લીનાસર, ૯ જોધપુર, ૧૦ બુધનાવર, ૧૧ ચિતોડ, ૧૨ ઉજજૈન, ૧૩ જયપુર, ૧૪ મુશ્રીદાબાદ, ૧૫ આથ્રા, ૧૬ અજમેર, ૧૭ સાબર, ૧૮ રીયાં, ૧૯ પાલીતાણા, ૨૦ માંડલ, ૨૧ વીરમગામ, ૨૨ પ્રાંગધ્રા, ૨૩ લીણઠી, ૨૪ ઉનાવા, ૨૫ ખીનપુર, ૨૬ અમદાવાદ, ૨૭ ખંલાત, ૨૮ રાધનપુર, ૨૯ વાલોતરા, ૩૦ પંચ પદરા, ૩૧ તિવરી, ૩૨ ખગડી, ૩૩ પટણા, ૩૪ અજુમગંજ, ૩૫ બુરાનપુર, ૩૬ ખાચરોદ વિગેરે સ્થળો તેઓશ્રીની ચરણુપાદુકાએ સ્થાપન કરવામાં આવી.

**પૂજયશ્રીપાર્બીચંદ્રસૂરીશ્વરજી મહારાજએ જે ઉત્ત્ર તપ કર્યા હતા તે તપની સમજ આ નીચે ઇમસર આપવામાં આવે છે. આ સૂત્રોમાં કહેલા તપ છે.**

(૧) ભદ્રતપ : આ તપને અંગે ૭૫ ઉપવાસ અનુક્રમે ૧ થી ૫ ઉપવાસો આવે છે, જે તપ ૧૦૦ દિવસે સંપૂર્ણ થાય છે. તેમાં ૨૫ પારણાના દિવસો આવી જાય છે. આ તપનું ઇણ કલ્યાણની પ્રામિ અથે છે. “શ્રી મહાવીરસ્વામી નાથાય નમઃ” ગરણું છે. આ તપ સાધુ અને શ્રાવકે કરવાનો તપ છે.

(૨) ભાગભાગતપ : આ તપમાં ભાગતપથી દિવસોની વૃદ્ધિ છે. ૧ થી ૭ સુધી ઉદ્દા સુદ્દા ઉપવાસ અને ૯૨૬ ઉપવાસે પારણું કરતાં કુલ ૧૬૬ ઉપવાસ અને ૪૮ પારણું મળી આડ માસ અને પાંચ દિવસો (કુલ ૨૪૫ દિવસો) આ તપ પૂરે થાય છે. આ તપનું ઇણ સર્વ વિધનોનો નાશ છે.

(૩) ભાગોત્તરતપ : પાંચ ઉપવાસથી ૬ સુધી ચડઉતર ઉપવાસ કરતાં કુલથે ઉપવાસ ૧૭૫ ને પારણું ૨૫ મળી ૨૦૦ દિવસે આ તપ પૂર્ણ થાય છે.

(૪) સર્વતોભાગતપ : ઉપવાસ અનુકૂળે ૫ થી ૧૧ ઉદ્દા સુદ્દા મળી કુલથે ૩૬૨ ઉપવાસ અને ૪૮ પારણું આવે છે. કુલ દિવસ ૪૪૨ થાય છે. આ તપમાં ગરણું વિગેરે ભાગતપની ચેઠે જાણુવું.

(૫) લઘુસિંહનિઃકીડિત તપ : જેમ સિંહ ચાલતાં ચાલતાં પાછળનો ભાગ જુએ છે તેમ સિંહનિઃકીડિત તપ કહેલ છે તેમાં પ્રથમ ૧ ઉપવાસ ને પારણું, ૨ ઉપવાસ ને પારણું પછી ૧ ઉપવાસ ને પારણું, પછી ૩ ઉપવાસ ને પારણું, પછી ૨ ઉપવાસ ને પારણું એ રીતે આનુપૂર્વીએ તપ કરવો પછી પશ્ચાનુપૂર્વીએ લેવું. એમ ચાર પરિપાઠી કરતાં આ તપ એ વર્ષ અને ૨૮ દિવસે (કુલ ૭૪૮ દિવસે) પૂરે થાય છે. એક પરિપાઠીના કાળ છ માસ ને સાત દિવસ છે. તેમાં ૧૫૪ ઉપવાસ ને ૩૩ પારણું આવે છે એટલે એક પરિપાઠીના કુલ ૧૮૭ દિવસો થાય છે આમાં “અ નમો અરિહંતાણું” તું

ગરણું ગણુવાનું છે. આ સાધુ તથા શ્રાવકને કરવાનો આગામી તપ છે.

(૬) બૃહત્સંહનિઃકીડિતતપુઃ પૂર્વોક્ત રીતે દરેક તપને અંતે પારણું કરલું. આ તપની એક પરિપાઠીને કાળ એક વર્ષ, છ માસ ને અઠાર દિવસ થાય છે. તેમાં ૪૬૭ ઉપવાસ અને ૬૧ પારણાં (કુલ પ્રેરણ દિવસ) થાય છે. એમ ચાર પરિપાઠીએ કરતાં છ વર્ષ, ૨ માસ અને ૧૨ દિવસે (કુલ ૨૨૩૨ દિવસે) આ તપ પૂરો થાય છે. આ તપનું કુળ ઉપશમ શ્રેણીની પ્રામિકૃપ છે. આ તપ સાધુ તેમજ શ્રાવક બજોને કરવાનો છે.

કનકાવલી, મુક્તાવલી, રત્નાવલી, લઘુસિહનિઃકીડિત અને આ તપ એમ પાંચે તપો ચાર પરિપાઠીએ કરવાના ‘પ્રવચન સારોદ્ધાર’ માં કહ્યા છે. તેમાં ગરણું ‘હ નમો અરિહંતાણું’ ગણુવાનું છે.

(૭) સુક્તાવલી તપ : તપસ્વીએને કંઠના આલરણું-ઝ્ય નિર્મણ સુક્તાવલી સમાન હોવાથી આ તપ સુક્તાવલી તપ કહેવાય છે તેમાં સોળ ઉપવાસાદિ સુધી બે આવળી-પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી જાણુવી. આ પ્રમાણે ૩૦૦ ઉપવાસ અને ૬૦ પારણાં મળી એક વર્ષે આ તપ પૂરો થાય છે.

(૮) કનકાવલી તપ : અનુક્રમે ૧-૨-૩ ઉપવાસો ને ત્રણું પારણાં, C છઠું અને આઠ પારણાં એમ જુદી જુદી શાખામાં બતાવેલ વિધિ મુજબ ઉપવાસો ને પારણાં આવે છે. કુલ ૩૮૪ ઉપવાસ અને ૮૮ પારણાં આવે છે. ‘પ્રવ-

ચનસારોદ્વાર'માં કહ્યું છે કે આ તપ ચાર વાર કરવાથી પાંચ  
વર્ષ, એ માઝ અને ૨૮ દિવસે પૂર્ણ થાય છે. 'જો નમો અરિ-  
હતાણું' નું ગરણું ગળવાનું છે. આ સાધુ તથા શ્રાવકને  
કરવાનો આગાઢ તપ છે. ઈતિ.



યુગપ્રધાન શ્રીપાઠ્યચંદ્રસૂરીશ્વરલુ લગવાનના

## લવનચરિત્રનો દુંક સારાંશ

જન્મસ્થાન :—હમીરપુર, આખુતીથૺ પાસે.

જન્મ :—વિ. સ'. ૧૫૭૭ના ચૈત્ર સુદ ૯ શુક્રવાર.

પિતાનું નામ :—વેગલશાહ નરોત્તમશાહ.

માતાનું નામ :—વિમદાહેવી-વિમળાખાઈ.

જ્ઞાતિ :—પોરવાડ-વીશાપોરવાડ.

દીક્ષા :—વિ. સ'. ૧૫૪૬ના વૈશાખ સુદ ૩. ( ઉ. વ. ૬ )

ગુરૂનું નામ :—શ્રીસાધુરત્નસૂરિલુ મહારાજ.

અભ્યાસ :—શરૂઆતમાં ષડાવશ્યક-પ્રકરણાદિ, વ્યાકરણ,  
કાંય, કોષ, સાહિત્ય, નાટક, ચંપ્યુ, સંગીત, છંદ,  
રસાલુંકાર, તક્કુ-ન્યાય, ચોગા, સ્વમતમંડન, પરમતખંડન,  
જ્યોતિષ સંખ્યાઓ વિવિધ શાસ્ત્રો.

ધર્મશાસ્ત્ર :—જિનમતના આગમો, પરમતના શ્રુતિ-સમૃતિઓ,  
ગણિત, ષડકર્ણનના તત્ત્વકર્ણક સિદ્ધાંતો વિગેરે વિગેરે.

**ઉપાદ્યાયપદ :**—વિ. સં. ૧૫૫૪ના વૈશાખ સુદ ૩, સ્થળ-  
નાગોર નગરે, શેડ સજલાણીગોત્રીય શ્રી સહસ્રમલલ  
વિગેરે શ્રાવકોએ આહરેલા અષ્ટાનિહકા મહોત્સવપૂર્વક  
ભારે ધામધૂમથી ઉપાદ્યાયપદ જન્મથી સત્તર વર્ષાંની  
ઉંમરે એનાયત કરવામાં આવ્યું.

**વિહાર :**—દક્ષિણ, પૂર્વ, મેવાડ, મારવાડ, માળવા, કચ્છ-  
કાઠિયાવાડ, ગુજરાત વિગેરે અનેક પ્રદેશોમાં ડેરડેર  
ઉશ્ર વિહાર કરી રાજા, મહારાજા વગેરે અનેક જીવોને  
ધર્મમાં લીન કર્યા.

**કિયોઢાર :**—( શુદ્ધ સંવેગમાર્ગનો સ્વીકાર ) વિ. સં. ૧૫૬૪  
માં પૂજ્યશ્રીએ જન્મથી રજમા વર્ષે કિયા ઉદ્ધાર કરી  
યતિઓએ ફેલાવેલ અંધાધુંધી અને શિથીલાચાર ફૂર  
કરવામાં મહાન યશસ્વી ઝાળો આપ્યો છે. જીવનચરિ-  
ત્રમાં વર્ણવ્યા મુજબ ૨૨ ગોત્રીઓનો ઉદ્ધાર, મહેશ્વરી  
ધર્મમાંથી જૈનધર્મમાં સેંકડો ઘરેને સહુઉપદેશથી લાવ્યા.  
નેધપુરનરેશ માલદેવલુ, ચિતોડગઢનરેશ સંઅમસિહલુ  
મહારાણા અને ખંભાતના નવાખસાહેબ ઈત્યાદિ  
રાજાઓને પ્રતિબોધી પોતાના પરમલક્તા બનાવ્યા. મેશ્રીઓ,  
ક્ષત્રીયો અને અન્યદર્શનવાળાઓને ઉપદેશવડે જૈન-  
માર્ગમાં નેડ્યા અને લોકોને શુદ્ધ કિયાનુષ્ઠાનવંત માર્ગ  
બતાવી શિથિલાચારને લગીરથ પુરુષાર્થ વડે હાંકી કાઢ્યો.

**આચાર્યપદ :**—વિક્રમ સં. ૧૫૬૫ના વૈશાખ સુહ ૩, સ્થળ જેધપુર. અહૃતી મહોત્સવ પૂર્વક શ્રીચતુર્વિધસંઘની હાજરીમાં, જન્મથી ૨૮ વર્ષની ઉમરે અને હીક્ષાથી ૧૮મા વર્ષે આચાર્યપદ આપવામાં આવ્યું.

**ચુગપ્રધાનપદ :**—સં. ૧૫૬૬ના વૈશાખ સુહ ૩, સ્થળ શ્રી સલક્ષણ (શંખવ)પુર, મોદ્રાતીય વિક્રમશાહી, સધરશાહી, વીશા શ્રીમાળીજાતીય ડોનાશાહી, ડળાશાહી, લાધાશાહી, પાનરાજ વિગેરેએ હજાવો લીધો. આચાર્યો, પંડિતપ્રવરે વિગેરે ચતુર્વિધ સંઘની હાજરીમાં જન્મથી ૬૨મા વર્ષે અને આચાર્યપદથી ૭૪મા વર્ષે ચુગપ્રધાનપદ એનાયત કરવામાં આવ્યું.

**ચમતકારી કૃતિઓ:**—(૧) અંલાતમાં કુરખાની મારે લઈ જવામાં આવતી ગાયને અદ્રક્ષય કરી તેને હાંકી જનારાઓને સ્થિર કર્યો. નવાખમાણેથે ક્ષમા યાચતા અને જીવહિસા પ્રતિગંધ કરતાં સર્વેની મુક્તિ.

(૨) જેધપુર નગરને આંગણે હુકાળથી અનેક જીવો મોતના જડભામાં હડસેલાઈ રહ્યા હતા. ત્યારે જેધવૃષ્ટિ થઈ અને સર્વત્ર લીલા હેઠેર.

(૩) ઉનાવા (ઉંઝા) મુકામે પૂજ્યશ્રી એક મેશ્રી વણિક ગૃહસ્થને ત્યાં ગૌચરી અથેં પધાર્યો. તે સમયે વણિક ગૃહસ્થની પતની છાણા થાપતી હતી. પૂજ્યશ્રીએ ધર્મલાલ કહેતાં ગુરુમામાં આવીને તેણે જોતાની પાસે પડેલું છાણ પાત્રમાં

નાંયું. તે લઈને મહાત્મા પોતાના સ્થાનકે પધાર્યો. પાછાથી વણ્ણિક ગૃહસ્થને આ વાતની જાણ થઈ એવે તુરતજ તે પૂર્ણ મહાત્મા સ્ત્રીની આવી ઉલો રહ્યો અને પોતાની પત્રીના અપકૃત્ય ખદલ ક્ષમા યાચ્યો. પરંતુ પૂજયશ્રીએ પાત્ર બતાવી કહ્યું કે મારી પાસે તેવી કોઈ વસ્તુ નથી. પણ લક્ષ્ય વસ્તુજ છે. આ જેઠ-સાંલળી તે ગૃહસ્થ વિસ્તય પામ્યો અને ખરેખર આ મહાત્મા કોઈ દૈવીપુરુષ છે એમ મનમાં ચિંતવવા લાગ્યો. અને સારાયે ગામમાં તેનો પ્રચાર થઈ ગયો. પૂર્ણ મહાત્માનો ઉપહેશ સાંલળી ૫૦૦ ધરેઓ શ્રીજૈનધમ્ન અંગીકાર કર્યો.

(૪) રાજનગરમાં સં. ૧૫૭૬ ના પૂજયશ્રીના આગમન સમયે મરકીનો ભારે ઉપર્દવ ચાલતો હતો. શ્રીસંધના ભાઈ-એએ આવીને પૂજયશ્રી પાસે આ બાબત બહુજ ખેદ સાથે જહેર કરી. પૂજયશ્રીએ દૈવીશક્તિના યોગે હજરો માણુસોને ભોતના જડખામાંથી બગાવી લીધા અને મરકીના ઉપર્દવને શાંત કર્યો. તેથી લવિક જીવોને અતિ હુખ્ય થયો.

(૫) પૂજયશ્રીના સ્વર્ગવાસ ખાદ જેધપુરનરેશ માલદેવજી મહારાજાની ઉપર દિવલીનો ખાદશાહ કાંઈક કારણુસર દૃષ્ટમાન થઈ સબળ સૈય સાથે આવી જેધપુરની ચોમેર મોારચા માંડી પ્રગતને રંજડવા લાગ્યો. તે વખતે જેધપુરનરેશે પોતાના સબળ સહાયક સ્વર્ગવાસી પૂજયગુરુદેવતનું એકાશચિત્તે ધ્યાન ધરી મનોખળને મજબૂત બનાયું. એ ધ્યાનની સુરતના ણળથી પ્રજરી પેદા થતાં સ્વર્ગવાસી ગુરુને અરજાંટ તાર મજબાની પેડે લક્ષ્યાના ફુઃખની એક ખળર મળી કે ‘લક્ષ્ય-

લીડલંજનમલો! જરા પણ વાર ન કરતા' એટલે સાધુવેશે ભક્ત મહારાજની સન્મુખ આવી પ્રસન્નતાપૂર્વક કહ્યું કે 'સેવક! જરાય ચિંતા કરીશ નહિ, સર્વ આકૃત દૂર થશે.' નાં મહારાજાએ તથાસ્તુ કહી હર્ષથી વંદન કરી વિનંયું કે 'લીડલંજન ભગવાન! આપ કેયે સ્થળે બીરાજે છો?' ગુરુરાજે કહ્યું કે 'ભક્ત! હું બીજા હેવલોકમાં વસું છું?' એટલું જણાવી અદ્રશ્ય થયા અને નાં મહારાજ તે સ્વરૂપને હૃદયમાં સ્થાપી આનંદમાં લીન થઈ અહોભાય માનવા લાગ્યા. બીજે દિવસે ચર્ચા આવેલા દિલહી-પતિના લશ્કરમાં ગુરુરાજના પ્રતાપથી કુટક્ષાટ થઈ ભાગાણું પડ્યું. બાદશાહી લશ્કરનો આગેવાન જીવ લઈ નાડો કોઈ એક બીજાને તપાસવા પણ ન રહ્યા આમ થવાથી જોધપુર-નરેશની ગુરુરાજ ઉપર મહાન શ્રદ્ધા ભક્તિભાવ વધ્યો ને ગુરુરાજની ચરણપાહુકાનો મહિમા વર્ણવી આનંદ પામ્યા. તેવી રીતે પૂજયશ્રીની જ્યાં જ્યાં ચરણપાહુકાઓ છે ત્યાં ત્યાં ભાવિકભક્તો ભાવથી પૂજન કરે છે અને તેમની આશાઓ પૂછું થતી જોવામાં આવે છે. એવા મહાપ્રલાભિક પુરુષ થઈ ગયા છે.

**સાહિત્ય સેવા:**—આ પુસ્તકમાં આવેખાયેલા પૂજયશ્રીના જીવનચરિત્રમાં તેઓશ્રીએ ગુજરાતી, પ્રાકૃત, સંસ્કૃત, હીન્દી વિગેરે ભાષામાં જે ૧૭૧ પુસ્તકો ગધ-પદ્ધમાં બનાવ્યાની નોંધ મળી છે તે પરથી સૌ કોઈને તેઓશ્રીના અગાધજ્ઞાનની પ્રતીતિ થાથ તેમ છે. પરંતુ એ સાહિત્ય વાંચતાં તેના એકએક શુદ્ધના થતા બિનાલિન અથેરી જોતાં ખરેખર આ કૃતિઓ કોઈ

દૈવી-ચમત્કારિક છે. એમ લાસ્યા વિના રહેતું નથી.

**વિશાળ ધર્મપ્રભાવનાના કાર્યો:**—અનેક લભ્ય જીવોનો ઉદ્ઘાર કરી શ્રીલાગવતીપ્રબ્રન્દ્યા આપી જૈનશાસનનો વિજયદ્વાર ફૂરકાવ્યો અને અંજનશલાકા પૂર્વક જિન-પ્રતિષ્ઠાઓ કરાવી.

### શિષ્ય સમુદ્દરાયઃ—

૧	શ્રી વિજયહેવસૂરિજી	૧૪	„ „ વીરજી
૨	„ સમરચંદ્રસૂરિજી	૧૫	પંડિતશ્રી પ્રદ્બાજી
૩	૩૦ શ્રી હેવરાજજી	૧૬	હેમરાજજી
૪	„ „ જિનરાજજી	૧૭	માલખિંજી
૫	„ „ શ્રીસારમુનિજી	૧૮	ભૂષણચંદ્રજી
૬	„ „ ઐમરાજજી	૧૯	હરપાલચંદ્રજી
૭	„ „ ઉદ્ધયચંદ્રજી	૨૦	મહીપચંદ્રજી
૮	„ „ હર્ષચંદ્રજી	૨૧	હેમચંદ્રજી
૯	„ „ હેવચંદ્રજી	૨૨	વાસવચંદ્રજી
૧૦	„ „ કુંભકરણુજી	૨૩	હાંપરાજજી
૧૧	„ „ કણ્ણરાજજી	૨૪	માલજી
૧૨	„ „ વરદરાજજી	૨૫	હામજી
૧૩	„ „ શ્રીરાજજી	૨૬	દ્વાણચંદ્રજી

૨૭ ખ. શ્રી કિંદ્રચંદ્રજી

આદિ વિક્ષાન કિયાપાત્ર અને ચારિત્રશીલ શિષ્ય-પ્રશિષ્યનો સમુદ્દર હતો. (જેટલાં નામ મળ્યાં તેટલાં અહીં આપ્યાં છે.)

શ્રી પાર્વત્યંદ્રગંધના ઉત્તરોત્તર ધુરંધર  
આચાર્ય મહારાજાંયે.



ઉપરની ડાખી આળુથી—

(૧) ૫૦ પૂરો શ્રીસમરચંદ્રસૂરિલુ (૨) ૫૦ પૂરો શ્રીરાજચંદ્રસૂરિલુ  
નીચેની ડાખી આળુથી—

(૩) ૫૦ પૂરો શ્રીવિમલચંદ્રસૂરિલુ (૪) ૫૦ પૂરો શ્રીજયચંદ્રસૂરિલુ  
આ ચાર પ્રતિમાઓ અમદાવાદ-શામળાની પોળમાં મહાવીરસ્વામીના  
હેરાસંમાં મેડા ઉપર બિરાજમાન છે.



**મિથ્યાત્વઅંડન:**— ચિતોડગઠની અને જેધપુરની રાજ-  
સભામાં મિથ્યાત્વીઓના મતનું અંડન કર્યું. લોંકાશાહ નામના  
મૂર્તિંઉત્થાપક ગૃહસ્થ સાથે વિવાદમાં કદાચહી થતાં છોડી  
ફીધો પણ તેના ઉ ગૃહસ્થ શિષ્યોએ પૂજયશ્રીના હાથે ફીક્ષા  
અંગીકાર કરી. યતિઓ, હુઠવાદીઓ અને ખીજ અનેક વિદ્ધા-  
નાને વાદમાં પરાજય કર્યાં. જે તેઓશ્રીના જીવનચરિત્રમાં  
સ્વિસ્તર આપેલું છે.

**તપ્યાઃ**— રલાવલીતપ, કનકાવલીતપ, મુક્તાવલીતપ,  
લક્ષ્રતપ, લદ્રોતરતપ, સર્વતોલક્ષ્રતપ, મહાલક્ષ્રતપ, લધુસિહ-  
નિઃકીડિતતપ, બૃહત્સિહનિઃકીડિતતપ, વીસસ્થાનકતપ,  
અષ્ટક્રમસ્સૂદનતપ, વર્ધમાનતપ વગેરે અનેક તપ કરી  
પૂજયશ્રીએ કર્મને જગ્યારીભૂત કર્યાં હતાં.

**ચાતુર્માસોઃ**— સં. ૧૫૪૬ થી ૧૫૬૩ સુધીમાં ૧૮ ચાતુર્માસ  
નાગોર, હમીરપુર, બારકેટ વિગેરે સ્થળોએ યતિપણામાં  
કરેલાં ત્યારપણી સં. ૧૫૬૪માં કિયોછાર કરી— (સંવેગી  
થયા પછી) જે કે પૂજયશ્રીનો સંપૂર્ણ સંવત્વાર ધતિ-  
હાસ મળી શકતો નથી તોપણ જે મળે છે તેને આધારે  
નીચે મુજબ ચાતુર્માસ કર્યાં સંલને છે.

સં. ૧૫૬૪ જેધપુર (મારવાડ)	'૬૮ લચાઉ (વાગડ)
'૬૫ નાગોર „	'૬૯ મોટીખાખર કે
'૬૬ ખીકાનેર „	અદ્રેશ્બર (કચ્છ)
'૬૭ રાધનપુર (ગુજરાત)	'૭૦ જુનાગઢ (કાઠિયાવાડ)

'૭૧ પાલીતાણા „	'૮૨ કલકટા
'૭૨ પ્રાંગધ્રા „	'૮૩ કદ્યાણુકભૂમિ-
'૭૩ શાંખેશ્વર કેરાધનપુર	અયોધ્યા
'૭૪ માંડલ કે વિરમગામ	'૮૪ ધીનપુર (માલવા)
'૭૫ પાટણ (ગુજરાત)	'૮૫ માંડવગઢ „
'૭૬ અમદાવાદ „	'૮૬ ચિત્તોડગઢ (મેવાડ)
'૭૭ ખલાત „	'૮૭ ઉદ્યપુર „
'૭૮ ઉજ્જેણુ (માલવા)	'૮૮ સલખણપુર
'૭૯ ખાચરોદ „	'૮૯ ખલાત
'૮૦ ધીનપુર „	'૯૦૦ અમદાવાદ
'૮૧ માંડવગઢ „	'૦૧ પાલીતાણા
'૮૨ ઉદ્યપુર (મેવાડ)	'૦૨ વાંકાનેર કે પ્રાંગધ્રા
'૮૩ જોધપુર (મારવાડ)	'૦૩ નાગોર
'૮૪ ધીકાનેર „	'૦૪ ખાચરોદ
'૮૫ રતનગઢ „	'૦૫ રતલામ કે ઈંદોર
'૮૬ જ્યાપુર „	'૦૬ માંડવગઢ
'૮૭ હિંદી „	'૦૭ ઉદ્યપુર કે ચિત્તોડ
'૮૮ આચા „	'૦૮ જોધપુર
'૮૯ ખનારસ	'૦૯ નાગોર
'૯૦ સુર્ખિંદાખાદ	'૧૦ નાગોર
'૯૧ કદ્યાણુક ભૂમિ-	'૧૧ જોધપુર
સમેતશિખ?	

આ પ્રમાણે ઉક્ત પ્રદેશોમાં ડેરફેર ચાંતુર્માસ અને ઉત્ત્રવિહાર કરી અનેક લવિજીવોને સન્માર્ગમાં જોડ્યા છે.

**કાળધૂર્મ:**—ઈત્યાહિ અનેક ઉપકારો કરી, છાસઠ વર્ષો સુધી દીક્ષા પાળી, સુડતાલીસ વર્ષો સુધી આચાર્ય પદવી લોગવી અને તેર વર્ષો સુધી યુગપ્રધાનપદ હીપાવી. સં. ૧૯૧૨ ના માગશર સુદ ઉ ને રવિવારે જેધપુરમાં લતપદ્યભાણુ અણુસણુ (આહાર-પાણીના ત્યાગ) પૂર્વક પોતાનું ૭૪ વર્ષો, ૭ માસ અને ૨૪ દિવસનું સર્વ આયુ: પૂણું કરી ભમાધિ અહિત કાળધૂર્મ પામી સ્વર્ગવાસી થયા.

### પર્વતિથિનુ' આરાધન.

યુગમધાન શ્રીપાદ્યંદ્રસૂરીશ્વરજી મહારાજએ સિદ્ધાન્તાનુસારે ભાદ્રવા સુદ પંચમીની સંવત્સરી, આષાઢી, કાતાંકી અને ક્રાંતુખી-એ તથુ પુનમની ચૌમાશી અને બાર મહિનાની ચોવીસ ચૌદશની ચોવીસ પદ્ભી પ્રતિક્રમણુ કરવાનું કરમાવેલ છે.

પર્યુધણુપર્વ' પંચમીના દિવસે કરવુ' તેનો નિર્ણય

‘શ્રીક્રમવાયંગસૂત્ર’ના ૭૦મા સમવાયમાં પ્રથમ આલા-પકમાં કહું છે કે સમણે ભગવં મહાવીરે વાસાણં સવીસઝરાએ માસે વિકંતે સત્તરિષ્ટિ રાંદિષ્ટિ સેસેહિ વાસાવાસં પજોસવેઈ ૧૧’ એટલે શ્રીમણુ ભગવાન् શ્રીમહાવીરસ્વામીએ, વર્ષાંક્રતુના વીશ દિવભ સહિત એક માસ વ્યતીત થયે અને સીતેર રાત્રિદિવસ

શેષ રહે લારે વર્ધિવાનું પ્રત્યે નિવાસ કર્યો (ચોમાસું રહ્યા) અર્થાત् અવાડ વહ ૧ થી ૫૦ મે દિવસે એટલે ભાડરવા સુદ્ધ પંચમીએ પચુંધણુપવ્વ કર્યાં અને ભાડરવા સુદ્ધ ૬ થી કાતીંકી પુનમ સુધી એટલે ૭૦ દિવસ સુધી યોગ્ય ઠેકાણે ચોમાસું રહ્યા. માટે સંવત્સરી મતિકભણું પંચમીએ કર્તાંય છે.

ચતુર્થીના પચુંધણું કરનાર શ્રી કાલિકાચાર્યના સંતા-નીયાએ એ કારણુથી અપવાદ ઉત્સર્ગની પરંપરાની માર્ગ દ્રષ્ટિરાગને વશીભૂત થઈ ‘નિશીથવૃણી’ માં લખ્યું છે કે—

‘ સીસો પુચ્છતિ, ઇયાર્ણિ કહું ચડત્થીએ અપદ્વ પજો-સવિજ્જતિ? | આયરિઓ ભણતિ કારણિયા ચડત્થી | અજ્જકાલ-ગયારિએણ પવન્તિયા | કહું ખેતે કારણં? કાલગાયરિયો વિહરંતો ઉજ્જેણિગતો, તત્થ વાસાવાસંતરંદ્વિઓ, તત્થ નગરિએ બલમિત્તો રાયા, તસ્સ કળિદ્વો ભાયા ભાણુમિત્તો જુવરાયા, તેસિં ભગિણી ભાણુસિરી ણામ, તસ્સ પુત્તો બલભાણુણ ણામ, સોય પગઇભહૃવિણિ-યયાએ સાહૂ પજુવાસતિ, આયરિએહિં સે ધર્મો કહિતો, પદિબુદ્ધો પવ્વાવિતોય તેહિય બલમિત્તભાણુમિત્તેહિં કાલગજો પજોસવિતે નિવિસતો કતો કેતિ ’ | એટલે—

શિષ્ય પૂછે છે કે-હાલમાં અપવ્વ ચતુર્થીએ સંવત્સરી કેમ કરવામાં આવે છે?

આચાર્યભગવાન્—આચાર્ય કાલિકાચાર્યજીએ કારણે ચોથ પ્રત્યાવી છે. માટે

## શિષ્ય—હે ભગવન् કયા કારણે ?

આચાર્યભગવાનુ—શ્રીકાલિકાચાર્યજી વિહાર કરતા કરતા ઉજ્જેણી નગરીએ આવ્યા ને ચોમાસા માટે રહ્યા. ત્યાં ખલભિત રાજ અને તેનો નાનો લાઠ લાનુભિત યુવરાજ હતો. તથા તેમની જેણ લાનુશ્રી નામે હતી ને તેનો પુત્ર ખલભાનુ નામે હતો. તે સ્વલ્ભાવથી જરૂર અને વિનયવાનુ હોવાથી સાધુઓની સેવા પર્યુંપાસના કરતો હતો. આચાર્ય મહારાજે તેને યોગ્ય જાણી ધર્મ કર્યો અને પ્રતિષ્ઠાધ પામવાથી રાજને પૂછ્યા વિના દીક્ષા આપી દીધી. તે કારણે રાજએ કાલિકા-ચાર્યજીને દેશનિકાલ કર્યો.

વિહરંતા પદ્માઇણં ણગરં તેણ પઠિત્તા, પદ્માણે સમણ સંઘસસ ય અજ્જકાલગેહિં સંદિદ્ધં ‘જાવહેં આગચ્છામિ તાવ તુભ્મેહિં ણો પજોસવિયબ્વં’ તત્થય સયવાહણો રાયા સોય કાલગજ્જં એં સોઉં ણિગતો અભિમુહો, સમણસંઘોય મહયા બિભૂતિએ પવિદ્ધો। કાલગજો પવિદ્ધોહિય ભળિયં ભહૃન્ય પંચમીએ પજોસવિજ્જતિ સમણસંઘેણ પડિવન્નું, તાહે રન્ના ભળિયં તહ્વિસં મમ લોગાણુબત્તીએ ઇંદો અણુજાએજ્જાબ્વો હોહિત્તિ, સાહૂચેતિ તેણ પજોસવી તે સેસ્સતો છદ્વીએ પજોસવણાકજ્જાઉ, આયરિષિં ભળિયં વદૃત્તિ પંચમી અતિક્કામેઉં, તાહે રન્ના ભળિયં તો અણાગય ચુત્થીએ પજોસવિજ્જતિ, આયરિણ ભળિયં એવં ભવઉ, તાહે ચુત્થીએ પજોસવિયં”

अर्थात्—ऐवा सबल कारणुथी चोमासामां श्रीकालिकाचार्यજु हेशनिकाल थया. तेथी त्यांधी विहार करी पैठाणुपुर तरङ्ग चाल्या अने पैठाणुपुर नगरमां पोताना संघाडाना साधुओने संदेशो मोळयो. के ज्यांसुधी हुं त्यां न आवुं त्यांसुधी तमे रહेवा माटे—(पर्युषण) नझी करशो नहि (ऐटके चोमासुं रહेवा माटे हा पाठवी नहि) पछी विचरतां विचरतां श्री कालिकाचार्यजु महाराष्ट्रना पैठाणुपुरे आव्या. त्यांना राज शालिवाहन (शतवाहन) तथा श्रीसंघे मोरा महेतसव-पूर्वक नगरमां प्रवेश कराव्यो. ते वर्खते आचार्ये संघने कहुं के ‘आपणे जेवी रीते भाद्रवा सुदी पंचमीना दिवसे पर्युषण पर्व’ करीचे छीचे तेवी रीतेज करवाना छे, ते वात सर्वे कुखुल करो पण शालिवाहन राजाचे कहुं के पंचमीना दिवसे तो अमारा ईद्रयाचाने। महेतसव छे माटे छक्कना दिवसे आप पर्युषण करो. ते सांलणी श्री कालिकाचार्यजु बोल्या के ‘पंचमीनु’ तो मेरे पर्वतनी चूलिकानी जेम उल्लंघन थाय नहिं. त्यारे राजाचे कहुं के आवती चोथना पर्युषण करो. (ते सांलणी श्री कालिकाचार्य विचार करो के—ऐक हेशमांथा चोमासामांज विहार करी भां अही आववुं थयुं अने हवे पञ्जुषण आडा चारेक दिवस रह्या छे तेथी अहींथा विहार थर्फ शके तेम नथी माटे राज कडे तेम करवुं ठीक छे. कारणु के हवे केए उपाय नथी अम जाणु न (झटके) आचार्य महाराजे कहुं के “अम थाओ” अपवाहे चोथना पर्युषण करीशुं. ‘अंतरावासे कण्ठइ’ ऐ पाठथी पंचमीना पहेला दिवसे करवुं

કદ્વે. આવા આસ કારણુથી કારણે ચોથ સ્વીકારી પણ તે અલાવવાને માટે કરી ન હતી.

‘નિશીથયૂણી’ કાલિકાચાર્યાજીના સંતાનીયાએ બનાવી છે પણ શ્રી દેવર્ધીંગણી ખમાસમણુણીની બનાવેલી નથી માટે કાલિકાચાર્ય પ્રથમ થઇ ગયા છે અને ચૂણી તો પાછળથી બનાવેલી છે તેથી તેમાં કાલિકાચાર્યાજીનો સંખંધ છે. તથા કાલિકાચાર્યાજીની કથામાં તો એ ચૂણીથી વિરુદ્ધ લખેતું છે કે ‘ભાનુમિત્ર અને ખળમિત્ર બન્ને ભાઈ ભરુઅચ્યના રાજ હતા તેમની ફળેન ભાનુશ્રી હતી. તેના પુત્રને વિના પૂછે દીક્ષા દીધી. વળી પુરોહિતની અપ્રીતિથી આચાર્ય દેશભાર નીકળ્યા છે.’ તથા કાલિકાચાર્યાજીની કથામાં લખ્યું છે કે ‘કાલિકાચાર્યાજીની પાસે નિગોદના સ્વરૂપ સંખંધી પ્રશ્ન પૂછવા માટે ઈંદ્રમહારાજ આવ્યા હતા’ એ વાત એમના સંતાનીયાએ લખી દીધી છે તે મહુમિથ્યાત્વ છે. કારણું કે વિકુમાદિત્ય રાજને ૧૩૫ વર્ષ થઇ ગયા તે પછી શાલિવાહન રાજ થયાછે, તેણે પોતાનો શક અલાવ્યો છે. તે સૌ કોઈ જણે છે.

વીર નિર્વાણુથી ૪૭૦ વર્ષે વિકુમરાજ થયો છે. તે પછી શાલિવાહનરાજના વખતમાં ચોથના પણુસણુ કરનારા કાલિકાચાર્ય થયા છે, તે વીરનિર્વાણ ૬૦૫ વર્ષે પછી થયા છે અને ‘પત્રવણાસૂત્ર’ના કર્તા કાલિકાચાર્ય કે જેમનું ખીણું નામ શ્યામાચાર્ય હતું તેમને ઈંદ્રમહારાજે આવી પ્રશ્ન પૂછ્યા છે, તે આચાર્ય તો વીરનિર્વાણુથી ૩૩૫ વર્ષે

થયા છે. છતાં એમના સંતાનીયાએ દ્રષ્ટિરાગથી પ્રગટ ભિથ્યાત્મ અંગીકાર કરીને ચોથની પુષ્ટી કરવા માટે વીરનિર્વાણથી ૬૦૫ વર્ષે પછી શાલિવાહન રાજના સમયમાં ચોથની સંવત્સરી કરનાર ખીજ કાલિકાચાર્ય થયા છે. તેમનેજ ઈંદ્રના પ્રક્ષના ઉત્તર આપનારા તરિકે જોડવી હીધા છે કે જેથી વાંચનારા ભ્રમમાં પડી જાય. પરંતુ વિચારકને મન તો સત્ય હુંમેશાં સત્યદ્રોપેજ જણાવવાનું. આવા ભ્રમણોત્પાદક ઉદ્દિન-સુદ્દિન લખાણો લખી સ્વમતનું શાખોકૃત કથનથી ઉદ્દી રીતે પોષણું કરવા જનાર ઉધાડા પડી ગયા વીના રહેતા નથી.

તથા ‘તિથોગાલિય પયન્નો’ પણ એમનાજ સંતાનીયાએ ખનાવેલ છે પણ તે દર્શા પયન્નાએની અંદર નથી. પરંતુ ખીજ સિદ્ધાંતોની ગાથાઓ એકત્ર કરી રહેલ છે. તેમાં એક ગાથા લખી નાંખી છે જેનો ભાવાર્થ એ છે કે :— “વીર નિર્વાણ પછી ૬૬૭માં કાલિકસૂરિએ લાદરવા સુદ ૪ પચુંખણું સ્થાપ્યા-કર્યા.” વળી ખીજ બ્રથોમાં પણ નીચે મુજબ ગાથા લખેલી છે કે—ગદ્દાલીલ રાજના ઉચ્છેદક કાલિકાચાર્યે પણ થયા છે. એમ ‘નિશીથચૂંહિં’ બતાવે છે.

આ રીતે એમના સંતાનીયાએનાં વચ્ચેનો અજણની માઝક લખેલાં હેખાય છે. વળી લોકોને સમજાવે છે. કે : જે સર્વ શ્રીસંઘે મળીને ચોથની સંવત્સરી કરી છે ’તે તો મહારાષ્ટ્રદેશના શાલિવાહન રાજને આધીન એવો સંઘ હતો. તે સંઘે કખુલ કરી હશે. નહિં કે ખીજ સંઘેાએ. તથા કાલિકાચાર્યજીના સંતાનીયાએ કાલિકાચાર્યને યુગપ્રધાન

માનીને તેણે કણુલ કરી હશે. પણ લાનુભિત્રની ફેનના દિકરાને તેના પિતાની રજ સિવાય સ્વયમેવ દીક્ષા આપી દેવાથી તે દેશ છોડવો પડ્યો. ત્યાંથી ચોમાસામાં મહારાષ્ટ્ર દેશમાં પઈંડુણુ પત્તનમાં આવવું પડ્યું અને ત્યાં પણ રાજના કહેવા ઉપરથી પાંચમને ખદ્દે ચોથની સંવત્સરી કરવી પડી. કદાપિ જે તેઓ ચોથની સંવત્સરી નહિ કરત તો રાજ સાથે અપ્રીતિ થાત ને નવી પીડા ઉપજત. એ સર્વ યુગ-પ્રધાનની અતિસ્મયસૂચક વાત દેખાતી નથી. પણ ખીજે વખેં તે આચાર્ય કાળધમ્ પાર્યા. તે પછી તેમના સંતાનીયાએ તેમની પ્રવૃત્તિની પરંપરા કરી દીધી. અથવા કાલિકાચાર્ય પઈંડુણુ નગરમાં ઘણેં કાળ રહ્યા તેથી ચોથની પરંપરા ચાલતી થઈ. તે માત્ર તેમના સંતાનીયા તથા શાલિ-વાહુન રાજના રાજ્યમાં વસનારાઓએ ચલાવી.

તો પણ ખીજ અન્ય ગચ્છવાળા શ્રીસંઘોએ તો પરંપરા ગત ચાલી આવેલી પાંચમની સંવત્સરી કરવી પડતી મૂકી નથી કારણું પાંચમ છોડીને ચોથ ચલાવવાનું કોઈ કારણ ન હતું એટલું નહિં પણ તે શાખાશાથી વિર્દ્ધ હતું. વળી ‘સર્વ સંઘે ચોથની સંવત્સરી કણુલ કરી’ તથા ‘શ્રીકાલિ-કાચાર્ય યુગપ્રધાન હતા’ એલું જે કહેવામાં આવે છે તેનો પુરાવો કયાંય ભળતો નથી એટલે તે મિથ્યા છે. કેમકે કોઈના પુત્રને તેના માતપિતાની સંભતિ વગર યુગ-પ્રધાન દીક્ષા આપેજ નહિં એમ શાસ્કડાર મહારાજાએ ક્રમાવેલું છે. તેથી ‘આવશ્યક નિર્યુક્તિની ટીકા’ માં શ્રી

હરિલક્ષ્મસુરિજીએ લખ્યું છે કે એસ પદમા સેહ નિષ્ફળિયા' તે પ્રથમ શિષ્યનિષ્ટેટક કહેવાણું ઈત્યાદિ અનેક જાતના ઉલ્લેખો મળી આવે છે. એ માટે અતાદિકાળથી સંવત્તસરી પંચમીની ચાડી આવે છે. અપર્વમાં પર્વસંજ્ઞા અને પર્વમાં અપર્વસંજ્ઞા કહેવી તે નિશ્ચયે 'ઠાણુંગસૂત્ર' માં ભિદ્યાત્વ કહ્યું છે. માટે વિચારકો અને વિદ્ધાનોએ આ બાધતનો નિશ્ચય શાખાધારેજ મેળવી લેવાની જરૂર છે. અપવાહ એ હંમેશાં અપવાહજ ગણ્ણાય છે. માટે હડાથડ નહિ સેવતાં શ્રી જિનાજાનેજ પ્રમાણ માની વર્તોવ કરવો જોઈએ.

અને જે ડોઈ કહે છે કે અમે ચોથ આર્યકાલકાચાર્યજીની આજાથી કરીએ છીએ. તો કાલિકાચાર્યજીએ નગરમાં પ્રવેશતાં એમ ડેમ કહ્યું કે ભાઈરવા સુદ પ નાં પર્યુષણ છે ને સાધુઓએ પણ તે વાત કયુદ કેમ કરી? આ બાધતમાં સત્ય હક્કીકત એ છે કે ચોથનો આહેશ રાજાએજ કરાવ્યો છે પણ આચાર્યજીનો આહેશ તો પાંચમનોજ ચૂણ્ણિકારે લખ્યો છે. વળી ચૂણ્ણિકારે કાર્તાકી પૂનમની ચોમાસી કર્યા પછી એકમના હિવસે વિહાર કરવાની આજા આપેલી છે.

આ ઉપરથી સમજ શકાય કે ચૂણ્ણિકાર પોતે ચોથને અપર્વ કહે છે. ને અપર્વમાં પર્યુષણ કરાયજ નહિં અને કરે તો ગ્રાયશ્વિત કહ્યું છે. માટે પર્વમાંજ શ્રીપર્વ

કરાય એમ ખુદ્દી રીતે (૧) ‘નિશીથસૂત્ર’ (૨) ‘નિશીથચૂણીં’ (૩) ‘કદપનિર્ણિત’ (૪) ‘સમવાયાંગસૂત્ર’ દીકા (૫) ‘કદપચૂણીં’ (૬) દશાશુતસ્કષ્ટસૂત્ર’ તથા તેની ચૂણીં (૭) હરિભદ્રસૂરિકૃત ‘પંચાસક’—દીકા, વિગેરેમાં પર્વના દિવસે પર્યુષણુ પર્વ કરવાના કહ્યા છે.

## ચૌમાસી-નિર્ણય

ચૌમાસી પૂનમને શાસ્કકારે કહે છે.

કોઈપણ શાસ્કકારે ચૌમાસી ચૌદશે કહી નથી. અને જે કોઈ ચતુર્દશીને ચાતુર્માસી કહે તો તે શષ્ઠશાસ્ક (૦૪૦૨૨૪) થી તથા ધર્મશાસ્કથી વિર્દ્ધ છે. કારણ કે શષ્ઠશાસ્કમાં શષ્ઠશાસ્કકારે તથા ધર્મશાસ્કમાં ધર્મશાસ્કકારે તેવી રીતની હક્કીકત કોઈપણ સ્થળમાં કોઈપણ શાસ્કકારે બતાવી નથી. માટે ચૈદશને ચૈમાશી કહેવી તે શાસ્કસંભત નથી પણ પૂર્ણિમાને ચાતુર્માસી કહેવી એ શાસ્કસંભત છે. તે આ પ્રમાણે :—શ્રીહેમયંત્રાચાર્ય ‘સિદ્ધહેમચંદ્રાભિધા-નસ્વોપદ્ધશબ્દાનુશાસનવૃદ્ધવૃત્તિ’ માં પ્રતિપાદન કરે છે કે- ચતુર્માસિશબ્દાત્તત્ત્વ ભવેણપ્રત્યયો ભવતિ । નામ્નિ-સમુદાયશ્રેભામ ભવતિ । ચતુર્ષુ માસેષુ ભવા ચાતુર્માસી-આષાઢી કાર્તિકી ફાલ્ગુની ચ પૌર્ણમાસી ભણ્યતે ।

એટલે છુટો અધ્યાયના ત્રીજા પાઠનું ૧૩૩મું એ સૂત્ર છે. તેનો અર્થ—ચતુર્માસ શષ્ઠિથી ત્યાં ( સંજામાં ) અણ પ્રત્યય થાય છે. સમુદ્દરથી જે કોઈની સંજા થતી હોય તો ચાર મહીને ચૌમાસી કહેવાય. તે કોઈની સંજા છે ? તે આચાર્ય બતાવે છે તે ચૌમાસીને આષાઢી, કાર્તિકી અને ક્રાંતિકાની પૂનમ ( ની સંજા ) કહેવાય છે. માટે પૂનમને ચૌમાસી કહેવી તે શાસ્ત્રસંમત છે. આ વ્યાખ્યા સ્વસમયવતીઃ આચાર્ય મહારાજે કરી છે.

વળી પાળિનીયવ્યાકરણ (સિદ્ધાંત કૌમુદી)ની કાશિકા-વૃત્તિમાં પરસમયવતીઃ આચાર્ય આ પ્રમાણે વ્યાખ્યા લખે છે—  
**‘સંજાયામણ વત્તવ્યः’**—ચતુર્ષુ માસેષુ ભવા ચાતુર્માસી-પૌર્ણમાસી આષાઢી કાર્તિકી ફાળણુંની । તથા તેવીજ રીતે કૌમુદીકારે તદ્વિતાન્તર્ગતકાલાધિકારમાં આ પ્રમાણે વ્યાખ્યા કરી છે:-  
**‘સંજાયામણ’**—ચતુર્ષુ માસેષુ ભવતિ સા ચાતુર્માસી-આષાઢી આષાઢનક્ષત્રયુક્તા પૌર્ણમાસીત્ત્યર્થઃ । એ વાતિંકસૂત્ર છે. ચતુર્માસ શષ્ઠિથી સંજામાં અણ પ્રત્યય થાય છે એમ કહેલું જોઈએ. ચાર મહીને ચૌમાસી કહેવાય અને તે પૂનમની સંજા છે; તે પણ કઈ પૂનમ લેવી ? તે માટે કહે છે કે ( વૃદ્ધિ-ક્ષય વિનાની તિથિ નક્ષત્રસહચારિણી હોય છે માટે ) પૂર્વાં કે ઉત્તરાષાઢાનનક્ષત્રયુક્તા આષાઢી પૂનમ, કૃતિકાનનક્ષત્રયુક્તા કાર્તિકી પૂનમ અને પૂર્વાં કે ઉત્તરાક્રાંતિકાનનક્ષત્રયુક્તા ક્રાંતિકાનીપૂનમ એ ત્રણ પૂનમનેજ ચાતુર્માસી તરીકે શષ્ઠિશાખકારોને સિદ્ધ

કરી છે પણ ચૌદસને સિદ્ધ કરી નથી.

વળી ધર્મશાસ્ત્રમાં ધર્મશાસ્ત્રકારોએ પણ ત્રણુ પૂનમની ચૈમાસી કહી છે. તેનું કર્મભાગ શ્રીસૂયગડાંગમુદ્રા અને તેની બૃહદ્વૃત્તિમાં શ્રાવકાધિકારમાં આ પ્રમાણે કહ્યું છે :—મૂલ ‘ ચાઉહસદ્ગુહિદૃપુનમાસિણીસુ ’ તેની ટીકા :—ચતુર્દશ્યષ્ટમ્યા-  
દિષુ તિથિષ્વપદિષ્ટાસુ મહાકલ્યાણિકત્વેન પ્રસિદ્ધાસુ તથા પૌર્ણ-  
માસીષુ ચ તિસૃષ્વપિ ચતુર્માસિકતિથિષ્વિત્યર્થઃ । એટલે ચૌદશ,  
આઠમ અને પૂનમ-ચૈમાસીની ત્રણુ પૂનમ તથા કદ્વાણુક  
તિથિ એ પવાં વગેરે પવિત્ર તિથિઓ—ઇત્યાહિ ધર્મના દિવ-  
સોમાં શ્રાવકો પૌર્ણધત્રત સ્વીકારી શ્રાવકધર્મને આરાધેછે.  
એવીરીતે ત્રણુ પૂનમની ચૈમાસી ‘ સૂયગડાંગ ’, ‘ લગ-  
વતી ’, ‘ ઉત્તરાધ્યયન ’ આહિ સૂત્રોની ટીકામાં ખતાવી છે.  
માટે લભ્યજીવોએ ત્રણુ પૂનમની ચૈમાસીની અવશ્ય શ્રદ્ધા  
કરવી જોઈએ.

આવીરીતે શાણદશાસ્ત્રથી અને ધર્મશાસ્ત્રથી સિદ્ધ થયેલી  
ચૈમાસી ત્રણુ પૂનમની છે. છતાં જે કોઈ સ્વમતાશ્રહી તે  
સત્યવાતને કખુલ નહિં કરે તો તેને પરાણે કોણુ મનાવી  
શકે ? જગતો સુધુ રહે તેને ઉઠાડવામાં કોણુ સમર્થ  
થાય ? માટે જે તત્ત્વયુહણુ કરવાની ઈરણ્ણાવાળો,  
સત્યની પોજ કરનારો, ભવલીરૂ તથા જિનમેણુિત-  
સૂત્રનો આરાધક આત્મા હશે તે તો આપોઆપ રોધ  
કરી સત્યવાતને અંગીકાર કરશેજ. એ નિષે અમારો

કાઈપણ આથડ નથી. કોઈપણ જિજાસુ પૂછે તેને શુદ્ધ ને સત્ય માર્ગ બતાવવો જ જોઈએ. પણી કરો ન કરો તે મરળ ઉપર છે. પણ સંસારસમુદ્ર તરવા માટે જૈનદર્શનનો મળ પાયો બોધિ-(સમકિત) હોવાથી સુસુદ્ધ આત્માએ કારણ વશાતું કદાચ અમલમાં મૂકી ન શકે, તો પણ તેઓ સત્યની સફળણા-શ્રદ્ધા જરૂર કરશો કારણુંકે 'માર્દ તે સાચું નહિ પણ સાચું તે માર્દ' એ સિદ્ધાંતને તેઓ માનનારા હોય છે.



## પાક્ષિક—નિર્ણય

કેટલાક કહે છે કે પાખી ચૌદસે કરવી, ત્યારે કેટલાક કહે છે કે ના, પાખી તો પુનમ-અમાસે કરવી. આને નિર્ણય તો પ્રવચન-ધર્મશાસ્ત્રી થઈ શકે. પંદર દિવસે પક્ષ-પખવાડીયું કહેવાય છે તે કાળસ્વરૂપ છે. શ્રીજિનરાજે શ્રાવકોને પૌષ્ઠ્ર કરવા સાર્દ પાખી ક્રમાવી છે, તેમાં દિવસો ન ગણુંવા. પક્ષે પાખી, ચાર માસે ચૌમાસી અને સંવત્સરે સંવત્સરી કહેવાય. પણ પાંચ દિવસે પાખી, દશ દિવસે સંવત્સરી અને પક્ષે ચૌમાસી તો નજ કહેવાય. છતાં જેએ દ્રષ્ટિરાગ ન મૂકુશે તેએ સત્યવચન ચૂકુશે. એક તરફથી શાસ્ત્રનું નામ લેવું ને બીજુ તરફથી દિવસો ગણુંવા એનું શું કારણ? માટે ચૌદશને પર્વતિથિ જાણી પૌષ્ઠ્ર કરવો અને દિવસ ગણુંવાનો ભ્રમ ટાળવો.

ને તિથિ (ની ધડી-પણ)માં સૂર્યોદય થાય તે તિથિ આપે। દિવસ ગણ્યાય અને એ ઉદ્ઘિકૃતિથિને પ્રમાણું કરવી પણ આથમતી તિથિને પ્રમાણ ન કરવી એમ ‘ચંદ્ર-પજ્ઞતિ, સૂર્યપનનત્તિ ઉપાંગ તથા ભગવતી’ આદિ સૂત્રોમાં કરમાયું છે. માટે ઉદ્ઘિકૃતિથિને પ્રમાણું કરી પર્વતિથિ આરાધની. અંતોપહ્રલ્લવસ્સ માં અંતો અવ્યય છે. અને તેનો અર્થ ‘મધ્ય-અંદર-વર્ષયે’ એવો થાય છે. તેથી પણાંતઃ એટલે પખવાડીયાની અંદર અર્થાત્ ચૌદશ જાણુવી પણ પણાંતે એટલે એકમ તે પક્ષનું ધર અને પજરસી તે પક્ષનો છેડો અર્થાત્ પુનમ-અમાસ જાણુવી નહિ.

નેમ રાધ વખતે હેવસી અને હેવસી વખતે રાધ પડિકુભણું ન કરાય, તેમ પાખીના દિવસે ચૌમાસી અને ચૌમાસીના દિવસે પાખી પડિકુભણું પણ ન થાય. માટેજ ધર્મશાસ્ત્રોમાં પાખી ચૌદશે અને ચૌમાની પૂનમે કરવાનું કરમાવેલ છે. આમ કરવાથી ચૌદશે પાખી પડિકુભણું મૂકાય નહિ અને પૂનમે ચૌમાસી કરવાથી ત્રણ પાખી પડિકુભણું પણ ચૂકાય નહિ. એટલે બારસ માસાણ ચુચ્ચીસપહ્રલ્લાણ એ પાઠ પ્રમાણે બાર માસે ચોવીસ પાખી અને ત્રણ ચૌમાસી પડિકુભણું થાય. પણ શું આ કરમાનને તપગચ્છીય, અરતરગચ્છીય અને અંચલગચ્છીય ચતુર્વિધ સંધ માન આપે છે?

વળી ધર્મશાસ્ત્રકારોએ અષાડી, કાર્તિકી અને

શાલ્યગુની એ ત્રણ પૂનમોને પર્વણી કહી છે અને તે  
માસની સુદ ૮ થી સુદ ૧૫ સુધીની અઠાઈ ઝરભાવી છે.

તથા પાખીનો તપ ચૌદ્દશો, ચૌમાસીનો તપ  
ચૌદ્દશ-પૂનમે અને સંવત્સરીનો તપ ભાદ્રવા સુદ ૩-  
૪-૫ મે કરવાનું ઝરભાવેલ છે. આ સર્વ શ્રમણુસંઘોનો  
આચાર છે.

## પર્વતિથિ—મંતવ્ય

જે તિથિમે રવિસંક્રમે, તે તિથિ ઉદ્યિક જાણ ।

આખો દિન તેહનો ગણો, ધર્મકાજ મન આણ      ||૧||  
ઘટતાં તિથિ પૂરવ ગ્રહો, વધતાં આગળ જાણ ।

પર્વ તિથિ વિચારણા, ઇણિપરે મનમે આણ      ||૨||  
પડવાથી અદ્દમ દિને, આઠમ ઉત્તમ જોડ ।

ગદ પાખીથી આવતી, પાખી પક્ષે હોડ      ||૩||  
અંતોપલ્લવસ્સ જાણવો, અંતો મધ્ય વિચાર ।

પૂનમ પહેલો દિહડો, પાખી ચૌદસ સાર  
આઠમ ત્રૂટે સાતમીએ, આઠમ કરવી હોય ।

જો આઠમ દિન બે હુવે, તો બીજી આઠમ જોય      ||૫||  
ચૌદસ ઘટતાં તેરસે, પાખીપર્વ આરાહ ।

બે ચૌદસ થતાં થકી, બીજીએ પાખી થાય      ||૬||

चउमासी पूनम घटे, पाखी तेरसे देह ।

चउदस दिन चौमासनुं, पडिकमणु विरतेह ॥७॥

चउमासी पूनम वधे, चौदस पाखी धार ।

पहेली पूरी पूनमे, चउमासु संभार ॥८॥

चउमासी चौदस वधे, बीजीए पाखी थाय ।

पूनम दिन चौमासनुं, पडिकमणु कर भाय ॥९॥

चौमासी चउदस घटे, तेरसे पाखी साध ।

पूनम दिन चउमासनुं, पडिकमणु आराध ॥१०॥

जो घटे संवच्छरी, तो चोथे पंचमी जोय ।

जो दिन पंचमी बे हुवे, तो प्रथम पञ्चसण होय ॥११॥

उपाध्याय श्री मेघराजजी कृत

‘ साधुसमाचारी ’ मांथी

## ५८८तिथिने। निष्ठूर्य

जेधपुरीय पंचांगमां

(१) जे लाठ० सुह ५ नो क्षय डोय तो चाँथि पांचम  
गण्डुवी एटले चाथने। क्षय करवे। कारणु के चाथमां पांचमने  
अंश आवे छे, वर्णी लाठ० सुह० ५ ऐ डोय तो पहेली  
पांचमे संवच्छरी करवी अने थीजु पांचमने छठमां गण्डुवी  
एट्टे ऐ छहो करवी।

(૨) સુદમાં કે વદમાં ચૌદશનો ક્ષય હોય તો તેરસે ચૌદશ કરવી એટલે તેરશનો ક્ષય કરવો. કારણું કે તેરશમાં ચૌદશનો અંશ આવે છે.

(૩) સુદમાં કે વદમાં એ ચૌદશ હોય તો પહેલી ચૌદશ ને તેરશમાં ગણુવી એટલે એ તેરશો કરવી અને ખીજુને ચૌદશ માની આરાધવી.

(૪) પુનમનો કે અમાસનો ક્ષય હોય તો તેરશે ચૌદશ અને ચૌદશો પુનમ કે અમાસ કરવી એટલે તેરશનો ક્ષય કરવો.

(૫) એ પુનમો કે એ અમાસો હોય તો ખીજુ પુનમ કે અમાસને એકમમાં ગણુવી એટલે એ એકમો. કરવી પણ એ તેરશો નહિ કારણું કે જેમાં જેનો અંશ આવે તેમાં તે તિથિ મનાય છે. એ એકમો. કરવાથી ઉદ્દ્યવાળી ચૌદશ આરાધી શકાય છે અને એ તેરશો કરવાથી ચૌદશ તિથિ વિરાધાય છે માટે ખીજુ પુનમ કે ખીજુ અમાસને એકમમાં ગણુવી એટલે એ એકમો. કરવી.

આકીની તિથિઓ જેમ કરીએ છીએ તેમ કરવાની છે એટલે

એ ખીજ હોય તો એ એકમ કરવી. એ પાંચમ હોય તો એ ચાથ કરવી પણ સંવચ્છરીની હોય તો એ છઢુ કરવી.

એ આઠમ હોય તો એ સાતમ કરવી. એ અગ્નારસ હોય તો એ દશમ કરવી. એ ચૌદશ હોય તો એ તેરશ કરવી.

એ પુનમ હોય તો ખીજુ પુનમને એકમ કરવી.

એ અમાસ હોય તો બીજુ અમાસને એકમમાં ગળુવી.

બીજનો ક્ષય હોય તો એકમનો, પાંચમનો ક્ષય હોય તો ચાથનો, આઠમનો ક્ષય હોય તો સાતમનો, અગ્નારસનો ક્ષય હોય તો દશમનો, ચૌદશનો ક્ષય હોય તો તેરશનો ક્ષય કરવો. પણ ચૌમાસી પુનમ ઘટે તો તેરશે પણખી અને ચૌદશે ચૌમાસી પડિજીમણું કરલું એટલે તેરશનો ક્ષય કરવો.

૧૦—‘ જૈનપંચાંગ ’ના અલાવે જ્યોતિષશાસ્ત્ર મુજબ ‘ જૈનેતર પંચાંગ ’માં વાસ્તવિક જે તિથિઓ હોય તેજ માનવી જોઈએ છતાં આમ તિથિઓમાં ફેરફાર કરવાનું શું કારણું ?

૧૦—પર્વતિથિની આરાધના કરવા માટે. જે પંચાંગ મુજબ એ આઠમ કે એ ચૌદસ વગેરે બુધે પર્વતિથિઓ રાખવામાં આવે તો ગૃહસ્થો ભ્રમમાં પડી જય અને કહે કે અમારે પોષધવત તથા અધ્યયાર્થી નિયમોનું પાલન કર્ય તિથિએ કરલું ? એવી શાંકાઓ થતાં ભતલેદ ઉલા થાય અને જૈનસંધની એકયતામાં ભંગાણું પડે માટે તે ન પડે પણ ઐક્યતા ભાતૃભાવ વગેરે કાયમ રહે ઈત્યાદિ કારણે જૈનેતર પંચાંગમાંથી તિથિઓને ફેરફાર કરવો પડે છે.

## પાઠપરંપરા

જગહુવંધ શાસ્ત્રવિશારદ શાસનમેભાવક ચુગ-  
મધ્યાન આચાર્ય ભગવાનું શ્રી ૧૦૦૮ શ્રીપાદ્યંદ્રસૂરી-  
શ્વરજી મહારાજાની પાટે આચાર્ય ભગવાનું શ્રીસમર-  
ચંદ્રસૂરીશ્વરજી થયા. ત્યારપછી ઉત્તરોત્તર

શ્રીરાજચંદ્રસૂરીજી,	શ્રીવિમલચંદ્રસૂરીજી
શ્રીજયચંદ્રસૂરીજી,	શ્રીપદ્મચંદ્રસૂરીજી.
શ્રીમુનિચંદ્રસૂરીજી(ભીજ),	શ્રીનેમિચંદ્રસૂરીજી(ભીજ),
શ્રીકનકચંદ્રસૂરીજી,	શ્રીશિવચંદ્રસૂરીજી,
શ્રીભાતુચંદ્રસૂરીજી,	શ્રીવિવેકચંદ્રસૂરીજી
શ્રીલભિષ્ણુચંદ્રસૂરીજી,	શ્રી હર્ષચંદ્રસૂરીજી
‘ધર્મભૂતિ’ આચાર્ય શ્રીહર્ષચંદ્રસૂરીશ્વરજીના અનેક શિષ્યોમાં ત્રણ શિષ્યોની પરંપરા.	

શ્રીહેમચંદ્રસૂરીજી	શ્રીકુશાલચંદ્રગણી	શ્રીમુક્તિચંદ્રગણી
શ્રીહેવચંદ્રસૂરીજી	મુ. ખુશાલચંદ્રજી	શ્રીભાતુચંદ્રસૂરીજી
યતિશાખા	વગેરે	

આ પૈકી આધમહાપુરુષ સંવેગરંગરંગિત આત્મા શ્રી  
કુશાલચંદ્રજીગણીનું દુંક જીવન વૃત્તાંત ભવિજુયોના હિતાથેં  
અત્રે રજુ કરવામાં આવે છે.

समतासागर मुनिगणसुकृत्यायमान शान्तसुधाकर  
यारित्रयूठाभणि श्रीकुशलचंद्रजगणिवर महाराज



जन्म सं० १८८४ कोटाय ( ५२७ )

हीक्षा सं० १९०७ कोट १३ पालीताण्णा

स्वर्गवास सं० १९६६ आ. सुद १० कोटाय ( ५२७ )



## શાંતમૂર્તિ શ્રીકુશલચંદ્રજગણિવર

આપણા ગચ્છના આ આધમહાપુરુષે જ્ઞાન અને કિયા સુમેળવાળી સાધનાનો પ્રચાર કરી અનેક ભવી જીવોને સન્માર્ગમાં જોડ્યા છે. કારણું શાસ્કકાર મહારાજાએ કુરમાવે છે કે ‘એકલા જ્ઞાનથી કે એકલી કિયાથી મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી પરંતુ જ્યારે જ્ઞાન કિયામાં પરિણુંભે છે અને સમ્યગ્જ્ઞાન, દર્શન ને ચારિત્રનો ત્રિવેણીસંગમ થાય છે ત્યારેજ આત્મા મોક્ષના ચિત્તવનમાં એકાકાર ખને છે અને કર્મો ખપાવતો ભવખંધનને તોડતો સિદ્ધશીલાએ પહોંચવા ભાગ્યશાળી થાય છે’. આવા મહાત્માઓ હંમેશાં જીવનભર અધ્યાર્થી વ્રતને પાળનારા હોય છે. અધ્યાર્થીએ એવું વ્રત છે કે જેને શાસ્કકાર મહારાજાએ જગતમાં એ વ્રતને દીપકની-સમુદ્રની ઉપમા આપી છે આ વ્રત પાળનારમાં બીજુ આત્માની અનંત શક્તિએ સ્વર્ગ મગટે છે અને એ પ્રગટવા સાથે પોતે જગતમાં ઈલા-ચેલ ધર્મ વિષેના અંધકારને ફેરાવા શક્તિમાન થાય છે અને જેણે અધ્યાર્થી વ્રત અંગીકાર કર્યું તે જગતના મોહ-માયા ને ભમત્વ પર આધિપત્ય સ્થાપે છે.

**શ્રીકુશલચંદ્રજગણિમાં એવી મહાન શક્તિએનો સંચાર થઈ ચૂક્યો હતો કે તેઓશ્રીએ બાલ્યકાગથીજ પોતાનો પ્રલાવ જૈનસમાજમાં પાડ્યો હતો. તેઓશ્રીએ મુખ્યત્વેકરીને કિયાતુષાનો વિષે ઈલાચેલી લૌકિક આચારશ્રેણીને દૂર કરી**

શ્રીજિનેક્ષરહેવોએ લાગ્યા મુજબના સંમાર્ગમાં હજરે।  
આત્માઓને જેડી મહદુ ઉપકાર કર્યો છે.

આવા ગચ્છિનાયક શ્રીકુશલચંદ્રજી ગણ્ણીનો જન્મ  
સં. ૧૮૮૪માં કેડાય (કંચિ)માં થયો હતો. પિતાનું નામ  
જેતસ્તીભાઈ અને માતાનું નામ ભમદુભાઈ હતું. માત-  
પિતાના સંસ્કારોના સિચનથી શ્રીકુશલચંદ્રજીમાં અનેક  
વિધ ધર્મસંસ્કારોના ખીજ રોપાયા. માતપિતા ને પુત્રને  
તેના આત્મહિતનો સાચો રાહ દાખવે તો જૈનધર્મમાં અનેક  
આત્માઓ તરી જાય અને કુળને અજ્વાળે. પરંતુ આજે  
જૈનમાતપિતાઓ જેટલી પોતાના બાળકોની વ્યવહારિક કેળ-  
વણ્ણીને કુશળતા માટે કાળજી ધરાવે છે તે પૈકી ને અંશમાત્ર  
પણ ધર્મમાર્ગમાં સ્થિર કરવાની પ્રવૃત્તિ અંગે ધરાવે તો  
આજે જૈન સમાજમાં ધર્મની જાહેરલાલી પ્રગટી નીકળે.

છેવટે સંસારની અસારતા વિષે પૂજય મુનિરાજેના સંસ-  
ગંથી ચોણ્ય જ્ઞાનની પ્રાપ્તિ થતાં તેઓશ્રી પગે ચાલીને ખીજ  
ચાર સાથીઓ સંગાતે પાડીતાણું ગયા. ત્યાં બિરાજમાન  
પૂર્ણ આરો શ્રીહર્ષચંદ્રસૂરીક્ષરજી પાસે દીક્ષા લેવાની ભાવના  
વ્યક્તા કરી. શુરૂહેવે ચોણ્યતાની કસોટી કરી અને સં. ૧૯૦૭  
ના કારતક વહ ૧૫ના રોજ દીક્ષા અંગીકાર કરી. આ સમયે  
અણાનિહુકા મહેતસવાદિ ભારે ધામધુમ થઈ.

આમ મુનિવેશ અંગીકાર કર્યો બાદ પૂજયશ્રીએ સાધુ  
આવશ્યક હિયાઓ-સ્તુત્રો વિં નો સારો અલ્યાસ કરી સાધુ

જીવનને ઉચ્ચ કક્ષા પર મૂક્યું. ગામોગામ વિહાર કરતાં પૂજ્યશ્રીએ શ્રીપાર્થ્યદ્રગરછને ઉત્તેતિના શિખરે પહોંચાડ્યો. અનેક જીવાને હેશવિરતિ અને સર્વવિરતિ બનાવ્યા.

આમ ઉપકાર કરતા કરતા તેઓશ્રી ૧૯૬૬ (૧૯૭૦ કરછી) ના લાદરવા સુદ ૧૦ના રોજ સ્વવતન ડેડાયમાં સમાધિપૂર્વકના અંતિમ આરાધના સાથે સ્વર્ગ સિધાવ્યા.

આવા મહાત્યાગી વૈરાગી પરમોપકારી મહા-પુરુષોના પરિચયમાં જે જે આત્માએ આવે છે તેઓ સરળતાથી સન્માર્ગમાં જોડાવા સદ્યાય તત્પર રહે છે. તેમના જીવનનો આદર્શ અન્ય જીવા પર ઉપકારક-વૃત્તિ ધારણું કરનારો હોય છે. મહાજ્ઞનોનાં જીવન-ચરિત્ર એટલે આ અસાર સંસારની અટવીમાં રહેલા કર્મરૂપી ચોરેને દૂર કરવા માટેનું ઉત્તમ સાધન છે. તેઓ જીવન જીવી જાણે છે અને મરી પણ જાણે છે કારણું કે તેમના મૃત્યુ પણી પણું સાહિત્ય-કિયા-તપ-જપાદિની સુવાસ વધો સુધી પ્રસરેલી રહે છે.

આ મહાપુરુષના જીવન વિષે આપણું સંપૂર્ણ હકીકતો સાંપડતી નથી પરંતુ આજે એમનું નામ શ્રીપાર્થ્યદ્રગરછના તકતા પર અમર છે એજ એમના ધર્મપ્રભાવનાના અનેકવિધ કાર્યોનો સચોટ પુરાવો આપે છે.

આ ત્યાગીઓમાં આધપુરુષ શ્રીકુશલદ્રજગણી

પછી તેઓ શ્રીનો સાધુસમુદ્દાય ( સ્વો અને વિધમાન ) નીચે  
પ્રમાણે છે. જે પરથી જોઈ શકાય એમ છે કે આ મહાપુરુષના  
સમયમાં તપગચ્છમાં માત્ર ૩૦-૩૫ જેટલા સાધુઓની વિચ-  
રતા હતા તે સમયે શ્રીપાંદ્રીચંદ્રગચ્છમાં પણ સાધુઓની  
સારી સંખ્યા હતી. એ ઉપરથી ગચ્છની જગહળતી જન્યોત  
સાબિત થાય છે.

## શાંતમૂર્તિ શ્રીકુશાલચંદ્રજી ગણીના શિષ્યપ્રશિષ્યો.

૧	મુનિશ્રી ખુશાલચંદ્રજી	૧૦	મુનિશ્રી વૃદ્ધિચંદ્રજી
૨	” કપૂરચંદ્રજી	૧૧	” શુણુચંદ્રજી
૩	” દેવચંદ્રજી	૧૨	” અધીરચંદ્રજી
૪	” કલ્યાણુચંદ્રજી	૧૩	” દૈવચંદ્રજી
૫	” વિજયચંદ્રજી	૧૪	” લક્ષ્મિચંદ્રજી
૬	” મોતીચંદ્રજી	૧૫	” પ્રોતિચંદ્રજી
૭	” ઘેમચંદ્રજી	૧૬	” વિનયચંદ્રજી
૮	” પ્રેમચંદ્રજી	૧૭	” દ્વાલચંદ્રજી
૯	” દીપચંદ્રજી		

આમ પૂજયશ્રી પોતાની પછી હોણેલા શિષ્યસમુદ્દાય  
મૂકો ગયા. ભારતભૂષણ આચાર્યશ્રીજ્ઞાતૃચંદ્રસૂરીશ્વરજી  
તથા શાંતમૂર્તિ શ્રીપુનમચંદ્રજીનું વરના સ્વર્ગાંગમન ખાદ  
ગચ્છમાં શિષ્યસમુદ્દાયની તુરી હોવા છતાં આપણને એ  
સાલતી નથી એ આપણી કમનસીભી છે. ગચ્છની પાઠ  
સાચવનાર મુનિરાનેજ છે. આજે કુચ્છ-કાઠીયાવાડ  
ગુજરાતમાં એવા અનેક સ્થળો છે કે જે મુનિઓના તેમજ

મુનિવિહારના અભાવે ગચ્છનું નામનિશાન દેખાતું નથી. આજે મુનિવિહાર અને મુનિરાજેની સંખ્યા વૃદ્ધિ તરફ શ્રીસંઘે નજર કરવાની આવશ્યકતા છે.

**પૂજયશ્રીકુશલચંદ્રજિ ગણિવરના પ્રાપ્ત થતાં સંક્ષિપ્ત જીવનચરિત્રમાંથી પણ સાગરમાં બિંદુ સમાન લાલ લેવામાં આવે તો અનેક ભવ્યાત્માઓ તરી જાય.**

**શાંતમૂર્તિશ્રીકુશલચંદ્રજિગણિવરના**

**જીવનનો ટુકુ સાર**

**જી-મર્યાદાન :-** કેડાય ( કચ્છ )

**જી-મ :-** સ. ૧૮૮૪

**પિતાનું નામ :-** જેતસીલાઈ

**માતાનું નામ :-** લમદ્ધિબાઈ

**જ્ઞાતિ :-** વીશા ઓસવાળ

**દીક્ષા :-** સ. ૧૬૦૭ - પાલીતાણ

**ગુરૂનું નામ :-** આચાર્યશ્રીહષ્ઠંચંદ્રસુરિજિ

**સ્વર્ગવાસ :-** સ. ૧૬૬૬ બા. સુ. ૧૦



ભારતભૂમણશ્રીભાતૃચંદ્રસૂરીશ્વરજીના

## જીવનનો ટુંક પરિચય

જગત્પૂજ્ય શાસ્ત્રવિશારેદ શાસનપ્રેલાવકે ચુગ-  
પ્રધાન શ્રીપાંદ્રસૂરીશ્વરજી મહારાજ પછી શ્રીમ-  
નાગપુરીયતપાગંધિને પ્રકાશમાં આણુનાર પૂજ્યશ્રી  
કુશલચંદ્રજીની સુધી અનેક આચારોં અને મહાત્માઓ  
થઈ ગયા છે. જેમાં આચાર્યમહારાજ શ્રીભાતૃચંદ્રસૂરી-  
શ્વરજીનું નામ સુવર્ણાક્ષરે કોતરાઈ રહેશે. શ્રી હેમચંદ્રસૂરિ  
( ખીળ ) ની પાટે પૂ. આચાર્યમહારાજ થયા.

આખુતીર્થની દક્ષિણ સીમા પર આવેલા (વાંકડીઆ) વડગામમાં ઓહીન્ય પ્રાણણ દાનમલજી રહેતા હતા તેમની વિજયા નામે ધર્મપતની હતી તેમને રતનસિંહ, લખ, ભલુ અને કલુ એ નામનાં ચાર પુત્રો હતા. સં. ૧૯૨૫માં વિજયા માતા સ્વર્ગવાસી થયા તે પછી દાનમલજી પોતાના મેટા પુત્રને સંખારીઓને સુપ્રત કરી ત્રણે પુત્રોને સાથે લઈ ગુજરાતના વઢીઆર વિલાગમાં ચાચરવાળી બહુચરાળાના મેળા ઉપર શાંખલપુર જઈ પહોંચ્યા. એ મેળામાં કોઈ કાર્યવશાત્ આવેલા યતિઓને જોયા. અને જે આ યતિઓ પૈકી કોઈ મારા પુત્રોને લેવાનું સ્વીકારે તો મારે અવશ્ય અર્પણું કરી હેવા. છોકરાઓ સુખી થશે અને મારી ઉપાધિ ટળશે. એવો દ્રદ સંકલ્પ કરી ભૂહેવ તે યતિઓની પાછળ પાછળ તેમના ઉતારે ગયો અને પોતાનો સંકલ્પ જહેર

૫૦ પૂઠ બાળઅન્ધચારી શાસનપ્રભાવક શાસ્ત્રવિશારદ

## શ્રી ભાતુચંદ્રસૂરીશ્વરજીમહારાજ.



જન-મ સં. ૧૯૨૦ પોણ વદ ૧૦, વડગામ ( નાની ભારવાડ )

દીક્ષા સં. ૧૯૩૫ શાગણુ સુ. ૨ વિરમગામ.

કિયોદાર સં. ૧૯૩૭ વૈશાખ સુ. ૧૧ માંડલ.

આચાર્યપદ સં. ૧૯૬૭ વૈશાખ સુ. ૧૩ શિવગંજ. ( ભારવાડ )

સ્વર્ગવાસ સં. ૧૯૭૨ વૈશાખ વ. ૮ અમદાવાદ.



કર્યો. એટલે તેઓએ છોકરાઓને જેવાની છચ્છા જણાવી. ભૂદેવે છોકરાઓને રણુ કર્યો, યતિમંડળે જેથા. તે યતિઓ પૈકી ડોટવાલ શ્રીહરચંદ્રજીએ કદ્યું કે મારી સાથે તમો માંડલ ચાલો. ભૂદેવે હા પાડી ત્યાંથી બીજે દિવસે વિદ્યાય થઈ માંડલ આવ્યા. ત્યાંના શ્રાવકોની સલાહ લઈ ત્રણે પુત્રોને જેવાની ગોઠવણું કરી અને ત્રણે પુત્રોને સ્વીકારી વીધા. તે પછી વીરમગામથી ૫ં. શ્રીમુક્તિચંદ્રજીગણીને બોલાવ્યા. તેમણે ભલુલાઇને સ્વાધીન કરી પોતાના સ્નેહલાવમાં વૃદ્ધિ કરી. ભૂદેવ થોડો વખત માંડલમાં રહી પછીથી પોતાના વતને ગયો. ત્રણે શિષ્યોને કુમવાર વિદ્યાધ્યયન કરાવતું શરૂ કર્યું. તેમણે પોતપોતાની બુદ્ધિ મુજબ યોગ્ય વિદ્યાસંપાદન કરી. સમય થતાં યતિવર્ય શ્રીહરચંદ્રજીએ એ શિષ્યોને દીક્ષા આપી લખુનું લખમીચંદ્રજી અને કલુનું કલ્યાણચંદ્રજી નામ પાડ્યું.

સં. ૧૯૨૦ ના પોસ વહ ૧૦ ના રોજ (વાંકડીઆ) વડગામે વિજ્યા માતા પુત્ર રત્નને જન્મ આપે છે. પુત્ર-જન્મની ઝુશાલીમાં ધાર્મિકાર્યો ઉપરાંત ગ્રામ્યજીનોમાં વધાઈ ઝેલાતાં આનંદ આનંદ છવાઈ જાય છે. અને પુત્રનું નામ ભલુ રાખવામાં આવે છે એના અહુયોગમાં રાજ યા તો યોગી થવાનું લખાયતું છે. તે ભલુને ૫૦ શ્રી મુક્તિચંદ્રજી ગણી આવશ્યક, પ્રકરણ, વ્યાકરણ, ન્યાય વિગેરેનો વિદ્યાર્થ્યાસ કરાવે છે.

આમ અભ્યાસ કરતાં કરતાં ભલુની ઉમર ૧૬ વર્ષની

થાય છે અને ગુરુદ્દેવને વિનંતિ કરે છે કે મને હવે પરમો-  
પકારી શ્રીભાગવતીપ્રવરજયા અર્પણું કરો અને વીરમગામ  
મુકામે સં. ૧૬૭૫ ના ક્રાગણુ સુદ ૨ ના શુલ્ક દિને ભારે  
ધામધૂમ અને શ્રીઅષ્ટાનિહકામહોત્સવના ૩૧૩૫ ડેર્ટેર  
નિમંત્રણુથી પધારેલા શ્રીસંઘના ભાઈઓ અને શ્રીચતુર્વિધ-  
સંઘની હાજરીમાં ભલુને દીક્ષા આપી તેનું નામ શ્રીઆતૃચંદ્રજ  
રાખવામાં આવ્યું.

દીક્ષાને છજ દિવસો થયા ત્યાંતો શ્રી મુક્તિચંદ્રગણી  
સ્વરો સિધાવ્યા. પૂર્ણ શ્રી આતૃચંદ્રજને આથી ભારે  
આધાત લાગ્યો. આમ ગુરુદ્રેવનો વિરહ મનમાં બહુ સાલવા  
લાગ્યો. પરંતુ કુદરતની ગતિને કોણુ પહેંચી શકવા શક્તિમાન  
છે? એમ વિચાર કરે છે ત્યાં પૂર્ણ મુર્ખ શ્રી કુશલચંદ્રજ  
ગણીનો સાથ મળી આવે છે.

શ્રીપાશ્વિચંદ્રગચ્છના પરમત્યાગી વડિલ ગુરુદ્રેવ શ્રી  
કુશલચંદ્રજ ગણુવર સં. ૧૬૭૭ ની સાલમાં માંડલ  
મુકામે પધારે છે, અને તેએશ્રી પાસે યત્તિવર્ય શ્રીઆતૃચંદ્રજ  
સં. ૧૬૭૭ ના વૈશાખ સુદ ૧૧ ક્રિયા ઉદ્ઘાર કરે છે (સંવેગી  
અને છે) એ વડિલની છત્રછાયામાં ધર્મશાસ્કોનો અલ્યાસ  
કરે છે અને શ્રીસંઘની વિનંતિથી એ ચાતુર્માસ પણ  
માંડળમાંજ થાય છે. ત્યાં પૂર્ણ ગુરુદ્રેવની અમૃતવાણીથી  
પ્રેરાઈ શ્રાવક-શાવિકાઓ જ્ય, ત્ય, પર્ચયખાણો મોટા પ્રમાણુમાં  
કરે છે અને એચ્છવાદિ ધામધૂમ પણ સારા પ્રમાણુમાં થાય છે.

માંડલનું ચાતુર્માસ પૂર્ણ થતાં શ્રીકુશલચંદ્રજ ગણુવર

૫૦ પૂઠ બાળશ્રહયારી ભારતભૂષણ આઠ મ૦  
 શ્રી ભાતૃચંદ્રસૂરિ-યરણપાદુકા.



સ્વર્ગવાસ સં. ૧૯૭૨ ના વૈશાખ વદ કે અધ્યવાર  
 શામગાની પોળ—અમદાવાદ.



સાથે મુનિરાજ શ્રીભાતૃચંદ્રજી વિહાર કરી આઠ માસ વિચરે છે. પૂજયશ્રીનું સં. ૧૯૩૮ નું ચાતુર્માસ ભારે ધામધૂમથી થયેલ પ્રવેશ ખાદ જામનગર મુકામે થાય છે. એ વખતના મહારાજ જામસાહેબ શ્રીવિલાલ ગુડ્હેવની અમૃતવાળી સાંલળવા પ્રસંગોપાત પધારેલા અને પ્રતિઓધ પામી સ્વરાજ્યમાં લુણહિસા વિગેર પર પ્રતિબંધ મૂકેલો.

એ પછી ત્યાંથી પૂજયશ્રી સં. ૧૯૩૯ નું ચાતુર્માસ કર્ય કેણાયમાં કરે છે ત્યાં ગામેગામથી શ્રીસંધ પૂજય ગુડ્હેવની પ્રશાંસા સાંલળી વાંદવા માટે આવે છે. અને અફુાઈ મહોત્સવાદિ ધાર્મિક કાર્યો સારા પ્રમાણુમાં થાય છે.

ત્યાંથી પૂજયશ્રી વિહાર કરીને માંડળમાં પધારે છે અને માસકલ્ય કરી અનેક લુલોને તપના બળનું મહાત્મ્ય સમજાવે છે. ત્યારખાદ સં. ૧૯૪૦ માં મુનિરાજશ્રીભાતૃચંદ્રજી વીરમગામમાં શ્રીસંધનિમંત્રણુથી સામૈયાપૂર્વક પ્રવેશ કરે છે. અને શ્રીસંધની વિનંતિથી શ્રીભગવતીજી વાંચવાનું શરૂ કરે છે. આમ ગુડ્હેવની વાંચનાશક્તિ અને ધર્મસ્ફુરોના અપાર મહિમાને જાણવા જૈન-જૈનેતરો મોટા પ્રમાણુમાં લાલ લે છે અફુાઈ મહોત્સવ, ભાવના, પ્રભાવના, તપ, પ્રત નિયમાદિ સારા પ્રમાણુમાં થાય છે.

સં. ૧૯૪૧ માં પુનઃ માંડળ મુકામે પધારી ત્યાં શ્રીસંધમાં વિક્ષેપ હતો તે શુદ્ધ ઉપહેશ દ્વારા ફર કરી શ્રીસંધમાં પૂજયશ્રી સંપ કરાવે છે. સં. ૧૯૪૨ નું ચોમાસું

કુંદી-કોડાય, સં. ૧૯૪૭ તું ચોમામું લુજ નગરમાં થાય છે આ સમયે આ વિલાગમાં ધર્મકિયા અને કરણી ખાખત ભારે મુંઝવણું ઈલાય છે. જેને દૂર કરી પૂજય ગુરુહેવ શુદ્ધ કિયાનુષ્ઠાન પ્રવરતાવે છે.

ચાતુર્માસના અંતે પૂજય ગુરુહેવ મર્દધર (મારવાડ) માં વિચરતા પાલી પધારે છે ત્યાંના શ્રીકરણાવત ભગવાનજી ગુરુ આજ્ઞા લઈને શ્રી કેશરીયાજી તીર્થનો છહરી પાળતો સંધ કાઢે છે. પૂજય ગુરુહેવ માર્ગમાં ઉપહેશ દ્વારા ધર્મનું સાચું સ્વરૂપ પમાડતાં શ્રી સંધ સાથે કેશરીયાજીની યાત્રા કરી ખાડીના આઠ માસ મારવાડ ભેવાડ ભૂમિમાં પગલાં પાવન કરે છે અને ચાતુર્માસ પાલી ગામમાં ધામધૂમથી થાય છે. ત્યાંથી વિચરતાં સં. ૧૯૪૫ તું ચાતુર્માસ પૂજયશ્રી સામૈયાપૂર્વક બીકાનેરના ઉપાશ્રયમાં કરે છે ત્યાં સહુઉપહેશના પરિણામે તપ, જપ, નિયમાદિ ધાર્મિક અનુષ્ઠાનોની પ્રલાવના સારા પ્રમાણમાં થાય છે. એ સમયે પૂજય ગુરુહેવના ઉપહેશથી પ્રેરાઈ મૃગીબાઈ નામના શ્રાવિક! બેણ જેસલમેરનો સંધ કાઢે છે. સંધના રસ્તાના વસવાટ દરમ્યાન અન્ય ધર્મીઓને અનુમોદનીય એવી ધર્મ કિયાએ ચાલુ થયા કરે છે અને જેસલમેર પધારતાં ત્યાંના શ્રીસંધમાં પડેલા મતલેહો પૂજયશ્રીના ઉપહેશના પરિણામે સમાઈ જાય છે અને સંધમાં ઐક્યતાનો જ્યયજ્યકાર થાય છે. ત્યાંનો જાનભંડાર જુએ છે, આથી ત્યાંના મહારાજ પૂજયશ્રી પ્રત્યે બહુ સહુભાવ વૃત્તિવાળા બનવા સાથે તેઓશ્રીને વંદન કરી ધર્મઉપહેશને શિરસાવંધ

કરે છે. આ પછી સં. ૧૯૪૬ નું અણુહીલપુર પાઠ્ય અને સં. ૧૯૪૭ નું ચાતુર્માસ જામનગરમાં ભારે દળદખા કિયા-વિધિ અને ધર્મની પ્રલાવનારૂપ થાય છે અને ત્યાંના કેઠારી શ્રીસિદ્ધાચલજીનો સંઘ કાળી અનેક ભવી આત્માઓને ઉત્તુતિના માર્ગે પૂર્ણ ગુરુદેવની વાણીના પ્રતાપે લઈ જાય છે.


શ્રી સિદ્ધાચલગિરિને લેટીને પૂજ્યશ્રી હળવદ પધાર્યાં ત્યાં માસ કલ્પ કરતાં ભારે એચ્છવ રાદ થયો. એ દરમ્યાન અનેક-વિધ ધર્મકાર્યો થયાં. ત્યાંથી પ્રાંગંગા ભારે દળદખાલર્યો સત્કાર વડે શ્રીપાંકુંદ્રસ્તુરિગંધીના ઉપાશ્રયે પધાર્યાં અને ભવ્ય મહેત્સવ વર્ચે પરમોપકારી ગંધીનાયક સ્તુરિસંપ્રાદ શ્રી પાંકુંદ્રસ્તુરીકૃત્તિરજુ મહારાજાની ચરણુપાહુકા ત્યાંના ઉપાશ્રયમાં પ્રતિષ્ઠિત કરાવી. ત્યાંથી ધામધૂમપૂર્વક બજાણુંમાં પધાર્યાં ત્યાં ગુરુદેવની અગાધ જાનશક્તિ અને તપોબળના ગુણગાનથી પ્રેરાઈ દરખારશ્રીનર્થીઅખાનજી ગુરુદેવને વંદન કરવા પધાર્યાં. ગુરુદેવે તેમને રાજ્યધર્મ સમજાવી જીવ હિંસા નહિ કરવા પ્રતિબોધ્યા અને તેની સુંદર અસર થઈ. ત્યાંથી પાઠડી સુકામે પધારતાં પાઠડી દરખાર શ્રી સૂરજ-મલજી તથા અલુમગંજ નિવાસી બાળુ ગણુપતસિંહજી, અને બાળુ બુદ્ધસિંહજી આદિ ગુરુદેવને વંદનાર્થે પધાર્યાં અને ગુરુદેવની લક્ષ્ણ સુશ્રુષા કરી. ત્યાંથી વિહાર કરી વિરમગામ પધાર્યાં તે વખતે વીરમગામમાં પડેલા તડોને સાંધ્યા. અને સં. ૧૯૪૮ નું ચાતુર્માસ માંદળમાં થતાં શ્રીભગવતીજીનું વાંગન શ્રીસંધની વિનાંતિથી શરૂ કરવામાં આવ્યું, જે દરમ્યાન

## અનેકવિધ મહોત્સવાદિ ધાર્મિક કાર્યો થયાં.

સં. ૧૯૪૬ ની સાલમાં પૂજય ગુરુદેવ શ્રીભાતૃચંદ્રજી મહારાજ રાજનગરે પધારતાં શ્રીસંઘે ભવ્ય સામૈયું કરી તેઓશ્રીને શામળાની પોળના ઉપાશ્રીયે ભીરાજમાન કરવામાં આવ્યા. તેઓશ્રીની સાથે તે સમયે પૂર્ણ મુનિરાજ શ્રી દીપચંદ્રજી તથા શ્રી ગુણુચંદ્રજી મહારાજ હતા. અને ચાતુર્માસ દરમ્યાન અફુાઈ મહોત્સવાદિ ધાર્મિક પ્રભાવનાના ઉત્તમ કાર્યો શ્રીસંઘના ઉત્સાહથી થયાં. અને પૂજય ગુરુદેવની અમૃતવાહીનો આસ્વાદ પુનઃ ઝીલવા માટે શ્રીસંઘે સં. ૧૯૫૦ ની સાલનું ચાતુર્માસ કરવા આગ્રહભરી વિનંતિ કરતાં લાભાતુલાલ જોઈ પૂજય ગુરુદેવે માગણીનો સ્વીકાર કર્યો. આ સમયે પૂજય ગુરુદેવ શ્રીયશોધરચરિત્રનું વાંચન કરતા હતા. ગુરુદેવની વૈરાગ્યવાહિની દેશના, શુદ્ધ ચારિત્રપાલનશક્તિ અને અમૃતવાહીના આસ્વાદથી શ્રીસંઘમાં પૂજયશ્રી પ્રત્યે બહુમાન ઉપજયું અને પૂજયશ્રીના સહઉપદેશથી લાવી પ્રજામાં ધાર્મિક સંસ્કારો રેડાય એ માટે “શ્રી જૈન સરેસ્વતી સલા” ની સ્થાપના થઈ. આ હહાવો તેઓશ્રીના અનન્ય લક્ષ્ણ શ્રી હઠિકિંહભાઈ રાયચંદ્રભાઈએ લીધો. તે સાથે એક વિશાળ પૌષ્ઠ્રશાળા ખંધાવી અનેકવિધ પુષ્ય ઉપાજન કર્યો. આ પ્રસંગે શ્રીસંઘનો ઉલ્લાસ દરિયાના પૂનમની ભરતીના મોણ સમાન ઉછળી રહ્યો હતો. અનેક લાવી આત્માઓ તપ, જપ, કિયામાં જોડાયા અને ધણ્યાએ શ્રીચતુર્થ્યત્રતને અંગીકાર કર્યો અને ઘેરબેર આનંદ મંગળ પ્રવતી રહ્યો.

પૂ. પા. કિયાપાત્ર ગચ્છના વયોવૃક્ત મુનિરાજ

શ્રી દીપચંડજી મહારાજ.



નેચ્યો વષોથી કચ્છ ભૂમિમાં વીચરી ધર્માપહેશની  
અધ્યાંડ ધારા વહાવી રહ્યા છે, અને અનેક જીવાને  
ધર્મમાર્ગમાં સ્થીર કરી રહેલા છે.



ચાતુર્માસની પૂર્ણાહૃતિના અંતે પૂજયશ્રી મહુજ, એડા, ભાતર, પેટલાદ થઈ અંભાતમાં સં. ૧૯૫૨ ના ચાતુર્માસ ની વિનંતિ માટે પધારતાં શ્રીસંઘે ભારે ઠાઠપૂર્વક સામૈયું કર્યું. શ્રીસંઘે ગુરુદેવની શુદ્ધ પ્રકારે વૈયાવચ્ચ કરી જાનામૃત આલી મંદશક્તિઓને સતેજ કરી અને ત્યાંપણ શેડ કુલચંદ માણેકચંદની વિનંતિથી શ્રી લગવતીજી સૂત્રનું વાંચન થતાં જૈન જૈનેતરોએ છેણાળા પ્રમાણુમાં ગુરુવાણીનો લાભ કીધો. ચોમાસા પછી વિચરતાં પૂજયશ્રી માંડળ સુંમે પધાર્યો. ત્યાં ચંદનશ્રીની દીક્ષા ભારે ધામધૂમથી થઈ. સ્વામી-વાતસલ્ય, પૂજા, પ્રલાવનાહિ અનેક ધાર્મિક કાર્યો થયાં.

ત્યાંથી પૂજયશ્રી વિહાર કરતાં બીજુવાડા થઈ શ્રી શાંખેશ્વરજી પાર્થીનાથની ચાત્રા કરી છીનીઆર ગામે પધાર્યો. ત્યાં તેઓશ્રીના વરદ હુસ્તે શ્રીજિતપ્રતિષ્ઠાનો મહેતસવ શરૂ થયો. અને ભારે દબદભાલરી કિયા વચ્ચે મોટી માનવમેદની સમક્ષ પૂજય ગુરુદેવની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠા કરવામાં આવી. અને તે પછી સં. ૧૯૫૨ નું ચાતુર્માસ શ્રી રાજનગરમાં થયું. આ સમયે પણ શ્રી રાજનગરના શ્રી-મજાગપુરીયતપાગચ્છના ભાઈઓએ પૂજય ગુરુવાણીનો લાભ ઉત્તમ પ્રકારે ઉંડાવીને ત૪, ૪૪, કિયાદિ ધાર્મિકતા વૃદ્ધિંગત થાય એવા કાર્યો કર્યાં.

પૂજયશ્રી ત્યાંથી વિહાર કરી વીરમગામ, માંડલ, પાટડી, બજાણુા, ધૂમેઠ, ગાડા, ઝાંગઝા અને ટીકર થઈ કર્યા પ્રહેશ તરફ પુનઃ પદ્ધાર્યો. અને સં. ૧૯૫૩ નું

આતુર્માસ કચ્છ મોટી ખાખરમાં થયું. શ્રીભગવતીજી સૂત્રનું વાંચન શ્રીસંધની વિનંતિથી થતાં અનેક લભ્યાત્માએ આ ગુરુદેવના ઉપદેશનો લાલ લીધો. અને શેડ હેવરાજના સુપુત્ર શ્રીરવળ્લભાઈએ ગુરુવાણીથી પ્રેરાઈ એક લાખ ડોરી અચી' ભારે હાંદો લીધો. અને શ્રીભાતૃચંદ્રાલયુદ્ધ પાડશાળાની સ્થાપના કરી. તે સાથે અન્ય ભાઈ બહેનોએ પણ પૌષ્ઠ્રશાળા બંધાવી દ્રવ્યનો સહઉપયોગ કર્યો. આ સમયે ધ્રાગંગા તાબે દુદ્ધાપરના શા. ડાકેરસી મુળળ્લભાઈ પૂજય ગુરુદેવ પાસે આવી પહોંચ્યા. ગુરુદેવને શિષ્ટતાપૂર્વક વંદન કર્યું અને પોતાનો આરમા શ્રીભાગવતીપ્રવન્યા અડણ કરવા તત્પર થયો. છે એવી કુચિંતા પ્રદર્શિત કરી. ગુરુદેવે તેમને અભ્યાસમાં જેણ્યા જાદ સં. ૧૯૫૪ ના માગશાર સુદી ૧૦ ને ગુરુવારના રોજ દીક્ષા આપવાનું નક્કો કરવામાં આવ્યું ને શ્રી સંધને એ વાતની જણ કરાઈ. દીક્ષા મહેતસવની આમંત્રણ પત્રિકાએ. ડેર્ટેર મોકલાવાઈ અને સ્થળે સ્થળેથી શ્રીસંધના અશ્રેસરો. અને બીજી ભાઈએ. આવી પહોંચ્યા હતા. આમ દીક્ષાના નિર્માણ થયેલા હિને શ્રીયતુનિર્ધસંધની મોટી મેદની સમક્ષ પૂજયશ્રીના વરદ હસ્તે ભાઈ ડાકેરસી જેમની ઉમર ૩૦ વર્ષની હતી. તેમને દીક્ષા આપવામાં આવી અને નવ-દીક્ષિતનું નામ મુનિરાજ શ્રીપુનમચંદ્રજી રાગવામાં આવ્યું આ પ્રસંગે દીક્ષાનો લભ્ય વરધોડો, સ્વામીવાત્મકલ્યો, પૂજા પ્રલાવનાહિ અનેક ધર્મકરણીને ઉત્તેજીત કરનારાં કાર્યો થયાં.

આમ નૂતન શિષ્યાદિ સાથે વિચરતાં પૂજયશ્રી કચ્છ-અણડાસામાં પદ્માર્થી ત્યાં સંઘેામાં ઐક્યતા કરાવી શાંતિશ્રીજી


તथा આણું શ્રીજીને દીક્ષા આપી સં. ૧૯૫૪ નું ચાતુર્માસ સુશ્રી-માં થયું. ને લગવતીસૂત્ર વંચાયુ. ચોમાસું ઉત્તરતાં પૂજયશ્રી સુદરા ગામે આવ્યા. ત્યાંના ખરતરગચ્છના શ્રીસંઘે ખરતર-ગચ્છના દેરાસરજીમાં મૂળનાયકલું શ્રીમુનિસુવત સ્વામીજી હતા, તેથી કોઈ ઠેમના કારણે ખસેડી ત્યાં શ્રી મહાવીર-સ્વામી ને મૂળનાયક સ્થાપ્યા હતા અને શ્રીમુનિસુવતસ્વામીને પડાએ બેસાડ્યા હતા. તે ત્યાંથી ચલાયમાન થઈ જતા હતા તે માટે બહુ પ્રયત્ન કરવા છતાં સ્થિર થતા ન હતા તેની પ્રતિષ્ઠા શુરૂઆજે કરાવી ત્યારથી હિંયર થયા અને પૂજય શુરૂ-દેવની શક્તિના ગુણાચાર ચોમેર એ પ્રદેશમાં પ્રસરી રહ્યા.

ત્યાંથી વિડાર કરી શ્રી ભદ્રેસર તીર્થની ચાત્રા કરી અંજારે મુકામે પધાર્યા. અતે શ્રીસંઘે શુરૂદેવની લક્ષ્મિ બહુજ લાર-પૂર્વક કરી અને શ્રીસંધની વિનંતીથી સં. ૧૯૫૫નું ચાતુર્માસ ત્યાંજ કરવામાં આવ્યું. કચ્છ દેશલપુરના લાગ્યશાળી શ્રી હધુભાઈની શ્રીભાગવતી પ્રત્રજ્યા માટેની જિજાસા થઈ. શ્રી-સંધનિમંત્રણ પત્રિકાએ લખવામાં આવી. અને શ્રીઅષાન્ડુકા મહોત્સવ શરૂ થયો. સં. ૧૯૫૫ના ફાગણ વદ ૧૦ બુધવારે શ્રી સંધની હાજરીમાં દીક્ષા અર્પણ કરવામાં આવી અને હધુભાઈનું નામ મુનિજગતચંદ્રજી રાખવામાં આવ્યું. ચાતુર્માસ પૂર્વ થયા ખાદ જુજ નગર થઈ માંડવી બંદર પધાર્યા. ત્યાંથી ધર્મોપદેશ આપી અનેક મુમુક્ષુઓને પ્રતિષેધતાં માળીઆ, ખાખરેચી, હળવદ થઈ ક્ષાંગધ્રા પધાર્યા. ત્યાં ગચ્છનાયક શ્રીપાંચ્ચંદ્રસૂરીશ્વરજી મહારાજના ચરણ-

પાહુકા સ્થાપી લારે ઉત્સવ ઉજવાયો અને પ્રાંગધાના આંગણે લીલાલહેર થઈ ગયા. ત્યાંથી સં. ૧૯૫૬નું ચાતુર્માસ વીરમગામમાં થયું. ત્યાંથી સં. ૧૯૫૭નું ચાતુર્માસ રાજનગર માં શ્રી સંધની ઉપરાઉપરી થતી વિનંતીના પરિણામે કરવામાં આવ્યું. શ્રી ‘ઉવવાઈ સૂત’ના વાંચનથી શ્રીસંધમાં ધર્મપ્રત્યે ઝચિ વધવા લાગી, તપ, જપ ઓચ્છવ સારા પ્રમાણમાં રાજનગરના શ્રીસંધે કર્યો. આમ રાજનગર ખાડ સં. ૧૯૫૮નું ચાતુર્માસ ખંભાતમાં થયું.

પૂજયશ્રીના ઉપદેશથી પ્રેરાક ખાદ્યસંસ્કાર જેના ઉત્ત્ર છે અને જેનું ચિત્ત વૈરાગ્યમાં ચોટેલું છે એવા શામળ ધારશીએ સં. ૧૯૫૮ના મહા સુદ ૧૩ પૂજયશ્રી પાસે શ્રી ભાગવતી પ્રવર્જયા આંગીકાર કરી તેમનું નામ સુનિ સાગર-ચંદ્રજ રાખવામાં આવ્યું. આ સમયે સ્વામીવાત્સલ્ય, અફુઠ મહોઃત્સવ આદિ ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થયા હતા. પૂજય ગુરુદેવે શ્રી શત્રુંજય ગિરિરાજના મહાત્મ્ય વિષે સુંદર વ્યાખ્યાનો વાંચી જનતામાં ધર્મના બીજ ઉડા ઉતાર્યો હતા. અને તે ચાતુર્માસ ખાડ પૂજયશ્રી શ્રીસિદ્ધાચળજીની યાત્રાએ ઉત્ત્ર વિહાર કરતાં પદ્ધાર્યો. આ સંધ શેડ દીપચંદ્રભાઇએ કાઢી અનેક લબ્ધાત્માઓને પૂજય ગુરુદેવની વાણીનો લાલ અને શ્રી સિદ્ધાચળજીની યાત્રાનો હહાવો લેવડાયો. પૂજય-શ્રીએ શ્રીસિદ્ધાચળજીમાં માસકલ્પ કર્યો. ત્યાંથી વિહાર કરતાં માર્ગમાં અનેક જીવોને પ્રતિષ્ઠાધતાં પૂજયશ્રી લીંઅડી અને ચુડા મુદ્રાએ પદ્ધાર્યો. લીંઅડીના રાજ યશવંત-

५० पू० बाणश्वरारी प्रातःस्मरणीय स्वपर  
 शाखपारगाभी सुप्रसिद्ध जैनाचार्य श्री १००८  
 श्री भ्रातृचंद्रसूरीश्वर पादुका।



अंभात ओरपीपणा धर्मशाणा पासे  
 स्थापित पादुका हेरी।



સિંહજ બહારુર તેમજ ચુડાના ઠાકોર સાહેખને પ્રતિ-  
ઓધીને પૂજ્યશ્રી વઢવાણુ પધાર્યો ને સં. ૧૯૫૮ની સાલનું  
ચાતુર્માસ શ્રીસંઘની વિનંતિને માન આપી પૂજ્યશ્રીએ ત્યાં ચોમા-  
સું કર્યું. ગામેગામથી શ્રીસંઘના અભેસરો પૂજ્યશ્રીને વંદના-  
સુખસાતાપૂછવા અથે ત્યાં પધાર્યો. ચાતુર્માસ પછી તેઓ શ્રી પોતા-  
ના શિષ્યપરિવાર સાથે વઢવાણુ કેંપમાં પધારતાં ભારે સામૈયું  
કરવામાં આવ્યું. ડેરડેર ગહુંલીએ થઈ અને પૂજ્યશ્રીને મોતીડે  
વધાવવામાં આવ્યા. ત્યાંથી વિહાર કરી રાજ્યપર, અંકેવાળીએ,  
પેટા; ખેરવા, બજાણુા, પાટડી અને માંડલ થઈ પૂજ્યશ્રી  
વીરમગામ પધાર્યો. ત્યાં સં. ૧૯૬૦ના ઝાગણુ વદ પ મે  
રાજશ્રીજીને ભારે ધામધૂમ અને ઉત્સવ વચ્ચે પૂજ્યશ્રીએ  
દીક્ષા આપી અને તે સાલનું ચાતુર્માસ લાલાનુલાલ જોઈ  
ત્યાંજ કરવામાં આવ્યું. આ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીના  
સફુલિપદેશથી શ્રીઆજિતનાથજીના હેરાસરનો જિણોદ્ધાર  
કરાવવામાં આવ્યો.

આ સમયે ત્યાં ખેંગનો ભયંકર રોગ ઝાટી નીકળ્યો.  
પૂજ્યશ્રીને શ્રીસંઘે વિનંતિ કરી કે અપવાદના કારણે આપશ્રી  
આ હવામાંથી અન્ય સ્થળે પધારો. એટલે પૂજ્યશ્રી ગોલવાડી  
દરવાનની બહાર નવલપણાના બંગલે શેઠ સૌભાગ્યચંદ  
નથુભાઈ વિગેરેની વિનંતિથી ત્યાં પધાર્યો. તેઓ શ્રીની સુશ્રૂતામાં  
રેકાયેલા શ્રીસંઘના ભાઇઓને જરાપણ આંચ આવી ન હતી.

આમ વીરમગામનું ચાતુર્માસ પૂર્ણ થતાં પૂજ્યશ્રી માંડલ  
મુકામે પધાર્યો, ત્યાં ઓચ્છવ-મહોચ્છવપૂર્વક સં. ૧૯૬૧ પોષ

વદ ૬ કુમળશ્રીજીની હીક્ષા થઈ ત્યાંથી લવી જનોને પ્રતિ-  
ઓધતાં સીતાપુર, એચરગામ, હેથળી, રાંતેજ, લોયણી,  
સુરેજ, નંદસણુ, છિત્રાલ થઈ પૂજ્યશ્રી કલોલ સુકામે  
પધાર્યો. ત્યાં ગુડવાણી સાંભળવા આવનાર કેટલાયે સ્થાનક-  
વાસીભાઈઓ બુઝ્યા અને પ્રલુના સાચા માર્ગમાં જોડાયા.  
પૂજ્યશ્રી વિહાર કરતાં સહજ, દીંટોડા થઈ પેથાપુર  
પધાર્યો. ત્યાં માંતિકુકોન્ફર-સની એઠક મળી હતી અને  
શ્રી આણુંદસાગરજી, શ્રી બુદ્ધિસાગરજી આદિ સુનિરાજે  
પધાર્યો હતા. ત્યાંથી વિહાર કરી ડેલોડા, સુવાડા, દેહગામ,  
નાના વડોદરા, નરોડા થઈ અમદાવાદ પધાર્યો. અને રાજ-  
નગરના શ્રીસંઘની વિનંતિના પરિણામે સં. ૧૯૬૧ ની સાલનું  
ચાતુર્માસ પણ રાજનગરમાં થયું. ને શા. સાંકેણયંદ  
વિઠુલભાઈની વિનંતિથી લગવતી સૂત્ર વંચાયું. રાજનગર  
વાસીઓ પ્રત્યે કોણું જણે પૂજ્યશ્રીનું અંતઃકરણ પણ એંચાતું  
હતું. એનું કારણ શ્રીસંઘના વૈયાવર્ય, લક્ષ્મિભાવ અને અન્ય  
ધર્મકાર્યોનુંજ કહી શકાય. આ ચાતુર્માસ દરમ્યાન કંઈ,  
મુંખદ્ધિ, ખંભાત, ધ્રાગ્ના આદિ સ્થળોએથી પૂજ્યશ્રીને વંદના  
અથેં અનેક ગૃહરથો ત્યાં પધાર્યો.

જેમ ખીજનો સૂર્ય દિનપ્રતિદિન વૃદ્ધિને પામે છે, જળ  
સીંચન થતાં કુમળ ખીલે છે તેમ શ્રીસંઘનો ભાવ પ્રકાશવંત  
થતો હોઇ આ ચાતુર્માસ યાદગાર એવા તપ, જપ, મહો-  
ત્સવાદ્ધિ ધાર્મિક પ્રલાવનાના અનુકરણીય અને અનુમોદનીય  
કાર્યો થયાં.

તે ચાતુર્માસ પૂજાં થયેથી પૂજયશ્રી ખંભાત સુકામે પધાર્યાયો. ત્યાં સં. ૧૯૬૨ ના માગશર સુહ ૧૧ ગુરૂવારે દેવશ્રીજી અને દ્વાશ્રીજીને દીક્ષા આપવામાં આવી. અને સં. ૧૯૬૨ નું ચાતુર્માસ પણ ધામધૂમપૂર્વક ત્યાંજ કરવામાં આવ્યું. ત્યાંથી અમદાવાદ પધારતાં વીરમગામના શ્રીસંઘે શ્રીઅણીતનાથજીના દેરાસરને જિણોદ્વાર સંપૂર્ણ થયાની હડીકતથી પૂજયશ્રીને વાકેક કથો અને પ્રતિષ્ઠા ઉપર પૂજયશ્રીને વીરમગામ પધારવા સાચ્છડ વિનંતિ કરી. વીરમગામ પ્રતિષ્ઠા પર જઈ તે કાર્ય ધામધૂમપૂર્વક સંપૂર્ણ કરાવી પૂજયશ્રી પુનઃ રાજનગરમાં આવી પહોંચ્યા. આ સમયે મુંખાંથી ચાતુર્માસની વિનંતિ અથે કેટલાક સહૃદ્યુહસ્થો પૂજયશ્રીને વિનંતિ કરવા પધાર્યા હતા.

પરંતુ કુદરતે જ્યાં મારવાડની ભૂમિ નિર્માણ કરી હોય ત્યાં મુંખાંથી કેમજ બને? મારવાડમાં પધારીને પંચતીથિં જાગ્રા કરી પૂજયશ્રી શિવગંજ પધાર્યાં. આ સમયે શ્રી પુલચંદજી કાલંદ્રિવાળાએ શ્રીકેશરીયાજીનો સંઘ કાઠવાનો હોછ પૂજય ગુરૂહેવને સાથે પધારવા નિર્માણ કર્યું. આમંત્રણનો સ્વોકાર કરી ગુરૂરાજે પોતાના પાટવી શિષ્ય સુનિરાજ શ્રીપુનમચંદ્રજીને કાલંદ્રી જવાની આજા કરી એટલે પોતે અને શ્રી કૃપાચંદ્રજી એ ઠાણા કાલંદ્રી પધાર્યાં. ત્યાંથી સંઘ સાથે શિવગંજ ગુરૂરાજ પાસે આવ્યા. પછી ત્યાંથી પૂજયશ્રી કેશરીયાજીના સંઘમાં પધાર્યાં. ઠેરઠેર ગુરૂહેવની વાણીની પ્રસંશા સાંભળી ભવી જીવો વૈરાગ્યવાહિની વાણીના ધોંધમાં પાવન થવા લાગ્યા.

સં. ૧૯૬૪ નું ચાતુર્માસ મેવાડના પાટનગર શ્રી ઉદ્દેપુરમાં થયું. ત્યાંથી ગોડવાડની પંચતીથી કરી, પાદી થઈ પૂજ્યશ્રી જોધપુર પધાર્યો અને સં. ૧૯૬૫ નું ચાતુર્માસ શ્રીસંધની વિનંતિથી ત્યાંજ કર્યું. અહીંથી ઇકોધી જત્રા કરી. પૂજ્યશ્રી બિકાનેર પધાર્યો ત્યાં કચ્છ મેરાઉના વેલલુભાઇને ભારે ધામધુમ-કિયાદિ મહોત્સવ વચ્ચે દીક્ષા આપવામાં આવી અને તુતન દીક્ષિતનું નામ મુનિ મસાદચંદ્રજી રાખવામાં આવ્યું. તેવીજ રીતે પ્રધાનશ્રીજી અને પ્રભાશ્રીજીએ પૂજ્યશ્રીના વરદ હસ્તે દીક્ષા થહુણ કરતાં ચંદ્રનશ્રીજીના શિષ્યા તરીકે બન્નેને જહેર કરવામાં આવ્યા. આમ આ દીક્ષા મહોત્સવથી બીકાનેર અને આસપાસમાં ધર્મનો વિજય દેવજ ઝરકતો રહ્યો તેમજ ત્યાગમાર્ગની પ્રાધાન્યતા સાબિત થઈ અને એ એકજ એવો માર્ગ છે કે જેના વડે આત્માની મુક્તિ સાધી શકાય છે એ શ્રી જિનવાણીનો પ્રભાવ મહિમાવંત બન્યો.

આમ આ ઉત્સવથી પ્રકૃષ્ટિત બનેલ બિકાનેરના શ્રી સંધની પૂજ્યશ્રીની વાણીનો લાલ વધુ લેવાના હેતુથી કરવામાં આવેલ વિનંતિને માન આપી સં. ૧૯૬૬ નું ચાતુર્માસ ત્યાંજ નક્કી થયું. આમ મધ્યમ તેમજ લક્ષ્મીપતિએ પણ પૂજ્યશ્રીના ચરણુકમળમાં પોતાની સેવા ધરીને અનુપમ હડાવો દેવા લાગ્યા.

આ ચાતુર્માસ દરમ્યાન ધર્મની અનેકવિધ પ્રભાવના થઈ હતી. લાંથી શિવગંજ પધારતાં પૂજ્યશ્રી સાથે ઘણ્ણા

શહેરોના શ્રીસંઘોના ગૃહસ્�ો પદ્ધાર્યો હતા. અતે પુન્જયશ્રીને ભારે ધામદુમપૂર્વક સં. ૧૯૬૭ વૈશાખ સુદ ૧૩ આચાર્યપદ આપવામાં આવ્યું. લાંથી વિહાર કરી આખુતીર્થની યાત્રા કરી પાલનપુર પદ્ધાર્યો. લાંના શ્રીસંઘની ચોમાસા માટે સાગર વિનંતિ હોવાથી પોતાના પાટવી શિષ્ય શાંતમૂર્તિ મુનિરાજ શ્રીપુનમચંદ્રજી તથા મુનિરાજ શ્રીકૃપા-ચંદ્રજી ઢાણા બેને ત્યાં ચાતુર્માસ કરવાની આજા આપી પુન્જયશ્રી અમદાવાદ પદ્ધાર્યો ત્યાં પુન્યશ્રીને દીક્ષા આપી સં. ૧૯૬૭ નું ચોમાસું કર્યું. ચોમાસું પૂર્ણ થતાં અનુક્રમે માંડલ પદ્ધાર્યો. ત્યાં સં. ૧૯૬૮ નું ચોમાસું કર્યું. ચોમાસું ઉત્તરતાં ચુગમધાનશ્રીપાશ્રીચંદ્રસૂરીશ્વરજીમહારાજના ચરણપાહુકાની ઉપાશ્રયમાં પ્રતિષ્ઠા કરાવી અનુક્રમે શ્રી શાંખેશ્વર યાત્રાથે પદ્ધાર્યો. ત્યાં પુન્જયશ્રીએ પોતાના પાટવી શિષ્ય મુનિરાજ શ્રીપુનમચંદ્રજી ઢાણા બેને અમદાવાદ જવાની આજા આપી અને પોતે પાટડી, બજાણા થદ પ્રાંગંક્રી પદ્ધાર્યો. ત્યાં સં. ૧૯૬૯ નું ચોમાસું કર્યું. તે ચોમાસામાં ભા. સુ. ૧૦ કર્ચિ-કોડાયમાં શાંતસુધાકર ૫૦ પૂર્ણ શ્રીકૃશલચંદ્રજી ગણિષુવરનો સ્વર્ગવાસ થવાથી ચોમાસુ ઉત્તરતાં માગશર સુદ ૬ મુનિ જયશિખરજી તથા પ્રીતિશ્રીને દીક્ષા આપી. પુન્જયશ્રીની કર્ચિમાં જવાની ધર્છા થદ તેથી ત્યાંથી વિહાર કરી હલવદ પદ્ધાર્યો. પણ ત્યાં અક્રમાત્ આંખનું કારણું બનવાથી પાછા પ્રાંગમ્બે પદ્ધાર્યો અને સમાચાર મળતાં અમદાવાદથી વિહાર કરી પાટવી શિષ્ય મુનિરાજ શ્રીપુનમચંદ્રજી ઢાણા ત્રણ પ્રાંગમ્બે પદ્ધાર્યો. ત્યાંથી અમદાવાદના શ્રીસંઘે અમદાવાદમાં પધરામણી

કરાવી, ઉપાશ્રયમાં મુનિ તેશરીચંદળને દીક્ષા આપી. સં. ૧૯૭૦, ૧૯૭૧ ના ચાતુર્માસો અમદાવાદના આંગણે થયા.

આમ દેશવિદેશમાં ઉત્ત્ર વિહાર કરી વિચરતાં પૂજયશ્રીએ અનેક મુમુક્ષુઓને પ્રતિષેધી ધર્મની પ્રભાવના કરી છે. તેઓશ્રીના સમયમાં પણ અન્ય ગચ્છમાં સંવત્સરી પ્રતિક્રમણું અંગે લારે મતલેદો ઉલા થયા હતા. પરંતુ શ્રી શાસ્ત્રોક્ત પરંપરાને અનુસરીને પૂજયશ્રીએ પણ પુનમતું ચૈંમાસી પ્રતિક્રમણું અને પાંચમતું શ્રી સંવત્સરી પ્રતિક્રમણું કરાવી સન્માર્ગમાં હોય્યા હતા.

રાજનગરના ચાતુર્માસ દરમ્યાન પૂજયશ્રીની તથીયત લથડી હતી. પરંતુ મહાત્માઓ કદી આ નંખર હેઠની પરવાહ કરતા નથી પણ મળેલ સમય દરમ્યાન ઉત્કૃષ્ટ આરાધના કરવા તત્પર રહે છે. અમદાવાદના શ્રીસંઘના ગૃહસ્થોને પણ પૂજયશ્રીની તથીયત અંગે ચિત્તા થવા લાગી. વૈદિક અને ડાક્ટરી એવા સધળાએ ઉપચારો દ્રવ્યની પરવાહ કર્યા વિના કેવા શરૂ કર્યા. શ્રીસંઘના અશ્રેસરો ને ભાઇઓ પૂજયશ્રીની પથારી પાસેજ રાતદિવસ રહેવા લાગ્યા. આ વખતે પોતાના પાટવી શિષ્ય શાંતમૂર્તિ મુનિરાજ શ્રીપુનમંદ્રલુગણી આદિ કંચિત્તમાં વિચરતા હતા. તેથી ગુરુરાજની હાજરીમાં ન હતા પણ તપસ્વી મુનિરાજ શ્રીજગતચંદ્રલુ તથા વિક્રાન્તવક્તા મુનિરાજશ્રી સાગરચંદ્રલુ આદિ શુદ્ધેવની સુશ્રૂષા કરવામાં હાજર હતા. અને જરાપણું કમીના રાખતા ન હતા. છતાં કુદરતે જ્યાં કાળ નિર્માણ કર્યો હોય ત્યાં માનવીનું શું ચાલી શકે?

૫૦ ૫૦ બાળશ્રદ્ધારી શાસ્ત્રપારંગત ભારત-  
ભૂપણ આ મ. શ્રી ભાતુચંડસૂરિધરજીના શિષ્ય



મુનીરાજ શ્રી પ્રસાહચંડજી મહારાજ.



રાજનગરના શ્રીસંધની ભક્તિ જેએ ડેરઠેરથી પૂજયશ્રીની તથીયતના સમાચાર પૂછવા આવતાં ગૃહસ્થોના સુખમાંથી પ્રસંશાના શાખો બોલાવા લાગ્યા. ધન્ય છે રાજનગરના શ્રી સંધને કે જેણે આવા બાળપ્રદ્યારી મહાત્માની સેવાની તક અડપી મળેલી પળને ધન્ય કરી. આખરે સૌના ઐદ અને હું વરચે પૂજય આચાર્ય શ્રીભ્રાતૃચંદ્રસ્થોરિક્ષરજી મહારાજ સાહેબનો આત્મા દેહથી મૂક્તા થઈ ગયો. એ દિવસ હતો સં. ૧૯૭૨ ના વૈશાખ વદ ૮ ને ખુધવારની રાત્રીનો.

ગુરુનિરહથી તેઓશ્રીના શિષ્યરતનો અને શ્રીસંધને લારે આધાત લાગ્યો. લુધનસાઇલ્યના માર્ગદ્રષ્ટા, જનહિતકારી વચ્ચનોથી અનેક લુચો પર સન્માર્ગ દર્શનનો ઉપકાર કરનાર આવા મહાપુરુષના વિરહથી કોને હુઃખ ન થાય? સૌની આંખો અશ્રુભીની બની. બીજે દિવસે પૂજયશ્રીને લંઘ પાલખીમાં પદ્મરાવી શ્રીસંધના લાદુએ અને માંડલ-વીરમગામ-ખંભાત વિં સ્થળોએથી પદારેલા ગૃહસ્થોની મોટી મેદનીવાળી સમશાનયાત્રા નીકળી જે રાજનગરના રાજમાર્ગો પર થઈ ફુદેશ્વર સમશાનભૂમિમાં પદ્માર્થી અને ગુરુના દેહને અભિનિસંસ્કાર કરી પુનઃ સૌ વિખરાયા. પૂજયશ્રીના કાળધર્મને મહોત્ત્સવરૂપ ઉજવી ડેરઠેર અફુાઈ મહોત્સવો કર્યો અને સમારક તરીકે કેટલાક સ્થળે ચુરણુપાડુકા સ્થાપન કરવામાં આવી.

આચાર્ય શ્રી ભાતૃચંદ્ર સુરી કૃતજ્ઞના જીવનચરિત્રનો

## દુંક સારાંશ.

જન્મસ્થાન :—વડગામ—મહાર પાસે ( નાની મારવાડ )

જન્માન્ન :—સા. ૧૯૨૦ ના પોષ વદ ૧૦

પિતાનું નામ :—દાનમલજી.

માતાનું નામ :—વિજયા ( વિજુ )ખાઈ.

જાતિ :—ઓદિચ્ય ખાણણું.

દીક્ષા :—સા. ૧૯૩૫ ના ફાગણ સુદ ૨ ( ઉ. વ. ૧૬ ) વિરમગામ

ગુરૂનું નામ :—યતિવર્ય શ્રી મગનચંદ્રજી—મુક્તિચંદ્રજી ગણી.

અભ્યાસ :—શરૂઆતમાં ખડાવશ્યક—પ્રકરણાદિ, સારસ્વત વ્યાક-  
રણ, રધુવંશાદિ કાવ્ય, કોષ, સાહિત્ય, ન્યાય, છંદ,  
જ્યોતિષ, સંખ્યાધી વિવિધ શાસ્ત્રો.

કિયોછાર :—( સંવેળી માર્ગનો સ્વીકાર ) સા. ૧૯૭૭ના વૈશાખ  
સુદ ૧૧ માંડલમાં શાંતમૂર્તિં મુનિરાજશ્રીકુશલચંદ્રજી  
ગણીની નિશ્ચાચે કિયા ઉદ્ઘાર કર્યો.

વિહાર :—ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ, મારવાડ, મેવાડ વગેરે  
દેશોમાં ઉચ્ચ વિહાર કરી અનેક લંઘ જીવાને ધર્મમાં  
નોહ્યા.

આચાર્યપદ :—સા. ૧૯૬૭ ના વૈશાખ સુદ ૧૩ બુધવાર,  
સ્થળ શિવગંગ ( નાની મારવાડ ). અહુએ મહેત્ત્સવ  
પૂર્વે ચતુર્વિધસંઘની હાજરીમાં, જન્મથી ૪૮ વર્ષની

ઉંમરે અને દીક્ષાથી તૃતી મા વર્ષે આચાર્યપદ આપવામાં આવ્યું.

**અમતકારી કૃતિઓ :-**(૧) કચ્છ—મુદ્રામાં લગભગ પચીસ વર્ષથી માણ મૂળનાયકશ્રીમુનિસુવ્રતસ્વામીને પણાસણું પરથી ડેઢ વર્ષમના કારણુંસર ખસેડી ત્યાં શ્રી મહાવીર સ્વામીને મૂળનાયક સ્થાપ્યા હતા. આથી માણ મૂળનાયકજીના શાસનદેવ તરફથી એવો અમતકાર જાહેર થયો. કે ‘એ મુનિસુવ્રતસ્વામીને પડાએ બેસાડેલા તે દર રાતે અલાયમાન થઈ નવા મૂળનાયકજીના અગાડી આવી બિરાજતા હતા ને તે માટે અનેક પ્રથતન કર્યા છતાં તે જગ્યાએ સ્થિર રહેતાજ ન હતા’ એ વાત શુરૂરાજે સાંલળી ને એક દિવસ મુકરર કર્યો, તે દિવસે શુરૂરાજ, એક શ્રાવક અને એક સલાટ ત્રણે જણ દેરાસરમાં જઈ વિધિપૂર્વક શ્રીમુનિસુવ્રતસ્વામીની શુરૂરાજે પ્રતિષ્ઠા કરાવી તે આજ સુધી તેજ આસનપર સ્થિર છે.  
(૨) વિરમગામમાં શ્રી અન્જિતનાથજી લગવાનું પ્રતિષ્ઠા કરાવવા સારુ શુરૂરાજ અમદાવાદશી પદ્ધાર્યો. તે અરસામાં પાણીની તાણું ધણી હોવાથી ત્યાંના શ્રીસંઘે કહ્યું કે ‘પૂ. શુરૂદેવ ! જે આ મુહૂર્ત આધું દેવાય તો સારુ કારણું હાલમાં પાણીની ધણી તંગીને લીધે જે સાધમીંલાઇએ આવશે તેમણી લક્ષ્ણ અમારાથી પૂરેપૂરી થઈ શકશે નહિ’, તેના જવાબમાં શુરૂરાજે કુરમાંયું કે ‘સરે સારાવાના થશે’ તે પછી શ્રીસંઘે કામ શરૂ કર્યું. આમંત્રણપત્રિ-

કાઓ મોકલવામાં આવી, પ્રતિષ્ઠા કરવાના અગાઉ લગભગ  
ત્રણેક ગાઉ કુરતો લારે વરસાદ પડ્યો તેથી જૈનસમાજમાં  
આનંદ હેલાયો. સં. ૧૬૬૩ નેટ સુ. ૧૧ શ્રીઅન્જિતનાથજીની  
પ્રતિષ્ઠા અને નોકારસી વગેરે કાર્યો લારે ઉદ્ઘાસપૂર્વક થયાં.  
ધન્ય છે એવા તપોખણશાળી ધર્મધ્વજધારી મહાત્માને !

**વિશિષ્ટ ધર્મપ્રભાવનાનાં કાર્યો :—**—અનેક લભ્યજીવોનો ઉદ્ધાર  
કરી દેશ વિરતિ, સર્વવિરતિ બનાવી અને ગચ્છનાયક-  
ગુરુદેવની તથા શ્રી જિનરાજની પ્રતિષ્ઠાઓ કરાવી જૈન-  
શાસનનો વિજયધ્વજ કુરકાવ્યો.

### શિષ્યમશિષ્ય સમુદ્દરાય :—

૧	મુનિશ્રીપુનમચંદ્રજી	૮	મુનિશ્રીખાલચંદ્રજી
૨	„ જગતચંદ્રજી	૯	„ રાયચંદ્રજી
૩	„ સાગરચંદ્રજી	૧૦	„ વૃદ્ધચંદ્રજી
૪	„ કૃપાચંદ્રજી	૧૧	„ અમીચંદ્રજી
૫	„ પ્રસાદચંદ્રજી	૧૨	„ વિદ્યાચંદ્રજી
૬	„ જયશિખરચંદ્રજી	૧૩	„ લાભચંદ્રજી
૭	„ કેશરીચંદ્રજી		

### ચાતુર્માસો :—

સં. ૧૬૭૫ તથા ૧૬૭૬ માંડલ કે વિરમગામ ચંતિપણુંમાં.	સં. ૧૬૪૧ માંડલ
„ ૩૭ માંડલ	„ ૪૨ કોડાય (કચ્છ)
„ ૩૮ જામનગર	„ ૪૩ ભુજ ( „ )
„ ૩૯ કોડાય (કચ્છ)	„ ૪૪ પાલી (મારવાડ)
„ ૪૦ વિરમગામ	

સં. ૧૬૪૫ ખીડાનેર (,,)	સં. ૧૬૫૮ ખંલાત
„ ૪૬ પાટણ (ગુજરાત)	„ ૫૬ વઢવાણુશહેર
„ ૪૭ જમનગર	„ ૬૦ વિરમગામ
„ ૪૮ વિરમગામ	„ ૬૧ અમદાવાદ
„ ૪૯-૫૦ અમદાવાદ	„ ૬૨ ખંલાત
„ ૫૧ ખંલાત	„ ૬૩ અમદાવાદ
„ ૫૨ અમદાવાદ	„ ૬૪ ઉદ્ધયપુર (મેવાડ)
સં. ૧૬૫૩ મોટીખાખર (કચ્છ)	„ ૬૫ જેધપુર (મારવાડ)
„ ૫૪ સુથરી (,,)	„ ૬૬ ખીડાનેર
„ ૫૫ અંનર (,,)	„ ૬૭ અમદાવાદ
„ ૫૬ વિરમગામ	„ ૬૮ માંડલ
„ ૫૭ અમદાવાદ	„ ૬૯ ક્રાંગધ્રા

**વિદૃત્તાનો પ્રભાવ:-** પૂજ્યશ્રીએ ધર્મોપદેશથી જમનગરના મહારાજા જમસાહેબ શ્રી વિલાળ બહાદુર, ક્રાંગધ્રાના મહારાજા શ્રીમાનસિહલુ, તેમના લાયાત શ્રીપ્રતાપ-સિહલુ, તથા શ્રીજલમસિહલુ, બજાણુના દરખાર સાહેબ શ્રીનસીબખાનલુ, પાટડીના દરખાર શ્રીસૂરજ-મલસિહલુ, લિંખડીના મહારાજા શ્રીયશવંતસિહલુ બહાદુર, કચ્છભુજનું રાજમંડળ તથા જેશલમેરના મહારાજા.

**જેધપુરના કવિરાજ મહામહોપાધ્યાયશ્રી મુરાદિદાનલુ; ન્યાયવિશારદ શાસ્ત્રી નારાયણુદ્દત્તલુ, વ્યાકરણાચાર્ય વિદ્ઘાભૂષણ પંડિતશ્રી લગવતીલાલલુ, આશુકવિ**

શાસ્ત્રી નિત્યાનંદજી, શાસ્ત્રી હરિકૃષ્ણજી, સાહિત્યપંડિત શ્રી ઉમાશંકરજી, શાસ્ત્રી મણિશંકરજી, રાજવૈદ્ય પંડિત હેમરાજભાઈ, આદિત્યરામજી વગેરેને જૈનધર્મ પ્રત્યે સારી લાગણીવાળા કર્યા હતા.

**જીર્ણોદ્ધારઃ**—જીર્ણોદ્ધારના ઉપદેશથી ખીકાનેરમાં ભાંડાસરજીનું મોટું દેરાસર, ખંભાતમાં નવપલ્લવજી, ચિતામણિજી, આદિનાથજી એ ત્રણું દેરાસર અને વિરમગામમાં શ્રી અન્જિતનાથજીનું દેરાસર. ઈત્યાદિ દેરાસરના જીર્ણોદ્ધાર થયા.

**તીર્થયાત્રા**—પૂજયશ્રીના તીર્થયાત્રા કરવા સંખાંધી ઉપદેશથી (૧) શ્રી શત્રુંજ્ય, (૨) શ્રી ગિરનાર, (૩) શ્રી શંખેશ્વર, (૪) શ્રી લોયણી, (૫) શ્રી આયુ, (૬) શ્રી વરકાણા, (૭) શ્રી રાણકપુર, (૮) શ્રી કેશરીયાજી, (૯) શ્રી જેસલ-મેર, (૧૦) શ્રી કાવી ગંધાર વગેરે તીર્થોના સંધ છ'રી પાળતા નીકળ્યા હતા.

**જીવદ્યા**—જીવદ્યાના ઉપદેશથી વિરમગામ, માંડલ વગેરે સ્થળોમાં પાંજરાપોળોમાં સારા સુધારા વધારા થયા.

**ધાર્મિક કેળવણી**—ધાર્મિક કેળવણીના સહુપદેશથી અમદાવાદમાં શ્રીજૈન હડીસિંગ સરસ્વતી સભા, પ્રાંગંધીમાં શ્રી કુશલચંદ્રગણી જૈનપાઠશાળા, કચ્છ—મોટીખાખરમાં શ્રી ભાતુચંદ્રાલયુદ્ધય પાઠશાળા તથા કન્યાશાળા વળી કેટલાક સ્થળે પૌષ્ઠ્રશાળા અને ધર્મશાળા વગેરે થઈ.

ભારતભૂપણ શ્રીભાતૃચંદ્રસુરીશ્વરજી મહારાજના  
લધુબંધુ યત્તિવર્ય શ્રી કલ્યાણચંદ્રજી.



જનમ સં. ૧૯૨૩,  
યુતિદીક્ષા સં. ૧૯૩૮ જેડ સુદ ૬ માંડલ.  
સ્વર્ગવાસ સં. ૧૯૭૪ ભા. વ. ૧૪ વિરમગામ.  
જેએ કવિ ને કળાકુશળ હતા, તથા સત્પવ્યમન નિષેધક  
સુષેધસંઘના કર્તાં છે.



જાનભંડારે:- પાટણુ, ખંલાત, ઝીકાનેર, જેસલમેર, વગેરેના પ્રાચીન જાનભંડારોને જેઠ સારી રીતે અનુભવ મેળવી પ્રવીષુ થયા હતા. તેમજ અમદાવાદ, ખંલાત વગેરે સ્થળે જાનભંડારો કર્યો-કરાવ્યા.

**કાળધર્મ;**- ઈત્યાદિ અનેક ઉપકારો કરી, છત્રીસ વર્ષ સુધી દીક્ષા પાળી, છ વર્ષ સુધી આચાર્યપદ હીપાવી સં. ૧૬૭૨ ના વેશાખ વદ ૮ ની રાતે અમદાવાદ શામળા-નીચેણમાં પોતાનું પર વર્ષ, ત માસ અને ૨૮ દિવસનું સર્વ આચુ પૂણું કરી સમાધિ પૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા.

### આચાર્યશ્રી ભાતૃચંદ્રસૂરીક્ષરજી

શ્રીપુનમ-	શ્રીજગત-	શ્રીસાગર-	શ્રીપ્રસાદ-	શ્રીજયશિ-	શ્રીકેશરી
ચંદ્રલુગણી	ચંદ્રગણી	ચંદ્રસૂરિ	ચંદ્રજી	ખરજી	ચંદ્રજી
શ્રી	શ્રી	શ્રી	શ્રી	શ્રી	શ્રી
શ્રી	શ્રી	શ્રી	શ્રી	શ્રી	શ્રી



શાંતમૂર્તિ શ્રીપુનમચંદ્રજી ગણિવરનું

## કુંક જીવન ચરિત્ર

ભારતભૂષણ પ્રાતઃસ્મરણીય આચાર્ય શ્રીભાતૃચંદ્ર-  
સૂરીશ્વરજી મહારાજના પદ્મમેલાવકુ પૂરો સુનિરાજ  
શ્રી પુનમચંદ્રજી ગણિવર થયા.

ધ્રાગંગા રાજ્યના તાબાના હુદાપુરે નામના ગામડામાં  
દશાશ્રીમાળી વણિક શેડ કરેશન નાથા રહેતા હતા. તેમને  
ચાર પુત્રો હતા-માનસંગ, જેઠાલાઈ, સુળજુભાઈ અને ચોથા  
કુમળશીલાઈ. તેમાં મુળજુભાઈને ત્રણુ પુત્રો હતા જેમના નામો  
દ્રાગંગાવનદાસ, ઠાકેરસી અને શીવલાલ હતા. પૂર્વના  
ધાર્મિકસંસ્કારેના સિંચનના પરિણામે આ કુદુંબ સુખપૂર્વક  
બ્રાહ્યજીવન વીતાવતું હતું. આપણા નિર્ણય ગુરુરાજ સ્વરૂપ  
શ્રી પુનમચંદ્રજી ગણિવર મહારાજનો જન્મ વિ. સં.  
૧૯૨૪ ના પોષ વદ પ ના રોજ શુલ બ્રહ્મયોગમાં થયો.  
અને તેમનું નામ ઠાકેરસી રાખવામાં આવ્યું. બ્રાહ્યજીવનની  
જરૂરીયાત મુજબ ગામડી નિશાળે લાઈ ઠાકેરસીએ એ ત્રણુ  
ગુજરાતી પુસ્તકો જેટલો અલ્યાસ કર્યો. અને તુરતજ વેપારમાં  
જેડાયા, વેપારના કામકાજ અંગે તેઓ ધ્રાગંગા અવારનવાર  
જતા આવતા હતા.

આમ વેપાર કરતાં કરતાં એક દિવસ હુકાનમાંની  
પેટીમાંથી ધીનો દીવો હંમેશા મુજબ કરવા માટે દીવાસળીની  
પેટી કેતાં તેમને સર્પદંશ થયો. પોતાના ગામ નજુક ઘોધાના

स्व. प. पू. योगप्रेमी निजानंदी गुणनिधि शांतमूर्ति-  
मुनिराज श्री १००८ श्री पुनमचंद्रजी गणी महाराज ।

नमस्तुङ्यं मुनीन्द्राय भ्रातुचन्द्रांश्चेविने ।



गुणगम्यगुणाधारा—याचालब्रह्मचारिणे ॥१॥

दद्याथीभाणी वाणीया, पिताशी भूषणभाई, भातुश्री सुंदरभाई  
जन्म वि. सं. १६२४ना पोए वह ५, गाम हुदापुर (ध्रांगध्रास्टेर)  
दीक्षा वि. सं. १६५४ना भागशर सुह १० गाम मेहीभाईर (कुर्छ)  
स्वर्गवास वि. सं. १६८० ना आसो वह २ भंगण, शामणानी  
पोण—अमदावाद.



સ્થાનકે લઈ જવામાં આવ્યા. જ્યાં ઉપગ્રાહ-મંત્રવિધિ વડે તેર ઉતારવામાં આવ્યું અને ઠાકેરભોભાઈને પુનર્જન્મ મળ્યો.

પૂર્વના સંસ્કારોથી વિલૂષિત થયેલા આત્માએ ગમે તેવા ખુણે જન્મવા છતાં પણ જીવનમાં ઝણક્યા વિના રહેતાજ નથી. તેએ હંમેશાં બીજાને અનુકર-ષ્ટીયરીતે પોતાનો વ્યાપાર ન્યાય-નીતિથી ચલાવનારા હોવા સાથે નાના-મોટા જીવો પ્રત્યે અનુકર્પા ધારણ કરનારા હોય છે. ઠાકેરસીભાઈને આમાં લેખાવી શકાય. એક સમયે ધ્રાંગદ્રા રાજ્યના માણુસો દુદ્ધાપરની નહીંએ મૃગનો શિકાર કરવા આવેલ ત્યારે ઠાકેરસીભાઈએ તેમને હિંસા કરવા દીધી નહિં. અને એ જીવદ્યાના પ્રતાપે પોતે પણ બચી ગયા.


એક સમયે તંદ્રાવસ્થામાં ઠાકેરસીભાઈને એવું સ્વર્ગનું આવ્યું કે ‘એ સુંદર કુન્યાએ આવી છે તે એક જમણો હાથ અને બીજુ ડાબો હાથ આવી એંચવા લાગ્યી. આ જેઈ ઠાકેરભોભાઈ જાગી ગયા. તેમણે ખૂબ વિચાર્યું અને જીવનનો પણ્ઠો ત્યાંથી થાય છે. ત્યારથીજ વૈરાગ્ય પર તેમની ઝિયિ થઈ અને અસાર સંસારના માયાવી બંધનથી ફૂર રહેવા નિર્ણય કર્યો. આર્યહેશના સર્વ સામાન્ય સંસ્કારોમાં પણ એ પરિબળ છે કે જે આજની કારમી અશાંનિત તેમજ ક્ષુદ્રવૃત્તિથી ઉત્પજ થયેલા ખોને ટાળે. જીવનમાં શાંતિ દૃષ્ટિનારાએ ધર્મનું

શરણું સ્વીકારવું જ રહ્યું. જે આત્માએ ધર્મને શરણે ગયેલા હોય છે તેએ કદાપિ ઈષાબુદ્ધિ સેવતા નથી પરંતુ જ્યાં સત્ય અને ન્યાયનું પદ્ધતિ હોય છે ત્યાં તે ઐસેછે. ભાગ્યશાળી ઠાકરસીભાઈ પોતાની ખુદ્દિ અનુસાર વિચારે છે કે આ સંસારમાં પદ્ધાર્થમાત્રમાં ભય રહેલો છે પરંતુ નિર્ભાય અનવાનું સાચું સાધન તો માત્ર શ્રીજિને શ્વરહેવોએ વારસામાં આપેલ સર્વવિરતિજ છે.

ઠાકરસીભાઈના માતપિતા સ્વર્ગવાસી થયા અને સંસારની અસારતા જણુતાં વૈરાગ્યભાવનાનું ભીજ વૃદ્ધિ પામતું ચાલ્યું. પ્રાંગધ્રાના શા. મૂળચંદ લાલજીના એ સુપુત્રો શા. હેવશીભાઈ અને ભીજ ગુલાખચંદભાઈએ અનુકૂમે સં. ૧૯૩૦ અને સં. ૧૯૩૮ માં શ્રીભાગવતીપ્રમન્યા અંગી-કાર કરેલી અને તેએ પાદીતાણું મુકામે ગુણવિજયજી અને હેવવિજયજીના નામથી વિચરતા હતા.

કુલહીપક ઠાકરસીભાઈનું ઝુદ્ય વૈરાગ્યભાવનાથી આત્મ-પ્રોત્સાહન અને હોાઈ તેએ ખણર મેળવી ઉક્ત મુનિરાજે પાસે ઘેર કદ્યા વગર પાદીતાણું ગયા તે વખતે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષનીજ હતી. સંસારને દુઃખમયમાનનારો દુઃખરૂપ કલને આપનાર માનનારો અને દુઃખની પર-પરાથી ભરપૂર માનવાવાળો ભવ્યાત્મા સંસારમાં હોય અને કોઈ કારણોસર વિરતિ ન આચરી શકે તોપણ એના હુદ્યનું દુઃખ પારાવાર હોય છે.

પ્ર. પા. શાંતમૂર્તિ મુનિરાજ શ્રી પુનમયંડળ  
ગણિવરની પાહુકા.



સ્વર્ગવાસ સં. ૧૯૮૦ના આસો વહ ૨ ને મંગળવાર  
શામળાની પોળ-અમહાવાદ.



ને વસ્તુને આત્મા હાનિકર માને તે છોડાય નહિં અને હિતકેવસ્તુ અહણું ન થાય ત્યાંસુધી સાચા સુખની માત્રિ અશક્ય છે આ વસ્તુને ડાકેરસીલાઈ યથાર્થ રીતે સમજતા હતા.

તેમના પાદીતાણું જવાના સમાચાર ઘેર ભળતાં તેમના ભાઈઓ શોધ કરતાં પાદીતાણું ગયા અને ડાકેરસીલાઈને ઘેર લઈ આવ્યા. પરંતુ યોઢાક દીવસના સહવાસમાં પણ તેઓ પોતાના આત્મહિતાર્થે રોજ રાત્રે ચોનીહાર, જવારે નોકારશી કે પોરશી પચ્ચાણું, દર વખે કાર્તિકી પુનમે શ્રીસિંહાચલલાની યાત્રા, નહિંતો ધીનો ત્યાગ, અધ્યાર્થ પાલન અને અવસરે દીક્ષા લધશ વગેરે નિયમો ધારતા ને અમલમાં સુકૃતા લાગ્યા.

ગામગાળા નિવાસી સ્વઠ૦ પારેખ લલ્લબાઈ રામજ સાથે ડાકેરસીલાઈને ગાઠ મિત્રતા હતી. શ્રી પારેખ ધર્મના રાગી અને શ્રીજ્ઞાવાનું હતા. ડાકેરસીલાઈએ લલ્લબાઈને પોતાનો વિચાર જણ્ણાંયો કે કોઈ યોગ્ય સારા ગુરુ મળે તો પોતાનો વિચાર દીક્ષા લેવાનો છે.

જ્યારે સં. ૧૯૫૩ ની સાતમાં પૂઠ પાઠ મુનિરોજ શ્રીજ્ઞાતૃચદ્રણ મહારાજ પ્રાંગમા જતાં ગાળા સુકામે પધાર્યો ત્યારે ધર્મભિત્ર લલ્લબાઈએ ડાકેરસીલાઈને ગાળા તેડાવી શુરુ સમાગમ-પરિચય કરાયો. ડાકેરસીલાઈનું મન

ઠથું અને પોતાના વિચાર પૂર્ણ ગુરૂદેવ સમક્ષ રણુ કર્યો. તુરતજ એ વિચારને અનુમોદન આપતાં પૂજયશ્રીએ જણાયું કે સારા કાર્યોમાં સો વિધો આવી પડે છે તો તેને શીક્ષ પતાવવું એ યોગ્ય અને ધર્મમાં રક્ત અનેલા આત્માએની ક્રેષ છે, જે આત્માને પુણ્યયોગે સહગુરુનો લેટો થાય તે તેની સેવાથી વંચિત કેમ રહે? ડાકેરસીલાઈ પૂજય ગુરૂદેવ સાથે પ્રાંગંગા. અને ત્યાંથી હળવદ ગયા. તેમના ભાઇઓને લાગ્યું કે ડાકેરસી જરૂર દીક્ષા લઈ દેશે એટલે તેઓ હળવદ જઈ પુનઃ ડાકેરસીને ઘેર લઈ ગયા. ગુરૂ મહારાજે કહ્યું કે 'તમારા ભાગ્યમાં દીક્ષા યોગ હોવાથી પરિપક્વ કાળે તમને તે રેતન પ્રાપ્ત થશે. માટે હાલ ઘેર જાઓ. અને હું કરછીમાં જઉં છું ત્યાં અવસરે આવજો.'

બહુજખિની હૃદયે અને નિરાશાથી તેઓ પોતાના બંધુઓ સાથે ઘેર તો ગયા પરંતુ તેમનું મન તો પૂજય ગુરૂદેવ તરફ હતું. ડાકેરસીલાઈને ઘેર આવ્યા પછી કોઈ કામમાં ચેન પડતું નહિં. અને એ વાત સાચી છે કે જ્યાંસુધી હિતકારી માર્ગનો સ્વીકાર ન થાય ત્યાંસુધી સરયગુરુજિટ આત્માએં જરૂરીને બેસી શક્તા નથી.

સં. ૧૬૫૩ નું પૂજય ગુરૂદેવનું ચાતુર્માસ કર્ચ મોટી ખાખરમાં થયું, ડાકેરસીલાઈનું દિલ ઉપડયું અને કર્ચ જવા રવાના થયા. હુદાપરથી પ્રાંગંગા ત્યાંથી વઠવાણ જઈ ગાડીમાં બેસી જામનગર, તુણાખંડર અને અંલાર પહોંચ્યા.

પ્ર. પા. ગુરુહેવ શ્રી પુનમચંદ્રજી ગણિવરના  
શિષ્યરત્ન શ્રી કૃપાચંદ્રજી મહારાજ.



જન્મ : સ. ૧૯૨૭

જન્મસ્થાન - ખાડા ( કચ્છ )

હીક્ષા સ. ૧૯૬૨ માગશર સુદ ૧૧ ( કોડાય કચ્છ )

લેખો આરિત્રશીલ, ભાદ્રિક અને આત્મારી છે.



ત્યાંથી ઉઠ ઉપર ઐસી દેશલપુર ગયા ત્યાં રાત રોકાઈ ત્યાંના શેડ હેવસી કુરપાળ સાથે બીજે દિવસે ત્યાંથી એક ગાઉ દ્વાર મોટી ખાખર પધાર્યો. ઠાકેરસીલાઈ પૂજય ગુરુદેવની નિશ્ચામાં અસ્યાસ કરવા લાગ્યા. એ વખતે પૂજય ગુરુદેવ શ્રી ભગવતીલસૂક્તનું વાંચન કરતા હતા. ઠાકેરસીલાઈ કે જેમની ઉંમર અત્યારે ૩૦ વર્ષની હતી તેઓ વિદ્યાધ્યયન કરવામાં મળ્ણ રહેતા. આમ યોગ્યતાએ પહેંચતાં સં. ૧૯૫૪ ના માગશર સુદ ૧૦ ને ગુરુવારના રોજ ભારે ધામધૂમ અને મહેત્સવપૂર્વક શ્રી ચતુર્વિંધ સંઘની હાજરીમાં ઠેરઠેર નિમંત્રણપત્રિકાને માન આપી પધારેલા શ્રીસંઘના સમુદ્દરય વચ્ચે શુલ્ક સુહૂરેં ઠાકેરસીલાઈને શ્રીલાગવતીપ્રમણ્યા પ્રદાન કરી તેમનું નામ શ્રીપુનમચંદ્રજી રાખવામાં આવ્યું.

જેમ સંસારી જીવો મનવાંચિછત ઇણ મળતાં આનંદને પામે છે, મેધના આગમનથી જેમ મયૂર મસ્ત બને છે તેમ ભાગ્યશાળી આત્માએ જીવન સાર્થકતાની પળનો સહઉપયોગ થયે પોતાને ધન્ય માની હર્ષિત બને છે.


હીક્ષા બાદ ખાલાયુદ્ધાચારી મુનિરાજ શ્રીપુનમચંદ્રજી મહારાજ દરરોજ એકાસણું કરતા અને બપોરના નિયમિત બે કલાક સુધી સૂર્યના તાપને જીવતાં એંકાર મંત્રનો જપ કરતા હતા. પૂજય ગુરુદેવ સાથે રહેવાથી આ સરળસ્ત્વભાવી મુનિરાજમાં પણ ગુરુદેવના ગુણો એતપ્રોત થવા લાગ્યા. અને

થોડા સમયમાં તીવ્ર ખુદ્ધિબળ વડે સાધુના આવરણકુ  
કિયાના સૂત્રો, દશવૈકાલિક, જ્વવિચાર, નવતર્ત્વ,  
દંડક, લધુસંધ્યણી, મોટી સંધ્યણી, ક્ષેત્રસમાસ,  
કર્મચંથ, વૈરાગ્યશતક, સિદ્ધરપ્રકર, સાધુવંદના,  
છંદો, ગૌતમસ્વામી રાસ આહિ પુસ્તકો કંઠાચ કરી તેનું  
અધ્યયન કરતા. મીડા જગથી જેમ વેલડીએ વૃદ્ધિ  
પામે છે તેમ સુગુરુના સહકારથી મુનિરાજ શ્રીપુનમ-  
ચંદ્રજીની આત્મશક્તિએ વિકસે છે.

તેઓશ્રી ગુરુદેવની સાથે કંચ્છ, કાઠીયાવાડ, શુજરાત,  
મેવાડ, મારવાડ આહિ તીર્થસ્થળોએ વિચરતાં મહા પૂજય-  
ઉપાજીન કરવા લાગ્યા. તેઓશ્રી દ્યાળુ ને ભીલનસારે  
સ્વભાવવાળા હોવાથી લોકોમાં વિદ્વાનોમાં અને સર્વ-  
જીનોમાં માનવંત સ્થાન લોાગવતા.

પૂરો સુરો શ્રી કુશલચંદ્રજી ગણી કે જેમને મુનિરાજ  
પર ખૂબ ઉપકાર હતો તે તેઓશ્રી કેમ ભૂલી શકે? સં. ૧૯૬૬ના  
ભાદ્રવા સુદ ૧૦ મે પૂરો શ્રીકુશલચંદ્રજી ગણી અને સં. ૧૯૭૨ ના વૈશાખ વદ ૮ મે આચાર્યશ્રી ભાતુચંદ્રસૂરોશ્વર  
રૂપી એ સૂર્ય અને ચંદ્રના અસ્તથી કમળ અને કુસુદની જેમ  
સ્વર્ગવાસના સમાચાર સાંલળી મુનિરાજ શ્રીપુનમચંદ્રજીની  
થઇ. પરંતુ એથી બીજે ઉપાય નહોંતો. સુરિષ્યો હંમેશાં  
ગુરુદેવની સાનિધ્યમાં રહેવા માટે તેમના જીવનમાંથી  
ઉત્તમ ઐધપાડ લઈ તેને પોતાના જીવનમાં ઉતારે છે.

૫૦૫૦ મુનિરાજ શ્રી પુનમચંદ્રજી ગણિવરના વ્યાખ્યાન  
 કુશળ શિષ્યરત્ન ૫૦૫૦ મુનિરાજ  
 શ્રી બાલચંદ્રજી મહારાજ સાહેભ.



જન્મ સં. ૧૯૫૩ જેઠ વહ ૧૩. જન્મસ્થાન મંતુપુર [સિદ્ધપુર]  
 દીક્ષા સં. ૧૯૭૦ માગશર સુદ ૬ ને યુધવાર [અમદાવાદ]  
 નેચોની વૈરાગ્યવાહિની દેશનાને પરિણામે અનેક સ્થળે ભવી  
 આત્માએ યુઝયા છે. અનેકો ધર્મભાર્ગમાં સ્થીર થતા જય છે.  
 તેઓશ્રી વ્યાખ્યાન કુશળ હોવા ઉપરાંત કાંયો રચવાની શક્તિ  
 ધરવે છે.



આવા ગુરુ અને શિષ્યનો સંયોગ આ કાળે મળવો અતિ દુર્લભ છે.

૫૦ ૫૦ ભારતભૂષણ શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના સ્વર્ગવાસ ખાદ સંઘાડાના નાયક મુનિરાજ શ્રીપુનમચંદ્રજી ગણેશી મહારાજ થયા અને સર્વે સાધુ-સાધ્વીઓ તેઓશ્રીની આજામાં હતા. ગુરુદેવ એક ગ્રામ્ય જીવનમાં ઉછરેલા સામાન્ય વ્યક્તિ છતાં ગુણાનુરાગ અને શ્રી જિનેશ્વર દેવો પ્રરૂપિત ધર્મના આલંબનને વળગી રહેતાં કેવા ઉચ્ચ અને પૂજ્ય સ્થાને પહોંચ્યા તે ઉપરથી આપણે જીવનમાં ધડો લેવો જોઈએ.

ચાતુર્માસોની યાદી જેતાં માલુમ પડી આવે છે કે પૂજ્ય ગુરુદેવે ૧૦ ચોમાસા-અમદાવાદ, ૫ ચોમાસા-ખંભાત અને ૭ ચોમાસા કચ્છમાં કર્યાં છે. કુલ ૨૭ ચાતુર્માસો થયાં છે. તે જુઓ પેજ ૧૩૩ માં છે.

તેઓશ્રી ૨૬ વર્ષ, ૧૦ માસ ને ૨૦ દિવસ ગૃહસ્થા-વસ્થા, ૨૭ વર્ષ, ૧૦ માસ ને ૭ દિવસ દીક્ષા પર્યાય. કુલ આયુષ્ય ૫૬ વર્ષ, ૮ માસ ને ૨૭ દિવસ પુરં કરી સં. ૧૬૮૦ ના આસો વદ ૨ ને મંગળવારે દિવસના પોતાના ગુરુદેવની જે કાળભૂમિ તે અમદાવાદમાં શ્રી શામળાની પોળના ઉપાશ્રયમાં સમાધિપૂર્વક આ દેહથી આત્મા છાડી પરલેાં સિધાંયો. અમદાવાદના શ્રીસંદે ગુરુદેવની લક્ષ્મિ-સુશ્રૂષા એટલી સુંદર રીતિયે કરી કે ઠેરઠેરથી તેમના પર પ્રશંસાના પુણ્યો વેરાવા કાગ્યા.

આસો વહ ઉ ને ખુધવારે સવારે ગુરુદેવને જરીયાનની પાલખીમાં બિરાજમાન કરતાં શ્રાવક-શ્રાવિકાનો મોટો સમૃદ્ધાય અગ્નિ સંસ્કાર માટે હુદેશ્વરની ભૂમિ તરફ 'જથજથ નંદા જથજથ લદા'ના ખુલંદ અવાને ગજવતા લઈ ગયા. અમદાવાદના શ્રીસંઘે આ કારણે અફૂાઈ મહેત્સુવ કર્યો અને લારે ધામધૂમથી ગુરુદેવની સ્મૃતિ હૃદયમાં કાયમ કરી.

પૂજયશ્રી પોતાની પાછળ એ શિષ્યો સુકતા ગયા છે જેમાં એકનું નામ શ્રી કૃપાચંદ્રજી છે તથા ખીળ શ્રી આલચંદ્રજી છે કે જેઓએ ગચ્છમાં વિદ્ધતા અને વક્તૃત્વશક્તિ માટે માનનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

### નાનાનાના

બાલબ્રહ્મચારી શ્રીપુનમચંદ્રજી ગણિવરના

જીવનનો દુંક સારાંશ.

જન્મસ્થાન :—હુદાપુર ( પ્રાંગમણા સ્ટેટ )

જન્મ :—સં. ૧૯૨૪ના પોષ વહ ૫

પિતાનું નામ :—શા. મૂળજીબાઈ કરસન નાથા

માતાનું નામ :—સુંદરબાઈ

જ્ઞાતિ :—દશા શ્રીમાણી વણ્ણિક

દીક્ષા :—સં. ૧૯૫૪ માગ. સુ. ૧૦ ગુરુવાર મોટીખાખર (કચ્છ)

ગુરુનું નામ :—આચાર્યશ્રી ભાતુચંદ્રસૂરિજી મહારાજ

**અભ્યાસ :-** ષડાવશ્યક-સાધુદીયાના સૂત્રો, જીવવિચાર, નવ-તત્ત્વ, દંડક, લઘુસંધયણી, મોટીસંધયણી ક્ષેત્રસમાસ, કર્મશ્રંથ વિગેરે પ્રકરણો, દશપૈકાલિકસૂત્ર, કર્મછત્રીસી, આનંદધનચીવીશી, પ્રસ્તાવિક શ્વેષા-હુહાઓ, સિદ્ધર-પ્રકરાદિ સુલાખિતકાવ્યો, બાસઠમાર્ગણ્ણાદ્વારયંત્ર, આરાધના, ભાવત્રિલંગીયંત્ર, વૈરાગ્યશાટક, ગૌતમસ્વામી-રાસ, સાધુવંદના, છંદો, સ્તવનો, સ્તુતિઓ, સજાયો વિગેરે વિવિધ શાઓ.

**ધર્મશાસ્કવાંચન :-** ઉપાસક દશાંગ, ઉત્તરાધ્યયન, જાતાધર્મકથા, ભગવતીળનું ધીજક, ભગવતીળનો આલાવો, વિપાકસૂત્ર, આચારાંગસૂત્ર, અણુત્તરોવવાઈ, નંદીસૂત્ર, તંડુલવેયાલિયપ-, યજો, ચઉસરણુ પથનો, વંગચૂલિયા, બારસાસૂત્ર વગેરે આગમો. ચાણુકયરાજનીતિ, સંખોધસિત્તરી, દાનકલપદ્રુમ (ધન્યચરિત), મહીપાલનૃપચરિત, યશોધરચરિત, મુનિપતિ ચરિત, કુર્માપુત્રચરિત, સુસદ્યચરિત, વિજ્યચંહકેવલિયરિત, જંખુસ્વામીચરિત, સુદર્શનાચરિત ( સમજીવિહાર ), શ્રીપાલચરિત, ચિત્રસેન પદ્માવતીચરિત, ષટ્પુરુષચરિત, વગેરે જીવન ચરિતો. એકવિશતિસ્થાન, અભયાદિકુલક, છ આરાના ધૂટા ખોલ, રત્નસંચય, સમ્યકૃત્વકોમુદ્રી, દાનરીલત-તપલાવસંવાદનાં ઢાળીયા, વૈરાગ્યપચીસી, રત્નાકરપચીસી, સંવિજસ સાધુસમાચારી કુલક, શાલિબદ્રના શ્વેષા, પરમાનંદ પચીસી, ઉપહેશમાળા, ક્ષેત્રવિચાર ( અઠીદ્વીપવિચાર ), પવીકુથાસંગ્રહ, ભવભાવના, ભાગ્યત્રય, કર્મશ્રંથયંત્ર, અહૃદંયાખ્યાન, પુરાણુશાસ્કૃતસારસંગ્રહ, કુલુંકભવ-

વિચાર, નવસમરણુ, તત્ત્વજ્ઞાનતરંગિણી, તીર્થોંકર વખ્ચિદાન સ્તત્વન, દૃપચંદ્રલુકૃત હોડરાશતક, વિહુરમાન એકવીશ ઠાણુ, જિનપ્રતિમાસ્થાપનાદ્વિપંચાશિકા, નેમ રાજુલ દ્વંડા, શત્રુંજ્યરાસ, નારચંદ્ર જ્યોતિષ, ચાર ધ્યાનનો વિચાર, વર્ધ્માનહેશના, ઉપહેશ રત્નકોષ, યોગવિધિ, ગૌતમ-પૃથ્વી ધર્ત્યાદિ સ્વમત-પરમતના સિદ્ધાંતો વગેરે વગેરે

**વિહાર :-**કુચ્છિ, કાઢિયાવાડ, આલાવાડ, ભાલ, ગોહિલવાડ, વઢીયાર, ગુજરાત, મારવાડ, મેવાડ વગેરે પ્રદેશોમાં ઉથ વિહાર કરી અનેક લભ્યલુચોને ધર્મમાં લીન કર્યો. તેમજ લભ્ય નરનારીઓનો ઉદ્ધાર કરી હીક્ષાઓ આપી જૈનશાસનનો વિજ્યદ્વંજ ઝરકાવ્યો.

**ચમત્કાર કૃતિઓ :-**ગામ ગાળા અને ફુદાપુરની નહીમાં પાણી પીવા આવતા હરણોનો શિકાર કરવા માટે ધ્રાંગધ્રારાજ્ય તરફથી આવેલ માણુસોને શિકાર નહિ કરવા હેવા સંબંધી અને આ ઉપરાંત બીજા પણ ધણુા ચમત્કારે લભ્યાતમાઓના જેવામાં આવેલા. ધન્ય છે એવા તપોબ્ધણશાળી મુનિરાજને !

**સાહિત્યસેવા :-**૫૦ પૂછ શાંતમૂર્તિં શ્રીકુશલચંદ્રલ ગણુવરનો સ્વર્ગવાસ થતાં શ્રીકુશલચંદ્રલ ગણી વિરહ, પંચપ્રતિ-કુમણુસૂત્ર (ચીથી આવૃત્તિ), પોસહ વિધિ, પૂજાસંઘ, સજાયસંઘ વગેરે બુકો પૂજયત્રીના સહૃપહેશથી પ્રસિદ્ધ થઈ છે અને દશવૈકાલિક સૂત્ર, જીવવિચારાદિ

પ્રકરણો વગેરે અનેક થંથોને લખાવરાવી ઉદ્ઘાર કર્યો—  
કરાવ્યો. આમ જાનાચારની પૂણું આરાધના કરી.

**શિષ્યો :- ૧. પાટવીશિષ્ય .મુનિરાજ શ્રીકૃપાચંદ્રજી**

**૨ લધુશિષ્ય , , શ્રીબાલચંદ્રજી**

**તપ્સ્યા :-**—પંચમહાત્મતપ, પંચપરમેષ્ઠિતપ, શાન-દર્શન-  
ચારિતપ, અષ્ટકર્મસૂદનતપ, દશવિધ યતિધર્મતપ,  
ચૌદ્ધર્વતપ, જાનપંચમીતપ, અષ્ટમહાસિદ્ધિતપ, વીસ  
સ્થાનકતપ વગેરે અનેક તપસ્યા કરી પૂજયશ્રીએ કર્મને  
જજીરીભૂત કર્યાં હતાં.

### ચાતુર્ભાસો—

સં. ૧૬૫૪ સુથરી (કર્ચ)	,, ૬૭ પાલનપુર
,, ૫૫ અંનર ,,	,, ૬૮ માંડલ
,, ૫૬ વીરમગામ	,, ૬૯ અમદાવાદ
,, ૫૭ અમદાવાદ	,, ૭૦ અંલાત
,, ૫૮ અંલાત	,, ૭૧ મોટીખાખ : (કર્ચ)
,, ૫૯ કોડાય (કર્ચ)	,, ૭૨ નવાવાસ ,,
,, ૬૦ નાનાભાડિયા ,,	,, ૭૩ અમદાવાદ
,, ૬૧ ખાડા ,,	,, ૭૪ અંલાત
,, ૬૨ અમદાવાદ	,, ૭૫ અમદાવાદ
,, ૬૩ અંલાત	,, ૭૬ બીકાનેર(સારવાડ)
,, ૬૪ ઉદ્યપુર (મેવાડ)	,, ૭૭ અમદાવાદ
,, ૬૫ અમદાવાદ	,, ૭૮ ,,
,, ૬૬ અંલાત	,, ૭૯ ,,
	,, ૮૦ ,,

**કાળધ્રમ્:**—ઇથિાદિ સ્વ-પર-ઉપકાર કરી ૨૬ વર્ષો, ૧૦ માસ ને ૭ દિવસ સુધી દીક્ષા પાળી, સં. ૧૯૮૦ ના આસો વહ ર ને મંગ-ગવારે અપેણે એવાગે અમહાવાદ-શામળાની પોળમાં પોતાનું ૫૬ વર્ષો, ૮ માસ ને ૨૭ દિવસનું સર્વાયુઃ પૂર્ણ કરી સમાધિપૂર્વક કાળધ્રમ્ પામી સ્વર્ગવાસી થયા.



( માલિનીછંડ )


ભજત ભજત ભવ્યાઃ ! પૂર્ણચન્દ્રાનુ મુનીન્દ્રાનુ,  
સ્ફુરદુરુસુવિવેક—ક્ષાન્તિસદ્ભાવગણ્યાન् ।  
નમત નમત શીং વન્દ્યપાદારવિન્દાનુ,  
સ્મરત ધરત ચિત્તે સદ્ગુણશ્રેणિમાલામુ ॥  
જયતુ જયતુ ભવ્યા-મ્ભોધિચન્દ્રૈકરુપઃ ,  
કુમુદતત્ત્વિકાસં નિષ્કલંકોऽનિઃ તન્વનુ ।  
વિમલનિજગુણૌઘૈ-હૃલ્લાદયનુ સચ્ચકોરાનુ,  
દદતુ દદતુ નિર્દો-ષોઽમલં બોધિરત્નમુ ॥



० ..... ०

० ..... ०

શ્રી પરમપૂજયોપકારી આચાર્યશ્રી ૧૦૦૮ શ્રીભાતૃચંદ્ર-  
સૂરીશ્વરળના શિષ્ય તપસ્વી મુનિરાજ  
શ્રીજગતચંદ્રજી ગણિવર મહારાજ.



જન્મ સં. ૧૯૩૫ હેશંકપુર (તા. સુરા-કંઠ)  
હીંકા સં. ૧૯૪૫ ફા. વહ ૧૦ અંબાર (કંઠ)  
સ્વર્ગવાસ સં. ૧૯૬૭ વૈ. સુર ૪ ઉનાવા



તપસ્વી મુનિરાજ શ્રી જગતચંદ્રજ ગણ્યિવરનું

## કુંક લિવન ચરિત્ર


કરુછ દેશમાં ભુંદરા તાએ દેશલપુર ગામે રાયસીલાઈ અને નેણુખાઈ નામે ધર્મદંપતી પોતાની સ્થિતિ અનુસાર ધર્મપ્રવૃત્તિમાં મઝ રહેતા હતા. શ્રીપાર્શ્વચંદ્રગચ્છિના વિક્રાન મુનિરાજેના અવારનવાર થતા ચાતુર્માસો દરમ્યાન આ ધર્મદંપતી આત્માની આરાધના માટે શક્ય તેટલું કરવા ચુક્તા નહિ. સં. ૧૬૮૫ની સાલમાં નેણુખાઈએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. પુત્રના લક્ષણ્ય પારથુમાંથી તેમ આ ભાવક ધ્યાનધીમે વયને પામતાં તેજસ્વી અને કાંતિકારી જણાવા લાગ્યો. માતાએ એનું નામ હંધુલાઈ પાડ્યું. હંધુલાઈ પૂર્વના પુષ્યોદયે ધાર્મિક સંસ્કારથી રંગાવા લાગ્યા અને વ્યવહારિક કેળવણી સામાન્ય રીતે ચેળવી વધુ ચિત્ત તો ધાર્મિક કેળવણી અને ગુરુગમ પરતેજ હતું. દેશલપુરમાં પધારતાં પૂરો મુનિરાજેની સુશ્રૂષા-વૈચારચ્ચ કરતા હતા. આમ ગુરુહેદોની સેવા કરતાં કરતાં ઉમર થતાં એમનું મન વૈરાગ્ય તરફ ફળતું ગયું. માતપિતાદિ સમક્ષ પોતાનો મનસુષો જાહેર કર્યો કે પોતે સંસારની અટવીમાં અટવાવા માગતા નથી પણ પરેાપકારી શ્રીતીથેંકર પરમાત્માએ જગતના કલ્યાણ માટે દર્શાવેલ ત્યાગમાર્ગે જવા માગે છે.

આ સમય દરમ્યાન પૂરો પાઠ સ્વરૂપ આચાર્ય મહારાજ શ્રીભાતૃચંદ્રસૂરીશ્વરજ મહારાજનો પરિચય થયો. ગુરુ-

દેવની વૈરાગ્યવાહિનીદેશના અને ચારિત્રનો પ્રલાવ એમના પર પડ્યો. સરેળ આત્માઓ સાચા ગુરુને જોઈ પોતાના આત્માનું યથાશક્તિ સાધુન કરી લેવા ચુક્તા નથી. તેવીજ રીતે પોતાના વડિલોને આમજનો સમક્ષ હુદુલાઇએ પોતાનો મજ્જમ નિર્ણય જહેર કર્યો. અને સં. ૧૯૫૪ ના સુથરીના ચોમાસામાં ગુરુદેવ પાસે રહી ધાર્મિક અભ્યાસ કરતા ચોમાસુ ઉત્તરતાં માંડવી, મુંદરા, લદ્રેક્શર વગેરે ગામોમાં વિચરતાં ગુરુદેવની સાથે અંનાર આવ્યા ત્યાં કાગળ વદ ૧૦ ના દિવસે સં. ૧૯૫૫ની સાલમાં બાલપ્રદ્ધયારી શ્રીહુદુલાઇએ ૨૦ વર્ષની યુવાન વચે ધામધુમપૂર્વક શ્રી ભાગવતી પ્રત્યજ્ઞા અંગીકાર કરી અને સુનિ જગતચંદ્રજી નામ રાખવામાં આવ્યું. અને એ સાલનું ચાતુર્માસ અંનારમાંજ થયું.

એંતાલીસ વર્ષના લાંબા દીક્ષા પર્યાય દરમ્યાન પૂરો સુન શ્રીજગતચંદ્રજી ગણી મહારાજે ધર્મશાસ્ત્રાનું ચોગ્ય અદ્યયન મનન કર્યું. તપશ્ચર્યાએ પણ સારા પ્રમાણમાં કરી અને પૂરો પાઠ ગુરુદેવની સેવા-સુશ્રુષા એવા ભાવથી કરી કે જેથી તેઓ સ્વરૂપ ગુરુદેવના ખૂબ પ્રિય બની રહ્યા. તેઓ શ્રીએ પૂરો પાઠ ગુરુદેવ સાથે અને ગુરુદેવના સ્વર્ગવાસ બાદ વડીલ ગુરુલાઇ ૫૦ પૂરો સુનિરાજ શ્રી પુનમચંદ્રજી ગણિવરની આજામાં રહી મારવાડ-કર્ચિ-કાઠિયાવાડ ને ગુજરાતમાં અનેકવિધ સ્થળોએ ચાતુર્માસો કરી ભાવ્યાત્માઓને ધર્મમાર્ગમાં જોડ્યા છે. અનેકની શાંકા-કુશાંકાઓનું પોતાના વિદ્વતાલર્યા શાસ્ત્રોક્તા જ્ઞાન વડે નિવારણ કરી સન્માર્ગમાં જોડ્યા હતા.

૫૦ ૫૦ ખાલથિયારી તપસ્વી મુનિરાજ શ્રી  
જગતચંદ્ર ગણીના શિષ્ય



તપસ્વી મુનિ શ્રી અમીચંદ્ર મહારાજ.



૨૪૦ શુરૂદેવ શ્રી ભાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજના અંતિમ માંદગીના સમય દરમયાન અમદાવાદ સુકામે સ્વો શુરૂદેવની જે લક્ષ્મિલાવ-વિનયપૂર્વક સેવા-સુશ્રુષા કરી તે અને તેવા આજ અનેક ગુણોને શ્રી સંવ આજે પણ થાડ કરે છે.

તેઓશ્રી છેલે માંદગી વધી પડતાં પાટણ સુકામે પ્રવત્તક શ્રી કાંતિવિજયજીની નીશ્રામાં કેટલોક સમય રહ્યા. ત્યાં ઔષધિક ઉપયારો કરવામાં આવ્યા અને કાળધર્મ પામ્યા નેના એ હિવસ અગાઉજ તેઓશ્રીનો વિચાર ઉનાવા સુકામે જવાનો થયો. અને સુ. શ્રી. વિદ્યાચંદ્રજી અને શ્રી લાભચંદ્રજી સાથે ઉનાવા સુકામે આવી પહેંચ્યા. ત્યાંના શ્રી પાર્શ્વચંદ્રગચ્છના લાઈઓએ લક્ષ્મિપૂર્વક ઉપયારો કર્યો પરંતુ એ બધા કારગત નીવડ્યા નહિ અને સં. ૧૯૬૭ ના વૈશાખ સુદ ૪ ના રોજ બપોરના સમયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રીના કાળધર્મના સમાચારથી શ્રીસંધમાં ગમગીનીની ભારે લાગણી પ્રગટી નીકળી કારણ સ્વો આચાર્યદેવ શ્રીમતુ સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજનો વિરહ સાતતો હતો. લ્યાં પૂઠ સુઠ શ્રીજગતચંદ્રજીના મહારાજના કાળધર્મથી ભારે આધાત થયો.

૨૪૦ સુઠ શ્રીજગતચંદ્રજીના મહારાજ કાળધર્મ પામ્યા છે છતાંથે તેઓશ્રીના અનેકવિધ ગુણો હંમેશા આપણી વર્ણે રહેશે અને શ્રીસંધને પ્રેરણા આપશે.



## ખાવાળના જીવનનો ટુંક સારાંશ.

૭૪-મરથાનઃ:-હેશલપુર (તા. સુરા કચ્છ)

૭૫-મૃ :-સં. ૧૬૩૫

પિતાનું નામઃ:-રાયસીલાઈ

માતાનું નામઃ:-નેણુગાઈ

જ્ઞાતિ :-વીશા ઓસવાળ

દીક્ષા :-સં. ૧૬૪૫ ના ઝા. વ. ૧૦, અઝર (કચ્છ)

ગુરૂનું નામઃ:-આચાર્ય શ્રીભાતુચંદ્રસુરિલુ મહારાજ

અલ્યાસુઃ-સાધુના આવશ્યક કિયાના સૂત્રો, જીવવિચાર,  
નવતાત્પ, દંડક, લધુ-મોટી સંઘર્ષણી, ક્ષેત્રસમાસ,  
કર્મશ્રંથ વગેરે પ્રકરણો.

વિહાર : -કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ મેવાડ વગેરે  
દેશોમાં વિહાર કરી લવિજનોને લાભ આપ્યો.

શિષ્યો :-૧ પાટવી શિષ્ય મુનિ શ્રીઅમીચંદ્રજી  
૨ લધુ શિષ્ય „ લાલચંદ્રજી

કાળધર્મ : -ઇલાદિ સ્વ-પર ઉપકાર કરી ૪૨ વર્ષ, ૧ માસ  
ને ૬ દિવસ સુધી દીક્ષા પાળી સં. ૧૬૬૭ ના વૈશાખ  
સુદ ૪ ને ખુધવારે (ઉંઝ) ઉનાવામાં પોતાનું ૬૨ વર્ષ,  
૧ માસ ને ૬ દિવસનું સર્વ આયુ; પૂર્ણ કરી સમાધિ-  
પૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા.


૫૦ પૂછો બાળઅભિયારી શાસ્ક્રપારગામી આ. મ.  
સાગરચંદ્રસૂરિધરજીના શિષ્ય



મુનિ શ્રી વિદ્યાચંદ્રજી મહારાજ.



૫૦ ૫૦ બાલઅળચારી તપસ્વી મુનિરાજ  
શ્રી જગતચંદ્રજ ગણુના શિષ્ય



મુનીશ્રી લાલચંદ્રજ મહારાજ.



ભાવશ્રમચારી શ્રી સાગરચંદ્રસૂરીકૃતજીનું

## દુંક જીવનચરિત્ર

સ્વ૦ લદ્દારક ચારિત્રયુડામણું વીતરાગશાસનના અણુનમ અંડાધારી મદાન પુરુષપુંગવ આચાર્ય શ્રીમહ્દ્રાતૃચંદ્રસૂરીકૃતજીમહારાજની પાટે સ્વ૦ આચાર્યશ્રીસાગરચંદ્રસૂરીકૃતજીથયા. પૂર્ણિમાની પ્રકાશિત રાત્રે દરિયાના પાણી પર પ્રકાશ પડતાં જેમ સાગર હેલે ચઢે છે તેમ સ્વ૦ આચાર્યશ્રીજીની વિદ્ધતા સંબંધમાં થરેલ પ્રગતિ વિષે કહી શકાય. સ્વ૦ આચાર્યશ્રીએ ખાદ્યવયમાં શ્રીલાગવતીપ્રવળયા અંગીકાર કરી. દુંક સમયમાં અદ્યયન ને મનન ક્ષારા જે જ્ઞાન મેળગ્યું તેનો વિકાસ એટલો સમૃજ્ઝપણે સાધ્યો કે એ જ્ઞાન હંમેશાં લોકોને શાસન પ્રત્યે આકર્ષણું સમાન નીવડયું. લક્ષ્મીના ખજનાને તો માણુસ બહુ છુપીરીતે સંતાડી રાખે છે. કોઈ ન જણી જય તેની એ બહુ પરવાહ રાખે છે પણ આ જ્ઞાનનો ખજનો એવો છે કે જેને કોઈ હુંટી શકતું નથી અને જેમ જેમ એ બંડાર લવ્યાત્માઓના હિતાર્થે ખાલી થાય છે તેમ તેમ તેમાં વૃદ્ધિજ થતી રહે છે. સ્વ૦ આચાર્યશ્રી એનું સાચું પ્રતિક છે એ એમના જીવનમાંથી આપણુંને મળી આવે છે.

કુચ્છ પ્રદેશમાં આવેલ નાના ભાડીયા ગામે શા. ધારસીભાઈના ઘેર સં. ૧૯૪૩ ના શુભ ચોધડીએ માતા તનમાઈની કુલ્લિથી ખાગણો જન્મ થયો, તેનું નામ


શામજી રાખવામાં આવ્યું. શામજીને નિશાળે મૂકવામાં આવ્યો અને ગુજરાતી પાંચ ચોપડીનો અભ્યાસ કર્યો. માતાનો વિચોગ પર્યો, પિતાએ કંઈ-માંડવીમાં એક પાઠશાળામાં શામજીને લણુવા મૂકેલા.

૫૦ પૂછ સુનિરાજ શ્રીભ્રાતૃચંદ્રજી મહારાજ સં. ૧૯૫૫નું ચોમાસુ ઉત્તરતાં અંભારથી અનુકૂળે વિહાર કરી લુજ અને ત્યાંથી માંડવી પદ્ધાર્યો ત્યાં ૫૦ પૂછ શાંતમૂર્તિ શ્રીકુશલચંદ્રજી ગણ્યિવર જિરાજમાન હતા. તેઓશ્રીને પ્રેમથી લેટ્યા અને ગુજરાત તરફ વિહાર કરવાની આજા મેળવી તે સમયે માંડવીમાં લણુતા શામજીને ગુરુદેવનો લેટો થયો. શામજીએ પોતાના પિતાશ્રીની રજ લઈ ગુરુદેવની સાથે સં. ૧૯૫૬ ની સાલમાં ગુજરાત તરફ પ્રયાણ કર્યું. અને સં. ૧૯૫૭ ની સાલનું ચાતુર્માસ અમદાવાદમાં થયું. ત્યાંથી અનુકૂળે ગુરુદેવ ખાલીત પદ્ધાર્યો. ત્યાં પોતાની પાસે વિદ્ધાધ્યયન કરતા શામજી-લાઈને હીક્ષા આપવાનું મુકરર કર્યું. એ માંગલિક પ્રસંગ પર અહૃાઈ મહોત્સવ શરૂ કર્યો અને સં. ૧૯૫૮ ના મહા સુદ ૧૩ ના દિવસે ચતુર્વિધસંઘની હાજરીમાં ગુરુરાજે હીક્ષા હીધી ને હીક્ષિતનું નામ સુનિ સાગરચંદ્રજી રાખ્યું.

પૂછ પાઠ ગુરુદેવની સાન્નિધ્યમાં રહી હીક્ષાકાળનો કેટલાક વર્ષો સુધીનો કાળ ધાર્મિક અભ્યાસ, મનન અને અધ્યયન પાછળ ગાય્યો. સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ, આગમાદ્િ શાસ્ત્રોના અભ્યાસમાં તીક્ષ્ણ ભુંઝી અને નિયારથાધ્યશક્તિ

૫. પા. આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ બાતુચંદ-  
સૂરીધરજી મહારાજના વિક્રાન શિષ્યરલ સ્વ.

બાલશ્રદ્ધાચારી પુ. આચાર્ય  
શ્રી સાગરચંદ્રસૂરીધરજી મહારાજ



જન્મ : સં. ૧૯૪૩

દીક્ષા : સં. ૧૯૫૮

આચાર્યપદ : સં. ૧૯૯૩

સ્વર્ગવાસ : સં. ૧૯૯૪



વડે સારી રીતીયે દિનપ્રતિદિન પ્રગતિજ કરતા રહ્યા. પછી તો પૂઠ પાઠ શુરૂ હેવની નીશ્રામાં લક્ષ્માજનોને વ્યાપ્તયાનવાણી સુણાવતા અનેકના દિલોને ધર્મજળથી છંટકારવા લાગ્યા. વાણીમાં મધુરતા અને મૃહુતા હતા. શાસ્ત્ર વાણીના પ્રવાહની અગંડધારા ચાલી અને થોડાજ વર્ષોમાં જૈન-જૈનેતરોની પ્રશંસા મેળવી લીધી. પૂજ્યશ્રી પોતાના વડીલખંધુ ૫૦ પૂઠ સુનિરાજ શ્રીપુનમચંદ્રજી ગણિવરની આજામાં રહેતા હતા. અને પૂજ્યશ્રી વિદ્ધાન હોઈ વડીલખંધુ પણ તેમનું સારુ માન સાચવતા હતા. ૫૦ પૂઠ તપ્યાની સુનિરાજ શ્રી જગતચંદ્રજી ગણિવરે પણ પૂજ્યશ્રીની સારી સેવા ઉઠાવેલી. તેમોશ્રીના ચાતુર્માસો—

સં. ૧૬૫૮ ખંભાત	,, ૬૮ અમદાવાદ
,, ૫૯ વઢવાણ શહેર	,, ૬૬ પ્રાંગંધ્રા
,, ૬૦ વીરમગામ	,, ૭૦ અમદાવાદ
,, ૬૧ અમદાવાદ	,, ૭૧ ખંભાત
,, ૬૨ ખંભાત	,, ૭૨ અમદાવાદ
,, ૬૩ અમદાવાદ	,, ૭૩ ખંભાત
,, ૬૪ ઉદ્યપુર (મેવાડ)	,, ૭૪ અમદાવાદ
,, ૬૫ જેધપુર(મારવાડ)	,, ૭૫-૭૬ બીકાનેર
,, ૬૬ બીકાનેર	,, ૭૭ અમદાવાદ
,, ૬૭ અમદાવાદ	,, ૭૮ વીરમગામ
સં. ૧૬૭૬ ભાડીઆ શ્રી ભગવતીસૂત્ર વાંચન	
,, ૮૦ મોટીખાખર	,, ,

,, ૮૧	અમદાવાદ		
,, ૮૨	ખંલાત		
,, ૮૩	મોટીખાખર શ્રી લગ્નવતીસૂત્ર વાંચન		
,, ૮૪	ભાડીઓ	„	„
,, ૮૫	પ્રાંગધ્રા	„	„
,, ૮૬	અમદાવાદ		
,, ૮૭	„		
,, ૮૮	ખંલાત	„	„
,, ૮૯	„	„	„
,, ૯૦	અમદાવાદ		
,, ૯૧	„	„	„
,, ૯૨	„	„	„
,, ૯૩	માંડલ	„	„
,, ૯૪	„	„	„
,, ૯૫	પ્રાંગધ્રા	„	„

આ દરેક સ્થળોએ સંઘે તરફથી ભારે આદર સત્કાર થયો હતો. અને વ્યાખ્યાન વાણીના પ્રભાવથી જૈન જૈનેતરો, વિદ્ધાનો, અધિકારીઓ, વિ. પર સારી અસર નીપળું હતી. તેઓ પૂજ્યશ્રીની સાનિધ્યમાં વધુને વધુ નજીક આવવા લાગ્યા અને આત્મહિતની પ્રવૃત્તિમાં લીન બનતા ગયા.

સં. ૧૯૮૫ ની એ સાલ હતી જ્યારે કચ્છમાંથી રણ ઉતરી માણીઓ ગામે પધાર્યો. ત્યાંના શ્રીસંઘે ભાવ્ય સ્વાગત કર્યું. અને તેઓશ્રીએ ‘માનવધર્મ’ ના વિષય ઉપર વ્યાખ્યાન

આચ્યુ. પૂજયની પ્રશંસા એકજ દિવસમાં પ્રચલિત થતાં ત્યાંના દરખાર સાહેબ, મે. દિવાન સાહેબ અને અધિકારી વગે પણ વાણીનો લાલ લીધો હતો. પૂજયશ્રીએ રાજધર્મ અને પ્રજધર્મ વિષે સચોટ શૈલીમાં પ્રવચન કરી ધાર્મિક ઉત્તેના કાર્યમાં રાજ-પ્રજના સહકાર વિષે સતત ઉપદેશધારા વહેતી મુક્કી હતી. પરંતુ એ લાલ વધુ સમય કેવાઈ ન શક્યો. અને પૂજયશ્રીને વિહાર કરવાનો હોઈ સૌ કોઈના દિવિમાં રંજ પેઢા થયો.

માળીયાથી વિહાર કરી ચાતુર્માસ માટે પ્રાંગધા પધારતાં રસ્તામાં જમકંડોરણું ગામે મુકામ કર્યો. ત્યાંના વિક્રાન મેળુસ્ટ્રેટ સાહેબ અને શ્રાવકોએ પૂજયશ્રીના ઉપદેશનો સારો લાલ ઉઠાવી અનેક જાતના પ્રત નિયમો શહુણું કરી એક યાદ તાજ રાખવા ઉધમી બન્યા.

ત્યારખાદ ચાતુર્માસ નજીક આવતાં પુ. સુનિરાજ શ્રીસાગરચંદ્રજી મહારાજે ભારે ધામધુમપૂર્વકના સામૈયા-ક્રારા પ્રાંગધામાં પ્રવેશ કર્યો. અતે શ્રી ભગવતીજીનું વાંચન કરાવવામાં આવતાં અન્ય ગચ્છ ઉપરાંત સ્થાનકવાસી સમુદ્ધાયના વિક્રાન ગૃહસ્થો મળી એટલી સંખ્યામાં વ્યાખ્યાન સાંભળવા જનતા આવવા લાગી કે ઉપાશ્રયનો વિશાળ હોલ ચીકાર ભરાઈ જતો. પાછળથી આવનારને તો ઉભા રહેવું પડતું.

શ્રી ભગવતીજ જેવા મહાન કઠીન આગમનું વાંચન તેઓશ્રી એટલી સરળ અને સાહી ભાષામાં કરી રહ્યા હતા

કે એકદેથી ધુંટનાર પણ તે સહેલાઈથી સમજુ શકે. સ્થાનક-વાસી અગ્રેસરોને પ્રક્ષોના પ્રત્યુત્તર આપી મૂર્તિપૂજાનું વિધાન સાથીત કરતી સચોટ શ્રદ્ધા ઉત્પત્ત કરાવી હતી. આ વર્ષ દરમ્યાન શ્રીસંધમાં સ્વામીવાત્સલ્ય, પ્રભાવનાદિ કાર્યો સારા પ્રમાણુમાં થયા હતા.

સં. ૧૯૮૮ અને સં. ૧૯૮૯ ના ચાતુર્માસો ખંલાત મુકામે જેવેરી દલપતભાઈ ખુશાલચંદ અને અન્ય આગેવાનોની સાચ્છડ વિનિતિથા થયાં.

આ ચાતુર્માસ દરમ્યાન ખંલાતમાં શ્રીલગવતીસૂત્ર વાંચન સરળ શૈલીથી શરૂ થયું. શ્રીપાર્વીચંદ્ર ગચ્છ-સંધના તેમજ અન્ય ધર્મરસિક ભાઈઓનો સારા પ્રમાણુમાં લાલ ઉઢાવવા લાગ્યા અને શાસ્ત્રોક્ત પ્રવચનના અંકેણાને ટકાવી રાખવાના ઉપરે માત્રથી ખીજું ચાતુર્માસ સાચ્છડ વિનિતિ કરીને રાખવામાં આવ્યા. આ સમયે અન્ય ગચ્છમાં કેટલાક ખોટી લાગણીઓથી કદાચહી બનેલાઓને ઉપરેશ અને સમજકારા સન્માગે જોડ્યા જેઓ હજુ પણ એ ઉપકારને ભૂલતા નથી. શ્રીસંધની કૃતિ અને જહોજલાલીમાં વધારો થયો. ધાર્મિક કાર્યો, તપશ્ચર્યાઓ વિગેરે સારા પ્રમાણુમાં થયા.

તે પછીનું રાજનગરનું ચાતુર્માસ પૂજયશ્રીના નામ સાથે હંમેશને માટે જોડાઈ રહે એવા એક મહાન કાર્યમાં પોતાનો યશસ્વી હીસ્સે આપીને જૈન જનતાને તેઓશ્રીની વિક્રતાથી મુંઘ કરી દીધી હતી. આજપૂર્વે તેઓશ્રીની વિક્રતા પંકતાં

પણ સીધો સંસર્ગ તો અમદાવાદ મુકામે કેટલાક ચર્ચાસ્પદ પ્રશ્નો જેવા કે હેવડાય, દીક્ષા વિગેરે પર સર્વાનુમતે નિર્ણય કરવા માટે એલાવવામાં આવેલ શ્રી અભિલ ભારતીય જૈન શ્રી. મૃ. પુ. સાધુ સંમેલન સમયે થયો. નગરશૈઠ શ્રી કસ્તુરભાઈ મહેનીભાઈ કેઓએ આ સંમેલન અનેક જહેમતે મેળાયું તેઓ તરફથી શ્રીપાર્થ્યદ્રસૂરિગંધિના મુનિરાજે પૂરો શ્રી જગત્યદ્રશ્ય ગણી મહારાજ અને પૂરો શ્રી સાગરચંદ્રજી મહારાજ વિઠ ને આમંત્રણ કરવામાં આવ્યું. અને સ્વરૂપ પૂરો આચાર્ય મહારાજ શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજની વિદ્ધા, ચર્ચા કરવાની પ્રશાસનીય રીત જેધને તેઓ શ્રીને શ્રીપાર્થ્યદ્રસૂરિગંધિના પ્રતિનિધિ તરીકે પ્રથમ જર ની અને પછી ઉત્તો ની કમીટીમાં નીમવામાં આવ્યા. દિવસો સુધી ઉપરોક્ત પ્રશ્નો પર ચર્ચાએ ચાલી. તેમાં સ્વરૂપ આચાર્ય મહારાજે રસપૂર્વક સુંદર લાગ લાગ્યો. છે એટલુંજ નહિ પણ કેટલીયે બાબતોમાં તટસ્થ તરીકે એમનાં સલાહ-સૂચનો કિમતી થઈ પડ્યા છે એમ એ સંમેલનમાં હાજરી આપનારા અનેક પૂરો આચાર્યાદિ મુનિરાજેના સુખેથી સંખળવામાં આવ્યું છે. અને છેવટે જે સુખ્ય નવની કમીટી નિયુક્ત કરવામાં આવી તેમાં પણ પૂજ્યશ્રી એક હતા. એજ બતાવી આપે છે કે તેઓ શ્રીની વિદ્ધાની જે કિમત ગૃહૂસ્થો આંકતા તેટલીજ કિમત અન્ય ગંધિના વિદ્ધાન આચાર્યાદિ મુનિરાજે પણ આંકતા હતા. આ સંમેલને પદૃકર્દ્યે કરેલા ઠરાવો પર સ્વ. આચાર્યશ્રીનો ઝોર છાપ હતી અને ભારત વર્ષના જૈનસંઘના દ્વારે એ પદૃકો પહોંચી પણ ગયા હતા. આમ

પૂજયશ્રીની ખ્યાતી હિંદના ચારે ખૂણુમાં ફેલાવા સાથે અન્ય સહધમીઓનું આકર્ષણું વધ્યું. આ સંમેલને પછુકડ્ઝે કરેલા ઠરાવોનું હાલ થથાર્થ પાલન નહિ થવાથી જ્યારે ખૂમ પડી રહી છે ત્યારે સ્વ. આચાર્યદેવ જેવા સ્પષ્ટ વક્તાની ઓટ સાલે છે.

લારયધી સં. ૧૯૬૧-૬૨ ના ચાતુર્માસો પણ રાજ-નગરમાં શામળાની પોળના ઉપાશ્રેયે થયાં. આ અન્ને ચાતુર્માસ દરમ્યાન શ્રીસંધની સાથે ક વિનંતીને પરિણુંમે શ્રી લગવતીસૂત્રનું વાંચન રાખવામાં આવેલ. એનો લાભ શ્રીસંધના અન્નેસરે. અને સૌ કોઈ લેવા લાગ્યા. પ્રત-નિયમો અને તપશ્ચર્યા, સાધમિંક વાત્સલ્યો. વિ૦ સારા પ્રમાણુમાં થયા.

પૂજયશ્રીને આચાર્યપદારોપણ કરવાની શ્રીસંધની ભાવનાએ મૂર્તિસ્વરૂપ ધારણું કર્યું. આથી આ વાત રાજનગરના શ્રીસંધે પૂર્ણ સાગરચંદ્રજી મહારાજ વિહાર કરે તે પહેલાં આચાર્યપદ અર્પણું કરવા મછ્જમ નિર્ધાર કર્યો અને અંદુાઈ મહેત્સવ દરમ્યાન આચાર્યશ્રી વિજયવલલભસૂરીશ્વરજીના વિદ્ધાન પ્રશિષ્યરતન આચાર્યશ્રી વિજયઉમંગસૂરિજીના હસ્તે સં. ૧૯૬૩ ના જેઠ સુદ-૪ ના રોજ શુલ્ક મુહૂર્તે-મંગળમય ચોધડીયે આચાર્યપદ અર્પણું કરવામાં આવ્યું. આ ઉત્સવમાં ભાગ લેવા માટે માંડલ, ખંભાત, પ્રાંગધા વીરમગામ વિ૦ સ્થળોએથી ગચ્છના અન્ને અન્ય સસુદ્ધાય સારી સંખ્યામાં ઉતરી પડ્યો હતો. શ્રી શાસન-દેવ-કી જ્યના નાદોથી ઉપાશ્ર્યનું વિશાળ ચોગાન માનવમેદનીથી ઉલરાઈ

૫૦ ૫૦ બાળખલયારી આચાર્ય  
શ્રી સાગરચંડસુરીશ્વરજી  
મહારાજની પાદુકા.



સ્વર્ગવાસ : સં. ૧૯૬૫ ના ભાદરવા વહ ૪  
ક્રાંગદ્રામાં સ્વર્ગવાસ થયા પછી રેતીમાં  
પડેલી પાદુકા.



ગયું હતું. ચોમેરથી પૂજયપાદ આચાર્યદેવ નાણુને ફેરા ફરતાં અક્ષતઉછાગવામાં આવ્યા હતા. આમ આ દિવસથી મુનિરાજ-શ્રી સાગરચંદ્રજી મહારાજ પૂરો પાઠ આચાર્યશ્રી સાગર-ચંદ્રસૂરીશ્વરજી મહારાજના નામથી સંખેધાયા.

પૂરો પા. ભારતભૂષણ આચાર્ય શ્રીમહુ ભાતૃચંદ્રસૂરી-શ્વરજી મહારાજ અને પૂરો પૂરો મુનિરાજ શ્રીપુનમચંદ્રજી-ગણ્ણિવર મહારાજશ્રીના કાળધમે પછી અદ્વપસંખ્યા ધરાવતા આ ગચ્છમાં જે થોડાક સાધુરતનો છે તે પૈકી આચાર્યશ્રી સાગર-ચંદ્રસૂરીશ્વરજી મહારાજ જુદાજ તરી આવતા હતા. વ્યાખ્યાન વાણી દ્વારા એમણે વ્યાખ્યાન વાચયસ્પતિનું બિદ્દ સ્વયં ગ્રાતું હતું. સારા માણુસોના જીવન હંમેશાં દુંકા કેમ ન લખાયા હોય એમ પૂજયશ્રીની બાખતમાં પણ બન્યું.

સંવત ૧૯૬૩-૬૪ના ચાતુર્માસો માંડલના શ્રીસંઘની વિનંતિથી ત્યાં થયા અને શ્રીભગવતી સૂત્રની શાખધારા અસ્થલિતપણે ચાલતાં જૈન-જૈનેતર જનતાએ તેનો સારો લાલ ઉઠાવ્યો. વોરાશ્રી મોહનલાઈ જીવરાજ અને અન્ય અશ્રેસરોએ પૂજયશ્રીની સેવા-સુશ્રુષા એટલી સુંદર રિતિયે ઉઠાવી અને આ ચાતુર્માસો દરમ્યાન ધર્મપ્રલાવનાના એવા કાર્યો થયા કે જેની જવહૂંત જયોત હંમેશાં જળહળતીજ રહેશે.

માંડલના ચાતુર્માસ ખાદ તેઓશ્રીની તથીયત લથડી. વિહાર કરી પ્રાંગમા પધાર્યો. ત્યાં ગયા ખાદ તથીયતે ધીમે-ધીમે ઉથલો ખાયો. શ્રીસંઘે તથીયત વધુ ગંભીર લાગતાં પૂજયશ્રીને પ્રાંગમા રાજ્યની હોસ્પિટલમાં ઉપચાર અર્થે

રાખવામાં આવ્યા. રાજ્યની હોસ્પિટલના વડા તથીઅ, અન્ય ડેક્ટરો અને તેઓના સ્ટાફ્ પૂજ્યશ્રીની સુશ્રુષા-ઉપચાર વિ૦ બહુજ કાળજીપૂર્વક કરવા માંડ્યા. પરંતુ ઘડીમાં તડકો ને ઘડીમાં છાંયડાની જેમ તથીયત ઠીક-અઠીક અને ચિંતાજનક હેખાવા લાગી. પૂજ્યશ્રીના દેહની સુખસાતા પૂછવા માટે બહારગામથી શ્રીસંધના ભાઈએનો આવવા લાગ્યા. તેઓના લોજન વિ. ની વ્યવસ્થા પ્રાંગધાના શ્રી છોટાલાલભાઈ ડામરલાઈ અને અન્ય અગ્રેસરોએ સુંદરરીતે કરી હતી. પ્રાંગધાના શ્રીસંધના ભાઈએ ૮—૮ ની દુકડીમાં રાત ને દિવસલર પૂજ્યશ્રીની સુશ્રુષા-સેવા અથે હોસ્પિટલ ખાતે રહેવાનું નક્કી કરેલું અને તે સુજખ સુંદર લાસ ઉઠાવ્યો. પરંતુ કાળચકની ગતી કોઇથીયે અટકી નથી અને અટકે પણ નહિં. સં. ૧૯૬૫ ના ભાદરવા વઢી-૪ નો એ દિવસ હતો કે જે દિવસે શ્રી ગચ્છને શોકમગ્ન છોડી પૂરો પાઠ આચાર્યશ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજનો દેહ આત્માથી છુટો થયો. અને તેઓશ્રી પંચત્વને પામ્યા. આ દિવસ પ્રાંગધાના શ્રીસંધ અને ગચ્છના અન્ય શહેરોના સંધ માટે બહુ વિકટ ને કપરાદિન તરિકે નોંધાઈ રહેશે. સારાયે પ્રાંગધા શહેર પર શોકની છાયા પ્રસરી રહી હતી. તે દિવસે અમદાવાદ, વીરમગામ, ખાંલાત, માંડલ વિ૦ સ્થળોએ તાર કરેલા. ત્યાંથી ધણ્ણા ભાઈએ ખીજે દિવસે આવી પહોંચ્યા હતા. પાંચમને દિવસે સુંદર અને સુશોલિત પાલભીમાં પૂજ્યશ્રીના મૃતહેઠને પધરાવવામાં આવ્યો. અને સેંકડો જૈન જૈનેતરોએ એ લખ્ય સમશાનયાત્રામાં ભાગ લીધ્યો. આગા

અનાજ અને પૈસાનું ગાડું હતું જે છુટા હાથે ઉડાડવામાં આવેલ અને જય જય નહા—જય જય લહા ના બુલંદ અવાજે વાતાવરણને વિશુદ્ધ કરતા ધૂપેના ગોરેગોટા ચાલતા હતા. રમશાનભૂમિ પર પાલખી ઉતારવામાં આવી અને ચંદનના લાકડાની ચિતામાં પૂજયશ્રીના દેહને પદ્મરાવી અમહાવાદના શા. મોતીલાલ છગનલાલે અનિનદાહનો લાલ લીધો. આ અંગે બીજુ નાની મોટી ટીક ટીક ઉપજ થઈ હતી. પૂજયશ્રીના દેહની રાખ થઈ અને સૌ શોકાતુર હૈયે સ્વગૃહે સિધાવ્યા.

આ સમાચારથી શ્રીપાર્શ્વચંદ્રગરછમાં દીલગીરીની ભારે લાગણી પ્રગટી નીકળી હતી. ધ્રાંગધાના ઉપાશ્રયમાં એક સ્થાને રેતી પાથરવામાં આવી હતી જ્યાં બીજે દિવસે શ્રીસંઘના ભાઈઓએ નીહાળતાં પૂજયશ્રીના કુમકુમ પગલાં પડેલા જેવામાં આવ્યાં જેનો ફોટો મોબિલ છે. પૂજયશ્રીના પ્રલાવિકારાનું આ પ્રતિક હતું. આમ શ્રી ગરછને પૂજયશ્રીના સ્વર્ગવાસથી ન પૂરાય એવી મહાન ખોટ પડી છે.


પૂજયશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે જુદા જુદા સ્થળોએ અફૂઅ મહોત્સવો કરવામાં આવ્યા અને રાજનગરના શ્રીસંઘે તો એ અફૂઅ મહોત્સવ અદ્વિતીયરીતે ઉજ્વયે. દિવસેની જહેમત બાદ સં. ૧૯૬૬ ના કા. ૧. ૧૩ ના રોજથી અફૂઅ મહોત્સવનો પ્રારંભ થયો. રોજ જુદી જુદી પૂજાઓ સુંદર રાગરાગણીમાં શ્રી હઠીસીંગ સરસ્વતી ભૂભાના ભાઈઓએ ભણાવી. કાંસીજેડાનો ખડખડાટ ને ખીલ વિધિ-વિધાને અજબ આલદાદ જમાવ્યો હતો. અફૂઅ મહોત્સવ

દરમ્યાન શ્રી પાવાપુરીજી શ્રી રત્નસાતું પર્વતની રચના ઉપાશ્રયના ઉપરના વિશાળ હોલમાં કરવામાં આવી હતી. રોશનીથી સાંઝે સ્થાન જળહળી રહ્યું હતું. રોતે ભાવનામાં તો રમાટ બોલતી. સંગીતરત્ન પ્રજ્ઞાચક્ષુ શ્રી ભાબુભાઈ અને અન્ય સંગીતકુશળ ભાઈઓએ પોતાની કળાની ઘીલવણી કરી આપાયે પ્રસંગને અનુપમ બનાવવાના શ્રીસંધના કાર્યમાં સુંદર ક્રાળો આપ્યો હતો. શહેરમાંથી અફાઈ મહેતસવ ની રચના જેવા માટે રોજ હજારો ભાઈખણોની ભીડ જામતી હતી. મંગળ ગીતો ગવાતા હતા અને આઠે દિવસો દરમ્યાન આ સ્થળે ખસ ધર્મના વાતાવરણની ધૂન લાગતી હતી. તેમાંથી શાંતિસનાત્રના દિવસે તો શહેરના તમામ સંભાવિત અશ્રેસરો અને જૈન જૈનેતરોએ દર્શાનનો અપૂર્વ લાલ લીધો હતો. શ્રીસંધના અશ્રેસરો આ કાર્યની પાછળ વેપાર ધંધા સામું જોયા વિના ખડે પગે ઉલા હતા. ચુવાન ભાઈ-ઓએ પણ વ્યવસ્થા સુંદર રીતે જળવવા માટે લારે જહેમત ઉડાવી હતી. સાધર્મિક વાતસહયો થયા હતાં. અને ખીજ અનેકવિધ ધર્મગ્રલાવનાના કાયો પૂજયશ્રીની પાછળ થયાં. એજ ખતાવે છે કે એ આત્મા પ્રત્યેની જનતાની અક્ષિત કેવી અપૂર્વ હતી.

પૂજયશ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજના જીવનમાંથી આપણે નીચેના તરવો તારવી શકીએ.

(૧) પોતાના જીવનકાળનો મોટો સમય અક્ષાસ, અધ્યયન અને મનન પાછળ ગાળી જાનને સારી રીતે ફોરવી

પ્રો. પાઠ આલાયકુમારી શાસ્ત્રવિશારદ આ. મ.  
શ્રી સાગરચંડ્રસૂરિશ્વરજીના શિષ્ય



મુનીરાજ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ.





અનેક આત્માઓને સન્માર્ગ દર્શન કરાવી શ્રી વીતરાગ માર્ગમાં દ્રઢ કર્યો હતા.

(૨) સંવત્સરીના ચાલતા ભતલેહો અંગે તેઓશ્રીએ એક પ્રશ્નોત્તરપ્રકાશ શ્રીભ્રાતુચંદ્રસૂરિ અંથમાળા રૂપે ખડાર પાડી ભાદરવા સુદી પંચમીની સંવત્સરી શાસ્કોક્તા છે એમ વિદ્ધતા વડે જિદ્ધ કરી ખતાવ્યું છે. એ વિષેના સચોટ લખાણો ઉક્ત પુસ્તકમાં મોજુદ છે.

(૩) સ્વ. આચાર્યમહારાજ વિદ્ધાન વક્તા ઉપરાંત કવિ-ત્વશક્તિ પણ સારા પ્રમાણુમાં ધરાવતા હતા જે તેઓશ્રીએ રચેલ ગુરુસ્તુતિએ, સ્તવનો અને સજાયો ઉપરથી જણાઈ આવે છે.

(૪) સ્વનું નૂતન દીક્ષિત કરવા માટે પરીક્ષા ને અભિપરીક્ષામાં માનનારા હતા તેથી તેઓશ્રીની વિદ્ધતાના પ્રમાણુમાં શિષ્યોની સંખ્યા ઓછી જણાશે. હાલ તેઓશ્રીના શિષ્યોમાં શ્રી વૃદ્ધિચંદ્રજી તથા શ્રી વિદ્ધાચંદ્રજી વિદ્ધમાન છે. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે ઠીકઠીક અસ્થાસ કર્યો છે. તેઓશ્રીને પોતાના આ ગુરુવર્યની ખોટ આજે ભારે સાલે તેમાં આશ્ર્ય જેબું શું છે ?


(૫) જે બહુજ થોડાના જીવનમાં જોવામાં આવે છે તે સ્પષ્ટવકૃત્વને પૂજયશ્રી વરેલા હતા. સાચું કહે લારે કેટલાકને લાગતું કે પૂજયશ્રીનો સ્વભાવ આકરો છે પણ વિચાર કરતાં ખાળું પણ કણુલ કરવું પડતું કે તેઓશ્રીનું કડવું કથન પણ

હિતકારી છે. સાચા ગુરુએ લક્ષોની એટી પ્રશાંસા કું આગપંપાળ કરનારા હોતા નથી પણ જે રૂપોટ લાગે તે રૂપોટ કહેનારા હોય છે.

(૬) પોતાના ગુરુવર્ય લદ્વારક આચાર્ય શ્રી ભ્રાતૃ-  
ચંદ્રસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ ખાદ પૂરો મુનિરાજ  
શ્રીપુનમચંદ્રજી ગણિષુવર મહારાજ તથા પૂરો મુઠો  
શ્રીજગતચંદ્રજી ગણિષુવર મહારાજ સાથે રહીને પૂજયશ્રી  
પોતાના વડીલ ગુરુભાઈએની અનુપમ સેવા-સુશ્રુષા વિનયાદિ  
સાચવતા હતા.

આવી મહાન વિલૂપ્તિને શ્રી પાંચ્ચિચંદ્રસૂરિગચ્છના  
નાયકો અને સહ્યો કેમ બુલી શકે. તેઓશ્રીની એટ આજે  
પણ સાલે છે.

તેમાંથે તાજેતરમાં પૂરો મુનિરાજ શ્રી જગતચંદ્રજી ગણી  
મહારાજ (ખાવાળ) ના સ્વર્ગવાસથી શ્રી ગચ્છને ખીજે ફુરકો  
પડ્યો છે. એક ધા રૂઝાયો નહોતો ત્યાં ખીજે પડ્યો છે.  
પરંતુ આટલા વિરહ અને વિયોગમાં પણ પૂરો વિદ્ધાન ને  
ક્રિયાપાત્ર મુનિરાજેનું જે નાનું ભંડાળ છે તેમાંથી લવિષ્યે  
માટો સમુદ્દરાય થશો એવી આશાસહ સ્વર્ગસ્થ આચાર્યદેવને  
અંજકી અપી તેમના આત્માને ચિર શાંતિ ઈચ્છી અને  
તેઓશ્રીનું જીવન અનેકને ધડાડ્ય નીવડો એવી ભાવના આવી  
આ ચરિત્ર સંપૂર્ણ કરીશું.



આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજીના જીવનચરિત્રનો

## કુંક સારાંશ

જન્મ :- સ. ૧૯૪૩, નાનાભાડીયા (કર્ણ)

પિતાનું નામ :- ધારસીલાઈ વીરજી

માતાનું નામ :- રતનખાઈ

જાતિ :- વીસા ઓસવાળ

દીક્ષા :- સ. ૧૯૫૮ મહા સુદ ૧૩, અંબાત

ગુરુનું નામ :- આચાર્ય શ્રી ભાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજ

અલ્યાસુ :- સાધુના આવશ્યક કિયાના સૂત્રો, જીવવિચારાદિ ખધા પ્રકરણો, પાણીનીય વ્યાકરણુ (સિદ્ધાંત કૌમુદી), રધુવંશાદિ ટાંબો, સાહિત્ય, કોશ, તર્ફ-ન્યાય, છંદ (પિગળ), જ્યોતિષ સંબંધી વિવિધ શાસ્ત્રો.

ધર્મશાસ્ત્રવાંચન :- દશપૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂયગડાંગ, ઠાણુંગ, સમવાયાંગ, ભગવતી વગેરે સૂત્રો, શાલિલદ્રચરિત્ર મહાકાવ્ય વગેરે મહાન પુરુષોના જીવન ચરિત્રો.

વિહાર :- ગુજરાત, કાઠિયાવાડ, મેવાડ મારવાડ કર્ણ, વગેરે પ્રદેશોમાં વિહાર કરી અનેક ભણ્યાત્માઓને દેશવિરતિ, સર્વવિરતિ ખનાવ્યા અને પ્રતિષ્ઠાએ કરાવી જૈનશાસનનો વિજયદેવજ કુરકાંબો.

**આચાર્યપદ** :- સ. ૧૬૬૩ ના જેઠ સુદ ૪ ને શનિવાર, સ્થળી અમદાવાદ-શામળાની પોળના ઉપાશ્રયમાં અહૃતી મહોત્સવપૂર્વક આચાર્યપદ એનાયત કરવામાં આવ્યું.

**સાહિત્યસેવા** :- શ્રી ભગ્નાગપુરીયતપાગચ્છની પદ્માવતી (પ્રથમાવૃત્તિ), શ્રી હેવસીરાઈ પ્રતિકુમણુ સૂત્ર (શાસ્ત્રી તથા ગુજરાતી), સ્તવન-સંઘર્ષ, પૂજા-સંઘર્ષ, પંચપ્રતિકુમણુ સૂત્ર (પંચમી આવૃત્તિ), સંજાય-સંઘર્ષ ભાગ ૧ લો, શ્રી શાનુંજ્ય તીર્થીદિ સ્તવન-સંઘર્ષ (ગુજરાતી તથા શાસ્ત્રી), ગુરુઅધ્યક્ષારી પૂજા (પ. શ્રીઆલમચંદ્રજી કૃત), ખાશ ભાવનાના તેર ઢાળીયા (પ. શ્રીવત્સરાજજી કૃત), સંક્ષિપ્ત ખાર પ્રતની ટીપ, મૌન એકાદશીનું દોદસો કલ્યાણુકનું ગણુણું, શ્રી જિનેન્દ્ર નમસ્કારાદિ સંઘર્ષઃ, જૈનરાસ-સંઘર્ષ ભાગ ૧ લો, શ્રી જિનેન્દ્ર ગુણુસ્તવન-સંઘર્ષ, સ્તવન-સંજાય-સંઘર્ષ, ધૂત્યાદિ પુસ્તકોના સંઘર્ષક તથા સંશોધક. સ્વાધ્યાય પ્રકરણુરતન ભાગ ૧ લો, તથા સસપહીશાસ્ત્રના સંપાદક તથા અનુવાદક. પ્રશ્નોત્તર-પ્રકાશ ભાગ ૧ લા, ખીજના લેખક અને ચૈત્યવંદનાદિ ચોવીશી (સ્તવનાદિ સંઘર્ષ) ના રચયિતા. આમ પૂજયશ્રીએ પોતાના પરમોપકારી ગુરુરાજના રમારક તરીકે આચાર્ય શ્રીભાતુચંદ્રસૂરિ અંથમાળા ચાલુ કરેલ તેનો આજ સુધીમાં છેલ્દો પ૪ મો મણુકો જોવામાં આવે છે. (તે હુમ્બવાર નહિ મળવાથી અહીં આપવામાં આવ્યા નથી.)

શિષ્યો : - પાટવી શિષ્ય સુનિરાજ શ્રી રાયચંદ્રજી  
 લઘુ શિષ્ય „ વૃદ્ધિચંદ્રજી  
 „ „ વિદ્યાચંદ્રજી

**કાળધૂમ્:** - ઈત્યાહિ સ્વ-પર ઉપકાર કરી ઉછ વર્ષ, ૭ માસ ને  
 ૬ દિવસની દીક્ષા પાળી, તેમાંના ૨ વર્ષ, ૩ માસ ને ૧૫  
 દિવસનું આચાર્યપદ લોગવી સં. ૧૬૬૫ ના ભાડવા  
 વદ ૪ થે ખ્રાંગધ્રામાં પોતાનું પર વર્ષ, ૭ માસ ને  
 ૬ દિવસનું સર્વ આયુ : પૂર્ણ કરી સમાધિપૂર્વક કાળધૂમ્  
 પામી સ્વર્ગવાસી થયા.




# શ્રી જૈન હઠીસીંગ સરસ્વતી સભા.

આદર્શ શિક્ષણ સંસ્થા.

૪૧૦ આચાર્ય શ્રીજ્ઞાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજના  
ઉપરેશતું પરિણામ.

શ્રી અને સરસ્વતી હેવીની કૃપાથી ઇલ્યા-પુલેલા ગુજરાતની ભૂમિમાં તેનું પાટનગર અમદાવાદ ઉદ્દેશ્ય રાજનગરે જૈનપુરી નામ ધરાવવા જેટલું મહત્વ પ્રાપ્ત કર્યું છે. ગુજરાતને આંગણે એટલા દાનવીરો, કર્મવીરો અને ધર્મવીરો પાક્યા છે કે તે ભૂમિ આજે જગમશાહુર બની છે. એવા ગુજરાતમાં આજે ધાર્મિક શિક્ષણ આપતી અનેક સંસ્થાઓ ચાલી રહી છે. ગુજરાતને શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે સાહિત્ય અને જ્ઞાનનો અમૃત્ય ખળનો આપ્યો છે. શ્રી વાદિહેવ-સૂરીશ્વરજી જેવાંને ન્યાયના અનેક અંશો જેના ચરણે ધર્યો છે. યુગપ્રધાન શ્રીમહ્ય પાચ્ચચંદ્રસૂરીશ્વરજી, શ્રી આણંદ-વિમલસૂરિજી જેવા કિયોછારક ગચ્છનાયકોથી જે ભૂમિ ઉજળી છે એ તેના કર્મયોગ વડેજ. આથીંક સંપત્તિ ધરાવનારા અનેક આત્માઓ આવી ગયા પરંતુ કિમત તો કર્મયોગીઓનીજ લેખવામાં આવી છે કે જેએઓએ પોતાના આત્માની શુદ્ધિ વડે અનેક ભવ્યાત્માઓને આ ભવસમુદ્ર તરવાનો માર્ગ બતાએયો. છે. અત્યંત પ્રાચીન સમયની વાત હ્યો અને જુઓ કે અહિંસા ધર્મના આધ્યાત્મિક યુગાદિહેવ શ્રી ડ્રષ્ટભદેવજી, નૈષિક અન્ધાર્યનો આદર્શ

શ્રી જૈન હરીસીંગ સરસ્વતી સભાના  
પ્રેસીડિન્ટ.



શ્રોદ હરીસીંગ રાયચંદ.

(શામળાની પોળ) અમદાવાદ.

અવસાન સં. ૧૯૫૮ના લાદરવા સુદ ૫



આપનાર યાદવ તીર્થંકર શ્રી અરિષ્ટનેમિજુ અને કર્મયોગને અપનાવી જગત સમક્ષ એક મહાન બોધપાઠ રજુ કરનાર ભગવાન શ્રી કૃષ્ણના પુરુષાર્થ વડે ધર્મભૂમિની ક્રિતિ આજીવણી સુવાસ આપી રહી છે. આ ખદ્યો પ્રતાપ ધાર્મિક જ્ઞાનનો હતો. જીવનમાં ધાર્મિક કેળવણી એ આવશ્યક વસ્તુ છે એમ જ્યારે સમજાય, તેના પ્રત્યે પ્રીતિ ઉત્પત્ત થાય લ્યારેજ તેનો વાસ્તવિક મર્મ આપણે સમજુ શકીએ.

પ્રત્યેક સમાજ, રાષ્ટ્ર અને ધર્મનો વિકાસ ભાવી પ્રજાના હાથમાં રહેલો છે. એ ભાવી પ્રજા જેટલી સમાજ પ્રિય, રાષ્ટ્રપ્રેમી અને ધર્મપ્રેમની જ્યોતથી વિલૂધિત થયેલી હોય છે તેરલો તે સમાજ, રાષ્ટ્ર ને ધર્મની ઉજ્ઝીવિ સાધ્ય બને છે. એથીજ આપણે બાળકોને બચપણુમાંજ સુભંસ્કારોનો વારસો આપવા અથેં ધાર્મિક કેળવણી તરફ હોરવા જોઈએ. કેળવણી એ જીવનમાં દીપક સમાન છે. આજે ઉમરે પહોંચેલા ચુવાનોને બોધ અસર કરી શકવા અસર્થ છે સિવાય કે તે વત્તમાન વાતાવરણની અટવીમાં અટવાયેલો ન હોય અને પૂર્વના અહુયોગો સારા હોય. આજનો ચુવાન વર્ગ તો વાતવાતમાં શાંકા-કુશાંકાએ ઉઠાવનારો અને દલીલો ખૂટે ત્યાં વિતંડાવાદ કરનારો માહુમ પડે છે. વર્ત્તમાન જગતનું વાતાવરણજ એલું છે કે ધાર્મિકતા તરફ એનું ધ્યાન લાગ્યેજ હોરાય છે. એટલુંજ નહિં પણ જરૂર પદાર્થીમાં એની આશક્તિ વધતી જાય છે. વળી જેઓ ઉમરે પહોંચેલા છે તેઓને પણ યોગ્ય માર્ગે લાવવામાં સુશકેલી છે. ત્યારે એક બાધ્યવર્ગજ

એવો છે કે જેને બગ્યપણુમાંથી સુસંસ્કારોનો વારસો આપવો હોય તેવો આપી શકાય એમ છે. કુમળા ઝાડને જેમ વાળીએ તેમ બાળકો પણ માતાપિતાદિની આજા મુજબ વળે છે.

ધણા એવો પ્રશ્ન કરે છે કે બાળકો માથે આ બોલે શું ? તેઓ માગધી કે સંસ્કૃત ભાષાના સૂત્રો કંઠસ્થ કરવા હજુ ઉમર લાયક નથી પરંતુ તેઓ ભૂલી જાય છે કે બાળકને વય એજ સુસંસ્કારોના સિચન માટેની ચોંચ વય છે. આપણે બાળકોને ઉઠ કહીએ તો તે ઉઠે છે, બેસ કહીએ તો તો બેસે છે, હેરાસર લઈ જઈએ તો તે હંમેશાં આપણી સાથે આવે છે અને જે પ્રમાણે અદ્ભુત રાખવા કહીએ તે પ્રમાણે રાખે છે. તો શું એ ધાર્મિક કેળવણી કંઠસ્થ ન કરી શકે ? આપણા પૂર્વાચ્યોના દ્રષ્ટાંતો તરફ નજર કરો ન એમાંનો મોટો વર્ગ બાલ્યસંસ્કારથી મહાત્મા અને મહા-પુરુષની કક્ષામાં મુકાયેલો છે. વિઘમાન પૈકિ અનેક આચાર્ય મહારાજો અને મુનિરાજોએ બાલ્યવયમાં ધાર્મિક જ્ઞાન મેળવી સર્વવિરતિ અંગીકાર કરી છે. જૈન ગૃહસ્થને સંસારમાં રહેલું પડે તો પણ તે પોતાના ધ્યેય તરિકે તો હંમેશાં સર્વવિરતિનુંજ ચિત્તવન કરે. પરંતુ આજે માતપિતાદિ પણ પોતાના બાળકોનું લાલી વિસરવા લાગ્યા છે. ધાર્મિક કેળવણીને બોલ રૂપ માનવા લાગ્યા છે. અને બીજુ બાંજુ ચુવાન પ્રજલમાં સ્વતંત્રતાના નામે જે સ્વચ્છાંદ્તા પ્રસરી રહી છે, વિનય અને વિવેક, શિષ્ટાચાર ને સહયતા ભુલાયા છે તેથી

લમણે હાથ દઈ નિરાશાના નિજાસા નાંખે છે. પરંતુ જે એજ ચુવાનોને બાદ્યવયમાં હેવ, ગુડુ, ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉત્પજ કરે એવી કેળવણી આપી હોત તો આ દશા આવત ? એ પ્રત્યેક માતપિતાએ વિચારીને પોતાના આગંકે ધાર્મિક કેળવણી માટે પાડશાળાએઓ મોકલવા જેહાંએ. આજે ડેર ડેર ગુરુકુળો, વિદ્યાવિહારો છે પરંતુ એમાંથી સ્વધર્મને માટે ગૌરવ લઈ એનો વિજયદ્વજ ઝરકાવવા કેટલા નીકળ્યા એ તપાસીશું તો પરિણામ લગભગ કેાઈ અપવાહો સિવાય શુન્યજ જણુશે. આ સંસ્થાએની ભવ્યતા તેની સુંદર ધીમારતો પરથી નહિ પણ તેમાં ભણુતા વિદ્યાર્થીએની સંરક્ષારિતા પરથી આંકી શકાય છે.

આથી ધર્મમાં પ્રવેશ કરનાર, કરાવનાર અને તેમાં સહાયસૂત થનાર એ ત્રણે સહૃગતિના ભાગીદાર બને છે. આવી સહૃગતિના ભાગીદાર બનવા આજથી ૪૮ વર્ષો પૂર્વે શામળાની પોળમાં રહેતા શ્રી પાંચાંદ્રસૂરિગંધિના એક ધર્મશ્રેષ્ઠ શ્રી હઠીસીંગ રાયચંદ્રભાઈની જિજાસા તીવ્ર બનતાં સ. ૧૯૫૦ ના માગશર સુદ ૨ ના રોજ શ્રીસંઘના અન્ય ગૃહસ્થોના અનુમોદન સાથે અને સ્વ૦ ભરુારક આચાર્ય શ્રીમહદ્ધ્રાતૃચંદ્રસૂરીશ્વરજી જેવા મહાન ઉપકારી પુરુષના આશિર્વાદ સાથે ‘શ્રી જૈન સરેસ્વતી સલા’ નામની ધાર્મિક શિક્ષણ આપવા માટેની એક સંસ્થાની રાજનગરના આંગળે શામળાની પોળમાં સ્થાપના થઈ. શેઠશ્રી હઠીસીંગ-ભાઈની ઉદાર વૃત્તિ અને ગુરુ ઉપદેશના પરિણામે વૃદ્ધિને પામી.

આ સલા સાથે તેઓશ્રીનું નામ જોડાયેલું રહે એ માટે તેઓશ્રીના અવસાન ખાદ તેમની ઈચ્છાનુસાર તેમના વિધવા ધર્મપત્ની હરકુંવરભાઈએ નાદર રકમ આપી મહુંમની ઈચ્છા અને આશાને પરિપૂર્ણ કરી. સં. ૧૯૬૨ થી સંસ્થાનું નામ “શ્રી જૈન હઠીસીંગ સરેસ્વતી સલા” રાખવામાં આયું.

શરૂઆતમાં એ સલામાં દાખલ થનાર માટે સમર્પયસનોના ત્યાગને કરળાયત અનાવવામાં આવ્યો છે. કારણ જે આત્માઓ વ્યસની હોય એમનામાં ધીરે ધીરે એક પછી ભીજે ને ભીજા પછી ત્રીજે એમ અનેક જાતના દોષો દાખલ થાય છે. આજે ધાર્મિક કેળવણી પામેલા ધણ્ણાયે એવા છે કે જેમના જીવનમાં વ્યસને ઘર ધાલવાને પરિણામે તેઓ કોઈ આદર્શ રંજુ કરી શકતા નથી બલ્કે તેમની છાપ પડતી નથી.

આ સલાના દ્વિતીય વર્ષના રીપોર્ટ પરથી જણાય છે કે પ્રથમ નવકાર મંત્રથી ઉપરોક્ત સલામાં વિધાર્થીઓને અભ્યાસ શરૂ કરાવવામાં આવે છે અને જ્યારે આપણે એ રિપોર્ટમાં જોઈએ છીએ કે સં. ૧૯૫૧ ના ભીજા વર્ષમાં પ્રતિક્રમણ, જીવવિચાર, નવતાત્વ, દંડક, લઘુસંઘયણી, નવસમરણ વિ. નો અભ્યાસ ચાલે છે ત્યારે સહેજે લાગે છે કે આ સલાના વિધાર્થીઓ કેટલી લાગણી પૂર્વક અભ્યાસ કરતા હોવા જોઈએ કે એકજ વર્ષમાં તેઓ ધાર્મિક શિક્ષણની આટલી ઉચ્ચ કક્ષાએ જઈ રહ્યા છે. ત્યારખાદ માગધી અને

સંસ્કૃતના અફ્યાસની વ્યવસ્થા કરવા માટે એમાં જણાવવામાં આવ્યું છે અને તે માટે સં. ૧૬૫૮ની સાલથી એક વિદ્ધાન પંડિતને રોડીને વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સંસ્થાની હેડ કમીટી જેના પર સંસ્થાના નિષાબ -પાલન પોખ્યુ અને દૈખરેખનો છોંઝે હતો તેમાં નીચેના ગૃહસ્થો હતા.

૧ રા. રા. શેઠ હઠીસીંગભાઈ રાયચંદ્રભાઈ—પ્રેસીડેન્ટ	૧૮ „ પુણભાઈ હીરાચંદ્ર
૨ „ મનસુખરામ નાનચંદ્રભાઈ—વાઈસપ્રેસીડેન્ટ	પાધીલાલ
૩ „ બહેચરભાઈ કસ્તુરભાઈ વકીલ	
૪ શા. વાડીલાલ નગીનદાસ થાલીસહનાર	
૫ „ ઝલેચંદ્ર ડેવટચંદ્ર	૧૯ „ મણીલાલ દલસુખરામ
૬ „ મધ્યીલાલ દેવટચંદ્ર	૨૦ „ ચુનીલાલ અમીચંદ્ર
૭ „ ચુંબભાઈ હીરાચંદ્ર	૨૧ „ મનસુખરામ ઉમેદચંદ્ર
૮ „ નગીનદાસ કરભચંદ્ર	૨૨ „ હરિલાઈ મોતીચંદ્ર જેઠા
૯ „ પોચાભાઈ કેવળદાસ	૨૩ „ ખાલાભાઈ કુંવરજી
૧૦ „ નાગળભાઈ કુંવરજી	૨૪ „ વાડીલાલ હરગોવનદાસ
૧૧ „ વાડીલાલ કાળીદાસ	૨૫ „ સાંકળચંદ્ર પેમચંદ્ર
૧૨ „ કુરાભાઈ છગનલાલ	ભગત
૧૩ „ સાંકળચંદ્ર વિઠુલદાસ	૨૬ „ લલલુભાઈ શુલાખચંદ્ર
૧૪ „ મહાસુખરામ કાળીદાસ	૨૭ „ મોહેલાલ લલલુભાઈ
૧૫ „ ચુનીલાલ દીપચંદ્ર	પુણી
૧૬ „ વાડીલાલ મગનલાલ	૨૮ „ નાથાભાઈ લલલુભાઈ
૧૭ „ વાડીલાલ નગીનદાસ	૨૯ „ ભગુભાઈ મલુકચંદ્ર
પટ્ટવા	૩૦ „ છગનલાલ જથચંદ્ર
	૩૧ „ દલપતભાઈ પ્રેમચંદ્ર

ઉપરોક્ત ગૃહસ્થોમાંથી તેમજ ખીજ મળીને ૧૯ ગૃહસ્થાની એક સબ કમિટીની નીમળુંક કરવામાં આવી હતી જેમનાં સુભારક નામ નીચે પ્રમાણે.

૧ રા. રા. શા.	સોમાલાઈ ભગુલાઈ સેકેટરી અને ખજનચી.
૨ ,,	ખાલાલાઈમોકમચંદ જેઇન્ટ સેકેટરી અને ખજનચી
૩ ,,	સાંકળચંદ પીતાંખર- દાસ ડવિ
૪ ,,	મણીલાલ દોલતચંદ
૫ ,,	નથુલાઈ ઓતમદાસ
૬ ,,	નાથાલાઈ લલુલાઈ
૭ ,,	ચુનીલાલ અમથાસા
૮ ,,	વાડીલાલ વીરચંદ મોહી
૯ ,,	મોહનલાલ કાળીદાસ
૧૦ ,,	વાડીલાલ ઐચરલાઈ
	૧૧ , માનચંદ નથુલાઈ
	૧૨ , જેડાલાઈ ઐમચંદ
	૧૩ , મણીલાલ હકમચંદ
	૧૪ , ભગુલાઈ છગનલાલ
	૧૫ , મંગળદાસ લલુલાઈ
	૧૬ , ગોકળદાસ નગીનદાસ
	૧૭ , વાડીલાલ મગનલાલ
	૧૮ , લાલભાઈ ઝુશાલદાસ
	૧૯ , નકરચંદ પાનાચંદ

સલા કાયમ માટે નલી રહે એવી એક ચોજના ઉપરોક્ત એ કમિટીએ ૧૯૪૧ ના કારતક સુદ ૧ થી અમલમાં મૂકી અને તે સાથે સંસ્થાતુ' બંધારણું પણ ઘડાયું.

એકજ સાલમાં સલામાં ૨૦ વિદ્યાર્થીઓનો વધારો ખતાવવામાં આવ્યો અને સરાસરી ૪૦-૫૦ ની હતી. વિદ્યાર્થી ઓના અભ્યાસવિલાગમાં પંચપ્રતિકમળુ, નવરમરણ, જીવવિચાર, નવતત્ત્વ, દંડક, લઘુસંઘયણી સુધી ખતાવવામાં આવેલ છે.

વિદ્યાર્થીઓના એ વર્ગો રાખવામાં આવ્યા હતા. પ્રથમ વર્ગમાં-૩૫ અને ખીજ વર્ગમાં-૫૦. પ્રથમ વર્ગ એટલે ઉંચ્ય

અભ્યાસ કરતો અને બીજામાં નાની વયના વિદ્યાર્થીઓ હતા. એ વર્ષમાં સંસ્થાને ૧૨ પુસ્તકોની લેટ મળેલી છે.

સભાના નિભાવ માટે રૂપીઓ, એ રૂપીઆ મેમ્બરોનું લવાજમ રાખવામાં આવ્યું હતું. સભા પાસે એક નાની લાયયેરી હતી. જેમાં ૧૩૪ પુસ્તકો પૈકિમાંથી ૬૭ વિદ્યાર્થીઓને ઘેર વાંચવા માટે આપવામાં આવેલા છે. એજ સાલમાં સભાના પ્રેસીડેન્ટ શોઠ હઠીસીંગ રાયચંદ તરફથી સભા માટે એક મકાન તૈયાર કરાવવામાં આવતું હતું કે જે માટે આભાર દર્શાનની નોંધ લેવામાં આવી હતી.

ત્યારબાદ પૂજય ગુરુહેવોનો ઉપહેશ, શ્રીસંધના અયગણ્ય ગૃહન્થોની કાળજી અને બાળકોના ઉત્સાહ વડે સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી છે અને એ સભામાં અભ્યાસ કરનારા એ સમયના બાળકો પણ હાલના વડિલો આપણી સમક્ષ છે કે જેઓ આ સંસ્થામાં કેળવણી લઈ પોતાના ધર્મ, કુળ અને શ્રીસંધને હીપાવી રહ્યા છે.

પ્રાપ્ત થતા સં. ૧૯૮૮ ના વાર્ષિક હિન ઉજવણીના અહેવાલમાં બતાવ્યા મુજબ સંસ્થા આથે જેડાયેલ ચુવાન અને વડિલ ભાઈઓની શ્રીભાતૃચંદ્રસૂરીશ્વરજીના સહૃપદીશ્વરી સ્થાપિત ટોળી જે નિમંત્રણુથી રાત્રીનગરણુ પૂજાદિ ઉત્સવોમાં ભાગ લે છે. તેણે સં. ૧૯૮૧ માં એવા ૨૨ નિમંત્રણો સ્વીકાર્યો હતા. અને લક્ષ્ણમયસ્તવનો પોતાના ગુરુહેવને યાદ કરીને ગાતાં તાલ અને રસની સુંદર જમાવટ કરે છે. અનેક પોળોના ભાઇઓ એ વાતથી સુવિહિત છે.

આ વર્ષમાં સલામાં વિદ્યાર્થીઓની સંખ્યા પદ ની અતાવવામાં આવી છે. શિક્ષક તરિકે શ્રી સંકુળચંદ વાડીલાલભાઈ હતા કે જેમણી મહદમાં બીજ વિદ્યાર્થીએ પણ કામ ઉપાડી લેતા કારણું એક કે હોઠ કલાક જેટલા સમયમાં પદ વિદ્યાર્થીએને પહોંચી વળવું એ એક શિક્ષક માટે શક્ય નહોતું. આ ગૃહસ્થની સેવાએ માનદું ડેઇપણ જતના બદલા વિનાની ડેવળ સ્વપરહિતની દ્રષ્ટિએ આપવામાં આવી હતી. મૂળથી ચાલતી પ્રથા મુજબ સલાના સહાયકેના ગણ વગો રાખવામાં આવેલા જેના લવાજમ અનુકૂળે રૂ. ૫૦ રૂ અને રૂ રાખવામાં આવેલ. આવા સલાસહો ૮૦ હતા. એટલે ગઈ સાલ કરતાં ત નો ઘટાડો થયો. આયં-બિલની ઓળિનું કંડ શેડ શ્રી મનસુખરામ નાનચંદ કૈવળદાસ તરફથી કરવામાં આવતાં સારી રકમ ઉત્પજ થઈ હતી.

સં. ૧૯૮૮ ના ઉત્સવ બાદ મંદ્તાના કે ગમે તે કારણે પણ વાખ્યિક મહોત્સવ ચાર વર્ષ સુધી ઉજવાયો નહોતો. આવી જાંસ્થાના વાખ્યિક મહોત્સવ નિયમિત ઉજવાય એ ઉતોજન અને આકર્ષણું અથે' જરૂરી છે. આમ સંસ્થાનો સં. ૧૯૮૮ પછીને વાખ્યિક ઉત્સવ સં. ૧૯૯૨ ના માગશર વટ્ઠ ૧૨ ને રવિવારના રોજ ઉજવાયો હતો. ચાર વર્ષના ગ્રામામાં શિક્ષણુંની બ્યવસ્થાની ઉંઘુર અને પરિણામે ખાળેણી હાજરીમાં પડેલા મહાન ઇટકાના કારણે સભા બંધ રહેલી એ હુદાખ સમાચાર છે. જે પુરુષોએ એને આશીર્વાદ આપ્યા છે, જે પુરુષે પોતાના ઉત્સાહ અને ખંતથી ભાવી પ્રજાના

આતમાના કુલયાણુ અથેં નાદર રકમ અપણુ કરી છે તેવા આ પ્રવાહને નહિ અટકાવવાની જવાખદારી વિદ્યમાન કાર્ય-વાહકો હર રહેતી છે એ કે કુરજ સમજવી ધટે છે.

આ સાલમાં સભ્યોની સંખ્યા ૮૦ થી ધરીને ૬૫ ની થઈ જેના વાખ્યિક લવાજમની આવક રૂ. ૧૭૦૦ થઈ હતી.

૫૦૦૪૦આચાર્ય શ્રીમહ્દી આતૃયદ્રસ્કુરીશ્વરજી મહારાજની બાહ્યગીરી અને ગુરુલક્ષ્મિ અથેં ૨૧૦ શા. સાંકુળયંદ મોહકમયંદ (તાર માસ્તર) તરફથી 'આચાર્ય શ્રી આતૃયદ્રસ્કુરીશ્વર સ્મારક ઈંડ' નામનું ઈંડ ઉલ્લું કરવામાં આવ્યું છે કે જેની રકમના વ્યાજમાંથી વિદ્યાર્થીઓને ધનામ અથેં રૂ. ૨૫૦ સભાને આપવામાં આવે છે.

સં. ૧૬૬૩ માં વાખ્યિક ઉત્સવ કુલગણ વદ ૫ ને ગુરુવારના રોજ ઉજવવામાં આવ્યો. આ વર્ષ દરમ્યાન ૫૦ વિદ્યાન વક્તા મુનિરાજ શ્રી સ્પાગ્નયદ્રજી મહારાજ અને માસ્તર સાંકુળયંદભાઈ વાડીલાલે જુદાનુદા વિદ્યાર્થીઓની પરીક્ષા લેતાં પરિણામે કાંઈ ખાસ પ્રગતિ જણાઈ નથી વિદ્યાર્થીઓ કષ્ટ રીતે આગળ વધે એ હેતુથી સભાના કાર્યવાહકોએ માસ્તર શ્રી ચીતુભાઈ કુસ્તુર્યંદ અને માસ્તર મોતીલાલ નાનયંદભાઈને રોકયા. સભાસહોની સંખ્યા ઇક્ષતા ગાઈ સાલ કરતાં ૪ નો વધારો એટલે કુલલે ત્રણે વર્ગના મળી ૬૬ ખતાવે છે. જબારે લવાજમની આવકમાં રૂ. ૭૫ નો વધારો જણાય છે.

સં. ૧૬૬૪ માં સભાનો વાખ્યિક ઉત્સવ મહા વદ ૧ ને મંગળવારે યોનાયો હતો. વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૭

નો ઘરઠડો થતાં ૫૦ રહ્યા. કેટલાક કારણોસર આ પોળમાં ખીજુ એક સંસ્થા ચાલુ થવાને પરિણામે આ ઘરઠડો સુચવે છે. આ વરસે સું ૩૦ શ્રી અમીચંદ્રજી તથા સું ૩૦ શ્રી લાલચંદ્રજીએ વિદ્યાર્થીઓની પરીક્ષા લેતાં ૪૩ માંથી ૩૫ વિદ્યાર્થીઓ પસાર થયા હતા. એટલે પરિણામની દ્રષ્ટિએ તો ૮૧ ટકા જેટલું આવ્યું.

સં. ૧૯૬૫ નો વાર્ષિક મહોત્સવ માગશર સુદ ૩ ને શુક્રવારે ઉજવાયો. વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષ જેટલી ૫૦ ની હતી.

સભાના સંચાલકોની વિનિતિથી ૫૦ સુનિરાજ શ્રી કૃપાચંદ્રજી મ૦ તથા ૫૦ વિદ્યાન વક્તા સુનિરાજ શ્રી આલચંદ્રજી મહારાજ સાહેબે વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી. પરિણામ ટીકટીક આવ્યું. પૂજય સુનિરાજને શુદ્ધ ઉચ્ચારે. વિષેની ટીકાઓ કરી છે. અભ્યાસ લલે એહો હોય પણ શુદ્ધ હોય તે જરૂરી છે. એ વિષે શિક્ષકો તેમજ સંચાલકોએ ઘરટું કરવું જોઈએ.

સં. ૧૯૬૬ નો ઉત્સવ હિન માગશર સુદ ૫ ને શનિવારનો હતો. આ સાતમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬ નો વધારે બતાવે છે. ૫૦ સુનિરાજ શ્રી આલચંદ્રજી મહારાજે પરીક્ષા લેતાં સૂત્રોના ઉચ્ચારની ખામીનો પુનઃ નિર્દેશ કર્યો છે એ હુંઘદ છે. તે સાથે સંચાલકોને જવાખદારી અદ્દ કરવા માટે સુચન કર્યું છે જે મનનીય છે. આ વખતે ધાર્મિક સંવાદનો કાર્યક્રમ પણ ટીકટીક રીતે ભજવાયો. મેદની આદર્શવાનું આ એક ઉત્તમ સાધન હોવા સાથે હિતકર પણ છે. કારણ

ખાળકોમાં સંસ્કાર રેડવા માટે આવા ધાર્મિક સંવાહો જરૂરી ભાગ ભજવે છે.

સં. ૧૯૯૭ નો મહેત્સવ માગશર વદ ૧ રવિવારના રેજ જૈન અશ્રેસરો, શ્રી સંધના ગૃહસ્થો અને અન્ય લાઈ પ્લેનોની વિશાળ મેહની વચ્ચે શેઠશ્રી પુંજભાઈ દીપચંદની અધ્યક્ષતામાં ઉજવાયો હતો. આ સાલ ચાતુર્માસ રહેલા પૂર્ણ મુનિરાજ શ્રી કૃપાચંદ્રજી તથા નિદાન વક્તા પૂર્ણ સુર્ય શ્રી ભાલચંદ્રજી મં સાહેબે પરીક્ષા લીધી હતી. પૂર્ણ મુનિરાજના ઉપરેશ સિચન અને કાર્યવાહકોની જવાબદારી અદા કરવાની જગેલી થાડી પણ તત્પરતાને લઈ શ્રી રાજનગર ઈનામા પરીક્ષામાં એઠેલા સભાના ૧૧ વિદ્યાર્થીઓ-માંથી ૧૧ પાસ થયા હતા. આમ આ વર્ષ ખરેખર પ્રગતિનું નોંધી શકાય. આ સાલ આજવન સભ્ય (Life Member) ની યોજના કરી તેનું લવાજમ રૂ. ૧૦૧૧ ઠરાવવામાં આવ્યું. સભાસહોની સંખ્યા ૮૦ ની હતી. વાધીક લવાજમની આવક રૂ. ૨૦૬૫ આવી. તેમજ મહુર્મ શેડ લીખાભાઈ સાંકેલચંદ સત્તિયાના સમરણાથે રૂ. ૭૦૦૦ ની નાદર ૨૫મ તેઓશ્રીના સુપુત્ર ચંદુલાલભાઈએ આપી છે અને શેડ લાલભાઈ મનસુખરામની પ્રેરણ્યાથી ઈનામતરીકે વહેંચવા જાંપડાનીપોળના શા. ઉમેદચંદભાઈ વીરચંદભાઈ કે જેઓના દાનનો પ્રવાહ સુયોગ ને આત્મહિતના માર્ગોમાં ચાલુ છે તેઓ તરફથી ચાંદીની વાટકીએ કરાવી આપવામાં આવી છે.

સંસ્થાની હર વર્ષની કાર્યવાહીમાં પણ નવીનતા યોજવાની જરૂર છે. એ માટે નાણુંની જરૂરીયાત રહેજ. પરંતુ

બાળકોમાં ઉત્સાહ વધશે તો નાણું આપનારા તો જરૂર મળી આવશે. ખાસ કરીને બાળકોને પૂજા-પ્રતિકમણુ-સામાયિક વિગેરે સામુહાયિક કિયામાં જોડવા. સનાત્રમહોત્સવ દર માસે એક ઉજવવો. તેમને નળુકના તીર્થમાં લઈ જઈ તીર્થસ્થાનનું મહૃત્વ બાળશૈલીમાં સમજવવું અને અહવાડીએ એક દિવસ ધાર્મિક જ્ઞાનવાળા પુરુષોએ બાળકો સાથે તેમને સ્પર્શિતા વિખયોની ચર્ચામાં-આનંદી વાતોલાપમાં ગાળવો. જે આમ થશે તો સંસ્થા થોડાજ વર્ષમાં એક બાળકેળવણીનો એક આદર્શ રળુ કરવા શક્તિમાન થશે.

સંસ્થાના શિક્ષકો માનહુ સેવા આપતા હોય કે ખીલ રીતે કામ કરતા હોય તેમના પ્રત્યે સમાજે ખહુમાનથી જોવું જોઈએ. પ્રસંગે પ્રસંગે તેમના હૈયાના ઉદ્ઘાસમાં વૃદ્ધિ થાય એ રીતે એમની ચોચ્યતા પ્રમાણે કદર કરવી જોઈએ.

શિક્ષકોએ પણ પોતે સમયની ભર્યાદા સામે જોયા વિના પોતાના હાથ નીચે અર્થાસ કરતા બાળકોમાં ધાર્મિક સંસ્કારો કેમ રેડાય ને સુદ્રદ કેમ અને એવું તેમનું ચારિત્ર રાખી બાળકોને હોરવા જોઈએ તેમજ તેઓ લાદ્વી સમાજના ઘડવૈયા છે તો પગારની રક્ખ સામે નહિ જેતાં એક આદર્શ ખડો કરવાનોજ લોલ હંમેશાં રાખવો ધટે છે. એહલી વિનિતિ નઅભાવે કરીને વિરમીશું !





શાસન સમ્માટ આ.લ.

શ્રી વિજય નેમિકુરિશરજી મ.સા. નાં શિષ્યરત્ન  
પ.પૂ.આ.લ. શ્રી પદ્મકુરિ ગ્રંથાલય  
દાદા સાહેબ, ભાવનગર




શ્રી સુધર્માસ્વામી જીના ગ્યાનબંદર, સુરતનાડી, અમદાવાદ.

Shree Sudharmaswami Gyanbandar-Umara, Surat

[www.umaragyanbandar.com](http://www.umaragyanbandar.com)